

# કિસા ગોતમી અને ખીજાં ખીરલનો

[ બોદ્ધકાળીન ભારતની ઈ સલાહીઓનાં ચરિત્રે। ]



બિલ્કું આજેંડાંની પણ  
અરતું આઠીંદ્રા વર્દીંડ તાર્ટાલટા  
એ એ વાત અનેંદ્રા હોય કાંઈને કરી શકતા નથી હુંદું ॥

સવા ઇપિયો

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ ગુજરાતી કાવીરાશ્રમ વિભાગ ]

અનુક્રમાંક ૨૭૩૨૩ કિમત ૨૦૫૦

યંદ્યનામ (દ્વારા) (દ્વારા)

વર્ગાંક ૨૧૪૧૨૦૧૦

‘ભારતની હેવીઓ’ અંથ રનો

# કિસા ગોતમી

અને ખીજાં સ્વીરત્નો

(ખોદ્ધાલીન ભારતની ૬૩ સનારીઓનાં ચરિત્રા)

૧



પ્રયોગ :

૩૫૦ શિવઅસ્તાદ તત્ત્વપત્રામ પંહિત

સુકામ : કોટા (રાજસ્થાન)



લિંગુ અફ્ઝાંડનાંદ ની પ્રસાદી  
**અસ્તું આહિત્ય વર્ત્યક તાર્યાત્ય**  
 ડે. લદ્દ પાસે. અમદાવાદ અને અલલાદેવી સેડ મુનિરી



સંબા ઇંધિયો

સંવત ૨૦૦૫

માટે ૧૦૦૬

ગુજરાત વિધાનસભા  
અમદાવાદ  
ગુજરાતી લાંઘીશ એ સાહન  
૨૭૩૨૩

[ સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને રવાધાન છે. ]

મુદ્રક અને પ્રકાશક : વિષ્ણુપનહાસ ક૦ ટક્કે,  
અરસુ સાહિત્ય મુદ્રણાલય, રાયખાડે : આમદાવાદ

ନିବେଦନ

આ અગાઉ ‘ભારતનાં સ્વીરત્નો’ અને ‘ભારતની દેવીઓ’ના નામે વણુ આવૃત્તિ અહાર પડેલી છે. તે પૈકીના ખીજ અથવે વણુ વિભાગમાં વહેંચી નાખીને તે પૈકીનું આ પહેલું પુસ્તક ‘કિસા ગોતમી અને ખીજાં સ્વીરત્નો’ એ નામથી પ્રસિદ્ધ થાય છે.

‘લારતની ટેવીઓ’ પુસ્તક ધારું ઉપયોગી છે. એ હળ-  
હાર અંથને ખરીદી શકે એવાં કુદુંબોની સીંઘો આવા  
અંથના વાચનની વંચિત ન રહે એ લક્ષમાં લઈને આ રીતે  
જીટા વિલાગો કરવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં ઔર્ધ્વકાલીન ભારતવર્ષની દર સાથે સન્નારીઓનાં ચરિત્રા આવે છે.

મુખ્ય, } સરબું સાહિત્ય મુદ્રણાલય દ્વારાના ફરીએણો વતી  
તા. ૨૫-૭-'૪૮ } મતુ સુષેદાર (પ્રમુખ)

‘સર્વતુ’ સાહિત્ય એટલે ઊચામાં ઊચુ’ સાહિત્ય’

ધરમાં વસાવવા જેવા ગ્રંથો

			पान	किंभत	प्रारंगण
पुस्तकालय नाम अने विगत					
उपहेसासारसंचय-महात्मा तिळवल्लुवरनो वेदतुल्यमाध ३८४	१-८	०-४			
आध्यात्माणभाषण-लाभ १ लो-माधक आध्यात्मा ... ७-८	३-०	०-७			
स्वामी शामतीर्थ अंथ १ लो-अमना सदृपदेश,					
व्याख्यानो ८. ... ५६२	३-०	०-९			
" " " ४ लो-विस्तृत चरित तथा					
वेदानना उपहेशा ... ६७२	३-८	०-१७			
विवेकानंद भाज ८ जो-स्वामीशीना उपहेशा,					
बजियोग आवति रथ ... ३८४	२-०	०-४			
तुकारामगाथा-अंथ १ लो-२ जो-भजि, ज्ञान अने					
वैराघ्यप्रेरक अवगार्ह सरथ भाषांतर १८४० ६-०	०-१५				
आहशी चरित्रसंचय-लाभ ८ जो-४० दंको चरित्रो ६२४	३-०	०-७			
आहशी दृष्टांभाषण-लाभ १ लो-माधक ४२४					
" " " दंको दृष्टांतो ... ४३२	२-८	०-४			
" " " २ जो-माधक ४४४ दंको दृष्टांतो ... ४५६	२-८	०-१५			
चैतन्यमहाप्रभु-त्रिश अंगो, विस्तृत चरित्र (सचित्र) १५१६	८-०	०-१५			
संत तुकाराम-गडाराधना सुप्रसिद्ध संतानु चरित्र ६४८	३-०	०-९			
स्वामीशी अद्वानं ने शिवानंहनां चरित्रो ४२४	१-६	०-४			
भजाचरित्र-सत्तमागारा नहि आवेदन अरित्रो ५२८	२-८	०-९			
दूर्दी वारांचो-अंथ १ लो-सागानिक निर्विवृद्ध वातो ५८८	२-८	०-६			
" " " १ लो-सर्व माटे उपकारक ८९ वातो ७२०	२-८	०-६			
भारतनी हेवीओ अंथ १ लो-प्राचीनयुगनी सतीओ ७३२	३-०	०-९			
" " " २ जो-मध्ययुगनों औति. चरित्रो ७३२	३-०	०-७			
" " " ३ जो-मध्ययुग ने आवीचीन ... ८०४	३-०	०-८			
प्रीतमहासनीवाल्ली-सननो, धारा, छपापा, कक्षा, महिना ५६०	३-०	०-४			
सुविधापुण्यवटिका (युक्तिस्तो)-महात्मा रोभ साठीकृत ३६	०-५	०-२			
शुभसंचय भाज १ जो-हवाओ ने जरी					
मालिती आपता १४८ लेखा ५४४	३-०	०-५			
भाज ६ जो-हवाओ ने जरी मालिती, १५५ लेखा ७३६	३-०	०-६			
साक्षु द्वर्ग-भजि ने ज्ञान विषयक साही वातो ४६२	२-०	०-५			
स्वर्गोंनी दूर्दी-सद्वर्तन राखतां शीघ्रवतारो माध ३७२	२-०	०-४			
द्वर्गोंनी भूमी-मोक्षमार्ग प्राप्त करवानां १२ प्रथियां ३६०	३-०	०-४			

સ્વર્ગનો આનંદ-કાળિ ને તેના પ્રકારોની સમજ	૩૬૦	૨-૦	૦-૪
સ્વર્ગનો અળનો-કાળિઅર્થ સમબલવંતુ પુરતક	૩૧૨	૨-૦	૦-૪
સ્વર્ગનો ગ્રાકશ-શાન અને પરમાર્થની વાતો	૩૩૯	૨-૦	૦-૪
મોહનુહગં ને થીળાં દ્વારા રત્નો-સરળ અર્થ સાચે	૧૯૮	૧-૦	૦-૨
શત-દ્વારાંદ્વારાં ને થીળાં કાદ રત્નો-સરળ અર્થ સાચે	૧૦૦	૦-૧૨	૦-૨
સ્તોત્રસંઘણ-કાળિ ને વેદાંત-સ્તોત્રોનો અર્થ સાચે	૨૩૦	૦-૧૦	૦-૨
સર્વચેદાંત-સિદ્ધાંત-સારસંઘણ-કાળિઅંતર સાચે	૨૨૪	૧-૪	૦-૩
વિવેકશૂદામણી-સરળ અનુવાહ સાચે	૧૯૦	૦-૧૨	૦-૨
એકનાથી ભાગવત-એકનાથ મહારાજના વિવરણ સાચે	૧૦૦	૫-૦	૦-૧૨
મહાવાક્ય-રત્નાવલી-૧૦૮ ઉપનિષદોના સારસ્પ			
સંબંધ, સરળ ભાષાંતર સાચે ...	૧૮૪	૦-૧૨	૦-૨
વિહુરનીતિ-સરળ અનુવાહ સાચે ...	૧૯૮	૧-૦	૦-૨
આત્મમસાક્ષાત્કારની કષેટી-સ્વાગી ...			
સ્વયં જ્યોતિલીધિં ...	૨૦૮	૧-૪	૦-૨
અવધૂત ગીતા-સુધૂરાવધારા સાચે ૨૭ આચિત્તિ	૧૪૪	૧-૪	૦-૨
અધ્યાત્મ ગીતા-મૂળ સાચે સરળ ભાષાંતર ...	૭૨	૦-૮	૦-૧
ગીતા-પુરુષાર્થભાગિની-એ અંધમાં			
ભાગ ૧ લો- {મૂળ શ્લોડા, પદરચેદ, અર્થ અને}			
,, ૨-૩ લો- {પદિત સાતવલેકરની શ્લો સાચે}	૧૦૯૮	૧૨-૮	૧-૨
ઝાનસત્ત ગીતા-મૂળ શ્લોડા (શુદ્ધરાતી લિપિમાં)	૩૯૮	૧-૪	૦-૪
મોહનમાળા-કીમદુ રાજયંદેહત... ...	૧૬૨	૧-૪	૦-૩
શીરામબૃષણુ વાર્તાલાપ ભાગ ૨ નો-રામદૃષ્ણ-			
કથામુત્તરી આગળના ભાગમાં આવતા ઉપદેશો			
તથા કથાપ્રસ્તીઃ ...	૩૧૨	૨-૦	૦-૪
ધર્મધર્મ-બૌધ્ધ ધર્મનું ગીતા લેખું અમૃતું પુસ્તક... ...	૧૬૨	૧-૦	૦-૩
પંચીકરણું-મુસુકુણોના આત્મમોદ માટે સર્વોત્તમ			
અંધ, દ્વારાંત્રી અને યુહિન-અનુભવધારી રીકા સાચે... ...	૨૬૪	૨-૦	૦-૪
પલ્લુમય જીવન-સુધી થયાના સરળ ઉપાયો... ...	૧૬૨	૦-૧૨	૦-૨
,, જીવનનું રહસ્ય-સહૃપદેશ, ભજનો ધ. સાચે... ...	૧૯૮	૧-૦	૦-૪
વિચારસાગર-૨૭ આચિત્તિ, શ્રીનિષ્ઠળાસલ્લિકત			
વેદાંતનો મહાન અંધ મૂળ દોહા, અર્થ તથા			
વિવરણ સાચે ...	૪૦૦	૩-૦	૦-૫
સુર્યકાંત-મુસુકુણો ગાટે અંધાંત ઉપયોગી અંધ..	૨૭૨	૨-૦	૦-૪
ભાગસહિતોધ-,, વાર્તાઓડો ધાર્ભિક શિક્ષણ..	૧૨૮	૦-૮	૦-૨
ભાગભાગત- (સચિત્ર) સંક્ષિપ્ત મહાલાલાચ..	૨૮૮	૧-૮	૦-૪
એચાલાલાલ-મહાકિશી પ્રેમાનંદહૃત-મેટા અશ્વરોમાં			
અધરા શાખાના અર્થ સાચે... ...	૧૧૨	૦-૮	૦-૨

નળાખમાણ-(મહાકવિ પ્રેમાનંદિત) મોટા અક્ષરોમાં... ૧૩૬	૧-૦	૦-૩
ભજનસુંચાલ-ભૂદીલુદી સંતોનાં ૩૩૬ ભજનોનો સંચાલ ૨૪૦	૧-૦	૦-૩
શ્રી રમણ મહાર્થ-સુધારાવધારા સાચેની ૨૪ આવતી ૨૧૬	૨૦	૦-૪
અંસ મહારાજ-બેદાંત જેવા ગઢન વિષયને વિવિધ દ્વારા કારા સરળ રીતે સમબલપુર પુસ્તક ... :૮૦	૨-૮	૦-૫
શ્રીશાસકામહિલુદી-(ચરિત્ર) લે. આનંદેતન્ય ... ૧૦૪	૦-૮	૦-૨
થામરચના-આ. ૧-૨ (સચિત્ર) શ્રી. રલિશાંકર મહારાજ ... ... ... ૨૮૦	૧-૪	૦-૪
ગીતાપ્રેરથી-મગધાગીતાની ભાગપ્રેરથી-કર્મથોગના ૧૨૫ શૈલોકો, અર્થ તથા વિસ્તૃત સમબલી સાચે... ૧૦૪	૦-૯	૦-૧
ગીતાપ્રેરથી-કલાન-સા. શ્રીરમણ મહાર્થ: ગીતામાંથી તથા ધીનાં નાનુસુંદરનો શુનરાતી અર્થ સાચે .. ૫૨	૦ ૩	૦-૧
એ અદ્યાધી ગીતા-(અદ્ય ય ૧૨ ને ૧૫ માં) અર્થ સાચે ૪:	૦-૩	૦-૧
નારનાં અક્ષિતસુન્દર-મૂળ સુન્દરા, અર્થ તથા વિવેચન સાચે ૬૪	૦-૩	૦-૧
વિચાર સૂર્યોદાય-આ. ૨૪, સ્વામીશ્રી ભાધવતીર્થાઃ ૬૦	૦-૩	૦-૧
નિતિશાતક-(શ્રીભર્તુછિકૃત) સરળ અનુવાદ સાચે... ૮૦	૦-૩	૦-૧
વૈરાઘ્યશાતક-(શ્રીભર્તુછિકૃત) સરળ અનુવાદ સાચે ૬૬	૦-૪	૦-૧
પ્રેમપંથ ભાગ્ય લેટ-સાંપાડક: શ્રી. વાલજી ગો. હેસાઈ ૬૪	૦-૩	૦-૧
” ૨નો- ” ” ” ” ૧૦૪	૦-૪	૦-૧
સાંપાડ શ્રૂલિક અને હેલી નાંડા-નેન સંસ્કૃતિની એ ભજવાન લાયક નાટિકાઓ... ... ... ૬૪	૦-૩	૦-૧
જ્ઞાનનાં જરણ્યાં-(આ. ૩૭) લે. સ્વામીશ્રી ભાધવતીર્થાઃ ૬૪	૦-૩	૦-૧
સુદામા ચરિત્ર-(કાય) પ્રેમાનંદ હૃત... ... ૬૪	૦-૩	૦-૧
કેરીની મોસામ ને ધીજ વાતો-શ્રી. શય્દાની કસાયલી કલમે લખાયેલી ઊ વાતો... ... ૭૬	૦-૪	૦ ૧
ધાર્યાણુની ધારને ધીજ વાતો-શ્રી. ચૂનીલાલ મહિયાઃ માનવરવભાવ અને લાગળી પ્રગટ કરતી ઊ વાતો... ૭૬	૦-૩	૦ ૧
જ્ઞાનપદ-સોપાનપદ-જ્ઞાનપદ-૧૮૫૨૪	૦-૧	૦-૧
વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મંગાવો:		

## સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય

કુ. ભદ્ર, સેશન્સ કોર્ટ પાસે, પો. નં. ૫૦, અમદાવાદ  
અને કાલભાડેવી રોડ, હાથી ભીટિંગ, ગ્રીન્લે મારો, સુંધરી-૨

## અનુક્રમ

ક્રમાંક	નામ	પૃષ્ઠાંક
૧	માદ્રી	૭
૨	ચુલ્લાઘાધિની પત્ની	૧૪
૩	માચાહેવી	૧૬
૪	મહાપ્રાણપતિ ગૌતમી	૧૮
૫	ગોપા (યશોધરા)	૨૪
૬	કિસાગોતમી	૩૮
૭	સુભાતા	૪૪
૮	સુપ્રિયા	૪૧
૯	વાસવદાતા	૪૭
૧૦	પ્રલબ્દા	૪૬
૧૧	રૂકમાવતી	૬૦
૧૨	સોમા (પહેલી)	૬૨
૧૩	વિશાળા મિગારમાતા	૬૩
૧૪	કુલવધૂ સુભાતા	૬૬
૧૫	નકુલમાતા	૭૪
૧૬	અંકદાતા	૭૬
૧૭	શૈમા	૭૭
૧૮	કુલયા	૭૬
૧૯	શુક્લા	૮૦
૨૦	એમા (શૈમા)	૮૧
૨૧	ઉત્પલવશ્ચી	૮૪
૨૨	સુક્તા (સુતા પહેલી)	૮૬
૨૩	શૃંગારમાતા	૮૦
૨૪	ઉત્તરા (પહેલી)	૮૧
૨૫	મંડપદાચિકા	૮૨
૨૬	અન્સતરા તિષ્યા	૮૩
૨૭	તિષ્યા (તિસ્સા)	૮૪
૨૮	સંધા	૮૪
૨૯	ધર્મદિના	૮૫

૩૦	મુઠા ( સુતા-ખીલ )	....	....	૬૬
૩૧	થરી વિશાળા	....	....	૬૬
૩૨	સુમના-કૌશલકુમારી	....	....	૧૦૦
૩૩	સુમના ( પહેલી )	....	....	૧૦૦
૩૪	ધરમા	....	....	૧૦૧
૩૫	મેતિકા	....	....	૧૦૧
૩૬	અભિરૂપનંદા	....	....	૧૦૨
૩૭	સુસુત્તિકા ( સુમંગળની માતા )	....	....	૧૦૩
૩૮	જ્યંતી ( જેન્ટી )	....	....	૧૦૩
૩૯	અર્ધકાશી	....	....	૧૦૪
૪૦	ચિત્રા	....	....	૧૦૪
૪૧	પૂણ્ણી ( પુણ્ણા )	....	....	૧૦૪
૪૨	અલયમાતા	....	....	૧૦૬
૪૩	અલયા	....	....	૧૦૭
૪૪	સામા ( શયામા )	....	....	૧૦૮
૪૫	ઉત્તમા ( પહેલી )	....	....	૧૦૮
૪૬	ઉત્તમા ( ખીલ )	....	....	૧૦૯
૪૭	દંતિકા	....	....	૧૦૯
૪૮	શુષ્ણા ( શુકલા )	....	....	૧૧૦
૪૯	મિત્રા	....	....	૧૧૦
૫૦	શૈલા ( સેલા-શૈલાણ )	....	....	૧૧૧
૫૧	ડળખરિ	....	....	૧૧૨
૫૨	લદ્રા કાપિલા	....	....	૧૧૩
૫૩	સોમા ( ખીલ )	....	....	૧૧૪
૫૪	વિમળા	....	....	૧૧૬
૫૫	અડ્ઝેન્ની	....	....	૧૧૭
૫૬	સીહા ( સિંહા )	....	....	૧૧૭
૫૭	સુંદરી નંદા	....	....	૧૧૮
૫૮	મિત્રકાલી ( મિત્રકાલી )	....	....	૧૨૦
૫૯	નંદુતરા	....	....	૧૨૧
૬૦	સફુલા	....	....	૧૨૨
૬૧	સુભાતા ઘેરી	....	....	૧૨૩
૬૨	સોણ્ણા	....	....	૧૨૪

૬૩	ભડા કુંડલકેશા	....	....	૧૨૬
૬૪	પરાચારા	....	....	૧૨૯
૬૫	ચંદા	....	....	૧૩૨
૬૬	વાશિધી	....	....	૧૩૩
૬૭	અનોપમા (અનુપમા)	....	....	૧૩૪
૬૮	ઉત્સા (ખીલ)	....	....	૧૩૪
૬૯	શુમા	....	....	૧૩૫
૭૦	વિજયા	....	....	૧૩૬
૭૧	ચાલા	....	....	૧૩૭
૭૨	વડુંમાતા	....	....	૧૩૮
૭૩	ઉપચાલા	....	....	૧૩૯
૭૪	શિશુ ઉપચાલા	....	....	૧૩૯
૭૫	પુણિષુઙ્કા	....	....	૧૪૦
૭૬	અંખપાદી ગણિંકા	....	....	૧૪૨
૭૭	રોહિણી	....	....	૧૪૪
૭૮	સુંહરી	....	....	૧૪૬
૭૯	ચાપા	....	....	૧૪૭
૮૦	શુભા (સોનીની કન્યા)	....	....	૧૪૮
૮૧	શુભા જીવકંખનિંકા	....	....	૧૪૦
૮૨	ચારુમતી	....	....	૧૪૩
૮૩	મહિદાસી (ઋષિદાસી)	....	....	૧૪૪
૮૪	ધર્શાનદેવી	....	....	૧૪૭
૮૫	સુમેધા	....	....	૧૪૮
૮૬	સંઘમિત્રા	....	....	૧૬૪
૮૭	શ્રીમતી	....	....	૧૭૧
૮૮	ચંદ્રવતી	....	....	૧૭૩
૮૯	અમૃતપ્રભા	....	....	૧૭૪
૯૦	વાકુષ્ણા	....	....	૧૭૬
૯૧	દૈવસિમતા	....	....	૧૮૧
૯૨	ભારતી	....	....	૧૮૮
૯૩	ભામતી	....	....	૧૬૦

## શુદ્ધ પત્ર

નૂંઠ	પંક્તિ	અશુદ્ધ	શુદ્ધ
૫	૩૨	કાશાભીજૃત	કૌશાભીજૃત
૪૭	૧૪	લોગવતાં	લોગવતો
૬૩	૧૩	અહૃત	અહૃત
૧૦૪	૧૪	પાતાની	પાતાની
૧૨૭	૧૩	ધર્માપાલ	ધર્માપાલ
૧૨૮	૧૬	એકમ	એકમ
૧૪૧	૨૮	ત્રૈવિદ્ય	ત્રૈવિદ્ય
૧૪૮	૧૧	ગૌતમી	ગૌતમી
૧૫૪	૨૫	પ્રતિવતા	પ્રતિવતા
૧૬૪	૨૫	દૃપદાવણ્ય	દૃપદાવણ્ય
૧૭૦	૧.૬	કાચનું	કાર્યનું

‘ભારતની દેવીઓએ’ અંથ રણે

# કિસા ગોતમી અને ખીજાં ખીરતનો।

(બૌધ્ધકાલીન ભારતની ૬૩ સત્તારીઓનાં ચરિત્રા)



उपोद्घात

अमारी धर्षणी वांचक खड़ेनोने बौद्धधर्म संघंधी भरोभर  
भणर नहि होय तेथी बौद्ध सन्नारीओनां चरित्रनो पश्चिय कराव-  
तां पहेलां बौद्ध धर्म विष्णे शण्डो ठेवा अनुचित नहि गण्याय.

आजथी अढी हुन्नर करतां पणु वधारे वर्ष पूर्वे गौतमबुद्ध  
नामना एक महापुरुषे भारतवर्षमां ए धर्मनी स्थापना करी  
हुती. युद्धहेवना मृत्यु पाढी धर्षणां वर्षो सुधी ए धर्म आपणु  
हेशनो मुख्य धर्म रक्षो हुतो. भारतनी याहार चीन, जपान  
वर्गेरे हेशोमां आज पणु ए धर्मने लोडो माने हे अने युद्ध-  
हेवने जन्म आपनार पवित्र भारतभूमिनी यात्रा करवा साढ़े ए  
हेशथी अनेक यात्रीओ आवे हे. जैन लाइओना तीर्थंकर महा-  
वीर स्वामीनाज समयमां, पणु एमनाथी जराक पाछण युद्धहेव

<sup>x</sup> आ अंथनी आ अगाउनी ऐ आवृत्तिओ ‘भारतनां स्त्री-  
रत्नो’ना नामथी प्रसिद्ध यथेली छे. आ तेनी त्रीछ आवृत्ति ‘भारतनी  
देवीओ’ना नामथी प्रसिद्ध थाय छे.

—प्रकाशक

\* १-भाद्रीथी ६१-देवस्थिता सुधीनी देवीओ बौद्धयुगनी छे.  
ला-१

ઉત્પક્ષ થયા હતા. એમના વખતમાં આચોનો વૈદિક ધર્મ વિકાર પામી ચૂકુંચો હતો. સાપ ગયા અને લિસોટા રહ્યા એ પ્રમાણે વેદ અને ઉપનિષદ્ધના ઉત્તમ ગઢન સિદ્ધાંતો સમજનારા અને તે પ્રમાણે વર્તનારા તો થાડા રહ્યા હતા. અને કર્મકંડ, જોટા વાદવિવાદ અને જીવહિંસા આદિ વખોડવા લાયક કામ કરનારા ઘણું કોણો રહી ગયા હતા.

એને અરો જોધ થયો હોય, જે મોહનિદ્રામાંથી જાગ્યા હોય તેને બુદ્ધ કહે છે. બુદ્ધહેવનો ઉપહેશ એ હતો કે કેવળ વૈદિક યજયાગ કર્યાથી ધર્મ સધાતો નથી. પવિત્ર જીવન ગાળવું, સારા વિચારો રાખવા, એજ અરો ધર્મ છે. પ્રાણિણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂર બધા બરાબર રીતે એ ઉચ્ચ ધર્મના અધિકારી છે. યજમાં પશુનું અલિદાન આપવું અથવા અન્ય કોઈ પ્રકારે જીવની હિંસા કરવી એ મહાપાપ છે. પ્રાણિણશૂદ્ધનો લેટ ભૂલી જઈને સર્વ પ્રકારની જીવહિંસાનો ત્યાગ કરીને, બધાએ બોગવિલાસહીન પવિત્ર જીવન ગાળવું અને જગતનું કદ્વાળું કરવું. આ પ્રમાણે જીવન ગાળવાથી ધીમે ધીમે મતુષ્યનો આત્મા બધા પ્રકારના મોહ અને પાપ-વાસનામાંથી છૂટી જઈને નિર્વાણ મેળવશે.

ખૌદ્ધર્મના મહામંત્રમાં ત્રણ વિષય અતાવેલા છે.

‘કુદ્ધ શરણ ગચ્છામિ—હું બુદ્ધને શરણ જાઉં છું.’

‘ધર્મ શરણ ગચ્છામિ—હું ધર્મને શરણ જાઉં છું.’

‘સંચ શરણ ગચ્છામિ—હું સંધને શરણ જાઉં છું.’

ગૌતમ બુદ્ધનો સુખ્ય ઉપહેશ એ હતો કે આ સંસારમાં ફરેક વસ્તુ ક્ષણિલાંગુર અને હુઃખના કારણુદ્ય છે.

સંસારના એ હુઃખનો ધિલાજ શો? ધિલાજ કરતાં પહેલાં રોગનું કારણ શોધવું જેઠાએ. તૃષ્ણુ—સુખ બોગવવાની રાતહિવસ લાલસામાંથી હુઃખ જાપને છે, માટે આત્મવાદ ત્યાજ અનાત્મવાદ અદ્ધણુ કરવો; એટલે કે હુંપદ છોડી દેવું.

“તૃષ્ણુ અને તૃષ્ણુમાંથી જીપજતા ‘ઉપાદાન’ (વિષય-શહણ)નો નાશ થાય, એટલે પુનર્જન્મ અને પુનર્જન્મ સાથે જોડાયલાં જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ વગેરેનાં હુઃખો શરીર જાય. આ હુઃખરહિત સ્થિતિ તે નિર્વાણુ. ‘નિર્વાણુ’ એટલે બુઝાઈ

જવું-મનુષ્યના હૃદયમાં હુંપણું અને રાગદ્રેષ વળેરે જે જે વૃત્તિએ સળગે છે તેનું બુઝાઈ જવું.” (ધર્મવર્ણન)

એ નિર્વાણ પામવાને માટે બુઝદેવે કે ઉપાય બતાવ્યા છે છે તેને ‘મધ્યમ પ્રતિપદા’ અથવા ‘આર્ય અષાંગ માર્ગ’ કહે છે. એ આડ માર્ગ નીચે મુજબ છે:-

- (૧) સમ્યગું દિષ્ટિ-સારી સમજાણ, જ્ઞાન.
  - (૨) સમ્યકું સંકલ્પ-સારો સંકલ્પ (કિંયા કરવાનો નિશ્ચય.)
  - (૩) સમ્યગું વાકું-સારી વાણી; જેમકે અસત્ય ન એલખું, ચાડી કે નિંદા ન કરવી, ગાળ ન હેવી, ભિથ્યા બકવાદ ન કરવો.
  - (૪) સમ્યકું કર્મ-સારાં કર્મ, શીલ અને દાન.
  - (૫) સમ્યગું આળવ-સારી આળવિકા, સારો ધંધો કરીને ગુજરાન ચલાવવું.
  - (૬) સમ્યગું વ્યાચામ-સારો ગ્રયત્ન.
  - (૭) સમ્યકું સમૃતિ-સારી સમૃતિ તથા વિચાર.
  - (૮) સમ્યકું સમાધિ-સારી સમાધિ, ચિત્ત એકાશ કરવું તે.
- આ નિર્વાણ પ્રાંત કરવાના માર્ગમાં જે વિધ્નો નણ છે તેને ‘દશ સંચોજન’ કહે છે. એ વિધ્નો આ પ્રમાણે છે:—(૧) સત્કાર્ય દિષ્ટિ-આત્મવાદ=હુંપણાની દિષ્ટિ, (૨) વિચિકિત્સા=સંશય, (૩) શીલ-પ્રતપરામર્શ=શીલ અને પ્રતાનુંચિંતન કર્યો કરવું અને એને ચોતાના હુંપદ સાથે જોડવાં. (શીલ અને પ્રત પાળવાં સારાં છે, પણ એના જ ચિંતનમાં ભરાઈ રહેવાથી નુકસાન છે. આ પણ ‘સંચોજન’ તોડનાર ‘સોતાપન્ન’ થાય છે અથોત તે નિર્વાણના વહેખુંમાં પડે છે.) તે ઉપરાંત (૪) કામ, (૫) દ્રેષ, (૬) ઇપરાગ, (૭) અદ્યપરાગ (અણુદીઠ સ્વર્ગના સુખની આસક્તિ), (૮) માન, (૯) ઉદ્ઘતપણું અને (૧૦) અવિદ્યા (એ પણ નિર્વાણના માર્ગમાં આડે આવનારી અને મનુષ્યને સંસાર સાથે ખાંધી રાખનારી સાંકળો છે.)

ઓદ્ધર્મમાં વળી દશ શીલ, દશ શિક્ષા અને છ પારમિતા-એ કહી છે.

- (૧) હિંસા ન કરવી, (૨) ચોરી ન કરવી, (૩) જ્બહું ન એલખું,
- (૪) મધ ન પીલું, (૫) અદ્વાચર્ય પાળવું, (૬) રાતે લોજન ન કરવું,
- (૭) પુષ્પહાર, ચંદન વળેરે સુગંધી પદાર્થી ધારણું ન કરવા,
- (૮) જમીન ઉપર સાદકી પાથરીને સૂદું, (૯ થી ૧૮ સુધીનાં શીલ

ગૃહસ્થ માણુસે પણ અઠવાડિયામાં એક વાર પાળવાનાં છે.)  
(૬) નાચ અને ગાનતાનથી વિરમખું અને (૧૦) સુવણુંહિ ધાતુનો  
પરિશ્રષ્ટ ન કરવો. (સાધુઓએ દશે શીલ ખાસ પાળવાનાં છે.)

દશ શિક્ષા આ પ્રમાણે છે. (૧) હિંસા કરવી નહિ, (૨) વગર  
આચ્યું લેવું નહિ) (૩) અદ્ધર્યાર્થ પાળખું (ગૃહસ્થે પોતાનીજ પત્ની  
ઉપર સ્નેહ રાખવો), (૪) જીહું ન ખોલવું, (૫) ચાડી ન ખાવી,  
(૬) ઉદ્ધતાઈ ન વાપરવી, (૭) વૃથાપ્રલાપ ન કરવો, (૮) લોલ ન  
કરવો, (૯) દેખ ન રાખવો અને (૧૦) વિચિકિત્સા એટલે કે શાસ્ત્ર  
અને પરમાર્થ સંભાંધે સંશયપણું ન રાખવું.

૭ પારમિતાઓ અર્થોત् સંસારસાગરમાંથી પાર તરી જવાનાં  
૭ સાધનો આ પ્રમાણે છે:—

(૧) દાનપારમિતા (ક્રિય, વિદ્યા, ધર્મોપદેશ વગેરેનાં દાન)  
(૨) શીલપારમિતા. (ઉપર વળુંલેલાં શીલ પાળવાં), (૩) ક્ષાંતિપાર-  
મિતા, (હુઃઅ ભમવાં તથા પારકાના અપકારની ક્ષમા આપવી),  
(૪) વીર્યપારમિતા (સંસારની લાલચોને જીતી કદ્યાણને માર્ગે  
ચઢવાની મારામાં શક્તિ છે એમ ઉત્સાહ રાખવો), (૫) ક્ષાંતિપાર-  
મિતા (ધર્મ અને યુદ્ધ લગવાનનું દ્યાન કરવું અને (૬) પ્રજાપાર-  
મિતા (જ્ઞાન પ્રાપ કરવું)\*

બુદ્ધહેવને સ્વીનતિ પ્રત્યે ધાણું માન હતું અને જનસમાજ-  
માં સ્વી જલિનો આદર થાય એવી એમની ઈચ્છા હતી. છ દિશા-  
ઓની પૂજનું રહણસ્ય સમજનવતાં એમણે પત્નીપુત્રને હક્ષિણું દિશા-  
રૂપ માનીને તેમની પૂજનો વિધિ નીચેના શરૂહોમાં ખતાવ્યો છે.  
પશ્ચિમ દિશા કે પત્ની તેની પૂજનાં આ પાંચ અંગ છે. (૧) તેને  
માન આપવું, (૨) તેનું અપમાન ન થવા હેલું, (૩) એક પત્નીવિત  
આચરણું, (૪) ધરનો કારલાર તેને સેંપવો, (૫) વલાલંકારની તેને  
ઝોટ ન પડવા હેવી. આ પાંચ અંગોથી જે પતિ પત્નીની પૂજન  
કરે તો પત્ની તે પતિ ઉપર પાંચ પ્રકારનો અનુશ્રષ્ટ કરે છે:—

(૧) ધરમાં સારી વ્યવસ્થા રાખે છે, (૨) નોકરચાકરને પ્રેમથી  
સંલાળે છે; (૩) પતિવતા થાય છે; (૪) પતિએ મેળવેલી સંપત્તિ-

\* બૌદ્ધધર્મ સંભાંધી ઉપરની અધી લક્ષીકત આચાર્ય શ્રીઆનંદ-  
શંકર બાપુલાઈ મુન રચિત ‘ધર્મવર્ણન’ નામના ઉત્તમ અંથમાંથી  
સેવામાં આવી છે.

તું રક્ષણું કરે છે; ઉડાઉ થતી નથી અને (૫) સર્વ ગૃહફૂત્યોમાં તત્પર રહે છે. x

બૌદ્ધકાળમાં ભારતવર્ષની સ્વીચ્છાને શો હરજનો હતો, એ સંખ્યભર્માં ‘પ્રયુદ્ધભારત’માં એક વિદ્ધાન લાયે છે કે, “બિક્ષુઓ કરતાં બિક્ષુણીઓની સંખ્યા એઠી હતી, પણ સમાજમાં એમને ઘણું ઉચ્ચ સ્થાન મળેલું હતું. એમની વિદ્ધા, બુદ્ધિ તથા સમાજ ઉપરની તેમની ખાસ અસર સંખ્યા હક્કીકત આપણુને ‘માલતી-માધવ’ જેવા સંસ્કૃત પુસ્તકોમાંથી મળી આવે છે. કોઈ કોઈ બિક્ષુણી સમનેરા તથા અહીંતું પદને પણ પામી શકતી હતી. મહાત્મા ગૌતમખુદ્દના જીવનકાળમાં સુતપિતકની થેરીગાથા અનેક વૃદ્ધ બિક્ષુણીઓને હાથેજ રચાઈ હતી; એમાંની ઘણુણીખરી ગાથા-એ ઉત્તમ છે એટલુંજ નહિ, પણ સ્વીચ્છાની ઈશ્વરભક્તિ તથા બુદ્ધિનાં જ્ઞલંતં ઉદાહરણ પણ આપણુને એમાંથી મળી આવે છે. એમણે નીતિના સિદ્ધાંતો તથા બૌદ્ધધર્મના ઉપહેશોનું વર્ણનું બહુજ સરસ રીતે કર્યું છે. એ થેરીઓના ઉપહેશને સાંલળવા સારુ અનેક બિક્ષુ તથા બિક્ષુણીઓ એકદાં થતાં.

બૌદ્ધ સાહિત્ય સ્વીચ્છાને ઘણુંજ ઉચ્ચ સ્થાન આપે છે. સ્વીચ્છાને પહેલાં તો બૌદ્ધ મંહિરોથી દૂર રાખવામાં આવી હતી, પણ ધીમે ધીમે બૌદ્ધ ધર્મના મંહિરોની એજ ઘણીયોરી થઈ પડી હતી.

બૌદ્ધધર્મની પ્રથળ લહેર ખખી જલિઓમાં ફેલાઈ ગઈ હતી. એના શિક્ષણુની અસર બહુજ ડાંડી હતી. એ સમયના રાજવંશ, વણિકસમાજ તથા કારીગરોમાં પણ આદર્શ સ્વીચ્છાનાં એવાં ઉદાહરણ મળી આવે છે, જે ઉપરથી સિદ્ધ થાય છે કે વિદ્ધા અને બુદ્ધિ, ધર્મ અને ઉદારતા તથા દાન અને પુણ્યની પ્રવૃત્તિ કોઈ ખાસ ન્યાતની સ્વીચ્છામાંજ જોવામાં આવતી એમ નહેલું. પ્રત્યેક જલિ અને પ્રત્યેક વર્ણમાં એ પ્રવૃત્તિ વિદ્ધમાન હતી.

બૌદ્ધયુગમાં ખાળલમનહેલાતાં. કન્યા પુણ્યવયની થતી લારેજ તેનું લમ થતું. વરની પસંદગીની ખાખતમાં તેને સ્વતંત્રતા હતી. વિધવાવિવાહ નીચ જલિઓમાંજ નહિ પણ ઉચ્ચ જલિઓમાં પણ થતો હતો. ખાળક સમજણેણા થાય ત્યારેજ તેને પરણ્યાવવાનો

વિચાર કરવામાં આવતો. પ્રેમ અને સંવનનનો રિવાજ પણ હોય એમ જણ્ણાય છે. કુમારિકાઓનાં લગ્ન પણ ચુવાસસ્થાને ગ્રાસ થતાં લગ્ની થતાં નહોતાં. મામાની પુત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ રાજ-કડુંઘામાં અને ખાસ કરીને શાકાય વંશીઓમાં પ્રચલિત હતો.

સ્વીઓને ભષ્ટ ગળ્ણીને એકદમ ત્યલુ દેવામાં નહોતી આવતી. અંધપાલી ગણ્ણિકા તથા સમાજથી ભષ્ટ થયેલી બીજુ કેટલીક સ્વીઓ પ્રત્યે ભગવાન તથાગતે ખતાવેલી દયા તથા સહાતુભૂતિ એ વાતની સાક્ષી પૂરે છે અને પ્રકટ કરે છે કે બુદ્ધિની ફર્ખાનતાને લીધે—મનુષ્યમાં રહેલા કુદરતી સ્વભાવને લીધે—ઇદ્રિયના વિકારને વશ થઈ સત્પથમાંથી ચંગેલી સ્વીઓને પણ સુધારી શકાય છે અને એમના જીવનનો વિશેષ તિરસ્કાર ન કરીએ તો તેઓને હાથે પણ સમાજની અધિક લાલદાયક સેવા થઈ શકે છે.





## ૧-માદ્રી



માદ્રી રાજ પાંડુની પત્ની અને નકુલસહદેવની  
માતા માદ્રી નથી; પણ પ્રાચીન કાળની એક  
બીજું સત્તારી છે. એ સમયમાં શિષ્ય દેશમાં  
સંજય નામના એક રાજ રાજ્ય કરતો હતો.

તેના કુમારતું નામ વેસ્સાંતર હતું. રાજકુમાર ધણ્ણો પુષ્યાત્મા  
અને દાન કરવામાં ભૂટા હાથવાળો હતો. તેમના રાજ્યમાં ધોળા  
હાથી હતા અને એમ મનાતું ડે, એ હાથીઓના પ્રતાયે શત્રુઓ  
એ રાજ્ય ઉપર આફ્કમણું કરીને ક્ષાવી શકતા નહોયાત. એક દિવસ  
કલિંગ દેશના આઠ પ્રાહ્ણો આવીને રાજકુમાર પાસેથી માગીને  
એ ધોળા હાથીઓ દાનમાં લઈ ગયા. પ્રણ, એ વાતની અખર  
પડતાં ધણ્ણી ગુરસે થઈ. હું પોતાના રાજ્ય ઉપર અવશ્ય આકૃત  
આવશે એવો લય એમને ઉત્પન્ન થયો. પ્રણજનેાએ જઈને રાજ  
સંજય આગળ પ્રાર્થના કરી. એ વખતના રાજ્યો ધણ્ણાજ ન્યાયી  
અને નિષ્પક્ષપાતી હતા. મહારાજ સંજયને પ્રણની ઇરિયાદ  
વ્યાજખી જણ્ણાઈ અને તેમણે પુત્રને દેશનિકાલની સંબન્ધ કરી.

રાજકુમારને જ્યારે પિતા તરફની વનગમનની આજાની  
અખર પડી ત્યારે તેણે સાતસે વસ્તુઓના મહાદાનની હિયા કરવા  
સારુ એક દિવસની સુદત માણી. એ આખો દિવસ એણે દાનાલય-  
માં જઈને અનેક ડિંમતી પદાર્થોનું દાન કર્યું અને રાત પરી ત્યારે  
મનમાં વિચારવા લાગ્યો: “કાલ સવારે ભારે આ દેશ છોડીને  
ચાલ્યા જવું પડશો. ચાલ, હમણુંજ પિતામાતાની પાસે જઈને  
વિદાય લઈ આવું તથા છેક્ષા પ્રણામ પણ કરી આવું. રાતો રાતજ  
હું મહેલનો ત્યાગ કરીશ અને મહેલમાં ફરીથી પ્રવેશ નહિ કરું.”

ત્યાર પછી વેસ્સાંતર અશ્વોવાળા રથમાં બેસીને પિતાના મહેલ-  
માં ગયો. તેની રાણી માદ્રી મનમાં ને મનમાં વિચારવા લાગી: “હું  
પણ ફરીથી આ મહેલમાં પ્રવેશ નહિ કરું. હમણુંજ સાસુજી તથા

સસરાળને ભક્તિપૂર્વક પગે લાગી આવીને, તેમની પાસે વિદ્યાય માળીને હું પણ પતિહેવની સાથે સાથે જઈશ.”

એવો વિચાર કરીને રાજ્યપુત્રવૃદ્ધ માદ્રી પણ એજ રથમાં પતિની સાથે ચઢી એડી. વેસ્સંતરે પિતાની સમીપ જઈને તેમના અરણુમાં પડીને ભક્તિપૂર્વક કહેવા માંદયું: “ પ્રભાયે મને દેશનિકાલ કર્યો છે. કાલે હું બંંક પર્વત તરફે જવા નીકળીશ. પિતાલ ! મનુષ્યમાત્ર લાલ અને નુકસાન, યથ અને અપયથ, નિંદા અને સ્તુતિ, સુખ અને હુઃખ એ આઠ પ્રકારના લોકધર્મને આધીન છે. આ હુનિયામાં લુલમાત્રને કર્યી સુખ અને કર્યી હુઃખ લોગવવું પડ્યું છે, પછે છે અને પડશે. આળી જિંહણી સુધી લાગલાગટ સુખ કોઈ પણ મનુષ્ય કહાપિ લોગવી શકતો નથી. બધાને મૃત્યુના સુખમાં એક દિવસ સપદાવું પડશે, એમ ધારીને એ બધા હુઃખના વિચારથી ત્રાસ પામીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના ઉદેશથી મારા મહેલમાંની બધી વસ્તુઓને મેં અપવાળા લોકોને દાન કરી હીધી છે અને તેમની પ્રાર્થનાનુસાર આ રાજ્યનો પણ ત્યાગ કરવાની મને ઇરજ પડી છે. માણુસ સંપત્તિ અને વિષત્તિ-માંથી કર્યી પણ સંપૂર્ણરૂપે સુકલ રહી શકતો નથી, માટે હાલ તો જે કે હું વાઘ, ચિતા, રીંછ વગેરે ક્ષાડી જાનારાં વિકરાળ જનવરેથી વસાયલા ઘોર ભયાનક જંગલોમાં હીનતાથી વાસ કરીશ, તોપણું મારી ખાતરી છે કે, એ અરણ્યવાસમાંજ મારે હાથે કોઈ એવું કાર્ય થશે કે, જેથા મારું પ્રયોજન સિદ્ધ થશે. પિતાલ ! આ મોહ અને સુખમાં આપજ નિરાંતે પણ્યા રહો !”

પિતાની સાથે એ અમાણે વાતચીત કરીને વેસ્સંતર માતાની સમીપ ગયો. અને માતાને સંખોધન કરીને કહેવા લાગ્યો: “ મા ! તારા સ્નેહ અને લાડનો બદલો હું કોઈ દિવસ વાળી શકું એમ નથી. મેં મારી ચોતાની મિલકત દાન કરી હીધી તેથી પ્રભજનો-ને ધણું લાગી આવ્યું છે. એ પાપને લીધે મને દેશવટો મળ્યો છે. બંંક પર્વત ઉપર જઈને ગરીબાઈથી સંન્યાસીરૂપે હું મારું લુધન ગાળીશ. માતા ! મને શુલેચ્છાઓ સહિત વિદ્યાય કરો !”

જનનીએ કહ્યું: “ એટા ! બંંક પર્વત ઉપર જઈને તું યતિ જનીને અભિજાન અને સમાપત્તિ પ્રાપ્ત કરને. હું ઝુશીથી તને રણ આપું છું; પણ આ મારી કોમળાંગી વધૂએ કર્યી પણ ટાંતડકો

વેઠ્યો નથી. ગંભીર અરણુય એ તેને રહેવા લાયક સ્થાન કદાપિનથી. જાનની શોધખોળ કરવા નીકળેલા યતિની સાથે જરૂર, એ તેને માટે વ્યાજબી નથી. દીકરા ! તારી સાથે એને પણ વનમાં લઈ જવાની જરૂરજ શી છે ? પુત્ર સહિત એને તો ઘર આગળજ રહેવા હે ! ”

વેસ્સંતરે કહ્યું : “ માતા ! મારા પોતાના હેઠ ઉપર પણ મારી કોઈ સત્તા નથી, ખાસ કરીને હાલ તો હું મારા ખરીદેલા એક શુલામને પણ મારી સાથે જવાની કરજ પાડી શકું એવી દશામાં નથી. માદ્રીની પોતાની મરજ મારી સાથે જંગલમાં આવવાની હોય તો લદે આવે અને ઘેર રહેવાની હચ્છા હોય તો સુઝેથી ઘર આગળ રહે. ”

માદ્રીકરાની આ પ્રમાણે વાતચીત ચાલી રહી હતી તે સંભળી-ને રાની સંજ્ય પણું આગળ આવીને કહેવા લાગ્યા : —

“ દીકરી માદ્રિ ! તમને તો રાજમહેલમાં રહીને ચંદન આહિ સુગંધી દ્રવ્ય શરીરે ચોગવાનો અભ્યાસ છે. અરણુયમાં જઈ મૂળથી શરીરને ખરડી નાખવાનો અલિલાપ શા સાર્દ કરો છો ? તમે તો કાશીમાં બનેલા લાખો ઝપિયાનાં કિંમતી વખ્ત પહેરનારાં છો, હવે વલ્લક ધારણું કરવાની અલિલાપા શું કામ કરો છો ? વધુ-માતા ! અરણુયનો નિવાસ કાંઈ નાનાં છોકરાની રમત નથી. સંસારન્યાગી અને હુંઘ વેઠવાના અભ્યાસી સાધુસંતોને તથા રાજ્ય તરફથી સંભળ પામેલા આપરાધીઓને પણ એ વસ્તો લાગે છે, તો તમારું શું ગન્યું ? તમે તો શરીર અને મન અન્નેમાં હુર્ભણ છો, સહજ વાતમાં લયભીત થઈ જાઓ છો, અરણુય એ તમારે ચોંચ સ્થાન નથી; માટે મારી એજ સલાહ છે કે, તમે કુમારની સાથે ત્યાં જશો નહિં. ”

માદ્રીએ ઉત્તર આપ્યો : “ આર્ય ! આપ જે કાંઈ કહી રહ્યા છો તે અધું ખર્દ છે; પરંતુ હું સ્વામીથી વિભૂતી પડીને આંગ ઉપર તેલ, કૂલેલ, ચંદન વગેરેનો લેપ કરવાની કે, કુમળી સુખશાયા-માં સૂવાની કે, લાખો ઝપિયાના મૂહ્યનાં કાશીનાં વખ્તો પહેરવાની અલિલાપા જરાયે રાખતી નથી. હું તો સ્વામીની સાથે ધૂળવાળા રસ્તાઓમાં ફરવાનું, વલ્લક ધારણું કરવાનું અને કંદ, મૂળ જે કાંઈ મળે તે ખાઈને, અરણુયમાં લોંચ ઉપરજ સૂઈ રહેવાનું પસંદ કરું છું. એમાંજ હું પરમ સુખ માણું છું. મારે માટે તમે જરાયે

ક્રિકર કરશો નહિ.”

મહારાજ સંજયે હવે માદ્રીને ભયભત્તાવવા માંઝ્યો: “એટા! મારી વાત ધ્યાન દ્યાન દ્યાન સંબળ. અરણ્ય એ આપણા રાજમહેલ જેવું નથી; ત્યાં તો લમરા, મધમાખ, વીંઠી વગેરે ધણ્ણા જીવ છે જેના કરવાથી બહુ વેદના થાય છે. એ કલેશ તમારાથી નહિ સહન થાય. વળી ત્યાં માણુસને આપો ને આપો ગળી જાય એવા મોટા અજગર રહે છે. વળી ત્યાં કાળા અને મોટા મોટા વાળવાળાં રીંછ રહે છે. એક વાર નજરે પણ્યાં તો પછી આડ ઉપર ચઢી ગયે પણ છુટકો નથી. વળી ત્યાં એક નહીને કાંઠે સોયની આપી જેવાં તીણું શીંગાંવાળા પાડાએ રહે છે. આટલી બધી આપત્તિ-આમંથી તમે તમારું રક્ષણ કેવી રીતે કરશો? સંતાનોનું સુખ જૈયા વગર વાછરડું આવાઈ ગયું હોય એવી જાયની પેઠે તમે વલખાં નહિ મારો કે? દીકરિ! અહીંચાં મહેલમાં બેઠે બેઠે ડોઈ ડોઈ વાર શિયાળની ચીસ સંબળો છો, તો તમને મૂચ્છી આવી જાય છે, તો પછી બંદ પર્વત ઉપર જખું એ તમારે માટે કેવી રીતે સંબંધિત છે? બધોરે પક્ષીઓ એકદાં થદને કલરવ કરે છે, તેને અરણ્યમાંથી જે પડવો નીકળે છે તે ધણ્ણાજ ભયાનક હોય છે. જે વનમાં આવા અનેક પ્રકારના ભયનાં કારણો હાજર છે ત્યાં તમે કેવી રીતે રહી શકશો?”

માદ્રીએ ઉત્તર આપ્યો: “હે હેવ! હે શિબિરાન્યના અધી-શ્વર! અરણ્યમાં આપે વર્ષાવેલી બધી આકાશો હોવા છતાં પણ હું સ્વામીનું અનુગમન કરીશ અને એમ કરવાથી જેટલાં કષ પદશે તે બધાં ધૌરજપૂર્વક સહન કરીશ. હેવ! હું છાડીને ફૂક્ત સ્વામી-ના સુખમાંજ હું ભાગ પડાયું, તો પછી હું પતિની સહધર્મિણી ફેવી રીતે થદ શકું? ગાડા વનમાં થદને જવાનો પ્રસંગ આવશે, ત્યારે હું સ્વામીની આગળ આગળ જઈશ અને ઘાસ તથા નાનાં નાનાં જાડવાંને સ્વામીના માર્ગમાંથી ખસેડીને આધાં કરીશ. હું તેમની સગવડ પ્રત્યે નજર રાખીશ, એટલે સુધી કે કોમળ વેલ કે ઘાસનું તણુખાં પણ એમને અડવા ન પામે તેની કાળજી રાખીશ. આર્ય રમણીને માટે સારા પતિનો સંયોગ એ હુલ્લેલ વસ્તુ છે. સારો પતિ મળે એટલા સારુજ કન્યાએ. કર્તાવ્યપરાયણ થદને સાખાપણી સેવાચાકરી કરતી રહે છે, સદાચાર અને પવિત્રતાપૂર્વક

નીતિનું પાલન કરે છે અને કાળજીપૂર્વક સારાં વખાલૂષણું ધારણ કરે છે. હેવ ! ઓનિલિને માટે ભરથારહીન થવું એ અયંત મોઢું હુઃખ છે, તો પછી આપ સમજુ થઈને પતિનું અનુકરણ ન કરતાં ઘેર એસ્થિને વિધવાના જેવું જીવન ગાળવાની મને સલાહ આપો છો ? હું બીજું એક દ્વારાંત આપની આગળ રખ્યું કરીશ. મનોહર પુલિનક્રોચ અને સુંદર તટવાળી નહીં હોય પણ જે એમાં જળ ન હોય, તો બધું વ્યર્થ છે. ભાંચા કોટ અને કિલ્લાઓ, પહેરેણીરો, ઉધાન, સુંદર દરવાજાઓ, હવેલીઓ એ બધાથી સુશોભિત નગર હોય; પણ જે એમાં શાસન કરનારનો અભાવ હોય તો એ બધું ફૈગટ છે. માણુસની પાસે ધન અને કુળ એજે હોય પણ વિધા ન હોય તો એ એજે વૃથા છે. માણુસના શરીર ઉપર લાખો ઇપિયાનાં વખાલૂષણું હોય પણ જે તેનામાં સારી ચાલચલગત ન હોય તો એ બધું મિશ્યા છે; એટલું જ નહિ પણ રમણીને દર્શ લાઇ હોવા છતાં જે એને સ્વામી ન હોય તો એનું જીવન વૃથા છે. વળી એક ઉદાહરણ આપને બતાવું છું. જેવી રીતે રથની શક્તિ જ્યાપતાકા છે, અભિની શક્તિ ધૂમાડો છે, રાજ્યની શક્તિ રાની છે, મનુષ્યની શક્તિ વિધા છે તેમ રમણીની શક્તિ તેનો સ્વામી છે. આર્થ ! કોઈ પતિતા સ્વી સ્વામીના સુખદુઃખમાં ભાગ પડાવે છે, ત્યારે દેવતાઓ, આદ્યાણું અને સાક્ષાત ઈંદ્ર પણ એની પ્રશંસા કરે છે. હવેથી આપના પુત્ર લગવાં વસ્તુ ધારણું કરશો, એટલે હું પણ એમની સાથે એવાંજ વસ્તુ ધારણું કરીને બધી ઋતુઓમાં તેમના હુઃખમાં ભાગ પડાવતી સાથે ને સાથે રહીશ. પર્વતોમાં કે ઝીણુંમાં કોઈ ઝાડી કે કરડી ખાનાર જનવર આવશે, તો પહેલી હું આગળ થઈશ કે પહેલું મને મોત આવે. એકલી તો આ રાજ્યમાં રહીને આખા રાજ્યની શાસક થવાની પણ મારી મરળ નથી. આપના પુત્ર રાજ્ય કરતા હોત, તો જરૂર હું એ રાજ્યસુખમાં ભાગી બનત. જે રમણી સુખમાં તો સ્વામીની સાથે રહે પણ હુઃખમાં તેનો સંગ છાડી હે, તે રમણી પિશાચી અને રાક્ષસી જેવી નિરૂપ છે; માટે હું તો મારા સ્વામીની સહચારણીજ થઈશ.”

મહારાજ સંજયે કહ્યે : “વધૂમાતા ! સ્વામીની સુપતનીરૂપે તેના સુખદુઃખની ભાગીદાર બનવા સંભંધી તમે જે જે દલીલો ભતાવી તે બધી વ્યાજણી છે. એને લીધે તમને અરણુયમાં જતાં રૈકવાની મારી જરા પણ ઈચ્છા નથી; પણ મારાં આ એ કૂલ

જેવાં બાળકોનું શું ! તેમને માટે તો અરણુય ચોણ્ય સ્થાન નથીજ. તમે એમને મારી પાસેજ રાખતાં જાઓ. તમારાં કરતાં પણ વધારે કાળજી અને લાડથી એમે એમને ઉછેરીશું.”

માદ્રીએ ઉત્તર આપ્યો: “ પિતાજ ! આપનાં એ સંતાનોને હું પ્રાણું કરતાં પણ અધિક ચાહું છું. અરણુયમાં વસતી વખતે, નગર અને રાજમહેલની વાસનાએ મનમાં જગ્યી આવશે તે વખતે હુઃખને લીધે મરણુંતોલ દશા થઈ જશે. એવે સમયે આ સુકુમાર પ્યારાં બાળકોના સુખ સામું જોઈને હું હુઃખ વીસરી જઈશ અને શાંતિ મેળવીશ.”

પરંતુ રાજ સંજયનું ચિંતા એટલાથી શાંત થયું નહિ. પૌત્ર-પૌત્રીની ગ્રત્યે એમને વિશેષ સ્નેહ હતો; એટલે વનનાં હુઃખ ફરીથી ગણ્યાવીને તથા અલીંથાં જે રાજ્યૈભવમાં બાળકો જાહીરી રહ્યાં છે તેની સાથે સરખાવીને ફરીથી એમને રાજમહેલમાંજ મૂકી જવા સારુ માદ્રીને આગઢ કર્યો. તેના ઉત્તરમાં માદ્રીએ જણાવ્યું: “ આર્ય ! આપ જરા પણ ચિંતા રાખશો નહિ. આપનાં પૌત્ર-પૌત્રીની ફેખરેખ હુંજ રાખીશ. મને જે કંઈ આવાપીવાનું અને પહેલવાએઠવાનું મળશે તે પહેલાં એમને આપીને પછી હું કામમાં લઈશ. એમને કોઈ પણ જતની અડચણ ન પણ તેને માટે હું ખાસ કાળજી રાખીશ.”

સસરા અને પુત્રવધૂ માદ્રી વચ્ચે આ પ્રમાણે વાતચીત થતાં થતાં આપી રાત વીતી ગઈ અને પ્રભાત થવા આવ્યું. એ વખતે ચાર ઘોડાનેડોલો રથ મહારાજ સંજયના મહેલને બારણે આવીને વાટ જેતો હતો. માદ્રીદીવા વિનયપૂર્વક સાસુસસરાને પરો પડી, વિહાય મારીને તથા દાસીએ સાથે છેવટની થોડી ચીઠી વાતો કરીને, બાળકોને સાથે લઈ રાજમહેલમાંથી વિહાય થઈ અને રાજ વેસ્સંતરના પણ પહેલાં રથમાં એસી જઈ તેની વાટ જેવા લાગી.

ત્યાર પછી રાજકુમારે પણ બહુ સન્માનપૂર્વક જનકજનનીની પ્રદક્ષિણા કરીને એ રથમાં પ્રવેશ કર્યો અને બંક પર્વત લાણી પ્રચાણ કર્યું. હનરો દાસદાસીએ તેમને વળાવવા સારુ ગયાં.

માદ્રીદીવીના જીવનનો ઉત્તરાધ્ય પણ છોધજનક છે. પવિત્ર સીતાદીવીના ઉચ્ચય ચરિત્રે, પતિભક્તિનો ડેવો સુંદર અને ઉજાનવલ આદર્શ આર્યરમણીએ આગળ મુક્યો છે અને સંસ્કારી પતિ-

મતા રમણીએના જીવનમાં એ ઉચ્ચય આદર્શનું કેવી ખૂબી સાથે પુનરાવર્તન થતું રહ્યું છે, તે આ ચરિત્રના અવલોકન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.

વનયાત્રામાં ચાચકોએ રાજકુમાર પાસેથી રથ પણ માગી લીધો, એટલે વેસસંતરે જાલિ નામના પુત્રને તેડી લીધો અને રાણી માદ્રીએ કષણકિના નામની પુત્રીને કેઠે બેસાડી. પતિપત્નીએ પરો ચાલીને સુસાફરી કરવા માંડી અને બાંક પર્વત ઉપર પહોંચીને એક રમ્ય સ્થાનમાં સુંદર પર્ણું કુટિ બાંધીને નિવાસ કરવા લાગ્યાં.

એ પ્રમાણે ઘણો સમય વીતી ગયો. એક દિવસ પતિત્રતા માદ્રીહેવી પતિને સારુ સવારના પહોંચમાં ફળ, કંદમૂળ તથા પુષ્પ લાવવા સારુ ગાઈ હતી. એવામાં જુલા નામના એક પ્રાણીએ આખ્યાણે રાજકુમારને પ્રાર્થના કરી કે, “હું વૃદ્ધ પ્રાણીએ છું. મારી પત્નીને દાસદાસીની જરૂર છે. આપ આપનાં પુત્રપુત્રીને આપો તો મારું ઘડપણું સચ્ચવાય.”

વેસસંતર ના કહેવાનું શીજ્યાજ ન હતા. તેમણે અને બાળકો તરતજ પ્રાણીએ સોંપી દીધાં. માદ્રીહેવી કુળમૂળ લીણીને આશ્રમમાં આવી, ત્યારે એણે સંતાનને જેચાં નહિ. આકુળવ્યાકુળ થઇને તેણે પતિને સમાચાર પૂછ્યા, પણ એમણે તો મૌનત્રત લીધું હતું. રડતી કકળતી રાણી જંગલમાં બાળકોની શોધ કરવા લાગી. એના વિલાપથી અરણ્યવાસી પશુઓનાં હૃદય પણ પીગળ્યાં.

બીજે દિવસે પતિએ પત્નીને બાળકોના દાન સંખ્યાએ ખરી દુકીદત કહી, ત્યારે એ શાંત ચિંતની સતીએ એટલું કહ્યું કે, “આપે બાળકોનું દાન કર્યું તેમાં મારી પૂર્ણ સંમતિ છે, પણ આ વાત આપે મને કાલેજ કેમ ન કહી ?”

વેસસંતરના દાનની પ્રશાંસા સાંભળીને ઈદ્રને ઘણો ઉર લાગવા માંડ્યો કે, આ રાજ પત્નીને પણ કાંઈ દાનમાં ન આપી હે. એકવાર ઈદ્રે સાધુનો વેશ ધારીને એની કુટિરમાં પ્રવેશ કર્યો અને સહૃદયણી ભાર્યા માદ્રી દાનમાં માગી.

વેસસંતરે તરતજ સાધુવેશધારી ઈદ્રના હાથમાં પાણી મૂકીને પત્નીનું દાન કર્યું. ઈદ્રે પ્રસન્ન થઇને પોતાનો વેશ બદલીને ખરું સ્વરૂપ ધારણું કરીને જણાવ્યું: “મહારાજ ! આ પતિત્રતા માદ્રી હેવી હવે મારાં થઈ ચૂક્યાં; પણ એક અનામત વસ્તુ તરીકે હું

એમને તમારી પાસે મૂકી જાઉં છું. તેનું સારી એકે પાલન કરનો અને હવે બીજા કોઈને એમનું દાન કરવાનો આપનો હંક નથી રહ્યો એ ધ્યાનમાં રાખશો.”

શ્રીડા સમય પછી જૂઝક પ્રાણ્યાણની મારફતે રાજકુમારના નિવાસના ખબર મળ્યા અને એ પોતાના પ્રધાન સાથે બાંક પર્વત ઉપર જઈને પુત્ર તથા પુત્રવધૂને તેડી લાવ્યા.

કહેવાય છે કે, વેસ્સંતર એ પૂર્વોશ્રમના બોધિસત્ત્વ હતા અને એ જન્મમાં પ્રિયપત્ની અને બાળકોનું દાન કરીને ‘દાનપારમિતા’ શુણુનો અસ્યાસ કર્યો હતો.

દેવી માદ્રી (મહી) તું જીવન ખરેખર બોધક અને પ્રશાસાને પાત્ર છે.\*

## ૨-ચુલ્લબોધિની પત્ની



બિસત્ત્વ પૂર્વજન્મમાં એક વાર કાશી રાન્યમાં એબી થાણ્ય કુદુંણમાં જન્મ્યા હતા. એ જન્મમાં એમનું નામ ચુલ્લબોધિ હતું. તેમની પત્ની વાણી સુશીલ હતી. લભ થઈ ગયું હતું, પણ પતિની વૃત્તિ વૈરાગ્ય તરફ હોવાથી એ વિહુપી તરણીએ પણ પોતાની કામવૃત્તિએને અંકુશમાં રાખી અને પતિને ધર્મસાધનમાં મદહર્ય થઈ પડવાના હેતુથી તેના વ્રતમાં લંગ પડવા હીથો નહિ. આપરે જ્યારે ચુલ્લબોધિનાં માતપિતા મરણ પામ્યાં; લારે તેણે કહ્યું: “ ભદ્રે ! અમારા પૂર્વજેની આ અપાર સંપત્તિ તું કે અને દાનાદિક પુષ્ટ્યકર્મો કરીને આ ધરમાં સુખેથી કાળ વ્યતીત કર. મને ગૃહસ્થાશ્રમનો હવે કંટાળો આવ્યો છે. હું પરિવ્રાજક વેશો હિમાલય ઉપર વાસ કરવા ઈચ્છું છું.”

તેની પત્ની મોદી: “ આર્થપુત્ર ! પુરુષોએ પ્રવન્યા વેશ ધારણ કરવો અને સ્વીએઓ નહિ, એવો નિયમ છે શું ? ”

બોધિસત્ત્વે કહ્યું: “ એવો કાંઈ નિયમ નથી; તો પણ તું મોટા

\* શ્રીયુત ગનેદ્રલાલ ચૌધરીના ‘શસ્ત્રુર એ પુત્રવધૂ’ નામના લેખ તથા આચાર્ય કૌશામ્ભીના ‘શુદ્ધલોલાસારસંશ્લેષણ’ ઉપરથી.

કુળમાં જન્મેલી સુકુમાર ઓ છે. તારાથી અરજુયવાસનાં હુઃખો  
સદ્ગાં જરી નહિ. તેથી હું કહું છું કે, તારે આ ઘરમાં રહી  
દાનાં પુરુષકર્મ કરવાં.”

બોધિસત્ત્વે ભાર્યાને પોતાની સાથે ન આવવાને ઘણી સમ-  
નાવી, પરંતુ તે સત્ત્વશીલ ઓએ ભાવિ હુઃખોને ન ગણુકારતાં  
તાપસ વેશ સ્વીકારીને પતિનો માર્ગ થણું કર્યો. થાડો સમય  
અનેએ ઇળમૂળ ખાઈને હિમાલયમાં વ્યતીત કર્યો. ત્યાર પછી  
તેએ બિક્ષા માગવા સારુ કાશી રાજ્યમાં આવી પહેંચ્યાં.

કાશીરાજ એક દિવસે ખગીયામાં ફરવા ગયો. હતો, ત્યાં એણે  
એક વૃક્ષ નીચે બોધિસત્ત્વને અને બીજા વૃક્ષ નીચે તેની પત્નીને  
દીકાં. રાજ ઓનું રૂપ જોઈને મોહિત થઈ ગયો. અને કંઈ પણ  
પરવા ન કરતાં એ ઓને પોતાના મહેલમાં લઈ જવાનો સિપાઈ-  
ઓને હુકમ આપ્યો. રાજમહેલમાં રાજને તે ઓને લલચાવવાનો  
ઘણોયે પ્રયત્ન કર્યો પણ લથ કે લાલચ કશાની એ પતિવતા  
ઉપર અસર થઈ નહિ. આખરે રાજને પણ ખગાતકારથી સતીનું  
શિયળ લંગ કરવાનો વિચાર માંડી વાળીને તેને બોધિસત્ત્વની  
પાસે મોકલી આપી.

પતિની ઉચ્ચય અભિવાષાએ પોષવા માટે, હુઃખમાં પતિની  
સહયારિણી થવા માટે અને આપત્તિમાં પણ પાતિપ્રત્ય ધર્મમાં  
અટળ રહેવા માટે ચુલ્લાયોધિની પત્રી આપણી પ્રશંસાને પાત્ર છે.\*



\* ‘ખુલ્લાયોધિની પત્રી’ માંથી સાભાર ઉદ્ધૃત.



## ૩-માયાદેવી

એ ડોગિયા દેશના રાજ મહાસુપ્રથુદ્ધની જ્યેષ્ઠ કન્યા હતાં. હેવદહ નગરમાં એમનો જન્મ થયો હતો. એમના જન્મ સમયે આદ્યાણુએ ભવિષ્યવાણી કહી હતી કે, “આ કન્યાને પેટે ચક્રવર્તી કુમાર જન્મ લેશો.” પિતાને વેર એમને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળ્યું હતું અને અનેક સદ્ગુણ્યાથી એમનું જીવન વિભૂષિત થયું હતું. કપિલવસ્તુના પરાકર્મી રાજ શુદ્ધોદન સાથે એમનું લભ થયું હતું. રાજાએ એમને પટરાણીઝે સ્થાન્યાં હતાં. માયાદેવીમાં મિથ્યા માયા લેશમાત્ર નહોતી. એમનું દૃપ અધૂર્ય હતું. આજાનરૂપી અંધકારનો એમણે નાશ કર્યો હતો. પ્રબન્ની સાથે એમની વર્તાણું ક માતા સમાન હતી. સદા એમના કલ્યાણુ-માંજ પોતે તહીની રહેતાં. સુરણીએ પ્રયે સાક્ષાત લક્ષ્ણિરૂપ જનીને આજાધીનતા દાખલતાં. દૂર્કાણુમાં એ કે રાજ શુદ્ધોદન-ના રાજમહેલમાં તથા તેના આખા રાજ્યમાં દેવી માયા એક લક્ષ્મીરૂપ હતાં. પ્રબન્નો પણ તેમના પ્રત્યે પૂરો આહરભાવ હતો.

૨ મહાપુરુષદારા આખા જગતનું કલ્યાણ થવાનું હતું, ભૂત-દ્યા, મૈત્રી, કરુણા, ક્ષમા આહિ સદાચારનો સંહેશો. જગતને જેની મારફતે સંભળાવવાનો હતો, તેની માતા થવાનું વિધાતાએ સાધી માયાદેવીને માટે નિર્માણ કર્યું હતું.

આખાદી પૂર્ણિમા પહેલાં સાત દિવસ ઉપર કપિલવસ્તુમાં એક મોટા ઉત્સવનો આરંભ થતો. માયાદેવી સાત દિવસ સુધી ચંદ્રનુષ્ઠયી શરીર શાણુગારી અતિ આનંદથી ઉત્સવમાં ભાગ લેતાં. માયાદેવી તદ્દન નિર્બંસની હતાં. દાર્ઢને કહી પણ સ્પર્શ ન કરવાનો એમને નિયમ હતો. અને એ નિયમનું એમણે જિંદગી-પર્યાત પાલન કર્યું હતું. બીજાં ક્ષત્રિય લીપુરુષો એ સમયના રિવાજ મુજબ એ ઉત્સવમાં દાડ પીતાં, પણ માયાદેવી સર્વ પ્રકાર-ના માદક પદાર્થથી અલિસજ રહેતાં.

એક વરસ આ પૂર્ણિમાને દિવસે માયાહેવીએ અંધળાંગળાં વગેરે અનાથાને અને શ્રમણુ આદ્ધારોને પુષ્કળ દાન દીધાં અને રાતે ઘણોખરો વખત શાબ્દની કથા સાંલળવામાં ગાજ્યો.

એ રાતે સુઈ ગયા પછી એમને સ્વમ આવ્યું છે, ચારે દિશાના રક્ષક હેવો. તેમને જાંચકીને હિમાલય પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં એક વિશાળ શાલ વૃક્ષની નીચે મૂકી દીધાં. પછી એ ચારે દેવોની સ્વીચ્છાએ આવીને માયાહેવીને દિવ્ય ગંધેઠકથી સનાન કરાવ્યું અને દિવ્ય વખાલંકારથી શાણુગારીને એક સુવણ્ણુ વિમાનમાં ઉત્તમ પલંગ ઉપર પૂર્વમાં માશું કરીને સુવાર્યાં. પછી એક ઘણો હાથી ત્યાં આગળ આવ્યો અને પોતાની રૂપેરી સૂંઠમાં એક ક્ષેત્ર કમળ ઘાલીને માયાહેવીની વણુ પ્રદક્ષિણું કરી અને તેમની જમણી ફૂફમાં થઈને ધીરે ધીરે તેમના પેટમાં પેઠો.

પ્રાતઃકાળે રાણીએ સ્વમની વાત સ્વામીને જણ્ણાતી. રાજાએ આદ્ધારો તથા જેશીએને બોલાવીને સ્વમનું વૃત્તાંત જણ્ણાવ્યું અને તેનું ક્રણ પૂછ્યું.

આદ્ધારોએ કહ્યું: “એનો અર્થ એ છે કે, મહારાણીને પેટે એક મહાન પુરુષ જન્મવાનો છે. એ જો ગુહસ્થાશ્રમમાં રહેશે તો ચક્રવર્તી રાજ થશે. સંન્યાસી થશે તો યુદ્ધ થઈને જગતનું અરજાન દ્વર કરશે.”

આજથી મહારાણી માયાતું માન વદ્યું. રાજ યહુજ પ્રેમ અને કાળજીપૂર્વક એની સાથે વર્તન રાખવા લાગ્યો.

માયાહેવી સગર્ભ થયાં. મૂળથીજ એમનો સ્વભાવ દ્વારા હતો, પણ સગર્ભ થયા પછી જનસમાજ પ્રત્યેની દ્વારામાં વધારોજ થતો ગયો. વિષયવાસના એમના હૃદયમાંથી તદ્દન ચાલી ગઈ.

નવ માસ પૂરા થવા આવ્યા, એવામાં એમને પિયેર જવાની ઇચ્છા થઈ. કપિલવસ્તુથી દેવદહ જતાં માર્ગમાં દૂંભિની નામના એક સુંદર બગીચામાં તેમણે પડાવ નાખ્યો હતો. ત્યાં આગળજ તેમને પ્રસવપીડા થઈ અને બ્રાહ્મિસત્ત્વ-જૌતમયુદ્ધનો. જન્મ વૈશાખ સુદ્દિ પૂર્ણિમાને દિવસે થયો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડ્યું

પુત્રના પ્રભાવને જેઈને માયાહેવી હર્ષબેદાં થઈ ગયાં, અને સિદ્ધાર્થ સાત દિવસનો થયો. એટલામાં તો એ દેવલોકમાં સિદ્ધાંયાં.



## ४-महाप्रजापति गौतमी

या पवित्र सन्नारीनो जन्म गौतमसुखना जन्मनां योगांक वर्ष पूर्वे केणिया देशनी राजधानी देवदहु (देवदह) नामना नगरमां शाकचवंशना महासुप्रसुखने थां थयो हुतो. एमनुं जोत्र गौतम छोवाथी, ए गौतमी नामथी प्रसिद्ध थयां छे. पूर्वजन्मनां सत्कर्मोने लीघे बाल्यावस्थाथीज एमनो स्वलाव धण्डो सारो हुतो. सदाचार अने कर्तव्यपरायणुता ए एमना विशेष शुणु हुता. युद्धहेवनां माता भायावती एमनां मोटां अडेन थाय. जन्म समये अन्ने अडेनोनां शरीर उपर शुभ-चिह्नो जण्णायां हुतां. ज्योतिष अने सामुद्रिक जाणुनारा विद्वान आळण्डो अन्नेना जन्माक्षर अनावीने लविष्यवाणी कडी हुती के, “एमनां संतान अकवर्ती राज थशो, पछी अले ए मनुष्योना पार्थिव राज्यना के एमना हुद्यसाआक्यना राज थाय.”

देवदह नगरनी पासे रोहिणी नदीने किनारे कपिलवस्तु नाम-ना नगरमां शुद्धोदन नामनो राज राज्य करतो हुतो. तेनी साथे गौतमी अने तेमनां अडेन भायावतीनां लम थयां. वैशाख सुहि पूर्णिमाना पुष्य दिवसे भायावतीओ नेपाणनी तराईमां लूंभिनी नामक अगीयामां युद्धहेवने जन्म आयो. सुवावडमां सातमे दिवसेज भायाहेवीनुं मृत्यु थयुं. राजने हुवे धण्डी भोटी चिंता थवा लागी. जे पुत्रना जन्म समये ऋषिओ धण्डी भोटी भोटी आशा अंधावी हुती, जेनामां अस-भ्य शुल लक्षणो अताव्यां हुतां, तेनी माता परबोइ सिधावी. हुवे एने उछेरवाने भाटे स्नेहाण, रागदेव वगरनी, चतुर, शांत अने भातृपह लेवाने तैयार एवी झी क्यां ज्ञानवी? एना विचारमां राज निमझ थयो. महाप्रजापति गौतमीने एज समयमां नंह नामनो पुत्र सांपड्यो हुतो, एट्ले ए पण्ड नवरां नहेतां. भायाहेवीना मृत्यु पछी

એમને ‘અથમહિષી’, ‘મહાપ્રભતિ’ અને ‘પટરાણી’નું ‘પદ પ્રાસ થયું હતું, એટલે ધરસંસારની જવાભદરી પણ વધી હતી; પરંતુ સ્વર્ગવાસી બહેન ઉપર એમને નિઃસ્વાર્થ પ્રેમ હતો. વળી પતિની મૂઽઝવણું પણ એ પતિત્રતા સમજુ શકત્યાં હતાં. બોધિસત્ત્વ જેવા ઊજ્જવળ લવિષ્યવાળા કુમારને ઉછેરવાનો અને મોટી બહેનના પ્રેમનો બદલેવા વાળવાનો પ્રસંગ પ્રાસ થયો તો એને કહી પણ પાછો ન ડેલવો જેઠાં એવો ઉદાર વિચાર કરીને એ પરોપકારી રાણીએ પોતાના પુત્રને એક વિશ્વાસુ દાધને સોંપી દીધો અને બહેનના પુત્ર ગૌતમને સ્તનપાન કરાવવાનું તથા ઉછેરવાનું પોતે માથે લીધું. ધણું લાડારૂર્ક પોતાના પેટનું જ સંતાન હોય એ પ્રમાણે એમણે યુદ્ધહેવનું અત્યંત પ્રેમ સહિત લાલનપાલન કર્યું. આગકર્માં અનેક શુલ સંસ્કાર એમણે પોતાના શિક્ષણું અને સહાયાસશી દાખલ કર્યો. પ્રોફેસર ભાગવત વ્યાજધી લાંબે છે કે, “ગૌતમની પાછળી વયમાં જ્ઞાનલાલસા, દયા, ઉત્સાહ, યુદ્ધની તીવ્રતા, ઉદ્ઘોગ, વિશાદ દાખિ, કાર્યદક્ષતા, નેતા બનવાની કુશળતા વગેરે જે ગુણો જળ્ણાયા હતા, તેનું મોટું શ્રેય ગૌતમીનેજ હતું.”

યુદ્ધહેવ સંસારત્યાગ કરીને વનવાસી બન્યા તે સમયે મહાપ્રભતિના સ્નેહાળ હૃદયને ઘણ્ણો આધાત પહોંચ્યો હતો. અનેક વર્ષ પર્યાત ઉત્તર ભારતવર્ષમાં સુખ્ય સુખ્ય ગામોમાં ધર્મોપહેશ કરીને યુદ્ધહેવ પોતાના પિતાની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યા હતા. ત્યાં જઈને પણ એમણે ધર્મોપહેશ કર્યો. એમના પિતા શુદ્ધોદને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને અર્હત પદ પ્રાસ કર્યું. યુદ્ધહેવના પુત્ર રાહુલે શ્રમણુની હીક્ષા લીધી. થોડા સમય પછી રાજીએ અર્હત પદ પામીને મહાનિર્ણય પ્રાસ કર્યું. ત્યાર પછી થોડા હિવસમાં ગૌતમીના એકના એક પુત્ર નંદે પણ પોતાના વિવાહ અને રાજ્યાલિષેકને હિવસેજ ધરખાર છોડી દઈને સંન્યાસધર્મની હીક્ષા અહણું કરી. તેની પાછળ શાક્યવંશના અનેક ક્ષત્રિયોએ પણ સંસારનો ત્યાગ કરીને હીક્ષા લીધી.

કપિલવસ્તુમાં મહાપ્રભતિએ યુદ્ધહેવના ઉપહેશામૃતનું પુષ્કળ પાન કર્યું હતું. એવા મહાજાની બોધિસત્ત્વને પોતે સ્તનપાન કરાયું છે, ઉછેરીને મોટા કંચી છે એ બાબતનું એમને અલિ-

માન હતું. ખોડ્યધર્મ પ્રત્યે એમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. પતિના સૃત્યુ તથા પૌત્ર રાહુલ અને પુત્ર નંદના સંસારત્યાગથી તેના મનમાં પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયેા. એને વિચાર આવ્યો કે, “શું પુરુષોજ લિક્ષુ અનીને અદ્વાચયર્થપ્રત ધારણુ કરીને ધર્મનો પ્રચાર કરે અને અમે સ્વીએ એવા પુષ્ટયકાર્યને ન કરી શકીએ? હું પણ આ સ્વાધીં સંસારનો ત્યાગ કરીશ, બધી વાસનાએનો પરિત્યાગ કરીશ, આપી હુનિયાને માર્દ કુદુંબ ગણ્ણીશ અને સર્વાંગ વિચરીને લોકોને ઉત્ત્ર માર્ગમાં લઈ જવા પ્રયત્ન કરીશ.” એ વિચારે દફ થયા એટલુંજ નહિ પણ પીળ પાંચસે સ્વીએના હૃદયમાં તેમણે એ શુલ વિચારે ઠસાંયા. બુદ્ધહેવ વૈશાલિમાં બિરાજતા હતા, તે સમયે મહાપ્રભાપતિ મૂર્ઢન કરાવીને ૫૦૦ શાક્ય સ્વીએ સહિત ત્યાં જઈ પહોંચ્યાં. એ રાજવંશી સત્ત્રારીને પગે ચાલવાનો આ પ્રથમજ પ્રસંગ હતો. એના પગ સૂળ ગયા હતા. એના સુખ ઉપર ખેદ હતો. એદ એટલા માટે હતો કે પહેલાં કપિલવસ્તુમાં એમણે બુદ્ધહેવને લિક્ષુણીસંઘ સ્થાપવાની પ્રાર્થના કરી હતી; પણ એમ કર્યાથી લિક્ષુણી અને લિક્ષુણીએમાં લડાઈટા બિલા થવાનો લય લાગવાથી બુદ્ધહેવે એમ કરવાની ના કાઢી હતી. આ વખતે એ વધારે દફ સંકલ્પથી બુદ્ધહેવની પાસે ગયાં હતાં. એમના શિષ્ય આનંદની માર્ક્ઝતે પોતાનો ઉદેશ જણાયે. આનંદે બુદ્ધહેવને બિલામણુ કરીને પૃથ્યું કે, “લગવન! આપના ધર્મનો સાક્ષાત્કાર સ્વીએથી પણ થઈ શકે એમ છે કે નહિ?” બુદ્ધહેવ પહેલાં પણ અનેક વાર સ્વીએનો ધર્મશાસ્ત્ર સમજવામાં અધિકાર છે એવો ઉપદેશ આપી ચુક્યા હતા, એટલે આ પ્રસંગે પણ રૂપદ રીતે જણાયું કે, “મારા ધર્મનું રહસ્ય પુરુષો જેટલું સમજું શકે છે તેટલુંજ સ્વીએ પણ સમજું શકે એમ છે.” આનંદને હું લાગ મળ્યે. એણે કહ્યું: “એબું છે તો આપ મહાપ્રભાપતિ દેવીને શા સારુ નિરાશ કરો છો? એમની પ્રાર્થના કેમ સ્વીકારતા નથી? એમણેજ આપને ઉછેયો છે, આપના ઉપર એમનો ધર્મ સ્નેહ છે. એમના મનના સમાધાનની ખાતર, આપ એવો નિયમ કરો કે સ્વીએથી પણ પ્રત્યે લઈ શકાય છે.”

બુદ્ધહેવે આનંદની બિલામણુ માન્ય રાખી અને મહાપ્રભાપતિ તથા તેમની સાથે આવેલી ૫૦૦ શાક્ય કુમારીએને પ્રત્યે આપીને એક નવો લિક્ષુણીસંઘ સ્થાપ્યો. ભારતવર્ષમાં સ્વી-

આના અધિકારની ખાખતમાં એક સુવણુષીકારે નોંધી રાખવા ચોણ્ય દિવસ હતો. મહાપ્રભપતિ એ લિક્ષુણીસંઘનાં પ્રમુખ બન્યાં. બુદ્ધહેવે એ લિક્ષુણીઓને ધર્મનો ઉપહેશ સમજાવ્યો. થોડી વારમાં એમની ચોણ્યતા જોઈને બુદ્ધહેવે એ લિક્ષુણીઓને લિક્ષુણીઓના થીજન પણ અધિકાર સહિત સ્વતંત્રતા આપી. ત્યાર પછી તેમને ‘ઉપસંપત્તા’ મળી. એ સમયે પૂર્વ હજુ પ્રાપ્ત થયા અને લિક્ષુણીઓના મંડળમાં સર્વ વાતમાં મત આપવાનો અધિકાર એ કી-ઓને મળ્યો. મહાપ્રભપતિ તો પૂર્વજન્મનાં સંસ્કારી કી હતાં, એટલે બુદ્ધહેવના ઉપહેશથી થોડા સમયમાંજ એમને સમાધિયોગ પણ પ્રાપ્ત થયો. અને એકાગ્રચિત્તે ધ્યાન અને અનુધાન કરીને અલોકિક શક્તિ અને જ્ઞાન વડે અર્હત્પદ પ્રાપ્ત કર્યું. ગૌતમીએ સ્થાપેલો આ લિક્ષુણીસંઘનો ઈ. સ.ના ચોથા શતકમાં લોપ થયો, એવો આચાર્ય કૌશાંખીનો. અલિપ્રાય છે. આજકાલ પ્રદ્રષ્ટાભાઈ પણ એવા પ્રકારની એક સંસ્થા છે જેમાં સ્વીએને ‘દશ શીલધારિણી’ ઉપાસિકા કહે છે. અન્તુ !

એક દિવસ લગવાન બુદ્ધહેવ જેતવન વિહારમાં સ્થિતિ કરી રહ્યા હતા, તે વખતે તેમણે દરેક લિક્ષુણીને તેમના શુણું અને ચોણ્યતાનુસાર દરજને આપ્યો હતો. એ પ્રસંગે એમણે ગૌતમીને સૌની અધ્યક્ષ જગતાવી હતી અને ગૌતમીએ હૃતસત્તાપૂર્વક બુદ્ધહેવ આગળ કેટલીક આત્મજાન અને વૈરાગ્યસૂચક અમૃત્ય ગાથાએ ગાઈ હતી.

એક સમયે બુદ્ધ લગવાન વૈશાલી નગરની પાસે મહાવનમાં કુટાગાર નામક નગરમાં સ્થિતિ કરતા હતા, તે વખતે ગૌતમી દેવી ત્યાંની લિક્ષુણીઓના ઉપાશ્રય (અપાસરા)માં નિવાસ કરતી હતી. એક દિવસ વૈશાલી નગરમાં લિક્ષા મારી આવીને ગૌતમી દેવી પોતાના વિશ્રામસ્થાનમાં જઈને વિચારવા લાગી: “બુદ્ધનું પરિનિવોણું અથવા દેહત્યાગ મારાથી દેખી શકાશે નહિ. તેમના પ્રધાન શિષ્ય શુગલ, તેમના રાતદિવસના સેવક આનંદ, મારે પૌત્ર રાહુલ અને પુત્ર નંદકુમારના દેહત્યાગનો દેખાવ પણ મારાથી કહી જોઈ શકાશે નહિ. માટે એ સર્વને પૂર્ણને મારે તેમની પહેલાંજ આ દેહત્યાગ કરવો એ ઠીક છે.” આવા વિચારથી એણે બુદ્ધહેવને પોતાને ત્યાં તેડાવ્યા. બુદ્ધહેવ વિમાતા ગૌતમીના ઘરમાં પદ્ધાર્ય એટલે ગૌતમીએ તેમના ચરણમાં પડીને નમસ્કાર-

પૂર્વક વિનય સાથે હેહત્યાગ કરવાની—પરિનિર્વાણ લેવાની આશા માળી. બુદ્ધહેવે પોતાના સ્વભાવસિદ્ધ કેમળ પણ ગંભીર સ્વરે કહ્યું: “હવે તમારા હેહત્યાગનો સમય થઈ ચૂક્યો છે. હવે ખુશીથી જઈ શકશો.” ત્યાર પછી આનંદ વગેરે સેવકોને એધ આપીને અને બિક્ષુણીઓને ઉપહેશ આપીને ગૌતમી સમાધિસ્થ થઈ અને એજ દશામાં અનો પવિત્ર આત્મા નશ્વર હેઠનો. ત્યાગ કરીને નિર્વાણ-પદને પામી ગયો.

અપહાન તથા શૈરીગાથા અંથમાં એમની રચ્યલી વાણી છે. એ વાણીમાં બુદ્ધહેવ પ્રત્યે એમની સ્નેહભરી ભક્તિ શળહેશણ-માં ટપકે છે. એમની રચના ઘણી સરળ અને સુખ આપનારી છે. એ કહે છે કે:-

“હે સુગત ! હું તારી માતા છું અને તું મારો વીર પિતા છે; કેમકે ઉત્તમ ધર્મ શીખવીને મને નવો જન્મ આપીનેતું મારો પિતા બન્યો છે. મેં તને લાડ લડાવીને નાનેથી માટો કર્યો છે, શુદ્ધ અને પવિત્ર ધર્મરૂપી શરીર આપીને તેં મને મોટી કરી છે. મેં તો એક ઘડીભરની તારી તરસ છિપાવવાને આડ તને ધાવણું ધવરાંયું હતું. તેં મને એ ધર્મનું ધાવણું ધવરાંયું છે તેથી મને અક્ષય શાંતિ મળી છે. માંધાતા આહિ રાજાઓની માતાનાં નામ ભવસાગરમાં લુસ થઈ ગયાં છે; તારી મા થઈને હું ભવ-સાગરશી પાર ભિતરી ગઈ છું.

“રાજમાતા, રાજમહિષી એ અધાં નામ સ્વીઓને માટે સુલબ છે; પરંતુ બુદ્ધમાતા એ નામ પરમ હુર્લબ છે. સ્વીઓને બિક્ષુણી અનવાનો અધિકાર આપવા મેં તમને વારંવાર કહ્યું હતું, એટલા માટે મારો અપરાધ થયો. હોય તો હે સુરશ્વેષ ! મને ક્ષમા આપનો.

“તમારી આજાથી મેં બિક્ષુણીઓ ઉપર શાસન ચલાંયું છે. એ કાર્ય કરવામાં કોઈ જતની તૃટિ રહી ગઈ હોય, તો એને માટે પણ હે ક્ષમાપિતા ! (ક્ષમાના આધાર) મને ક્ષમા આપનો.

“તમે જ્યારે નાના હતા, ત્યારે તમને લેઇને તથા તમારી તોતડી વાણી સાંલળીને આંખ અને કાનને એટલી તૃસિ નહોતી થઈ, એટલી તૃસિ તમે આપેલા ધર્મરસના પાનથી થઈ છે.”

શૈરીગાથામાં મહાપ્રભપતિ કહે છે: “ બુદ્ધવીર ! હું તમને નમસ્કાર કરું છું. તમે સર્વ સત્તા છો, સૌથી શ્રેષ્ઠ છો; મારા જેવી ડેટલીયની હુંઅર્પી જવાળા તમે બુઝાવી છે. હુંઅનું નિદાન હવે મેં જાણ્યું છે. સથળાં હુંઅનું ભૂળ કરણું જે તૃપ્યણા તે હવે મારા-માંથી સુકાઈ ગઈ છે; કેમકે તમે આપેલા જ્ઞાન વડે મેં ધર્મનાં શ્રેષ્ઠ આઠ અંગોને પ્રાસ કર્યાં છે. પૂર્વજન્મોમાં માતા, પુત્ર, પિતા અને ભાઈઓએ વૈરેવેર ભટકી છું; પણ હવે મેં લગ્નવાનને જોગી કાઢ્યા છે. આ મારો છેલ્લો જન્મ છે. મારી સંસારની ગાંડ ધૂઢી ગઈ છે. આ લિખ્નાણીને હવે ફરીથી જન્મવાતું ને મરવાનું રહ્યું નથી. જુએઓ ! દઠ પરાકમપૂર્વક બધા સાધુમાર્ગમાં વિચરણ કરી રહ્યા છે. જીવનમાં સાધુતા પ્રાસ કરવી, એજ બુદ્ધિની સૌથી સારી વંદના છે.

“ હું ગૌતમ ! મારી માયા બહેને લોક હિતને ખાતરજ તમને જન્મ આપ્યો હતો. તમે હુંઅ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ, મૃત્યુ અને શોકનાં રૂદ્ધનને કરી લીધાં છે.”





## ૫-ગોપા (યશોધરા)

**આ** જથી અઢીહનાર કરતાં પણ વધારે વર્ષ પૂર્વે કપિલ-વસ્તુ નામતું નગર હતું. એ નગર કઈ જન્યાંએ હતું, તે સંબંધે વિકાનોના જુદા જુદા મત છે. એક અંગ્રેજ ઈતિહાસવેતાના મત પ્રમાણે સંખુક્ત પ્રાંતમાં ખસ્તી જિલ્લાની ઉત્તરે આવેલું હાલનું પિગાવા ગામ તેજ પ્રાચીન કપિલ-વસ્તુ. ખૌદ્વધર્મના ખાસ અસ્યાસી લીન અંગ્રેજ લેખકના મતે કપિલવસ્તુ હાલની ડોહાના નદીને પ્રાચીન રેલિષ્ણી નહીને હિનારે, બનારસથી ઈશાન દિશામાં સેં માહિલ છેટે હતું. ગમે તે હોં, પરંતુ એટલું તો નિવિચાદ છે કે, એ કપિલવસ્તુ નગરમાં પૂર્વે શાકચ લોકો વસતા હતા. એ જાતિના લોકો જેતીનો ધંધો કરતા હતા અને એમાંના ડેટલાંડ કુદુંઓ રાજવંશી હતાં. કપિલવસ્તુમાં શુદ્ધોદન નામનો એક શાકચવંશી રાજ રાજ્ય કરતો હતો. એ રાજ શુદ્ધવિદ્યામાં ધણો કુશળ અને પ્રતાપી હતો. એને એ રાણીઓ હતી. મહામાયા અને પ્રભાપતિ. વૃદ્ધાવસ્થામાં રાણી મહા-માયાના ગર્ભથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો હતો. એ બાળક ધણો સુંદર અને હિન્દુ કાંતિવાળો હતો. પુત્ર સાત દિવસનો થયો. એટલે એની માતા ભરણું પામી અને સાવકી મા પ્રભાપતિએ તેને પોતા-નાજ બાળકની પેઠે લાડમાં પાળીપાણીને મોટો કર્યો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. ગૌતમ નામથી પણ એ એણાખાતા.

સિદ્ધાર્થના જન્મ પછી કોઈ સિદ્ધ પુરુષે રાજપુત્રને જોઈને કહ્યું હતું કે, “આ બાળક કોઈ વખતે સંન્યાસ ધારણું કરીને એક પ્રસિદ્ધ મહાત્મા થશે.” શુદ્ધોદન ધણો વખતથી વાંઝિયો હતો. વૃદ્ધાવસ્થામાં રાજકુદુંઘના એક માત્ર આધારરૂપ આ પુત્ર જન્મ્યે. તે પણ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જશે, એ ચિંતાથી રાજના હુંઘનો પાર રહ્યો નહિં. પુત્રની મતિ વૈરાગ્ય તરફ ન

જથું એટલા સારુ સિદ્ધાર્થ મોટો થયો ત્યારથી તેને ઘણ્ણા પ્રકાર-  
ના લોગવિલાસમાં ઉછેયો.

પણ યુદ્ધહેવ તો બચપણુથીજ ભાવનામથ અને વિચારશીલ  
હતા, એટલે એમને એ ભધા લોગવિલાસ રૂચ્યા નહિં. ઘણ્ણી  
વખત ચાતે ચોવા આમોદપ્રમોદમાંથી હૂર જતા રહીને એકાંત  
સ્થળમાં ચિંતન કરતા.

કષિલવસ્તુની પાસે કલિદેશ નામનું એક નાનું રાજ્ય હતું.  
કલિદેશના રાજ દંડપાણિને ગોપા નામની એક પરમસુદર્દી,  
વિદ્યાવતી અને યુદ્ધિશાળી કન્યા હતી; અને સહયુષોથી એવિલુ-  
ષિત હતી. સિદ્ધાર્થનું વથ આગળીસ વર્ષનું હતું ત્યારે ગોપા સાથે  
તેનો વિવાહ થયો.

વિવાહ પૂર્વો રાજનો અનેક કુમારિકાઓને એક ઉત્સવમાં  
આમંત્રણ કર્યું હતું અને ત્યાં સિદ્ધાર્થને હાથે એક ડિંમતી લહાણી  
વહેંચાવવાની વ્યવસ્થા કરી હતી. અનેક રાજકન્યાઓ એ ઉત્સવ-  
માં ભાગ લેવા આવી અને રાજકુમારને હાથે લહાણી લઈને ચાદી  
ગઈ. ગોપા પણ આવી, પરંતુ તેની વારી આવી ત્યારે લહાણી  
ખૂટી ગઈ. સિદ્ધાર્થની અને ગોપાની ચાર આંખ થઈ. બજે એક  
બીજી પ્રત્યેથી ચક્કા ફેરવી શક્યાં નહિં, બોડી વારસુધી બજે ચિત્રની  
પેડ ભલાં રહ્યાં. બોડી વાર પછી ગોપા ચમકી, તેને શરમ આવી,  
આંખ નીચી કરી લઈને તેણે પૂછ્યું: “કુમાર ! મને લહાણી નહિં  
મળે ? હું પણ નિમંત્રણુથી આવી છું હોં.”

ગૌતમે કહ્યું: “મૈં તમને અપમાન કરવા સારુ જોકાવ્યાં  
નથી. ચુવણ્ણુથી પૂર્ણ આ અશોક-પાત્ર તમને લહાણીમાં આપું  
છું અને સાથે જાણે મારી આંગળીની વીંઠી પણ આપું છું.”  
એમ કહીને રાજકુમારે આંગળી ઉપરથી વીંઠી કાઢવા માંડી.

ગોપાએ તેને રોકીને કહ્યું: “ના, આપનો અલંકાર મારે  
નેધિતો નથી. મારી ઇચ્છા પૂર્ણ થઈ છે.” એટલું કહી લહાણી લઈને  
ગોપા ધીરે ધીરે ચાદી ગઈ. ગોપાનું રૂપ નીરભીને, વાતચીતમાં  
તેની વિદ્યા તથા ગુણુનો પરિચય પામીને કુમાર તેની તરફ આક-  
ર્ષયો. ગોપા પણ મનમાં ને મનમાંજ સિદ્ધાર્થને પોતાનો આત્મા  
સર્વપણું કરીને પિતૃગૃહે ગઈ.

પુત્રનો અલિપ્રાય જાહી જઈને રાજ શુદ્ધોહને દંડપાણિ  
લા-૩

પાસે ગોપાની સાથે સિદ્ધાર્થનો વિવાહ કરવાનું માણું મોકદ્યું; પણ ક્ષત્રિયોએ ચિત્ત શૌર્ય, પરાક્રમ આદિ શુણેં કરતાં વિચારશીલ અને તત્ત્વચિંતન માટે કુમાર સિદ્ધાર્થ ઘણેં પ્રસિદ્ધ હતો; એટલે દંડપાણિએ એવા રાજકુમારને પોતાની કન્યા આપતાં આંચ્યકો ખાદ્યા. સિદ્ધાર્થને એ વાતાની અભર પડતાં એણે જતની કસરત, જેલ, અસ્વચ્છાલન, વગેરે ક્ષત્રિયને છાજતા શુણેં અને એ સમયના ઉચ્ચ શિક્ષણું પોતાની પ્રવીણતા ઘણી સારી રીતે સાધિત કરી આપી. આ પ્રમાણે કુંવર સિદ્ધાર્થ ક્ષત્રિયોએ અવશ્ય જાણુવા ચોંગ વિષયોની પરીક્ષા પાર ઉતારીને ગોપાડું સ્વીરત્ન પ્રાસ કર્યું.

મનપસંદ વરને વરીને ગોપા છાયાની પેડે પતિની અનુગામિની અની. સુખદુઃખમાં ગોપા હમેશાં પતિની સાથેજ રહેતી. દર્શા વર્ષ સુધી એમનો સાંસાર ધણું સુખમાં વ્યતીત થયો. ગૌતમની બધી ચિંતાએ સુશીલ પત્નીના એમને લીધે ચાલી ગઈ. અને સુધી થયાં. આનંદના દિવસો વહી જતાં વાર પણ ન લાગી.

એક દિવસ ગૌતમ સુધી રહ્યા હતા, શત્રુ પૂર્ણી થવા આવી હતી, ચંદ્રમા પત્રિભ આકાશમાં દૂણી રહ્યો હતો, પૂર્વ દિશા સ્ત્રોણાં તરણું હિરણ્યાથી રંગાઈ રહી હતી. એવામાં એક ગવૈયો એવી મતલબનું ગીત ગાઈ રહ્યો હતો કે, “આ સાંસારમાં કશું નિત્ય રહેવાનું નથી. કાળ અધાની પાછળ લાગી રહેલો છે.” આ ગાયન સાંભળતાં વારજ એમની નિદ્રા ભરી ગઈ અને ભાંડા વિચારના તરંગો એમના મનમાં ઉત્પન્ન થયા ! વિચારનો પ્રવાહ હવે એ દિશામાંજ વહેવા લાગ્યો. શિકારે જતાં પણ વિચાર આવતો કે, સ્વચ્છાંહે રમતા આ નિર્દીષ પશુને મારવાનો મને શો અધિકાર છે ? આવો વિચાર કરીને ઉગામેલું ધનુષ્ય પાછું એચીને ઘર આવતા. કેટલાક ઐઝુતો પોતાના રવાર્થની ખાતર બળફને મારતા અથવા એમની પાસે એટલું વધારે કામ લેતા કે એ પશુઓની પીડ ઉપર ચાડાં પડી જતાં. એ જેઠિને ગૌતમને દ્વારા આવતી. એક દિવસ સારથિની સાથે રથમાં એચીને ઇરવા જતાં એક વૃદ્ધ પુરુષને જેણ્યો. માણુસ વૃદ્ધ શાથી થાય છે, વૃદ્ધાવસ્થામાં શાં હુઃખો છે, પુરવશતા કેટલી વધી પડે છે, એ બધું સારથિને પૂછ્યાથી જાણ્યું. એ પણ જાણ્યું કે, પોતાનો સુંદર અને સણળ દેહ પણ એક દિવસ આવીજ રીતે લુણ્ણ થશે.

ત્યાર પછી એક માણુસના શરણને લોડેા લઈ જતા હતા તે જેથું. તે ઉપરથી તેમને મનુષ્યના શરીરની નશરતા અને ક્ષણું-ભાંગુરપણાનું ભાન થયું. વળી એક સમયે એક રોજીને રોગથી તરક્કિયાં મારતો જેથો. એ સંબંધી તપાસ કરી તેઓ જણાયું કે, થોડા વખત પહેલાં એ સાલે હતો. હવે એને રોગ લાગુ પણ્યો છે; તેથી એ પીડાય છે. રોગ એ પણ શરીરનો ધર્મ છે.

જ્યારે જ્યારે ગૌતમે આવા દેખાવો જેથા ત્યારે ત્યારે એને ભાંધ ન આવી. ગઢન વિચારેભાં ચિત્ત ડામાડોળ થવા લાગ્યું. એક હિવન સારથિની સાથે કુરવા જતાં એક સંન્યાસીને દીડો. ગૌતમે એની સુલાકાત લીધી, એનો શો ઉદેશ છે, શા કારણુથી સંન્યસ્ત પ્રત લીધું છે વગેરે જણી લીધું અને મનમાં ને મનમાં કંઈ પ્રતિશા કરી.

ગોપાના વિવાહને દ્રશ્ય વર્ણ કીટી ગયાં. એ ગર્ભવતી થઈ અને દ્રશ્ય માસ પૂર્ણ થતાં એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ગૌતમના પિતાને આશા બંધાઈ કે પ્રેમની આ દફ સાંકળથી સિદ્ધાર્થ અંસારમાં બંધાઈ રહેશે. એને તત્ત્વજ્ઞાનના વિચારો કુરવાની કુરસદ હવે નહિ મળે.

સગલોવસ્થામાં એક રાત્રિએ ગોપા પતિની સાથે સુઈ રહી હતી. એવામાં એને કંઈક વિપભ સ્વમ આગ્યું અને તે જબકીને જાલી થઈ ગઈ. પતિના હસ્તને પ્રણ વાર ચુંબન કરીને પતિપ્રાણા સાંધી મોલી જાડી:—

“ નાથ ! જાગો ! નાથ જાગો ! વાણી દો આશ્વાસની ”

ગૌતમ જાગ્યા. “ વહાલી શું છે ? કેમ જબકી જાડી ? તબિયત તો ઠીક છે ને ? ” એમ પ્રેમપૂર્વક પૂછવા લાગ્યા, પણ ગોપાનું રૂઢન તો ચાલુજ હતું. એને ગળે દૂમો ભરાઈ ગયો હતો. આખરે સ્વસ્થ થઈને એ નામતાપૂર્વક મોલી:—

સ્કુતી હું નાથ ! સુએ મૃહ નીંદરે, શિશુ ઘહુ ઉદરે તુજ તે સ્કુરે; જીવન, મોદ અને વળી પ્રેમની, દ્વિગુણ નાડી વહી હૃદયે રહી. સુખદ જાનજ તે તણું હું સુણી, મધુર નીંદરમાં શામતી ઘણી; પણ અહો, કંઈ સ્વમજ કારમાં, અનુભવી છણી જણી હું તો હવાં.

એમ કહીને ગોપાએ પોતાને આવેલાં એ સ્વમોની વાત

જણ્ણાવી કે, “ પહેલું સ્વમ એવું આંધું કે જણે હું એક ઘોળો આખલો જોડું છું. તેનાં શીંગડાં ફ્રેલાયલોં છે. કપાળમાં એક ચળકતો મણિ છે. એ નગરના દરવાજાન તરફ મહાલતો મહાલતો જઈ રહ્યો હતો. કોઈ તેને રોકી શકતું નહિ. એટલામાં દ્યુરના મહિરમાંથી એક વાણી સાંલળાઈ: ‘ જો તમે એને રોકશો નહિ તો નગરની કીર્તિં ચાલી જશો.’ છતાં કોઈ રોકી શકતું નહિ. હું માટે સ્વરે રોકી રોકી એ આગળાને કઠે વળ્ણી અને રોકવા મથી. લોકોને નગરનાં દ્વાર બાંધ કરવાની આજા કરી, પણ વૃપલરાજ મારા હાથમાંથી સહેલાઈથી છૂટીને ચાહ્યો. અને દરવાજાની લોગળો તોડીને દરવાજોને પગ નીચે ચાહીને ચાહ્યો ગયો.

“ વળી બીજું સ્વમ આ પ્રમાણે તીવું. ચાર હિન્દુ સ્વરૂપા, સુમેરુ પર્વત ઉપર રહેતા હિંદુપાળ હોય એમ જણ્ણાતાં, આકાશમાંથી અસંખ્ય ગણેની સાથે જાતરીને નગરમાં જાપથી પેડાં. તે સાથે દ્વારલોકના દરવાજા ઉપરનો, સાનેરી વાવટો, કંદ્રાની નીચે પણ્ણો; ને તે સ્થળે એક તેજસ્વી વાવટો પ્રગટ થયો. તેના કંપડામાં રૂપેરી દ્વારે સીવેલાં માણ્ણુક ગુંધયાં હતાં અને તેનાં કિરણે વહે અધૂર્ય અને અર્થભાર લરેલાં વચ્ચેનો રચાયાં. તે વચ્ચેનીથી સર્વ જીવતાં પ્રાણીઓ હવિર્ત થયાં. પૂર્વમાંથી સૂર્યોదય સાથે પવન નીકળી એ વાવટો પહોળો. થતાં એ વચ્ચેનો સર્વને સ્પષ્ટ જણ્ણાયાં અને અદ્ભુત પુણ્ણોની વૃષ્ટિ થઈ.”

સિદ્ધાર્થ ઘણું આશ્વાસન આપી કહ્યું:—  
“ એ મારી મધુરી પદ્મની કળી! સર્વ છે સ્વમ એ ડ્રાં, હીઠાં જે તે કરી.”  
ગોપાએ ઉત્તર આપ્યો:—

“ સત્ય એ નાથ! પણ એડ વિરામતાં.  
દીન વાણી સુણી મેં તો; ‘આવી એ વેળ’ એમ ત્યાં.  
“ વહાલા ! એ ઉપરાંત મને કે સ્વમ આંધું હતું તેની પણ વાત સાંલળો. અને પછી કહો કે હું ગભરાઉં કે નહિ? એ સ્વઘું આ પ્રમાણે હતું. હું જણે આપના પડખામાં લરાવાનું કરતી હતી તોં આપ નહોલતા. માત્ર વગર દળાયલો તકિયો અને ખાલી જલ્દો ! સ્વમમાંજ હું જલ્દી થઈ અને મારી છાતી નીચે વાટેલી આપની માળા-મેખલા બદલાઈ જઈને સર્પ બની ગઈ. પગનાં કલ્લવાં સરી પણ્ણાં, હાથનાં સોનાનાં કંદણું તૂટીને પડી ગયાં; કેશમાંથી જૂદ્ધ-

નાં કૂલ કરમાઈને રજકણું થઈ ગયાં અને મારી લખશાચ્યા જાણે  
જમીનમાં દૂધી ગાઈ અને કિરમળ મચ્છરદાની કશાકથી ચિરાધ  
ગાઈ. આ પછી હૂર હૂર પેલા ઘેળા વૃષભનો અવાજ સંભળાયો  
અને પેલો ભરતકામનો વાવટો ક્રેઝ્યો અને ખીલ વાર ‘આવી  
એ વેળ’ પુકાર સંભળાયો. એ સંભળી હું જગી બડી.’’ આરથું  
ઓલીને ગોપા રડવા લાગી. ગૌતમે તેને દિલાસો આપવા કહ્યું:—

“ ધીરજ ધાર તું પ્રાણુ ! મધુરી ! એ ધીરજ ધારે;  
અવિચલ પ્રેમ છે સ્થાન, સતત આશ્વાસનનું તારે—ધીરજ૦  
(સાખી)

ભલે સ્વમ તુજ ભાવિનાં, ચિત્ર ચીતરે ગુઢ,  
ને હેવો ડગતા ભલે નિજ આસન આરૂધ;  
તદ્દિપિ તું ધીરજ ધારે—ધીરજ૦  
વિશ્વ શકે ઉદ્ધારનો, માર્ગ જણવા આજ,  
તત્પર ઊભું બેદ કંઈ, ગુઢ સમજવા કાજ;  
તદ્દિપિ તું ધીરજ ધારે—ધીરજ૦  
દ્યા આપણી પલટીને, ભલે તજે નિજ સ્થાન,  
સાત્ય વહું છું યશોધરા, હુંતી ને છે સુજ પ્રાણુ;  
હૃદય એ તું ધીરજ ધારે—ધીરજ૦  
હઃખિત જગ ઉદ્ધારવા, અવિરત કરતો ધ્યાન,  
નિર્મિત સમયજ આવતાં, ભાવિ નિશ્ચય દ્રણણે મહાન;  
વહાલી ! એ ધૈર્ય તું ધારે—ધીરજ૦ ”

આ પ્રમાણે પ્રેમથી આશ્વાસન આપીને કહ્યું: “ પ્રિયતમે ! હું  
અજાત જીવોના હુઃખથી હુઃખિત થાડું છું. તેમને માટે મારો  
આત્મા તલસી રહ્યા છે, તો પ્રિયમાં પ્રિય યશોધરાના જીવન ઉપર  
મારો આત્મા લખ્યા નહિ કરે? સર્વ વિશ્વમાં લમી વળીને આખર  
તારા ઉપરજ વિશ્રાભ લે છે. જે લીધ શોધ હું કરું છું તે સર્વ  
માનવોને અથે છે એ ખરું, પણ સર્વથી વિશેષ તારે અથે છે.”  
આમ કહીને તેને શાંત ખાડીને સુવાડી દીધી. પતિપ્રાણુ યશોધરા  
પતિની આજાથી જાંધી ગાઈ; નિદ્રામાં પણ એજ સ્વમાંના વિચાર  
આવી જતા અને તે લવી બઠીઃ “ એ વેળ આવી ! ”

એ દિવસે તો સિદ્ધાર્થ ગોપાને આશ્વાસન આપીને પોતે  
પણ સૂર્ય ગયા, પણ મનમાં સમજયા કે પત્નીનાં સ્વર્પનો બધાં

સાચાં છે. સંસાર પ્રત્યેની પોતાની આસક્તિ વાસ્તવિક રીતે એછી થતી જતી હતી અને જગતને ઉદ્ધારવાની ઈચ્છા પ્રભલ થતી હતી. રાજકુમારના ચિત્તમાં આ પ્રમાણે પરિવર્તન થઈ રહ્યું હતું, એવા-માં ગોપાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્ર થોડાકષ હિવસનો થયો. એટલામાં સિદ્ધાર્થની દષ્ટિએ આગળ જણુવી ગયા એવા સંસારની નશીરતા સૂચવનારા પ્રસંગે જોવાને મળ્યા. એક રાત્રિએ ગોપા નાના બાળક રાહુલને લેટીને સૂતી હતી, એ વખતે રાજકુમાર સિદ્ધાર્થને વિચાર આવ્યો:—

“આવી રજની એ ! ઉદ્ધારવા જન ને રૂપયા.

માર્ગ વર્ય તું પુણ્યનો કે જગત કેરી વિભૂતિનો;

આ ક્ષણુ જ નિર્ણય કહિન કર્ય સુખ હુઃખ કેરી પ્રસૂતિનો

રાજનો અધિરાજ બનીને આણુ નિજ વર્તાવવા,

કે સુકૃત ગુહિવિષુ શૂન્ય લટકી જગતનેજ બાચાવવા.

\* \* \* \*

કર્યો નિશ્ચય દઠ આ વાર, હવે હું ચાલું રે,

નવ પાછા કરું કેરી કાળ, અચળ પથ જાલું રે.

શોધુ સત્ય અતિ ગ્રદ્ધતે મળતા લગી કરું નહિ.

અન્વેષણ અતિ તીવ્ર ને તાપ ઉથ ફેણે લે કાંઈ.”

જીર નિદ્રામાં સુતેલી પ્રિયાને અને સુકુમાર બાળક રાહુલને તળ્ણને જતાં સિદ્ધાર્થની આંખમાં આંસુ આવી ગયાં. એણે વિચાર્યું કે બાળકને છેદલી વાર લેટી લઉં, પણ રાણીનો એક હાથ બાળક ઉપર પડેલો હતો તે ઉપાડીને પુત્રને લેવા નથ તો રાણી જણી જાઠે અને જાણ્યા પણી યશોધરા પતિને સંસારનો ત્યાગ કરીને જવા પણું હે? આવા વિચારથી તેણે હુદ્ધયને કઠણું કરીને—

ક્રીધી પ્રદક્ષિણા ત્રણુવાર, શાયા કેરી ધરી ભક્તિ સાર;

બેડી ધડકતે હુદ્ધયે પાણ્ય, બોલ્યો. સિદ્ધાર્થ અવિચલ વાણી:

“ કરી આ રન્ય શાયામાંહિ, કરું શાયન કરી હું નાંહિ.”

રાણીના સૌંદર્ય અને સદ્ગુણને લીધે સિદ્ધાર્થનો એના ઉપર અઠળક પ્રેમ હતો; એટલે ત્રણ વખત પાછા પત્નીશાયા પાસે આવ્યા અને ત્રણ વખત પાછા ગયા. છેદલી વખતે માયાનાં ભધાં ભંધનો જાનની તલવાર વડે કાંપી નાભીને સિદ્ધાર્થ ત્યાંથી વિદાય થયા. આ પ્રસંગને બૌદ્ધધર્મમાં “ મહાલિનિષ્કમણુ ” નામથી એળાખાવવામાં આવ્યો છે.

સવાર થતાં આ સમાચાર સઘળે ફેલાઈ ગયા. રાજમહેલ અને નગરવાસીઓ રહારોળ કરવા લાગ્યા. સ્વામીના વિચારોમાં થતું પરિવર્તન ગોપાએ ઘણું સમયથી જેણું હતું. પોતાને આવેલાં સ્વમાં ઉપરથી ભવિષ્યતું અનુમાન કર્યું હતું. એ સમજી ગઈ કે સ્વામી ગૃહકસંસાર ત્યાગી સંન્યાસી બન્યા. એ તો હવે જગતનો ઉદ્ઘાર કરશે; પણ હું શું કરેં? એક તો ખીની જત હતી, ખીનું ખાગડુન ખોળામાં હતો, ઘરનો ત્યાગ કરીને ચાહ્યા જલું તેને માટે સંભવિત નહોંતું. એ ઘરમાં રહીને સંન્યાસિની થઈ.

રાજવધૂનો વેશ કાઢી નાખીને ગોપાએ સંન્યાસિનીનો વેશ ધારણ કર્યો. રાજમહેલમાં કુળવધૂના બધા લોગવિલાસનો બિલ-કુલ ત્યાગ કરીને એણું કઠોર અદ્ધ્યાર્થ્યક્રત ધારણું કર્યું.

અસરાએ ઘણું સમજાવી. સાચુએ ઘણું રૂઢન કર્યું “પણ ગોપાનું મન ચયણું નહિં. એણું સંન્યાસિનીનો સાહો વેશ તથા કઠોર વત છોડ્યાં નહિં.

સાચુલુને ખોલાવીને ગોપાએ કહ્યું: “ મા ! તમે ધર્મશીલ હોવા છતાં મને અધર્મમાં શા માટે હોરવા માગો છો ? જેના સ્વામી સંન્યાસી થયા તે ખીને વખ્તાભૂપણ, લોગવિલાસનું શું પ્રયોજન ? સ્વામીજ નારીનું સર્વસ્વ છે; સ્વામી એજ તેનું સુખ, તેનો લોગવિલાસ અને તેનાં આભૂપણ છે. સ્વામીજ નયારે ઘર-બાર છાડીને સંન્યાસી થઈ ગયા, તો તેમની સાથે માર્ગ બધું સુખ પણ દૂ઱ી ગયું. ગૃહસ્થાશ્રમનું સુખ જતું રહ્યું, લોગવિલાસ જતા રહ્યા. વખ્તાભૂપણના આડંઘર કરવાનું હવે પ્રયોજન રહ્યું નથી. હવે તો મારો ધર્મજ બાણું બદલાઈ ગયો છે.

“ સ્વામી નયારે રાજપુત હતા ત્યારે હું રાજવધૂતરીકે તેમની સંગી અને સહધર્મિણી હતી. આજ એ સંન્યાસી થયા તો હું સંન્યાસિની થઈશ. ખીનું જીવનમત એજ છે કે સ્વામીની અનુગામિની થવું. એ વત મેં આરંભ્ય છે. તો માલુ ! કૃપા કરીને મને એમ કરતાં રોકશો નહિં. વળી મા ! તમારો એકનો એક પુત્ર આજે સંન્યાસી થઈ અરજ્યમાં કઠોર તપશ્ચર્થી કરે છે એ તમારાથી સહેવાય છે, તો ઘરમાં ખેસીને વહુ સંન્યાસિનીનો વેશ ધારણ કરીને, સંન્યાસિનીવત પણે છે એ શા માટે સહન નથી થતું ? ”

ગૌતમીહેવી પુત્રવધૂનો જવાણ સંભળીને ચૂપ રહી. એ સિદ્ધાર્થ-

ની માશી તેમજ ઓરમાન મા થતી હતી. સિદ્ધાર્થની જનની મહામાયા પુત્રના જન્મ પછી સાત દિવસમાં મરી ગઈ હતી. ગૌતમીએ માતાની માર્ક સિદ્ધાર્થને ઉછેચો હતો. ગૌતમીના પુત્ર તરીકેજ સિદ્ધાર્થ ગૌતમખુદ નામથી પ્રસિદ્ધ થયો.

આ રીતે:—

શોક ભરી બેસી રહી, ને જીવન સુખ સહુ છાંડયું;  
મધુર રાણી યશોધરાએ, વૈધવ્ય વિરલું માંડયું.

આ પ્રમાણે અનેક વર્ષ વીતી ગયાં. રાજ શુદ્ધોદને પુત્રની ઘણી તપાસ કરાવી પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. છ વર્ષ સુધી ગૌતમે રાજગૃહની પાસેના વનમાં અને પછી ગયાના ગંભીર અરણ્યમાં તપશ્ચયી કરી. આખરે ગયા નગરીની પાસેના એક વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરતાં ધરતાં એમને અંતર્જીવન પ્રાસ થયું. જે જાનની શોધમાં હતા તે મળી ગયું. એ જાણ્યા. હૃદયમાં ખરો બોધ થયો. એટલે પોતે ખુદ થયા. આ સમયે તેમની ઊભર ઉપ વર્ષની હતી. હવેથી એ બિક્ષુના વેશમાં સર્વત્ર પોતાને જાન થયું હતું તે જાનનો પ્રચાર કરવા લાગ્યા. હવે આપણે સિદ્ધાર્થને ખુદ્દેવ, ખુદ્દ લગવાનના પવિત્ર નામથી સંબોધીશું.

શાઠ સમય પછી ખુદ્દેવ ધર્મનો પ્રચાર કરતા કરતા એક દિવસ કપિલવસ્તુ નગરીમાં પહોંચ્યા. રાણી યશોધરા એ સમયે પતિવિરહથી હુઃખી બનીને, બાળપુત્ર રાહુલની બાળચેષ્ટાઓ નિહાળતી નદીકિનારે બેઠી હતી અને ઊંડા નિઃશાસ નાખીને મનમાં ને મનમાં પક્ષીઓને કહેતી હતી કે:—

“ કહી જઈ ચઢો અકસ્માત, જહિં છૂયા રહ્યા સુજ નાથ;  
કહેને યશોધરાના પ્રણામ, પછી વિનવીને વહને આમ:  
‘સુણું વા શાણદ એક તમ સુખનો, લેવા લાવો ક્ષણું સ્પર્શસુખનો,  
મરણોનુખ જીવતી છે દાસી,’ કહેને એટલું એંબા નભવાસી !”

આ પ્રમાણે રાણી શોકેદ્વારે કાઢી રહી હતી, એવામાં દાસીએ આવીને શુલ્ક સમાચાર કહ્યા:—

“ રાણીલુ ! એ રાણીલુ ! આવ્યા નવીન કો આપણા;  
પુરમાહિ દક્ષિણ દ્વારથી એ વણુક હસ્તિનાપુરતણા,

\* \* \*

લંડાર હુરજ દેશના.  
 લાનિયા, પણ એહ સર્વે રતનને જંખાવતી,  
 લાભ્યા અમોલી એક વાતો રાખ્યી! તમ મન લાવતી!  
 ભાજ લાણી એહની, તુજ નાથની અમ રાજની,  
 આ ભૂમિકેરી બધી આશા તણ્ણા એ શિરતાજની.  
 નિરખિયો સિદ્ધાર્થ નજરેનજર એ વહેયારિયે,  
 ને પૂજિયો ચરણે ટળી અલિવંદિયો શિરનામીને;  
 ભાખિયું હતું ભવિષ્ય તે અનુસાર બનિયો રાજ એ,  
 જાની તણ્ણા શુલુ, ભુવનવંધ, પવિત્ર અદ્ભુત આજ એ;  
 યુદ્ધ બનિયો, મધુર વચ્ચે ને અગાધ દ્યા શુણો,  
 જન તારતો, ઉજ્ઝવરતો, અહીં આવતો વણિકે કણો. ”

અંધને કૃતીથી નેત્રની પ્રાસિ થાય તેના કરતાં પણ હુનરો-  
 ગણ્ણા હર્ષ આ સમાચારથી ગોપાને થયો. એણે તરતજ એ વણિકેને  
 પોતાની પાસે જોલાભ્યા અને એ શુલુ સમાચાર પોતાને કાને  
 સંભજ્યા તથા અનેક રતન-માણિક્ય એ લોકેને ઇનામમાં  
 આપીને વિહાય કર્યો.

યુદ્ધદેવના પિતા રાજ શુદ્ધોદન એ સમયે લુવતા હતા.  
 કપિલવર્સ્તુ નગરીમાં બધે યુદ્ધદેવના પધાર્યોના સમાચાર પહેંચ્યો  
 ગયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો અને રાજુનું નેવા લોકેનાં  
 ટોળેઠોળાં છુલ્યાં. લોકોએ નેચું કે રાજકુમાર લિક્ષુકના વેશમાં  
 રસ્તામાં લિક્ષા માગે છે અને પોતાના ધર્મનો ઉપરેશ કરે છે.

ગોપાએ અગાશીમાં ચઢીને લિક્ષુ સ્વામીને જેથા.

હાય ! ગોપાથી આ દસ્ય હેખી શકાય ? કે રાજકુમારના  
 અંગ ઉપર હુનરો મણિમાણિક્ય જળકી ઊઠતાં હતાં, સેકઢો  
 દરળુએ જેનો પોપાક બનાવતાં થાકી જતા હતા, અસંખ્ય નોકરો  
 જેમની સેવામાં રાતદિવસ હાજર રહેતા હતા, જેનું સુંદર રૂપ  
 જેઠને ગોપા પોતે સુંધર થઈ ગઈ હતી, તેજ પ્રિય સ્વામી આજ  
 મુવની માર્ક રાજપાટનો ત્યાગ કરીને, પોતાની ઈચ્છાથી હીનવેશ  
 ધારણું કરીને પોતાનાજ રાજ્યના રાજમાર્ગમાં ઉધાડા પગે કરે  
 છે ! કે મસ્તકમાં રોજ જલતનતનાં સુગાંધીહાર તેલ નંખાતાં હતાં  
 તે સુંદર જૂલાક્ષાં હવે કચાં છે ? કાનમાં હીરાનાં કુંડળ કચાં છે ? એ  
 રાજકુમારનો પહેરવેશજ કચાં છે ? ગોપાએ ચુપચાપ બધું જેયું.

તેની આંખોમાંથી અશુદ્ધારા છૂટી. સ્વામીનું સુંડન કરાયેલું શિર અને ગરીબ લિખારી જેવો વેશ જેઠને ગોપાથી પોતાના હૃદયના આવેશને રોકી શકાયો નહિ.

ઘણ્ણી વાર સુધી રોઈને આખરે એણે મનને શાંત કર્યું. મનમાં ને મનમાં એ વિચારવા લાગ્યો: “છી ! હું આ શું કરું છું ? હું કયા હું ખથી રોડ છું ? હું દેખતી નથી કે તેમના અરણું રવિંદ્રથી નગર અગણગાટ થઈ ગયું છે. તેમના દર્શનથી નગરવાસીઓનાં મોં ઉપર કંધ હિવ્ય પ્રકાશજ જળાય આવે છે અને હું તેમની ધર્મપત્ની છું. હું રૂઢન કરી રહી છું ! હાય ! વેશાભૂષણુલીન હોવા છતાં પણ, એ મૂર્તિ અતુલ જ્યોતિર્મય છે. એની આગામ રાજતેજ શા હિસાબમાં ? એ પૂર્ણ શાંતિ અને જ્યોતિર્મય મહા-મૂર્તિ મારા સ્વામી છે. એજ મારા સ્વામી આજે મનુષ્યદ્રૂપમાં દેવતા છે. આજ એમણે બોગવિલાસનો ત્યાગ કર્યો છે, સુખહુંખથી તે અતીત છે. આજ રાજવેશ અને બિક્ષુક વેશમાં તેમના મનથી કંધ લેદનથી. આજ રાજમહેલનો રાજલોગ અને ગરીબ લિખારીની ઝૂપડીની ભાગું એમને મનથી સમાન છે. અહા ! આજ એ કેવા મહાન, કેવા ઉચ્ચ છે ! તેમના અમૃતમય ઉજાવળ દેખને હું પાર્થિવ વેશાભૂષણોથી દંડાયેલું જોવાની ઈચ્છા રાખતી હતી !! આજ મારે સ્વામીના મહત્વના ગૌરવથી પોતાને ગૌરવાન્વિત સમજવી જેઠાં; ન કે આમ મોહંદ ખીની પેઠે રાહું જેઠાં. જે મારામાં એટલું પણ મહત્વ ન હોય તો પછી એવા મહાયુરૂપની સ્ત્રી ગળું હોણાય છે.”

ગોપા અગાશીમાંથી એ હાથ જેઠીને બજિપૂર્વક દેવતાડ્રૂપી સ્વામીને નમસ્કાર કરીને નીચે ઉતરી.

બુદ્ધહેવ નિમન્ત્રિત થઈને રાજનગરીમાં આવ્યા હતા, પણ સ્વામીના સંન્યસ્તવતમાં ભંગ પણ એ બીકથી ગોપા તેમનાં દર્શન કરવા ગઈ નહોતી. બાળક પુત્ર રાહુલને એવાવીને અંતઃપુરમાંથી બુદ્ધહેવને દેખાડીને ગોપાએ કહ્યું: “એરા ! આ તારા પિતાજી. જી, એમને પ્રણામ કરીને એમની પાસે પિતૃધનની પ્રાર્થના કર !”

હાય ! ગોપા ! રાહુલનું પિતૃધન હવે કઠોર સંન્યાસ છે એ તને ખખર નથી ? સ્વામીના સંન્યાસથી તું સંન્યાસિની થઈને

ગૌરવ માને છે, પણ ખાળક પુત્રને પણ એજ કડોર સંન્યાસનો વારસો અપાવતાં તારું હૈયું કેમ ચાલે છે ?

રાહુલ પિતાની પાસે ગયો. પિતૃધન-પિતાના વારસાની ઈરછા રાખનાર પુત્રને સંન્યાસી પિતાએ સંન્યાસની હીક્ષા આપી.

વળી કેટલાંએક વર્ષો વીતી ગયાં. પિતા શુદ્ધોહનના ભૂત્યું સમયે બુદ્ધહેવ પાછા એક વાર કપિલવસ્તુ નગરમાં પથાર્યો. શુદ્ધોહનનું ભૂત્યું થયું. ગોપા અને નગરવાસી બીજું કેટલીક સ્વીએઓ બુદ્ધહેવની પાસે આવીને સંન્યાસધર્મ અહિયું કરવાની પ્રાર્થના કરી. એમને હીક્ષા આપીને બુદ્ધહેવે લિખ્યું સંપ્રદાય સ્થાપ્યો. ગોપા લિખ્યું સંપ્રદાયની-એ સેવિકાએની ટોળીની આગેવાન થઈ.

આજ ગોપાનું જીવન સંક્રાંતિ થયું. આજ સ્વામીના ત્યાગમાં ત્યાળી, સ્વામીના ગૌરવથી ગૌરવિષી, સ્વામીના ધર્મકર્મની સંંગી, સ્વામીના પુણ્યતેજના મહિમાથી મહિમામયી, જગતના સર્વશ્રેષ્ઠ માલાસાધકની સહધર્મિણી યશોધરા, ક્રક્ત કહેવાનીજ નહિ, પણ ખરેખરી વીતે સ્વામીની સહધર્મિણી અને સહયારિણી બની.

એ ત્યાળી અવસ્થામાં પરિવ્રાજિકા યશોધરાએ પતિ-ગુરુહેવને એક વાર પૂછ્યું:—

“ અરદાંત તણું ડાડા, હૃદયે કો સમે પડે;  
પૂર્વોવસ્થા તારી છાયા? ભગવન્! પૂછું આદરે.  
છાયાએ અર્પતી કંધ લાંછનો ઉર શુદ્ધને?  
નિર્વાણ શાંતિમાં એથી પડતો ભાગ કો ક્ષણે? ”

પત્નીનો એ સરળ અશ્ર સાંલળી બુદ્ધહેવે કૌમુહીપટમાં તદ્દુષણતા પામતી એક નૌકાને દષ્ટાંતર્દ્યે બતાવીને કહ્યું:—

( વસંતનિવકા )

“ સાધી! તને કહું હું આજ નિગૂઢ એક,  
અજ્ઞાન પામર લલી શકશો ન લેદે;  
નિર્વાણનું અકલ રૂપ ન મંદ જાણું,  
શાંતિ જલે લહરિને સ્થિતિ ભાગ માને!  
નિર્વાણ જિધુ જલમાં કહી ના વિકાર;  
આભાસ થાય કદી, અન્યજ એ પ્રકાર.  
મારા અગાધ હૃદયે બનિયા બનાવ,  
તેમાંથી એક વરણું, સુણ્ય ધારી ભાવ. ”

( અનુષ્ટુપ્ )

મંથનો મેં કર્યાં ઊડાં, એધિવૃક્ષ તળે રહી;  
 ચિંતેનાના પ્રકારેનાં, પ્રગટ્યાં ને ગચ્છાં શમી.  
 અંતે આનંદ-સિંહુના, જળમાં બોળતું મને;  
 પ્રગટ્યું તીવ ડો ઊડું, સંવેદન કહું તને.  
 પાર્યો હું સહસ્રા ત્યારે, અપમેય દશા નવી;  
 ખરે નિર્વાણુનો સિંહ, રેલાયો હૃદયે રમી.

( વસંતનિલકા )

નિર્વાણ એ અનુભવ્યો સતત પ્રવાહી,  
 વષો અનેક લગી, શાંતિ રહી છવાઈ.  
 તોએ ઊડા અનુભવો કહી બિજ ભાસી,  
 એ શાંતિમાં પ્રગટતા, પછી જાય નાસી.  
 જે એક વેળ ઘનિયું ન ઘનયું કહી જે,  
 હું ધ્યાનમાં સ્થિર રહ્યો, નવ લક્ષ બીજે;  
 ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની,  
 એ ધ્યાનમાં સ્કુરતીજે! પ્રગટીજ છાની.  
 આભૂષણ્ણો વળી, હુકૂલજ રાણી જેગાં,  
 સર્વે ગચ્છાં સરી, અને પ્રગટ્યાંજ બીજાં;  
 સાઢાં, તથાપિ કંઈ હીપિત હિવ્ય તેજે,  
 તે ધારતી મૃહુલ કાન્તિ નિહાણી મેં તે.

( અનુષ્ટુપ્ )

નૌકા ચેલી સરે જયોતસ્ના, પૂર્માં તે સમી સ્થિતિ;  
 હિવ્યતા પામતી તારી, મધુરી મૂર્તિની હતી.

( વસંતનિલકા )

એ શુદ્ધ મૂર્તિ આ હૃદયે સ્કુરતી,  
 નિર્વાણ-કૌમુદી જોણીડી મેં સરતી;  
 નિર્વાણમાં નવ થયો કંઈ તેથી ભાગ,  
 નિર્વાણ તું ઘણી રહી મમ હિવ્ય અંગ.”\*  
 બુદ્ધહેવનો આ ઉત્તર એમનો યશોધર માટેનો પ્રેમ તથા  
 સદ્ગુલાવ સૂચ્યવે છે. બુદ્ધહેવનો ધર્મ બહુ જડપથી આપા હેશનાં

\* આ ચરિત્રમાંની કવિતાઓ સાક્ષરવ્યર્થ રા. રા. નરસિંહ-  
 રાવલાધના ‘નરપુરઝંકાર’ અંથમાંથી લેવામાં આવી છે.

ખીપુરુષોમાં હેલાદ ગયો. તેનો કંઈક થશ આ આર્યનારીની પરમ સાધનાને પણ ઘટે છે. બિકુણી સંપ્રદાયની આગેવાન તરીકે અનેક રમણીઓને સેવા અને પરોપકારના મતમાં પ્રેરીને ગોપાએ જગતને મોટો લાલ પહોંચાયો હતો. .

યશોધરાના શરીરનો રંગ કંચન સમો હોવાથી ખૌદ્ધર્મના અંદ્રામાં પણ લદ્રા કંચનના નામથીજ તેને સંભાધવામાં આવ્યાં છે.

સંધમાં દાખલ થયા પણી આત્માજ્ઞતિ ઉપરજ તેણું પોતાનું સંધળું લક્ષ્ય પરોંયું હતું. બિકુણીસંધના નિયમોનું પાવન તેણું ખીજું બિકુણીઓની પેઢેજ પૂર્ણ કાળજીપૂર્વક કર્યું હતું. લાં એણું અહીંત પદ પ્રાપ્ત કર્યું અને અભિજાણોમાં પ્રવીણુતા મેળવી. એક હિવસ ધ્યાનમાં બેડી હતી, ત્યાં એને એકદમ પૂર્વકાળના હળવો જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તેનો એ ગુણ વિશેષ પ્રસિદ્ધ થયો.

યુદ્ધ ભગવાને બિકુણીસંધમાં પરવિહાનના સમારંભમાં મહાભિજા પ્રાપ્ત કરનાર બિકુણીઓમાં યશોધરાને અય્યું. મહાભિજા પ્રાપ્ત કરનાર બિકુણો તો થઈ ગયા છે; પરંતુ ખીણોમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરનારી એકલી યશોધરાજ હતી. હિવ્ય શક્તિને અભિજા કહે છે. જલતબતના ચ્યમતકાર કરવા, હિવ્યનાદ શ્વરણુ કરવો, જીવનાના મનની વાત પારખવી, પૂર્વજન્મનું સ્મરણ થાયું, હિવ્ય ચક્ર આવવાં અને વિકારાનો ક્ષય થયો એને અભિજા કહે છે. મહાભિજા એનાથી પણ ઉપરનો ફરજનો છે. એ પ્રાપ્ત કર્યાથી અસંખ્ય પૂર્વજન્મનું જાન થાય છે.

અલ્યાસથી યોગી એ શક્તિઓ પોતાની મેળેજ પ્રાપ્ત કરી શકે છે એવો યુદ્ધહેવનો અભિપ્રાય હતો; પણ એનેજ એકમાત્ર ધ્યેય ન સમજ લેવું જોઈએ અને એના પ્રત્યે આસક્તિ ન રાખવી જોઈએ એવો એમનો ઉપદેશ હતો.





## દુ-કિસાગોત્રમી

**મ**હાપ્રણપતિ ગૌતમી તથા ખીજુ ગોતમીઓથી જુહી પાઢવા સારુ અને કિસા અથવા કૃશા ગોતમી નામથી ઓળાખવામાં આવે છે. કૃશા એટલા માટે કહી છે કે એ કૃશાંગી સુકુમાર હેઠવાળી હતી. એમ કહેવાય છે કે, પૂર્વજન્મમાં પહુસુતાર યુદ્ધના સમયમાં એક ક્ષત્રિય સામંતના વંશમાં અને જન્મ થયો હતો. ભગવાનને સુખેથી એક સમયે સાદા વચ્છારી સંસારત્યાગી બિક્ષુણીઓની ઘણી પ્રશાંસા થતી સાંભળીને એહે મનમાં સંકલ્પ કર્યો હતો કે, “હું પણ કોઈ દિવસ એ બિક્ષુણીપદ પ્રાપ્ત કરીશ.” એ જન્મમાંંતો એની એ અલિકાપા પાર પડી નહિ, પરંતુ ગૌતમયુદ્ધના સમયમાં આવસ્તી નગરીના એક ગરીબ કુદુંખમાં અનો જન્મ થયો. દરિદ્ર ઘરની કન્યા હોવાથી સાસરામાં કોઈ અનો ભાવ પૂછું નહિ. સૌ કોઈ અનાદરની દિનીને નેતું. આખ્રે અને એક પુત્ર થયો, ત્યારથી એનું માન વધ્યું; પણ ગરીબતું નસીબ ગરીબજ હોય છે. માતાનું માન વધારનાર, માતાના સુખ અને સૌલાઙ્ઘનો એકમાત્ર આધાર એ બાળક, એક દિવસ રમવા ગયો હતો. ત્યાંથી અને સર્વ કરણો અને એ નિર્દોષ હસ-મુખું બાળક સદાને માટે માતાને હુઃઅ અને અશુની લેટ ધરી કાળના પંજમાં વિલીન થઈ ગયું. બિચારી ગોતમીના સુખનો સ્થૂર અસ્ત થઈ ગયો. એને ખાતરી થઈ કે આ સંસાર કરી મને હુઃઅ હેશો. પુત્રના ભરણુથી એના શોંકનો પાર રહ્યો નહિ. ભૂત બાળકને ઓળામાં લઈને ભૂતસંજીવની કોઈ ઔષધિની શોધમાં એ બૈરેબૈર બિક્ષા માગતી કરવા લાગી. યુદ્ધ ભગવાન પોતાના શિષ્યો. સહિત એ વખતે ધર્મપ્રચાર કરવા નીકળ્યા હતા. ગોતમીએ તેમને હીઠા; પછી શું થશું તે અમે સાક્ષરવર્ય નર-સિંહરાવલાઈના પ્રાસાદિક શરીરોમાં વર્ણવીશું:—

( લખિતછંદ )

- ચુવતિ તે મળી શાકચનાથને, ચરણું પંકજે જેડી હાથને;
- નમન નમ્રતા ભાવથી કર્યું, વદન આંસુને ભીજિયું ઘણું.
- નથન છે શીળાં જે કરોતીનાં, નથન તેહાં એહ રોતીનાં;
- ચુવતિ ત્યાં પછી હીન વાણીએ, વચન ઉચ્ચરી ભાવ આણીને.

( દાણ )

ભાવ આણી બોલી વાણી, વિનત વનિતા ત્યાં પછી,  
 “એ નાથ! આહિં તમેજ આંબ્યા! હીનપર કરેણું કરી.  
 પેલી તટ તરુચાજિમાં, સુજ પણુંકુઠીમાં હું વસું,  
 ને ભાગ સુજ ઉછેરતી રહી, હુઃખ જાણું નહિ કશું.  
 નાથ એ વટરાજિમાં કરી, તેજ કાદ્ય હયા ઘણી,  
 દીધું વચન ભાગ ઉગારવા” બહુ હીન તે ચુવતિ ભણી.  
 “ભાગુણો સુજ ઐલતો ચાલી ગયો તરુ કંઝમાં,  
 કંઈ કુપળ પણું વિશેજ હીઠા કૂટિલ એક ભુજંગ ત્યાં.  
 વાણી વળિયો નાગ એ સુજ ભાગુણા કર પરે,  
 ને ભાગ હેને ચીફવતો કંઈ હાસ અડઅડ શો કરે!  
 તીવ્ર જિહ્વા ચુગલ ધરતો, શીતળ હેનો જોડિયો.  
 સુખ વિકસાવીને કુંકવાટા કરતો ચીફવતાંન્યાં ઊડિયો.  
 પણ હાય! એ સુજ ભાગુણો ક્ષણુચારમાં પીળો થયો,  
 નિસ્તાર પદિયો, મેં ન જાણું કેમ એ રમતો રહ્યો.  
 અધરપુટના બંધથી સુજ રતન તનયું વળી તે કણો,  
 કોઈ કહે ‘વિષ ચઢ્યું હેને’ ‘નહિ લુવે’ વળી કોણો.  
 પણ મેં ગૂમાવાયે નહિ, સુજ ભાગ મોંધા મૂલનો,  
 ને કરી વિકાસ થવા ચહીને કરમિયા એ કૂલનો.  
 માંયું ઔષધ સહુ કને, જે ભાગુણને લોચને,  
 કરી જાડી ગયેહું તેજ પૂરે, પૂરે મન સુજ મોદને.  
 ચુંબન બિંહ એ સર્પતણું કંઈ જીણું અતિ નાનું,  
 વૈર ન સુજ ભાગ શું એ રાખે હું નિશ્ચય મન જાણું.  
 ભાયાળું સુજ ભાગ હુતો અતિ, પ્રાણી વિશે ધરે પ્રેમ;  
 રમત રમતમાં રપર્શી કરતાં સર્પ હૂલે હેને કેમ?

( વલથુ )

કેમ હ્વલે સુજ યાળને ? પ્રેમ લયો એ યાળ,  
માનું નહિ હું એ કહી સર્પ ડસે કો કાળ રે .

( ચોપાઈ )

પછી કો સુજને વહિયો વેણુ, કહું ઉપાય તુજને એ અહેન !  
પુષ્ટયાત્મા કો ગિરિ પર વસે,—ને ! ભગવાં ધરી ચાવ્યો પણુ,  
જ તું એ ઋપિજનને ચાચ, ઔપધ કંઈ તુજ યાગક કાજ;  
એહ સુણી કાલે તુજ પાસ, આવી હું ધરી મોટી આશ.

( વૈદલી વનમાં વલવલે—એ રાગ )

આશ ધરી મોટી નાથ હું આવી તારી સમીપ;  
કુર અનિલે હોલવ્યો પ્રકટાવવા મોંદ્યા દીપ. આશ૦  
હેવ સરીણું દીપતું તુજ ભાળ વિશાળ;  
નિરખી હું આવીને ઊલ્લી કંઈ મા ના તુજ યાળ. આશ૦

અંસુ દાળીને અસેદિયું શિશુ સુખ પટ્ટૂળ,  
લળી લળી તુજને પૃછિયું, ‘ઔપધ દિયું અનુકૂળ?’ આશ૦  
ને નાથ મોટા એા ! તે મને કાઢી તરછેડી નાહિ;  
મીડી મૃહ નજરે રહ્યો નિરખી પ્રેમે તું કંઈ. આશ૦  
ધીરા કોમળ કરવઠે સ્પર્શ કરીને તે વાર;  
સુખ પટ પાછું ટાકિયું, પછી કોણે ઉચ્ચાર. આશ૦

સુત્રશોદથી વિહૃવણ ઘનેલી માતાને પરમ સાધુ, સંસાર-  
ત્યાળી જુદ્ધદેવ વગર કોણું આશ્વાસન આપે ? એમણે યાગકના  
હેહ ઉપર મૃહ હસ્ત હેરવીને શાંત ચિત્ત કંધું :—

“ અહેન, ઉપાય અતાવું હું, જેથી હુઃખ તુજ રૂઝાય;  
ને હુઃખ રૂજે આ યાગતું, પણ ઔપધ તું લાભ્ય.

\* \* \*

શોધીને લાભ્ય તું કાળી કંઈ તોલો એકજ રાઈ.

પણ જોને ખાઈ ! એ ઘર વિંદે, મૃત્યુ પામ્યુ કો હોય;

માત, પિતા, સુત કે સુતા, હાસી હાસ વા કોય.

તે ઘેરથી નવ લાવતી રાઈ કણું તું એક;

હેવી મળે કહી રાઈ તો, —ધન્ય તુજ કર્મદેખ.”

જુદ્ધભગવાને કેવો સીધો ઉપાય અતાવ્યો ? કંધું કે, “હે અહેન !

તું એક તોલો કાળી-છલ્યા વગરની-રાઈ લઈ આવે તો હું તારા છોકરાને જીવતો કરું; પણ એક શરત છે. એ રાઈ એવા ઘરમાંથી માણી આણુવી જોઈએ કે એ ઘરમાં મા, બાપ, છોકરો, છોકરી, દાસદાસી, ભાઈઓને કોઈ ન મરણું પામ્યું હોય. શોકાતુર જોતભી એ વખતે ભગવાનના કથનનું આદ્યાત્મિક રહસ્ય સમજી નહિ. એ લોળીએ શું કર્યું તે એના શાણદોમાં જોઈએ.

( ગરભી )

“ નાથ ! ભટકી હું ઘેર ઘેર, ઉટજ\* ઉટજમાં રે,  
આ વનમાં અને ઠેર ઠેર નગર મારગમાં રે;  
હાણી હુક્કડા સરીસો બાળ, ગંધેા શીત અંગે રે,  
માગતી હીન હું દ્વાર દ્વાર, બહીલી સુણ બંધે રે.  
કોઈ આપશો તોલો રાઈ, કાળી, હું વીનવું રે,  
આણી હુદ્ધય હ્યા એં ભાઈ ! કરમ્યું કૂલ અીલવું રે;  
અને હૃતી જેને જેને ઘેર, સર્વેંચે આપી રે.  
રંક જન પર રંકની મહેર નિરંતર વ્યાપી રે.  
પણ પૂછયું મેં જેણી વાર-કદી આ ઘરમાં રે;  
ભાઈ ! કાંઈ મૂડા ? નર, નાર, કે બાળ ચાકરમાં રે ?  
મળ્યો ઉત્તર તરત આ—‘બહેન શી વાત આ પૂછે રે ?  
ઘણાં વણાં મરણુને ઠેણું, રઘાં અદ્ય પૂર્ણ રે.  
ભરી શોકે દઈ આભાર દઈ રાઈ પાછી રે;  
ચાલી આગળ બીજે દ્વાર, વિનંતિ ચાચી રે,  
પણ ત્યાં પણ ઉત્તર મળિયો : ‘રહી આ રાઈ રે,  
પણ દાસ હમારો પડિયો મરણુમાં ખાઈ રે.’  
કોઈ કહે વળી—‘દ્યો આ રાઈ, પણ આ સહનમાં રે;  
ગૃહ નાથ ગયો છે બાઈ અકાલ મરણુમાં રે !’  
કોઈ કહે—‘રાઈ આ જેણું વાવી તે વર્ષી વિરામે રે,  
હજુ લણુવા વેળ નથી આવી, ને પહેંચ્યો સ્વધામેરે.’

આ પ્રમાણે આખા ગામમાં ફરીને એવું એક પણ ઘર નહિ. દીકું કે એ ઘરમાં મૃત્યુનાં પગલાં ન થયાં હોય. ત્યારે જોતભી નિરાશ થઈને બીજે હિવસે ભગવાન યુદ્ધની પાસે ગઈ. ભગવાને પૂછયું : “ કેમ, કિસાગોત્તમી ! મેં કહું હતું એવી રાઈ લઈ આવ્યાં કે ? જોતભીએ પોતાનો સધળો વૃત્તાંત કહી સંભળાવીને જણાવ્યું કે,

“નવ મજયું ધર મુજને કહીં મૃત્યુ વિનાનું એક,  
થાકી પાછી હું વળી, પૂછવા સત્ય વિવેક રે.

(૬૩)

સત્ય અર્થ હું શોધવા પાછી આવી તારી પાસ,  
નહીંટ દ્રાક્ષાદુંજ મૂડી શિશુ ધાવેન કરે જે હાસ.  
દર્શન કરી તુજ ચરણ ચુંણીને પ્રાર્થન કરવા કાલે,  
કયાં મળશે સુજને રાઈકણું જ્યાં મૃત્યુ કદી નવ ગાજે.  
પણ હાય સુજભાગુડો હાવાંતો પદિયો હશે મૃત્યુ હાથ,  
લોકે કહું, ભય સુજ મન કે રહ્યું, સાચું પડ્યું તે નાથ.”

કિસાગોતમીને આ પ્રમાણે શોકાતુર જોઈને લગવાન યુદ્ધ

બોલ્યા:—

“સત્ય તત્ત્વ તું પામી એ બહેન !  
જડયું જે નહિ કોઈ જનને, દેવ શાંતિ મજયું તુજ મનને;  
કુદુ અમૃત હિવ્યજ એ તો, તુંને આપવા ધાર્યું તું મેં તો;  
તુજ ખાળ બહાલો તુંનેહતો, એ તો મરણ શરણ થઈ સુતો.  
તુજ હૃદય શાચ્યા પર કાલે, કરી જીવન એ નવ આલે;  
આને જાણું તેં જગ આ વિશાળ, તુજ હુઃએ દાળે આંસુ ધાર;  
અન્ય હૃદયોએ ભાગ લીધેલો, શોક થાય છે હળવો વહેલો;  
સુજ રક્ત રેઝચથી રોકાય, તુજ આંસું તો હું આંદ્ય;  
સઘ અર્પણું કરી હડું બહેન, સુજ રુધિરનું રાતું વહેણુ;  
અને શોધી કાઢું તત્ત્વ જાડું, જેથી જાકલે મહા હુઃએ ભૂંડું.  
જેહ હુઃએ કરી પ્રેમ મધુરો, શોકરૂપ બની થાય અધુરો;  
અને જે મતુજ ટોળાને, હાંકી લઈ જય છે અલિસ્થાને;  
મૂડ આ પણ યુથને જેમ, પણુના નાથ મતુજને તેમ;  
રચ્ય કુસુમ અને તૃણું ભૂમિ, આળાંગાવી હાંકી જય ધૂરી;  
પહોંચાડે મહા અલિસ્થાનમાંતે તીવ હુઃએ જડયું જન્મ સાથે.  
હું એ ગૂઢ તત્ત્વ ગોતું ખાળ ! હૃવેશિશુને શમશાન પહોંચાય.”

યુદ્ધહેવના આ ઉપદેશામૃતથી કિસાગોતમીનાં જાનચક્ષુ  
જીવજ્યાં. એના હૃદયનો શોક શરીર ગયો. સ્વસ્થ ચિત્તે તેણે પુત્રનો  
અગ્રિસંકાર કર્યો અને ચોતે ગૃહ તળુને યુદ્ધહેવની પાસે ધર્મનું  
જાન પ્રાપ્ત કરવા લાગી. આખરે એણે થેરી પદ અને છેવટે અર્હાત  
પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૨૧૩ થી ૨૨૩ સુધીના શ્રોક તેના

રહેલા છે. એ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણું છે:—

“ સાધુ પુરુષની સાથે મિત્રતા કરવી એ હિતકારી છે. સાધુ-જનનો સંગ પ્રાપ્ત કરીને મૂઠ મનુષ્ય પણ પંડિત થઈ જાય છે. સાધુની સોખતથી પ્રજા વધે છે અને પાપ તથા હુઃખ ફૂર થાય છે. હુઃખનો હેતુ શો છે અને હુઃખનો તિરોભાવ કેવી રીતે થાય તેનું શિક્ષણ મેળવ. આચોનાં ચાર સત્ય અને અધારંગ ધર્મને પ્રાપ્ત કર.

“ માનવોના સારથી કહી ગયા છે કે, સ્વીનું જીવન હુઃખમય છે. સપ્તની-શોકચ-નો સહવાસ, સુવાવડ એ બધાંને લીધે સ્વી-જીવન અતિશય હુઃખમય છે. એ હુઃખને લીધે કેટલીક સીઓ ગળે ઝાંસે આધિને મરે છે. ડોધ વિષ આધ લે છે. કોઈના ગર્ભ-માંનું ખાગક પણ માતાની સાથેજ મરણું પામે છે.”

ત્યાર પછી ચોતાની આપવીતી-જીવનકથા સંક્ષેપમાં જણાવી-ને કહે છે કે, “ કુલહીન, પતિહીન થયેલી મેં આખરે અમૃતત્વ પ્રાપ્ત કર્યું. આચોના આઠ અંગવાળા ધર્મનું ચિત્વન કર્યાથી ધર્મ-ના એ સ્વચ્છ આદર્શ વહે મેં આખરે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે.

“ હૃદય ઉપરથી હુઃખરૂપી પથથરનો ભાર હલકો પડી ગયો છે. મારી કરણી સક્રણ થઈ છે. સુકૃતચિત્ત થઈને મેં કિસાગોતમીએ આજે આ ગાથા ગાઈ છે. ”





## ૭-સુજાતા

આ અંથમાં અન્યત્ર કે સુજાતાનાં ચરિત્ર આપવામાં આવ્યાં છે, તેનાથી લિખ આ સુજાતા છે. ગૌતમ બુદ્ધહેવના સમયમાં એ પણ થઈ ગઈ છે. ઇથું નહીને તીરે એનો નિવાસ હતો. જેનાની વંશના એક ધનવાન પુરુષ સાથે એનું લગ્ન થયું હતું. એ સમયમાં ગાયો મતુપ્યની સમૃદ્ધિનું સુખ અંગ ગણ્યાતું. ગૌ એ ધન હતું. સુજાતાના પતિને વેર પુષ્પળ ગાયો હતી. ધનવાન હોવા સાથે એ ઘણો પરોપકારી પણ હતો. સુયોગ્ય પતનીની સાથે તેનો સમય સંસારસુખમાં વ્યતીત થતો હતો. સુજાતામાં સૌંદર્ય અને સહૃદયનો અપૂર્વ મણિકંચનયોગ થયો હતો. કવિશ્રી નરસિંહસાવલાઇના શાહીમાં કહીએ તો—

નામ સુજાતા હેતું સુંદર, ચંપક કાચા રંગ,  
નીલ કમલસમ લોચન શીળા, અતુપમ છે લાવણ્ય;  
એહ ભૂમિમાં સુંદર હેવી, કે નારી નવ અન્ય,  
વિનયવઠે એ સતી શોભતી હેત ભરીને હીન.  
વેણુ મધુર સાહુ સંગે વહતી, દીપે વહન કુલીન;  
હસતું સુખ ધરતીજ સહા એ લક્ષના મંડલ રતન.  
ગૃહસંસાર તણ્ણા સુખમાં નિર્ઝમતી જીવન શાંત.

\* \* \* \*

આ પ્રમાણે સુજાતાનો સંસાર ઘણો સુખી હતો; પણ એમાં એકજ વાતની ઓટ હતી. પતિપત્નીના સ્નેહને પવિત્ર સાંકળથી વધારે દઢ ડરનાર પુત્રનું સુખ હજુ સુધી એણે જેણું નહોતું.

શાંત ગૃહે વસતીજ સતી એ નિજ સ્વામીની સંગ,  
પ્રેમપૂર્ણ જીવન પણ આર્દ્ધ પુત્ર વિના સુખ લંગ.

પુત્ર વગર જીવનમાં એ દંપત્તિને કશું પણ સુખ જણ્યાતું નહિ.

પુત્રપ્રામિની આશામાં સુન્નતાએ અનેક મત, જપ, પૂજાપાડ કર્યો.

લક્ષ્મિભાવથી દેવ દેવિયો પ્રીતથી સહા પૂળ કેવીએ.

લક્ષ્મી હેવિને પુષ્ટયમંહિરે, પ્રાર્થની સહા પુત્ર અવતરે;

કરી પ્રદક્ષિણા કેટિવાર એ, પ્રાર્થની મહાહેવ બાળુને;

કંઈ ધરાવતી નવેદ નવનવાં, પુત્રરત્નની આશમાં હવાં.

એ સમયમાં બુદ્ધહેવ પાસેના વનમાં પરથળ્ઠ પરમાત્માતું ધ્યાન ધરી રહ્યા હતા. સંસારનાં અનેકવિધ હૃદ્દોમાંથી સુક્રિયા પામવાના ઉપાયો શોધી રહ્યા હતા. તેમની શીર્તિ સુન્નતાને કાને પણું પહોંચી હતી. અધાં દેવહેવીએ તરફથી નિરાશ થયેલી સુન્નતાએ બાધા રાણી કે:—

“પુત્ર રત્ન જે સાંપદે લેટ ધર્દાં સપ્રેમ,  
વનમાં વસિયો આખું જે હેવાંશી રે દેવ!  
હેને લોજન ભાવથી અપું હું તત્ત્વેવ;  
દેવો જે આરોગ્યા તલસે, હેલું પાન,  
કનક પાત્ર ભરી અપું હું;  
જ્યાં એ તરુતળ ધરતો ધ્યાન.”

સુન્નતાની શાદી ઈણી. દશ મહિનામાં એક સુંદર પુત્ર અને ચેટે જન્મ્યો. સુન્નતાના હર્ષનો પાર રહ્યો નહિ. પુત્ર ત્રણ માસનો થયો એટલે બુદ્ધહેવને પગે લગાડવા, પોતાની માનતા પૂરી કરવા એમને સારુ તૈયાર કરેલા સ્વાહિષ હૃદ્ધપાડના નેવેદ સાથે સુન્નતા વનભૂમિ ભાગી જવા નીકળી.

“ઉર આલાર ભરી હળ ભરતી, ખાડે હુંદ્યા સરસેં ધરતી;  
રાતી સાડીમાં શિશુને લાંઘેયો, નાનકડા ભુજ ઉર ધરી લેણ્યો;  
નિજ ઉરનું એ આનંદ રત્ન, દાળે ઉરથું કરે કરી જતન;  
અન્ય કર કરી જાયા સુરેખ, શિર સ્થિર ટેકંતી ભાર એક;  
પાત્ર સુગલતણો એ ભાર, માંદિ દેવ કાજ આડાર;

દાસીએ વૃક્ષની નીંયે એસી, પદ્માસન વાળી તપસ્યા કરતા દિવ્ય તેજવાળા શાંત અને નભ બુદ્ધહેવને દેખાયા. એટલે સુન્નતાએ ત્યાં જઈને માથું નમાવી મહભાવે વિનતી કરી:—  
અહો! હું જવાસી સાંત! અતિ પવિત્ર, એલી દીનનો અનાથનો તું ભિત્ર;  
શ્રેયદાતા! હું યાચું દાસી હીન, હયા દાન ધન્ય દર્શનજ નવીન.  
શુભ દહિં અનાવી લાવી આજ તાળું, અને હૃદ, હસ્તિ દંતશું નવાળું;

રંક કેરી સેટ આટલી સ્વીકારો, અને સદ્ગણ થાવ જન્મ આ હુમારો:

આ પ્રમાણે વિનિતિ કરીને સુભાતાએ કનકપાત્રમાં દૂધ અને દહીં જુદાં જુદાં પીરસ્યાં. ત્યાર પછી સ્ક્રિટિક-પાત્રમાં સુગંધી દ્રવ્યો મૂકીને બુદ્ધહેવને તેનું મર્દન કર્યું.

બુદ્ધહેવે મૌનપૂર્વક અનિ ગ્રસન્નતા સહિત એ લોજન કર્યું. ઉપવાસ અને ઉન્નતગરાથી ને શ્રમ પહોંચ્યો હતો તે આ પુષ્ટિ-કારક લોજન આરોગતાં વાર જતો રહ્યો. એ લોજનથી બુદ્ધહેવનો એ ગ્રસન્ન આત્મા—

દિવ્ય સત્યની ભૂમિ ભણી ઊઠવા થયો સમર્થ ઘણો.

ભગવાન બુદ્ધહેવના વદન ઉપર પહેલાં કરતાં વધારે દિવ્યતા અને ગૌરતા નીરખીને સુભાતાની તેમના પ્રત્યે ભક્તિ વધી અને તે હર્ષપૂર્વક પૂછવા લાગી:—

“ સાચે શું છો આપ હેવ અવનિમાં જીતયો ?

મુજ આનંદ અમાપ ગ્રસન્ન જે મુજ લેટથી.”

બુદ્ધહેવે પૂછ્યું: “ હેવિ ! હું તારા આ લોજનથી ઘણો ગ્રસન્ન થયો છું. એનાથી અનેક દિવસનો મારો થાક જીતરી ગયો છે. ધ્યાન ધરવાને મારામાં નવી સ્કૂર્ટ આવી છે. આજે મારામાં કાંઈ નવીનજ જીવન આવ્યું હોય એમ લાગે છે. તું એવું સ્વાહિષ લોજન કર્યાંથી લાવી ? ”

સુભાતાએ ઉદ્દાસપૂર્વક ઉત્તર આપ્યો:—

( કટાવ )

“ નાથ સુણોણુ, જોયાશો મુજ પતિના ધરનાં, તેમાં થકી સો ગાયો. શોધી, નવપ્રસૂતા, દૂધ એહનાં પાઈ પોખી; પચાસ બીજી, સુંદર ઘેનું, દૂધ એહનું, પચીસ બીજી ગૌને પાયું; પચીસ કેરું બીજી બારને પ્રેમે પાયું; એક બારનું યુથ, મહિની ઉત્તમ ખટ વૈનુને અપર્યું; એ ઘેનુંનું દૂધ ઉકાયું રૂપા કેરા લોટા મદ્યે; અને પછી મેં શુદ્ધ બીજને વીણી વીણી, મોતી કેરા દાણા સરખાં તાંહુલ લઈને, નવ એડેલી ભૂમિ મધ્યે, પ્રથમ થકી જીગાડી લણેલા ચોખા એારી, પાયસ રંધી અત્ર ધરાયો; ધન્ય ધન્ય મુજ જીવન, પ્રભુને આજે લાવ્યો.”

ત્યાર પછી પોતે વંદ્યાવસ્થામાં કેવું ચિંતામય જીવન ગાળતી

હતી અને ચોતાને પુત્ર અવતરવા સારુ બુદ્ધહેવની ડેવી માનતા માની હતી એ અખી વાત વિસ્તારીને કહી અને બાળકને લગવાનની આગળ ધર્યો. લગવાને બાળકના ઉપરથી લાલ પાલવ અસેડીને પ્રેમપૂર્વક નિહાયો તથા એના નાનકડા શિર ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો:—

“ લાંબુ સુખ લોગવને !  
જીવન હુઃખના લારને વહી નાંખણે રહેને  
સુંદર બાળક તારો !  
આશ્રય મુજને અજનો આપ્યો બહેન ! તેં આજે.  
હુંનથી હેવ ડો સ્વર્ગનો હું તુજ બાંધવ સાચે,  
સુંદર બાળ નિહાળું હું ”

“ હું પોતે પૂર્વાશ્રમમાં રાજકુમાર હતો, મોટા સુખવૈલવ લોગવતાં હતો અને હાલ છ વર્ષથી સંસારનાં હુઃખ અને અંધકારનો નાશ કરે એવા હિન્દ્ય જ્ઞાનની શોધમાં જંગલે જંગલ લટકું છું. આજ કેટલાયે દિવસનો હું ભૂખ્યો હતો તેને—

“ સુંદર ભગિની જીવાદિયો આપી લોજન મીહું;  
તે પૂર્વે કાયા નિર્ઝલી લથડી ગઈ ત્યાં મેં દીહું.  
દર્શન એ હિન્દ્ય નયોતિનું ! સુંદર આ બાળક સભું. ”

આ પ્રમાણે ચોતાનો અનુભવ કહી લગવાન બુદ્ધ ખરા સાધુને છાજે એમ પૂજવા લાગ્યા:—

“ બહેન ! કહે, પણ આજ જીવન સુખમય તું ગણું ?  
જીવન જીવી એમ સુખ માધુર્ય તું લોગવે ?  
જીવનને વળી પ્રેમ એ બે તું બસ માનતી ?

( વાણુ )

“ પ્રેમ અને જીવન તને પૂરાં લાગે માત્ર ? ”

કુદો સરલ પણ ગંભીર પ્રશ્ન છે ! બુદ્ધહેવનો એ પ્રશ્ન પ્રત્યેક વાચક બન્ધુ તથા બહેને પણ હાલને સમયે ચોતાને પૂછવો ઘટે છે. પાર્થિવ સુખ તથા વૈકષ પ્રત્યેનો મોહ સુભતાના કાળ કરતાંથી હંજારોગણો હાલમાં વધી પડ્યો છે. સુભતાએ હીન લાને ઉત્તર આપ્યો:—

“ પૂજય એંસ લગવાન !

ઉર માડં આ નાનકડું, તે થહે શું ભાર મહાન !  
 વિશાળ એતર ભીજવે નવ વર્ષી બિંહુ બોડાં,  
 તેથે બિંહુ ભરી હેતાં કુમુદ પટનાં મોડાં;  
 સુજનાથ કેરીકૃપામાં, ને આશિશુના સ્વિમિતમાંહિ;  
 જીવન રવિનું તેજ સુજને પૂરતું લાગે આંહિ.  
 ધરસંસાર તણું વ્યવહારે આનંદમાં સુખ ગાળું,  
 સૂર્ય ઉગમતાં વહેલી ઊરી દેવ સ્તવન ઉચ્ચારું.  
 ભિક્ષાદાન ઢકં, ને તુલસી કચારો સીંચું જળથી;  
 નિત્યકર્મ હાસીનન મધ્યે સોંપું પછી હું કળથી.  
 મધ્યાહને સુજનાથ પોઠતાશિર ધરી સુજ ઉચ્છારું;  
 વાચું હાળું વીજણુંએ પીતો ગાડ ઊમાંગે.  
 શાંત સંદેશાકાગ થાતાં લોજન પીરસું પ્રીતે,  
 અમીય ઊભી જમતાં નિરખું નાથને એ રીતે.  
 દેવ હર્ષન જઈ કરું, સાધીયો શું ગોધી ભાવે,  
 ત્યાં તારકગણુના હીય રૂપેરી પ્રગટે નિદ્રા લાવે.  
 આમ નિરંતર સુખસરિતામાં કેમન જાઉ તણુંતી;  
 ને સુજ નાથને સ્વર્ગ આપાવે પુત્ર ધર્યો એ છાતી.  
 શાસ્ત્ર વહે છે પથિક કાજ કે છાચા વૃક્ષો રોપે,  
 વાપી કૂપ જણુંબે તૃપિત કાજ તો હેવ ન કોપે.  
 પુત્ર રત્ન પામે કે નર તે મરણ પછી શુલ પામે,  
 શાસ્ત્ર વેદ તે હું શ્રદ્ધાથી માનું છું નન્દ લાવે.  
 વૃદ્ધ મોટા વહે તે થડી વધુ થાડં નવ શાણ્ણી;  
 દેવો સંગે વાતો કરતા વેદ મંત્રના જ્ઞાની.  
 પુષ્ય અને મોક્ષ તણું પંથો કેને પ્રત્યક્ષ વાત,  
 છેવા વૃદ્ધા આગળ હું તે નાથ ! કહો કેણું માત્ર ? ”

પતિગતા સુન્નતાએ સરળતાથી પોતાની દિનચર્ચો, પોતાની ધર્મશ્રદ્ધા જણુાવી ધર્મનું ખરું રહસ્ય પોતેશું અમળ છે તે જણાવ્યું :

“ નાથ ! જાણું વળી એક સત્ય—કેળે શુલ થડી શુલ નિત્ય,  
 અને ભૂંડાનું કેળે છે ભૂંડું, એહ નીતિ ધીજ છે રૂડું,  
 સર્વ જનને એ ન્યાય છાજે, સર્વ કાળે સર્વ સ્થળ સાચે;  
 મીઠાં મૂળનાં કેળે છે મીઠાં, વિષ મૂળનાં વિષ કેળું.

દેવ લાવથકી દેવ પ્રગટે, સ્નેહભાવે મળે ભિત્ર જગતે;  
ધૈર્ય સહન કરેં શાંતિ ફળશે, આમ આ જીવનમાં ભળશે;  
તો શું મળતાં નિર્ભિત કાળે અહીં જેણું ન શુભ ફળ ત્યારે?  
અરે તહારે અધિક ફળ રૂદું મળે, માનું એ સત્યજ જીંડું;  
એક કણું તાંડુલનો વાવ્યે, શત કણું ધર જીંધી આવે.”

શુદ્ધ ચિત્તથી બુદ્ધહેવ આગળ ધર્મનાં ધીજર્યપ આ સત્ય  
સનાતન તરવો જણુવીને સુભાતાએ આગળ કહેવા માંડયું:—

(ગરખી)

“ નાથ ! તદપિ હું જાણું જીવનમાં લયો,  
હૃદય ચીરતા વિધ વિધ હુઃખ પ્રસંગ જે;  
સહન કરતા ધીરજ તૂઠી ત્યાં પડે,  
કોમળ હઈડાં સહજ પામતાં લંગ જે. નાથ૦  
બાલૂડો સુજ પહેલાં જે ચાવ્યો જશો,  
હઈડું મારું સધ જશો ફાટી અરે!  
પ્રાણું તળ સુજ બાળક ઉરશું ધારીને,  
સ્વર્ગો વાટડી પતિની જેઠિશ હું અરે. નાથ૦  
પતિની પૂર્વે સ્વર્ગો વાસ સતી કરે,  
કેશે કેશે ગણુવા વર્ષ કરોડ જે;  
દેવલોકમાં વાસ પતિનો એટલો,  
વેદ વહે ને રમૃતિએ વચન અમોલ જે. નાથ૦  
તો નવ લીલિ ઉર ધારું હું જે જરી,  
જીવન સુખમાં સરકારું રસભેર જે;  
ને હુઃખીજન દીન હુષ્ટ કે પાપીનાં,  
જીવન નવ અવગણુતી હું કો ચેર જે. નાથ૦  
હું તો પુષ્ય જણુતો ખંથજ આદરું,  
દીન લાવથી સેણું ધર્મ સહાય જે;  
શ્રદ્ધા રાખું અટળ હૃદેમાં આટલી,  
અવશ્ય લાવિ સુખકર અતે થાય જે. નાથ૦

બુદ્ધહેવ સરળ હૃદયા સન્નારી સુભાતાના જીડા જાનથી ધણું  
પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા:—

“ એધ હિયે તું અમોલ એધકને,  
જાની જનથી અહું સરદ જાન તુજ ખરે સમર્થ બને.  
આ—૫

જાન વિના તૃપુ થને, આમ પુષ્યને સુધર્મ પથ ભણ્ણી,  
કેમળ કુસુમ ! તું વધને શાંત છાચામાં સહાય સુખ માની.  
મધ્યાહ્ન સમય કેળે સલ્ય સૂર્યનું જ તેજ અળહળતું,  
કેમળ અંદુર કાને તવ ઘડિયું એ લલે રહે અળતું.  
સુજ ચરણો પૂજાંતી તું તુજ ચરણો હું પૂજતો આને,  
શુદ્ધ હૃદય તું સરતા, અનાણુતાં જાન કૃપ તું સાચે.  
પ્રેમ તણ્ણાજ પ્રભાવે સરળ કોપોતી પળોજ નિજ માણે,  
તેમ તું ભક્તિબળથી લહય સ્થાને જઈશ એં આલે !  
સુખ શાંતિમાં લુલન વીતો તુજ નિર્મણું સહા ક્ષેમે,  
તુજ સિદ્ધિ સમીસિદ્ધિ સુજને મળજો-હું દચ્છું એ પ્રેમે.  
એને દશ્વર ધાર્યા તેં તે તુજનેજ વીનવે આને,  
આશિષ હે સુજને તું ‘સિદ્ધિ મળો’ સદ્ગ વિશ્વ સુખ કાને.”

આ પ્રમાણે ધર્મનો વિકાસ થવા અને સિદ્ધિ મળવાનો આશી-  
રીંદ બુદ્ધ લગવાને પવિત્ર મનની સુનના પાસે માણ્યો. સુનતાંએ  
તથા સુતુ કહી આશીરીંદ આયે.

બુદ્ધદેવ પણ બાળકને આશિષ આપી તથા સુનતાને ભક્તિ-  
પૂર્વક પ્રણામ કરી ત્યાંથી વિદ્યાય થયા.

એક સમયે હુનિયાના મોટા લાગમાં જાનરસિમ હેલાવનાર  
લગવાન બુદ્ધદેવના મન ઉપર પણ આવી ઊંડી અસર કરનાર  
દેવી સુનતાને ધન્ય છે.\*



\* આ આખું ચરિત્ર સુખ્યતવે સાક્ષર શ્રી નરસિંહરાવ  
બેણાનાથના ‘ગુજરાતી’ના ૧૯૭૮ ના દિવાળી અકમાં પ્રગટ થયેલા  
દેખભાંથી તેમની રણથી ઉપકારપૂર્વક લેવામાં આવ્યું છે.



## ८-सुप्रिया



अनाथपिंड नामना एक प्रसिद्ध धनवान वेपारीनी लाडकी कन्या हुती. ऐना संबंधमां एम क्षेवाय छे के, ए कन्या आ जगतमां पग मूँकतांनी साथेज पोतानी जनेताना मुख तरइ कोतुकलरी दिथी जेठने ‘बोद्धगाथा’ तु उच्चारणु करवा लागी हुती. ए गाथानो अर्थ एवा छे के, “बोद्ध लोकेने पुष्कर धन अने खानपानना पदाशेनुं दान करीने संतोष पमाणे। वे वे स्थगे पवित्र बोद्धस्थानो छेअ त्यां त्यां चापानां झुशेदार कूल चढावे।” आ तरतनी जन्मेली कन्यानी सूचना प्रमाणे तेना पिताये पुष्यदान कर्या. केटलांक वर्षो बाद एक बोद्ध परिवार्जक (साधु) तेमने घेर लिक्षा मागवा आवयो. ए साधुनु धर्मोपदेशरूपी वीज आणकी सुप्रियानी इण्ड्रूप चिता भूमिमां पडतांनी साथेज अंकुरित थयुं अने थेाडा समयमां वधीने एक चाढुं वृक्ष अनी गयुं. एम क्षेवाय छे के, केई अद्वलुत शक्तिनी असरथी ते पूर्वजन्मनुं वृत्तांत स्मरणु करीने कही शक्ती. सात वर्षनी वयेज महाप्रज्ञपति गौतमीना हाथे तेणु बोद्धधर्मनी दीक्षा लीधी हुती. दीक्षा लीधा पछी तेणु पोतानो अघो अभूत्य समय केवण तत्त्वज्ञान भेणववामां अने बोद्धधर्मना अस्यासमांज गाजयो हुतो. एम नथी; कारणुके एक तत्त्वज्ञानी क्षी तरीके तो ते प्रसिद्ध थई एटलुंज नहि, पणु भरकीथी सपडायेला रोगीच्या, हुकाळथी रिखाता कंगालो अने गरीबीनी सेवाचाकरी करीने ए पोताना समयना सधणा लोकेनी आभारपात्र अनी हुती. नीचेना एक अनाव उपरथी ऐनी ए परोपकार वृत्तिनो परिचय आपणुने मणी आवे छे.

शास्ता बुद्धहेव ए वधते जेतवनना विहारमां वास करी रह्या हुता.

એ વર્ષો શ્રાવસ્તી જેવા ધન અને મનુષ્યોથી પરિપૂર્ણ સમૃદ્ધિશાળી નગરના રહેવાસીઓ બોર હુકાળના પંનમાં સપડાયા હતા. એમને અજ્ઞના સંસા પડી રહ્યા હતા. એતરોમાં અનાજતું નામ નહોતું, દેશનાં લોકો રોગથી હાડપિંજર સમાં થઈ ગયાં હતાં.

ધનહીન અનાથ ભૂખ્યા હુકાળિયાના રૂદ્ધનો અવાજ શૈદિયાઓની હવેલીઓને ક્રાડીને અનંત આકાશમાં વિલીન થઈ જતો હતો. એ શૈદિયાઓ પોતાની આંખે એમતું હુઃખ જેતા, કાને એમની ચિચિયારી સાંભળતા પણ એમનાં હુઃખનું નિવારણ કરવાનો કોઈ ઉપાય એમણે કર્યો નહિ. એ વિષમ હુકાળના સમયમાં ગરીયાને મહદ આપવાને ધનિકોના હૃદયમાં જરા પણ સહાતું ભૂતિ ઉત્પન્ન થઈ નહિ.

શ્રાવસ્તી નગરમાં એ વખતે લક્ષાધિપતિઓની સંખ્યા કાંઈ ચોછી નહોતી; પરંતુ એ હુકાળમાં મહદ કરતી વખતે એમાંના ઘણ્યાખરા કંઝૂસીજ દર્શાવતા. હુકાળથી પીડાતાં લોકોની વહારે ધારું તો કચાં રહ્યું, એમને તો રાતદિવસ એજ ચિંતા રહેતી કે, રખે આ લોકો મારા ધરમાં પેસી જઈને મારી માત્રમત્તા લૂંટી ન દે. એ બીજીથી ધન અને અલંકારના રક્ષણુના અંદોખસ્તમાંજ એમનો બધો સમય વ્યતીત થતો હતો.

દૂંકામાં એજ કે સૌ કોઈ એ વખતે પોતપોતાના કુદુંખતું પોપણું કરવાના વિચારમાંજ ગુંથાયલા રહેતા હતા. બીજાઓનો વિચાર કોણું કરે? હાય સંસાર! તું આટલો સ્વાર્થી અને કુદુંખમિય છે!

એ દિવસે સવારે વિહારના ભારણા આગળ એક આશ્રમ વગરના ભાગકને મરણુંતોલ અવસ્થામાં પડેલો જોઈને બુદ્ધહેવના સુખ્ય શિષ્ય આનંદને ઘણ્યું હુઃખ ઉત્પન્ન થયું હતું. એતું જીવન બચાવવા સારુ એને ઘણ્યી ચિંતા ઉત્પન્ન થઈ અને એ બગવાન બુદ્ધહેવ પાસે જઈ હાથ જોઈને પૂછવા લાગ્યો: “ભગવન્! આવા સમયમાં મરણુંતોલ થયેલા અજ્ઞના અભાવે તરફિયાં મારતા મનુષ્યોના રક્ષણું માટે લિક્ષુસંધે શા ઉપાયો લેવા જોઈએ?”

બુદ્ધહેવ એનો પ્રશ્ન સાંભળીને જરા વાર વિચારમાં પહ્યા, લ્યાર પણી પોતાનું શાંત સુખ જરાક મલકાવીને ધીમે સાહે યોદ્યા: “આ વખતે તમારું કર્તવ્ય શું છે એ તમેજ નક્કી કરી લોા,”

આનંદ સ્વામીએ પછી વિશેષ કાંઈ પૂછ્યું નહિ. ધણી વાર સુધી એકીટથે તથાગત બુઝ્યા સુખ તરફ જોઈ રહ્યા અને પછી તે દિલ્લી તેમણે ભૂરા આકાશ તરફ ફેરવી.

ભૂરં આકાશ એ વખતે સ્થૂર્યદેવનાં પ્રભર કિરણોથી પ્રકાશિત થઈ રહ્યું હતું. આનંદ સ્થિર એ આકાશ તરફ થોડી વાર સુધી પલક પણું હલાયા વગર ઉદાસ ચિંતે જોઈ રહ્યા. તેમનાં નેત્રમાં પાણી ભરાઈ આન્યું. આર્ત મનુષ્યોનું રક્ષણું કરવા સાર્દી એમનું હૃદય એકદમ ચંચળ થઈ ગયું. એમની આંખમાં હવે સહાનું ભૂતિની તીવ્ર જ્યોતિ પ્રગટવા લાગી.

પાસે બેડેલા બધા લિખ્યો તેમના એ સુખ તરફ જોઈ રહ્યા હતા. આનંદ સ્વામીએ તેમના તરફ એક વાર સ્નેહભરી દિલ્લિથી જોયું.

ત્યાર પછી એ ગુરુજીની રણ લઈને લાંથી વિદ્યાય થયા.

એ દિવસે સંઘયાકાણે વિહારમાં આવેલા ભક્તોને ભગવાન બુઝે ‘જીવોનાં હુઃખ અને તેનું કારણ’ એ વિષય ઉપર સુમધુર દેશના આપી. ત્યાર પછી વિસર્જન થતાં પહેલાં તેમણે વાતચીતના પ્રસંગમાં શ્રાવસ્તીના એ હુકાળનું વિગતવાર વર્ણન કરીને બધાને એ સંકટનું નિવારણું કરવાનો આશ્રહ કર્યો.

ભગવાન તથાગતે પોતાના ભક્ત સેવકોને સંબોધીને કહ્યું: “તમારામાં તો ધણ્યા કુયેરના જેઠલી સંપત્તિવાળા છે. મારી ખાતરી છે કે તમારામાંનો એક જણું ધારે તો આ હુકાળના હુઃખનું નિવારણ કરી શકે અને એમ ન બને તો બધા મળીને તો જરૂર એ હુઃખ શર્માવી શકાય.”

ધનકુયેર રત્નાકર શેઠ ભગવાનની પાસે હાથ જોડીને જિલા અને કહેવા લાગ્યા: “ભગવન् ! વિશાળ શ્રાવસ્તી નગરી હુકાળના પંજમાં ફ્રસાઈ છે. એ નગરની વસ્તી કાંઈ નાનીસૂની નથી. એટલાં બધાં લોકોને માટે અજ્ઞની ગોઠવણું કરવી એ મારા તો ગળ ઉપરાંતની વાત છે.”

બુઝ્યેલે સામંતરાજ જયસેનને કહ્યું: “રત્નાકર શેઠથી જે કામ નથી થઈ શકતું તે કામ તમે કરી શકશો. એવી મને આશા છે.”

જયસેન માથું નમાનીને ઓદ્દોદો: “ભગવન् ! આપનાથી કાંઈ છાનું નથી. મારા પોતાના ધરમાંજ અજ્ઞનો અલાવ છે. કેવી

રીતે હું દેશની અનાજની તંગી પૂરી કરી શકવાનો હતો! મહા-  
રાજ! બાંધી ચૂહી લાખની છે.”

બુદ્ધહેવે જરાક હસ્તીને કહ્યું: ‘ડીક.’

ત્યાર પછી બીજા એક લક્ષાધિપતિ શૈઠ ધર્મપાલને કહ્યું:  
“વત્સ! હું ધારું છું કે તમારા પ્રયત્નથી આ હુકાળ શરીર  
શકવાનો સંભવ છે.”

ધર્મપાલે નમૃતાપૂર્વક કહ્યું: “ભગવન! આપને તો અખરજ  
છે કે આ વર્ષે પૂર્તું અનાજ નહિ પાકવાથી આ હુકાળ પણ્યો  
છે. મારે પુષ્કળ ઐતરો છે. એ બધામાં પાક નથી થયો. રાજ્યનો  
વેરો ભરવો એજ મારે માટે વસતું થઈ પડ્યું છે, તો પછી હું  
આ વિશાળ નગરનાં ભૂખ્યાં રહેવાસીઓને કેવી રીતે અનુભૂ?

ભગવાને કહ્યું: “ત્યારે આ સલામાં એવું કોઈ નથી કે જે  
ધારે તો આ લયંકર હુકાળથી દેશભંધુઓને બચાવી શકે?”

કોઈએ પ્રક્ષનો ઉત્તર આપ્યો નહિ.

ભગવાનનો પ્રિય શિષ્ય ભાગ્યવાન લક્ષાધિપતિ અનાથપિંડદ  
એ વખતે સલામાં હાજર નહોતો. બુદ્ધહેવે એક વાર આભી સલા  
તરક દિલ્હી ફેરી જોઈ. એમ જણાયું કે તેમનાં એ પવિત્ર લોચન  
એ સલામાં અનાથપિંડને શોધવા સારે કરી રહ્યાં હતાં; પરંતુ  
એ મેદનીમાં અનાથપિંડ નહોતો.

બુદ્ધહેવ શાંત ભાવે પોતાના આસન ઉપર બેસી રહ્યા. સલા-  
માંના બધાની દિલ્હી એમના ઉપર હતી. પાસે એઠેલા લિક્ષુએ પણ  
એમના બીજા આહેશો. સાંભળવાને આતુરતાથી બેસી રહ્યા હતા.

એક વાર કરીથી એ સલાત તરક જોઈને બુદ્ધહેવે કહ્યું: “ત્યારે  
શું આ સલામાં એવો કોઈ નથી કે જેના પ્રયત્નથી દેશવાસીઓ-  
નું રક્ષણ થઈ શકે?”

“છે.”

સલામાં એઠેલા બધા મતુષ્યો નેન ક્રાડીને જે દિશામાંથી એ  
અવાજ આવ્યો હતો તે દિશા તરક ઉત્કંઠાપૂર્વક જોવા લાગ્યા.

બુદ્ધહેવે પ્રસન્ન થઈને પૂછ્યું: “કોણ છે?”

“હું, ભગવન! આપની હીન સેવિકા આપની આજા માથે  
ચડાવવા સર્વદા તૈયાર છું.”

એક તેર વર્ષની ભાલિકા ધીમે ધીમે ભગવાનની સામે આવી-  
ને ધીરે સ્વરે બોલી: “ ભગવન ! હું છું આ અધમ સેવિકા  
આપની આજા પાળવા સારુ પોતાની જિંદગી આપવાને પણ પાછી  
પાની કરવાની નથી . ”

સભાજનો કટાક્ષપૂર્વક હસવા લાગ્યા. આનંદ સ્વામીએ  
ગંભીર સ્વરે બધાને શાંત રહેવા કહ્યું. ત્યાર પછી બુદ્ધહેવે એ  
કિશોરીની તરફ દિશિ કરીને ધીમે સ્વરે કહ્યું: “ હીકરિ ! તું તો  
ખાળક છે. તારા પ્રયત્નથી આ વિશાળ શહેરની અન્નની ઓટ કેવી  
રીતે પૂરી પડશો ! ”

“ અવશ્ય પૂરી પડશો . ” ભાલિકાએ તેનેગર્વિત સ્વરે કહ્યું.  
“ ભગવાનની કૃપા હુશે તો અવશ્ય આ ભાલિકા નગરવાસીઓને  
હુકાળની પીડાથી બચાવશો . ”

ભાલિકા થોડી વાર સુધી સ્થિર દિશિથી ભગવાનના સામુન્નેઈ  
રહી અને પછી બોલી: “ પ્રભુ ! કહો તો ખરા કે લોકોનું હું અ  
નિવારણું કરવાને ધનવાન લોકો તરફથી કાંઈ પણ પ્રયત્ન ન થાય  
તો શું એને લીધે દેશનું એ કષ્ટ કરી પણ નિવારણું નહિં થાય ?  
ણીન કોઈ દ્વારા ન આણે તો શું માતા પણ પોતાનાં ભૂખ્યાં  
આળકે. ઉપર દ્વારા આણુતાં સંકોચ કરશો ? ”

ભગવાન સ્નેહપૂર્વક બોલ્યા: “ ભાલિકા ! આ તો એક ખાળક-  
નું પાલન કરવાનો પ્રશ્ન નથી. કરોડો દેશવાસી સંતાનો ભૂખે ટળ-  
વળી રહ્યાં છે. એક માતાના પ્રયત્નથી એટલા બધા ખાળકોની  
ભૂખ કેવી રીતે મટી શકે ? ”

ભાલિકાએ પહેલાંના જેવાજ દદ સ્વરથી કહ્યું: “ જરૂર મટી  
શકશો ! ” ત્યારપછી પોતાના હાથમાંનું લિક્ષાપાત્ર બુદ્ધહેવને બતા-  
વીને એણે કહ્યું: “ પ્રભુ ! આપની દ્વારા હુશે તો મારું આ લિક્ષાપાત્ર  
સદા ભરેલુંજ રહેશે. એ ધનવાનો આપની આજા પાળવાથી  
વિસુખ રહ્યા છે તેમના ઘરના લંડારોમાં મારું આ લિક્ષાપાત્ર  
ભરવાની સામગ્રીની ઓટ નથી. હું ધનવાનોને ઘરથી બિક્ષા માગી  
આવીને ગરીબોને ખવરાવીશ, એ પ્રમાણે પીડાતા લોકોને અન્નની  
ઓટ પૂરી પડશો . ”

આનંદ સ્વામી હર્ષંદેલા થઈને પોતાના આસન ઉપરથી ઊભા  
થઈ ગયા. ભાલિકાને આશીર્વાદ આપીને એ બોલ્યા: “ મા ! ભગ-

વાન અમિતાલ (ખુદ્) તારી વાસના પૂર્ણ કરશે.”

ભગવાન યુદ્ધ તેને આશીર્વાદ આપીને વિહાય કરી. એ હિવસ-ની સલા વિસર્જન થઈ.

ખાલિકા સુપ્રિયાના રાતહિવસ જરા પણ થાક લીધા વગર કરેલા પ્રયત્નને લીધે આવસ્તીમાં હુકળથી પીડાતા લોકેનું સંકટ-નિવારણ થયું હતું. પોતાની તીવ્ર યુદ્ધથી એ યુદ્ધદેવના મનમાં શો અલિલાખ છે તે નાણી શકી હતી. એથી કરીને કુષેરના જેવા ધનાઢ્ય લોકેએ બહાનાં કાઢવા માંગ્યાં, ત્યારે એ ગર્લશ્રીમંત કન્યાએ હુઃએ અને દરિદ્રોની સેવા કરવા ખાતર હાથમાં જોળી લીધી હતી. જે મનુષ્ય પોતાના બંધુઓ ઉપર દયા આપેલું છે; તેમને હુઃએ હુઃએ થાય છે અને તેમને તન, મન, ધનથી મદદ કરવા પ્રયત્ન કરે છે તેમને ઈશ્વર પણ જરૂર મદદ કરે છે. ભગવાન યુદ્ધના આશીર્વાદથી સુપ્રિયાનું એ લિક્ષાપાત્ર કરી ખાલી ન થયું. ગામના લોકેએ જ્યારે એ કરેઠપતિ શૈદિયાની કન્યાને પારકાં-એની ખાતર લીખ માગવા આવતી જોઈ, ત્યારે એમનાં કઠોર ડેયાં પણ પીગળ્યાં. તેમની મદદથી સુપ્રિયાએ બધા હુકળિયાને અજ્ઞાની સહાયતા પહોંચાડી. એ અસાધારણ પ્રયત્ન અને ખાતરને લીધે બૌદ્ધ ઝીંઘોના ધનિહાસમાં સુપ્રિયા “દયાવંતી” નામથી પ્રસિદ્ધ થઈ ગઈ છે.

આતમવિશ્વાસ અને પ્રભુકૃપા હોય તો એક નાની અખણા પણ પરોપકારનાં કેટલાં મહાન કામ કરી શકે છે, તે સુપ્રિયાના ઉદાહરણું ઉપરથી જણ્યાઈ આવે છે.

સુપ્રિયા અને અનેક બૌદ્ધલિક્ષુણીઓના લુધન ઉપરથી આપ-ણુને બોધ મળે છે કે, ભારત રમણીઓને લોકસેવાનો મંત્ર શીખવા સાર્થકોપમાં હીક્ષા લેવા જરૂર પડે એમ નથી.





## ૯—વાસવદત્તા

પૂર્વ કાળમાં મથુરા નગરમાં વાસવદત્તા નામની એક વેશ્યા રહેતી હતી. એના અતુપમ સૌદર્યથી મોહિત થઈ જઈને મથુરાના શૈલિયાઓના અનેક જીવાન છોકરાઓએ પોતાનું સત્યાનાશ વાજયું હતું. એક હિવસ બુદ્ધ ભગવાનના શિષ્ય સંન્યાસી ઉપગુમને જેઠીને વાસવદત્તા સુખ થઈ ગઈ. ઉપગુમ અદ્ધ્યાત્મારી હતો. તેનું શરીર લાંબું અને હૃષ્ટપુષ્પ હતું. સુખ લાભ-ધ્યમય હતું અને વિશાળ લલાટ અદ્ધ્યાર્થના પવિત્ર તેજથી હેઠી-ધ્યમાન થઈ રહ્યું હતું. પ્રેમાકંક્ષી વારંગના વાસવદત્તાએ તેને પોતાને ઘેર આવવાને નિમંત્રણ મોકદ્યું; પરંતુ એ જિતેદ્વિય સંન્યાસીએ શાંત ચિત્તે જવાબ મોકદ્યો કે, “ઉપગુમને માટે વાસવદત્તાને ઘેર જવાનો સમય હણું આવી પહેંચ્યો નથી.”

કેવાસવદત્તાના સૌદર્યદ્ર્ય અભિમાં પડીને લસ્તીભૂત થઈ જવાને મથુરાના કરોડધિતિઓ તૈયાર હતા. તેજ વાસવદત્તાના સૌદર્યની એક બિખારીએ ઉપેક્ષા કરી !!! વાસવદત્તાએ આશ્ર્ય પામીને વિચાર કર્યો, સંન્યાસી પાસે પેસા આપવાના નહિ હોય માટે તે આવતાં સંડોચારો હશે. એટલા માટે એણે ફરીથી ઉપગુમને કહેવરાયું કે, “વાસવદત્તાને તમારી પાસેથી સોનામહેરો જેઠીની નથી. એ તો તમારા પ્રેમનીજ ભૂણી છે.” સંન્યાસીએ પહેલાંની પેઠેજ ધીરજથી એનો એજ જવાબ કહેવડાવી હીધે.

કેટલાક માસ વીતી ગયા. એટલામાં વાસવદત્તા મથુરાના એક ધનાદ્ય પુરુષ ઉપર ખોટો પ્રેમ જતાવીને તેને ઇસાવવાને પ્રપંચ કરી રહી હતી. એવામાં સાંભળવામાં આવ્યું કે, ભારતનો એક પ્રસિદ્ધ શૈઠ મથુરામાં આવ્યો છે. ધનના લોલથી એ પાપી વેશ્યાએ તેને પોતાને વશ કરવાનો યત્ન કરવા માંઝ્યો અને એ માટે પેલા મથુરાવાસી ચુંબકની હત્યા કરીને છાણુંચ્યોના દગલા-માં તેના સુદીને સંતાડી હીધું.

એનાં સગાવંડાલાંએ રાજ્યમાં દ્રિશ્યાદ કરી અને પોલીસની મહદ્વથી એ ઠગલામાંથી એ મશુરાવાસી ચુંબકનું શબ્દ ખોળી કાઢ્યું. રાજીની કચેરીમાં સુકદમો ચાલ્યો. અને આવું પાપી નિર્દ્દેશ કર્યા કરવા માટે, વાસવદત્તાના હાથપગ તથા નાકડાન કાપી નાળીને, તેને રમશાનમાં નાખી આવવાનો રાજી સિપાઈઓને હુકમ આપ્યો.

રમશાનની પાસે વાસવદત્તા પડી રહી છે. હાથપગ અને નાકડાનના ધામાંથી લોહી ઘડઘડ વદ્ધા કરે છે. એનાં વખ્ત પણ લોહીથી તરણોળ થઈ ગયાં છે. કાગડાઓ આવીને તેના શરીરને ચાંચા મારીને તેનું માંસ ખાવા આવે છે. એક દયાળું દાસી ત્યાં બેસીને એ કાગડાઓને ઉરાડે છે. એવામાં સૌમ્યમૂર્તિ સંન્યાસી ઉપગુમ ત્યાં આવી પહોંચ્યો.

સંન્યાસીને જેતાં વારજ ધાયલ થયેલો ભાગ હાંકી દેવાને વાસવદત્તાએ દાસીને હુકમ કર્યો. ઉપગુપ્તે કરુણામય સ્વરે તેની ખખર પૂછી ત્યારે વાસવદત્તાએ જોલટી ચિડાઈ જઈને કહ્યું: “એક દ્વિવસ આ દેહ કબળની માફક પોતાના સૌદર્ય વહે ચારે તરફ સૌને મોહસુષ્ય કરતો હતો. અને એ વખતે હું તમારા પ્રેમની લિખારણ હતી. એ વખતે આ દેહ મણિસુક્ષ્માથી તથા ભારીક મલમલની સાડીઓથી વિભૂષિત હતો. આજે જુલભી રાજીની આજાથી હું ધાયલ થઈ છું. લોહીથી કપડાં મેલાં થઈ ગયાં છે. તમે હું વિશ્વા સારુ આવ્યા?”

અદ્ભુતારીઓ ઉત્તર આપ્યો: “બાઇ! હું કાંઈ લોગની ધંચાથી તારી પાસે આવ્યો નથી. દેહનું લાવણ્ય તેં ખોયું છે; પણ તેના કરતાં વધારે ઉત્તમ સૌદર્ય આપવાને માટે હું તારી પાસે આવ્યો છું.

“તું જ્યારે ચોતરક લાલચોથી ઘેરાયલી હતી, જ્યારે સંસારની ક્ષણિક લોગલાલસા તારા હૃદયમાં પ્રણા હતી, ત્યારે મારા ધર્મને ઉપહેશ તારા મનમાં કરી વસી શકત નહિ, એટલા સારુ હું જાળ્યો જેઠને એ દહાડે તારી પાસે આવ્યો નહિ. એ વખતે તું ક્ષણુંશુર રૂપના અલિમાનથી કુલાઈ ગઈ હતી. જગતત્રાતા “તથાગત” (યુદ્ધહેવ) ના પવિત્ર ઉપહેશ ઉપર એ વખતે તેં કરી ધ્યાન આપ્યું નહોતું, માટે આજ હું એ ઉપહેશ સંભળવવા તારી પાસે આવ્યો છું.

“હાય ! અસ્થાયી આદ્ય સૌંદર્ય અને લોગવિલાસમાં તલ્લીન થઈ જવાનું આ કેવું શોચનીય પરિણામ આવ્યું ! ! સુંદર હૃદ્દપુષ્ટ દેહનું સૌંદર્ય તને છેતરીને સત્યાનાશને માર્ગ લઈ ગયું છે; પણ વાસવદત્તા ચાદ રાખજે કે, એક બીજું સૌંદર્ય એવું છે કે જેનો કહી નાશ થતો નથી. પ્રભુ જુદ્ધદેવને અમૃતમય ઉપહેશ સાંભળવાથી તારા હૃદયને એવી પવિત્ર શાંતિ મળશે તથા એ હૃદય એવું સુંદર બનશે કે, આ જગતમાં ઈદિયોના લોગવિલાસથી જે ક્ષણિક સુખ મળે છે, તે એ ચિરકાળના શાખ્યત સુખ આગળ કંઠજ વિસાતમાં નથી.”

ઉપગુમનો આવો મધુર ઉપહેશ સાંભળવાથી વાસવદત્તાનું હૃદય શાંત થયું. આધ્યાત્મિક આનંદને લીધે એ શરીરની વેહના ભૂલી ગઈ.

જગતમાં જે પ્રમાણે હું ખની વેહના છે તેજ પ્રમાણે બીજું તરફ એ હુંણ કરતાં પણ વધારે મોટી શાંતિ આપનાર આધ્યાત્મિક જ્ઞાન છે.

જુદ્ધધર્મનો આશ્રય લેવાથી આખી જિંદગી પાપાચરણુમાં ગાળનાર વારંગના વાસવદત્તા પણ શાંત ચિત્તે મૃત્યુ પામી.

## ૧૦—પ્રભવા



ભવા શ્રાવસ્તીનગરીના એક ધનવાન વણિકની કન્યા હતી. તેની સાથે લભ કરવાને અનેક વણિકો તથા રાજકુમારો ઉત્સુક હતા, પણ વણિકન્યા પ્રભવા એ તેમની બધાની વિનતિનો અસ્વીકાર કર્યો હતો. તેણે ચિરકૌમારવત ધારણ કર્યું હતું. જુદ્ધદેવની પાસે જઈને તેણે નિવોષુતત્ત્વનું શિક્ષણ મેળ્યું હતું. શિક્ષણના પ્રભાવથી એ ઘણી પ્રભાવશાળી સાધી થઈ હતી. નિવોષુનું તત્ત્વ તેણે ઉત્તમ રીતે હૃદયગત કર્યું હતું તથા ધીમે ધીમે ‘અહોત’ પદ પ્રાપ્ત કર્યું હતું. એમ કહેવાય છે કે, એક જન્મમાં એટલું બધું તત્ત્વજ્ઞાન કોઈને પ્રાપ્ત થશું નથી. પ્રભવાને તેના પૂર્વજન્મના અભ્યાસે એટલું બધું અસાધારણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી એમ પૌદ્ધ લોડાનું માનવું છે.



## ૧૧-રૂકમાવતી



જ્યુગમાં ઉત્પવલાવતી નગરીમાં રૂકમાવતી  
નામની એક ધનાદ્ય, દ્વાળું અને વિક્રાન સ્વી  
રહેતી હતી. તે કે મહોલ્લામાં રહેતી હતી,  
તે મહોલ્લામાં વસનારાં સ્વી પુરુષોમાં ડોઈ  
કદી અન્નવલાની તંગીને લીધે હુઃખ વેઠે છેએવી ખખર રૂકમાવતીને  
કાને પણ તો તે તરત તેનું હુઃખ દૂર કરવાના ઉપાય કરતી.  
મહોલ્લાઓમાં ડોઈ સંકટથી પીડાય છે કે કેમ તેની તેસદી ગુમ  
રીતે ખખર રાખતી અને હુઃખી મનુષ્યોનું હુઃખ મયાડવા તન,  
મન, ધનથી યતન કરતી. એક દિવસ દ્વાણી મૂર્તિસ્વરૂપ રૂકમાવતી  
રાજમાર્ગ ઉપર ફરી રહી હતી. ત્યાં તેના જેવામાં આવ્યું કે,  
સરિયામ રસ્તા ઉપર હુકાળથી રિભાતી, દ્વાળણા શરીરની ભૂખને  
માયે ટળવળતી, એક નારી પોતાની પાસે આવાની કાંઈ પણ  
વસ્તુ નહિ હોવાથી, બીજે કાંઈ પણ ઉપાય ન સુજવાથી પોતાના-  
જ તરતના જન્મેલા બાળકને ચીરી નાખીને ખાઈ જવાની તૈયા-  
રીમાં હતી. એક અખણા આવું નીચ કામ કરવા તૈયાર થાય એ  
વાત માનતાં, અમારી કેમળ હુદયની દ્વાળું ગુજરાતી ખહેનોને,  
કદાચ સંકોચ થાય એ સ્વલ્લાવિક છે; પણ અમારી કે ખહેનોએ  
હિંદુસ્તાનમાં આપણાજ જમાનામાં પડેલા લયંકર હુકાળોના  
વખતમાં બહાર જઈ હુકાળિયાંની સ્થિતિ નિહાળવાની તરફી લીધી  
હુશે તેઓં આ વાતને જરૂર ટેકો આપશે; કારણું તેમની પોતાની  
આંખો આગળ એવા ઘણું વાસજનક બનાવો અન્યા હુશે. ભૂખ  
એક એવી આદૃત છે કે જેથી ગલરાઈ જઈને આદમી કે પાપ  
કરવા તૈયાર ન થાય તે એછું. કે હિંદુઓ માંસતું નામ સાંભળીને  
અલડાઈ લય છે, તેજ હિંદુઓ બોર હુકાળના વખતમાં કથરો  
એહીને સુડાંઓનું માંસ આતા જેવામાં આવ્યા છે, તો પછી આ  
કંગાળ સ્વી પોતાના તરતના જન્મેલા બાળકનો લક્ષ કરવા તૈયાર

થઈ હોય તો તેમાં ન માનવા જેવું કંઈજ નથી; કેમકે કે વખત-  
ની આ વાત છે તે સમયે દેશમાં ઘોળા લયંકર ફડાળ પણો હતો.  
ભૂખરૂપી અભિથી બળીને લસમ થઈ જતાં પેટવાળાં નરનારીઓનાં  
માહેમાંહેના ત્રાસજનક પોકારથી એ સુંદર શહેર રમશાન જેવું  
લાગતું હતું. ચારે તરફ ભૂખે મરતા લોડા જુલ બહાર કાઢીને  
પણ્યાં હતાં. શહેર અને શહેર બહારનાં પરાંબોમાંની જાડની વેકો,  
પાંદડાંઓ અને કુલોં, તેમજ એતરોમાંનાં વાસસુધ્યાંત દરેક ચીને  
નાશ પામીને ફુકાળિયાંઓના જરાભિને સંતોષવાના સાધનરૂપ  
બની હતી. આહાર; વગર મૃત્યુના વિકરાળ મોંમાં ઇસાઈ પેલાં  
નરનારીઓા આમ તેમ તરફાંદિયાં મારતાં હોવાથી આખા હેઠે  
એક ધોર રમશાનનું રૂપ ધારણું કર્યું હતું.

દ્વાવતી લક્માવતીએ જ્યારે જેયું કે સુવાવડમાંથી તરતની  
ગુઠેલી સ્વી ભૂખની આળથી અધીરી અનીને નવા જન્મેલા આળક-  
ના દેહને ખાઈ જવા તત્પર છે, ત્યારે શું કરવું તેના વિચારમાં  
તે સ્તાંભિત થઈ ગઈ. તે વિચારવા લાગી: “મનુષ્યના હૃદયમાં  
આટલી હૃદ સુધી કઠોરતા કેમ પહેંચી હશે? માતા પાતાના  
શરીરના પોથણું માટે સુવના દેહનું માંસ ઉહરમાં નાણી ભૂખ  
મરાડવા માગે છે એ શું સેદલાવ નહેર નથી કરતું?” આવા  
પ્રકારના વિચાર કરતી કરતી લક્માવતી એજ ભૂખે મરતી નારીની  
પાસે ગઈ અને તેને કહેવા લાગી કે, “હે ભૂખે મરતી સ્વી! શાંત  
થા! ધીરજ પકડ!” તરત તે કંગાળ કીએ જવાણ આપ્યો: “ધીરજ  
તો ધર્ણાએ પકડું, પણ ખાડં શું? આખા દેશનાં જંગલી શાક,  
પાંદડાં, વનસ્પતિ તથા વાસ સુધ્યાંતા પણ લોડાના પેટમાં જઈને  
ઘૂરી ગયાં છે, તો હવે મારે ખાવું શું પથ્થર?” લક્માવતી  
ઓલી: “ધીરજ ધર બહેન! હું વેર જઈને તારે માટે આવાની  
સામગ્રી લઈ આવું છું, તે તું ખાને; પણ આ તરતના જન્મેલા  
અચ્ચાને ખાઈ જઈશ નહિં. બહેન જરા સખૂરી રાખ!” એવી રીતે  
દિલાસો આપીને બુદ્ધિમાન લક્માવતીએ કેટલાક વખતને માટે  
એ પિશાચણીને એ હુષ કામ કરતાં રોકી. તેને પણ એથી જરા  
હિંમત મળી; પણ હુરદેશ લક્માવતીને તરતજ વિચાર સૂજયો  
કે, “ને હું આવાનું આણુવા વેર જઈશ અને એટલી વારમાં લાગ  
મજ્યાથી ભૂખની મારી, પાતાના વચનનું લાન ભૂલી જઈને, આ  
અધીરી બનેલી સ્વી આળકને ખાઈ જય તો પછી શું કરવું?

બાળકનો પ્રાણું ખચાવવાનો મારો પ્રયત્ન તો નિષ્ઠળ જય ને ? વળી બાળકનું રક્ષણું કરવા માટે હું એને માતાના જોગામંથી જખરદરસ્તીથી લઇન્ના તો પુત્રવિયોગના શોકથી અને જડરામિની વેદનાથી એ અધીરી અનેલી માતા, પોતાનો પ્રાણું ત્યલું હે, તો મને સ્વીકાર્યાનું પાપ ન લાગે ? માટે હવે કરવું શું ? ” રૂક્માવતી ઘણી ગ્રૂંચવાદ ભરેલી સ્થિતિમાં આવી પડી. કોઈ પણ ચોક્કસ હરાવ ઉપર આવવું તેને સુશકેલ પડયું. તે પોતાને એક મોટા ધર્મસંકટમાં આવી પહેલી સમજવા લાગી; પરંતુ વધારે વખત જોવાનો આ પ્રસંગ નહોંતો, એટલે વિશેષ વિલંબ ન કરતાં તો એક ગંભીર નિશ્ચય ઉપર આવી. વહાલી બહેનો ! તમારી અટકળને જૂણ વેગથી હોટાવો અને પડી કહો કે એ નિશ્ચય શો દશો ?

તેણું પોતાનો પવિત્ર વિચાર પાર પાડવા માટે દફનિશ્ચય અને ધૈર્યપૂર્વક એક ધારવાળી છરી વડે પોતાનું સ્તન કાપી નાળીને તે સંતાનના લોહીની તરસી, હુકાળથી પીડાતી અને ભૂખથી અધીરી બની ગયેલી સ્વી તરફ હેંકચું. તરતજ તે સ્વીએ પોતાનો લાથ લંઘાવીને એ માંસખિંડ થલણું કર્યો અને તેને સ્વાદા કરી ગઈ. આ લાગ જેઠને તે દ્વારા બૌદ્ધ મહિલા, તે સાચી સેવિકા આગાકને ત્યાંથી લઈને ચાલી ગઈ. તેની છાતીમંથી વહેતી રહિદની ધારાએ ઉત્પલાવતી નગરીના રાજમાર્ગને રંગી નાણ્યો.

## ૧૨-સોમા



વસ્તી નગરીમાં “સોમા” નામની એક આદ્યાણુની છોકરી થઈ ગઈ છે. તેની બુદ્ધ અને સ્મરણુશક્તિ એવાં પ્રબળ હતાં કે, જે વાત એક વાર સાંસળી તે વાત તેને હમેશાં ચાહ રહી જતી. એની એ વાત એની આગળ ફરીથી કહેવાની જરૂર પડતી નહિં. એ અસાધારણ બુદ્ધ અને સ્મરણુશક્તિને લીધે, તેણું બધા બૌદ્ધ અંથ કંઠાય કરી દીધા હતા. ચોગવિદ્યાનો તેણું સારો અભ્યાસ કર્યો હતો અને તપશ્ચયોદ્ધારા ઉજ્જ્વિ મેળવીને હુલ્લેલ ‘અહંતુ’ પદ પ્રાપ્ત કર્યું હતું.



## ૧૩-વિશાળા મિગારમાતા



દ્વારા ઉત્કોષ કરવામાં આવ્યો છે તેમાં વિશાળાનું સ્થાન ઘણું જીંચું છે.

આવસ્તીથી સાત લોજનના અંતરે સાકેત નામનું એક મોટું શહેર વસેલું હતું. તે શહેર વસાવનાર ધનંજ્ય શ્રેષ્ઠીની ગણુતરી એ સમયે નવકોટિનારાયણોમાં થતી હતી. વિશાળા એ કરોડાધિપતિ શેડની એક અલ્યાંત સ્વરૂપવતી કન્યા હતી. તે વયમાં આવી ત્યારે શાવસ્તીના મિગાર શ્રેષ્ઠીના પૂર્ણવર્ધન નામના પુત્ર સાથે તેનો વિવાહ નક્કી થયો. સાકેત અને શાવસ્તી એ એટ શહેરોમાં ઉભય પક્ષો વિવાહ સમારંભ ભારે હાઠથી લોજન્યો.

વિવાહવિધિ પૂરો થયા આદ ધનંજ્ય શ્રેષ્ઠી પોતાની કન્યાને લઈ શાવસ્તી આવ્યો. ત્યાં તેણે પોતાની જાતિમાંના આડ કુલીન ગૃહસ્થોને પોલાની આણી તેમને વેવાઈ સમક્ષ એમ કહ્યું કે, “ને મારી પુત્રીનો કોઈ હોષ જણુાઈ આવે, તો તમારે ખરોખર ચાકદાઈ રાખવી.”

ધનંજ્ય શ્રેષ્ઠી પુત્રીને સાસરે મૂકી સાકેત ગયા પછી એક હિવસ મિગાર શ્રેષ્ઠીએ નિર્ભાથ શ્રમણો (નાગા સંન્યાસી) ને પોતાને વેર પુત્રના લગ્નસમારંભ નિમિત્ત લોજનાર્થે આપંત્રણ આપ્યું. મિગાર શેડ નિર્ભાથનો ઉપાસક હતો. તેમને માટે તેણે પાણી નાણયા વિના ચોણણા હૂધનીજ એર કરાવી હતી. નિર્ભાથ આવી પોતપોતાને આસને એડા. પછી મિગાર શ્રેષ્ઠીએ પોતે આદરાતિથ્ય કરી તેમને સંતોષપૂર્વક જમાણ્યા અને તેમનું લોજન પૂર્ણ થયા પછી પોતાની પુત્રવધૂને કહાયું કે, “આપણે વેર અહીંત આવ્યા છે. તેમને નમસ્કાર કરવા આવવું.”

‘અહીંત’ એ શાખ કાને પડતાંજ વિશાળાને ઘણ્યા આનંદ

થયો; કારણુકે નાનપણુથીજ તે ખુદ્ધની ઉપાસિકા હતી તથા ખુદ્ધ અને બૌદ્ધ બિક્ષુ સિવાય અન્યને પણ અહોત કહે છે એ તેને અધર ન હતી. ઉતાવળી ઉતાવળી લગડાં પહેરીને તે પોતાનો સસરો અને તેના સૌ, અહોત જે વીવાનખાનામાં બેઠા હતા લાં ગાધ; પણ તે નભ શ્રમણોને જેધ તેને અત્યંત તિરસ્કાર છૃદ્ધ્યો અને પોતાના સસરાને કહેવા લાગી કે, “મને આપે અહીં શા માટે બોલાવી? આવા નાગા ઉધાડા લોકો કહી અહોત હોઈ શકે ખરા કે? આવા નિર્લજ્જને અમે અહોત કહેતા નથી.” આ ઉદ્ગાર કાઢીને વિશાળા ત્યાંથી ચાલતી થઈ.

આ બાળુ, પેલા શ્રમણોને આ નવવધૂએ પોતાનું અપમાન કર્યો અહલ અતિશય જોકું લાગ્યું અને તે એકદમ મિગાર શ્રેષ્ઠને કહેવા લાગ્યા કે, “હે ગુરુપતિ! આવી કર્યાને તું ક્યાંથી પકડી લાગ્યો? બણું કે તારા પુત્રને આખા જગતમાં બીજુ કન્યાનું મળતી નહોતી?”

મિગારે કહ્યું: “હન્નુ તેનો સ્વભાવ છોકરવાહી છે, ધીર ધીરે સુધારતા જઈશું. તેના આ ઉદ્ધૃત આચરણ અહલ તેને ક્ષમા કરવી ઘટે છે.”

મિગાર જેમતેમ કરીને નિર્ભાને સમજવીને રસ્તે પાંચા અને પોતે હૃધની ખીરથી ભરેલી થાળી લઈ જમવાને બેઠા. વિશાળા તેને પંચાથી પવન નાખતી એક બાળુએ બોલી રહી હતી. એવામાં દ્વાર પાંચ એક બૌદ્ધ બિક્ષુ આની ડાલો રહ્યો. મિગાર એઠેલે ડેકાળુથી તે બિક્ષુને જોતો હતો, છતાં તેના લણ્ણી પૂર્ણ હુલ્લદ્વય કરી તે પોતાના લોજનમાં એકરસ થઈ ગયો હતો. ત્યારે વિશાળા-એ ત્યાંથીજ તે બિક્ષુને કહ્યું: “આર્થ! મારો સસરો વાશી ખાય છે. તમે ત્યાં બાબા ન રહેતાં આગળ વધો.”

વિશાળાના આ શાણદોકાને પડતાંજ મિગારે અતિશય સંતસ થઈ નોકરોને કહ્યું: “આ ખીર અહીંથી લઈ જાઓ અને આ છોકરીને મારા ઘરમાંથી આજ ક્ષણે હાંકી કાઢા. એ એટલી ઉનમતા થઈ છે કે મારા સમક્ષ મારું અપમાન કરતાં પણ એને લાજ આવતી નથી.”

મિગાર ને કે ઘણો ગુરુસે થયો હતો, તો પણ વિશાળાના અંગને હાથ લગાડવાની તેની કે તેના નોકરોની છાતી ચાલી

નહિ. તેણે શાંતપણે પોતાના સસરાને જવાય આપયો. કે, “આપને મારા ઉપર આટવો કોધ કરવો ઘટતો નથી. હું કંઈ વેચાતી આણેલી દાસી નથી. હું આપના જેવાજ મોટા કુળમાં જનની છું. પ્રથમ મારો અપરાધ મને સમજાવો અને પછી મને અહીંથી જવાનું કહો. મારા પર વિના કારણું આરોપ આવે નહિ તેથી મારા માટે મારા પિતાએ અહીં આડ કુલીન ગૃહસ્થોને મારા અપરાધની ચોકસી કરવા માટે કહી રાખ્યું છે, તો તેમની સમક્ષ મારો શો હોય છે તે જણાવો. જે તેઓ મને અપરાધી ઠરાવશે તો હું ઝુશીથી અહીંથી નીકળી જઈશ.”

પુત્રવધુનું આ સ્પષ્ટ પોતાવું સંભળી મિગારનો મિનજ જરા ઠેકાળે આવ્યો. તેણે તે આડ કુલીન ગૃહસ્થોને તરતજ હોલાવી મંગાવ્યા અને પોતાની પુત્રવધુનો શુને તેમને કહી સંભળાવી જણાવ્યું: “આને મારા ધરમાંથી આજ ને આજ કાઢી મૂકોએ.”

તે ગૃહસ્થોએ પૂછ્યું: “કેમ, બહેન વિશાળા ! તારા સસરા વાસી અજ ખાય છે એવું તે કહું હતું કે ?”

વિશાળા એલીઓ: “મારો સસરો જૂના પુષ્ય પર નિર્વીહ કરે છે અને નવીન પુષ્ય સંપાદન કરતો નથી, એવો મારા કહેવાનો અર્થ હતો, તેથી તે જુનુંપુરાણું ખાય છે એમ મેં કહું હતું.”

તે ગૃહસ્થોએ મિગારને કહ્યું: “આ કહેલું ધણ્યું ડહાપણ લરેલું જણાય છે. આરલા માટેજ વિશાળાને ધરમાંથી હાંકી કાઢવી એ તમને ઉચિત નથી.”

વિશાળાના ખીન્યે કેટલાક બાદીક બાદીક હોયો. મિગારે તે ગૃહસ્થોને જણાવ્યા, પણ તપાસ કરતાં તે હોય ન હોઈ, મિગારની કેવળ ગેરસમજ થઈ હતી એવું હેખાઈ આવ્યું. જ્યારે મિગાર એલ્યો: “પણ આનો ખાપ જ્યારે અહીં આવ્યો. ત્યારે અમારી સમક્ષ એણે દસ નિયમ એની પુત્રીને શીખાવ્યા હતા. અમને તો તે કેવળ વૈલાજ જણાય છે. પછી આને એનો અર્થ ને સમજાયો. હોય તે ખરો.”

તે ગૃહસ્થો એલ્યા: “કેમ, બહેન વિશાળા ! ધનંજય એકીએ તને કયા કયા નિયમ શીખાવ્યા હતા. અને તેમના અર્થ શા છે ?”

વિશાળા એલીઓ: “અંદરની આગ બહાર લઈ જવી નહિ, એ પહેલો નિયમ મારા પિતાએ મને શીખાવ્યો. તેનો અર્થ એવો છે

કે ધરમાં કોઈ તકરાર વળે થઈ હોય, તેની વાત ખડક કહેવી નહિ. ખડકારની આગ અંતર આણુવી નહિ, આ બીજે નિયમ. આનો અર્થ એવો છે કે, આડાશીપાડાશી સાસુસસરાના કે કેડાણી, દેરાણી કે નણુંદના અવગુણ મોલતા હોય, તો તે સમાચાર કોઈને ધરમાં કહેવા નહિ. આપનારનેજ આપવું એ બીજે નિયમ; અને ન આપનારને ન આપવું એ ચોથેના નિયમ. આનો અર્થ એ કે કોઈ ધરમાંની વસ્તુ ઉછીની લઈ જઈ પાછી આપે તેનેજ આપવી, કે આપતો નથી તેને તે ન આપવી. આપનાર કે ન આપનાર હોય તોએ આપવી એ પાંચમો નિયમ પાસેના સંગાં-સંબંધીને લાણું પછે છે. એટલે પોતાના સંબંધીઓમાં કોઈ દરિદ્રી હોય અને ઉછીની લીધેવી જણુસ પાછી આપવાનું સામર્થ્ય તેનામાં ન હોય, તો તેને તે આપવી. સુઝેથી એસવું એ છુંનું નિયમ, સુઝેથી જમવું એ સાતમો નિયમ અને સુઝેથી સૂલું એ આઠમો નિયમ. આનો અર્થ એ કે વડીલ માણુસો કે ડેકાણું વારવાર આવળ કરે તે ડેકાણું એસવું નહિ; તેમના જમ્યા પદેલાં પોતે જમવું નહિ; નોકરચાકરોની ખબર કાઢીને પછી જમવું; વડીલ માણુસોના સૂતા પહેલાં પોતે સૂલું નહિ. તેમની વ્યવસ્થા કરીને પછી સૂલું. અભિની પૂનઃ કરવી એ નવમો નિયમ. પતિપ્રતા ખીને પતિ અથિ સમાન પૂજ્ય હોવો જોઈએ અને પ્રાણાને અભિની પરિચર્યા કરે છે, તેમ તેણે પોતાના પતિની કરવી, એ આ નિયમનો અર્થ છે. ગુહદેવતાની પૂનઃ કરવી એ હસમો નિયમ, એરલે સાસુસસરા દૃત્યાદિ વડીલ માણુસોને ગુહદેવતા સમજ તેમની સેવા કરવી.”

વિશાખાએ પોતાના પિતાએ બતાવેલા હસ નિયમની આ પ્રમાણે સમજણું આપવાથી તે આડ કુલીન ગુહસ્થોએ તેની ઘણી પ્રશાંસા કરી અને ભિગાર એક્ષીને કહું કે, “આપ ગુસ્સે થઈને આ ડાહી છોકરીને ધરમાંથી કાઢી મૂકવા તૈયાર થયા છો; પણ એ તમારા ગુહની લક્ષ્મીજ છે એમ સમને.”

ભિગારે પોતાની ભૂલ કખૂલ કરી અને વિશાખાની ક્ષમા માળી.

વિશાખા બોલી: “આપ વડીલજ છો; એટલે ક્ષમા કરવા જેટલે માટો અપરાધ આપે કર્યો છે એમ હું ધારતી નથી; પરંતુ માત્ર એક વાતમાં મારે અને તમારે મેળ ખાય એમ લાગતું નથી. હું છું યુદ્ધની ઉપાસિકા અને આપ છો નિર્ધારણા ઉપાસક, એટલે

બૌદ્ધ બિક્ષુ અહીં બિક્ષાથેં આવતાં તે આપને પરવડણે નહિ અને એ નિર્ણય આવતાં તેમને હું નમસ્કાર કરનાર નથી. આ આખતમાં કંઈ નિર્ણય કર્યા સિવાય મારા અહીં રહેવાથી આપને કે મને સુખ થનાર નથી.”

ભિગાર બોલ્યો: “તારી ઈચ્છા સુજખ તું વર્તને; મને તેમાં કંઈજ હરકત નથી. મારે વેર પુષ્કળ ધનહોલત છે. બૌદ્ધ બિક્ષુને નિમંત્રણ કરી તું જમાડે તો તેથી હું કંઈ દરિદ્રી થઈ જવાનો નથી. હું મારા નિર્ણયાને અજ્ઞાત કરીશ અને તું યથાવકાશ તારા બૌદ્ધ બિક્ષુને અજ્ઞવસ્ત્વાદિકનું દાન કરશે.”

વિશાળાએ બીજોજ હિવસે બુદ્ધ અને બિક્ષુ સંઘને નિમંત્રણ કર્યું. આ સમાચાર નિર્ણયાને માલૂમ પડતાંજ તેઓ ભિગાર પ્રથીને મળ્યા અને બૌદ્ધ બિક્ષુએ કરેલા નિમંત્રણ વિષે તેમનો સુલાસો માળ્યો.

ભિગાર બોલ્યો: “મારી પુત્રવધૂ કંઈ નાના સૂના કુળની નથી. તેની જેઠે હાસી પ્રમાણે વર્તોવ કરવો શક્ય નથી. મારા ધરમાંને સુખ વર્તોવનું હોય તો મારી પુત્રવધૂને મારે ચોણ્ય સ્વાતંત્ર્ય આપવુંજ જોઈએ.”

નિર્ણય બોલ્યા: “બૌદ્ધ બિક્ષુએ તારે વેર આવવાની જે તું મનાઈ કરી શકતો ન હોય, તો તું તેનાં દર્શન કરવા ન જતો. એટલું તો જરૂર કરશે. બુદ્ધ સાટો માયાવી છે. તે લોકોને સુજખ કરી, પોતાના પંથમાં એંચ્યી લે છે એવું અમે સાંભળ્યું છે, માટે વિશાળા ગમે તેટલો આચ્છા કરે તો તે તું તેના દર્શને જઈશ નહિ.”

ભિગારે બુદ્ધ કે બૌદ્ધ બિક્ષુનાં દર્શન ન કરવાનું વચ્ચે આચ્છાથી નિર્ણય પોતાને આશ્રમે પાછા ફર્યો.

બીજો હિવસે વિશાળાએ લોજનની સર્વ તૈયારી કરી. બુદ્ધ અને બિક્ષુએ બોલાવી, ધણ્યા આદરસ્તકાર સહિત જમાઝ્યા. લોજન પછી વિશાળાએ પોતાને તથા ધરનાં સર્વ માણુસોને ધર્મોપદેશ કરવાની બુદ્ધશુલ્ને વિનિતિ કરી, પણ આ ઉપદેશ સાંભળવા ભિગાર આવ્યો નહિ. વિશાળાએ અત્યંત આચ્છા કર્યાથી તેણે પડહાની આણે એસી ધર્મોપદેશ સાંભળવા કખૂલ કર્યું. બુદ્ધ તું સુખ માત્ર તેને જેવું ન હતું! વિશાળાએ એક બાળુએ પડદો ખાંધી પોતાના સસરાને એસવાની સગવડ કરી.

સર્વ મંડળી લેગી થયા પછી બુદ્ધે પોતાની અમૃતતુલ્ય વાણીથી તેમને ઉપહેશ કર્યો. હાન, શીલ, લાવના ઈત્યાહિ વિષય સંખ્યાએ બુદ્ધે કરેલો. બોધ સાંલળી મિગાર શ્રેષ્ઠીને ઘણું લાગી આંધું. આવા મહાપુરુષ પોતાને વેર આવ્યા છતાં પોતે મૂર્ખીદ્ધથી તેનાં દર્શન કરવા તૈયાર નથી, એ વિચારથી અને ઘણે પશ્ચાત્તાપ થયો. તેથી એકદમ પડ્યો હુર ખેડી નાણી બહાર હોડી આવી, તેણું બુદ્ધના ચરણોમાં પોતાનું મસ્તક મૂર્ખી હીધું. તે બોહયો: “ લગ્નન, મારા અપરાધની ક્ષમા કરો. આજથી હું આપનો ઉપાસક થયો છું. આ બાબતમાં વિશાખા મારે માતા સમાન છે. તે જો મારે વેર આવી ન હોત, તો આપની અમૃતવાણી મારે કાને ન પડી હોત. તેથી આજથી હું તેને મારી માતાજ કહેતો જઈશ.”

ત્યારથી વિશાખાનું મિગારમાતા એવું નામ પડ્યું. શ્રાવસ્તિના ઘણુાખરા લોકો તેને મિગારમાતા નામથીજ ઓળાઅતા. તેણું બુદ્ધને અને લિખુસંધને રહેવા માટે પૂર્વોરામ નામના ઉધાનમાં એક પ્રાસાદ બાંધ્યો હતો. જેને ‘ મિગારમાતા પ્રાસાદ ’ કહેતા. શ્રાવસ્તિમાં વિશાખાના ડહાપણની અને નીતિમત્તાની ઝીતિં તરફ પ્રસરી અને રાયથી રંક સૌ ડોધ તેના તરફ આદરબુદ્ધિથી જોતા. મંગળ કાર્યો અને ઉત્સવોમાં વિશાખાને પહેલું આમંત્રણ દેવાનો વહીવટ ચાલુ થયો. શ્રાવસ્તિની બૌદ્ધ ઉપાસિકાઓમાં તે પ્રમુખ હતી. આવતાજતા અને રૈગયર્સ્ટ લિખુચ્ચોની માવજત તરફ તે ઘણું લક્ષ આપતી\*



\* પ્રોફેસર કૌશામ્ભીતા ‘બુદ્ધલીલાસારસંઘર્દ’ નામના ઉત્તમ અંથમાંથી તેમની રણથી ઉપકાર સહિત આ ચરિત્ર ઉત્તારવામાં આંધું છે.



## ૧૪-કુલવધૂ સુજાતા



ગવાન તથાગત જુદ્ધના આવિભૂવ-કાળમાં જંયુ-  
ક્રીપ, અંગ, મગધ, કાશી, કૌશલ વગેરે સોળ  
લાગમાં વહેંચાયલો હતો. મહારાજ બિંબિસાર  
મગધહેશના રાજ હતા. અંગ દેશ પણ તેમના-  
જ તાણમાં હતો. રાજ પ્રસેનજિત એ સમયમાં  
કૌશલના બિંહાસન ઉપર બિરાજતા હતા. બિં-  
બિસાર અને પ્રસેનજિત પોતાના સમયમાં ધન-  
વૈલવ આદિમાં લારતવર્ષના ધીન રાજએ. કરતાં શ્રેષ્ઠ હતા.  
તેમના પ્રચલની મગધ અને કૌશલ મહા પ્રતાપી અને શૈશ્વર્ય-  
શાળી રાજ્ય બન્યાં હતાં.

કૌશલ રાજ્યની રાજ્યધાની શ્રાવસ્તી નગરીમાં હતી. શ્રાવસ્તી  
નગરીના વૈલવ અને સૌદર્યની સીમા નહોટી. અનેક સુંદર  
આશ્રમસ્થાનો, ઉદ્યાન, વન, ઉપવન અને સરોવરો વગેરેથી એ  
નગરી સુશોલિત હતી. વિચિત્ર ચિત્ર અને કોતરકામથી સુંદર  
ખનેલી મોટી મોટી હવેલીઓ એ શહેરની શોભામાં વૃદ્ધિ કરી  
રહી હતી અને તેના રહેવાસીઓની સમૃદ્ધિની સાક્ષી પૂરતી હતી.  
નગરવાસીઓની આકર્ષક કાંતિ, તેમનાં વિશાળ ઉજ્જ્વલ શરીર,  
રમણીય અને ઉજ્જ્વળ સુખારવિંદ એ ખધાંને લીધે નગરની  
શોભામાં સોગણો વધારો થતો હતો.

એ શહેરમાં સુદૃત નામનો એક વણિક રહેતો હતો. એ શ્રાવ-  
સ્તી નગરીમાં સૌથી વધારે ધનવૈલવ વાળો પુરુષ હતો. સુષ્યદાન  
પણ એ પુષ્ટ કરતો હતો. તેનો વેપાર હિંહુસ્તાનમાં બહુ ફેલાયો  
હતો. પ્રત્યેક મોટા નગરમાં તેની હુકાન હતી. સદાચારી, ઉદાર,  
અસાધારણ દાતા અને પરમ ધાર્મિક પુરુષ તરીકે શ્રાવસ્તી નગર-  
માં એ ઘણ્ણાજ લોકપ્રિય થઈ પડ્યો હતો. વિક્રાન અને સદા-

ચારી આદ્ધણો ઉપર પણ તેની વિશેષ પ્રોત્િત હોવાથી આદ્ધણો પણ તેના ઘણાં વખતાણ કરતા હતા.

મોક્ષમાર્ગના શોધક, પરમ શાંતિ, પરમ સુખ અને નિર્વાણ-ધર્મના પ્રવર્તિક, સ્વયં લગવાન બુદ્ધહેવને સુધે તેમના અમૃત-મય, ધર્મ અને સંઘની કથા સુદર્શને રાજગૃહ નગરમાં પોતાની બહેનને વેર સાંભળી હતી. એ ઉપહેશથી સુદર્શના સંસારનાં હુંખ અને તાપથી કલેશ પામેલા હૃદયે અવર્જનીય શાંતિ અનુભવી હતી. તેના હૃદયમાં એ હિવસથી કંઈક અપૂર્વ સુખની રેખા ઉત્પન્ન થઈ હતી. તેણે સંકદ્ય કર્યો હતો કે, “મારી અગાધ હોલત-નો ઉપયોગ બૌદ્ધધર્મના પ્રચારમાં કરીશ અને ધર્મચિંત્વન તથા સાધુસેવામાં બાકીનું જીવન ગાળીશ.

બુદ્ધહેવ ઉપર તેને અચળ શ્રદ્ધા અને અટળ ભડિન હતી. ચ્ચારાસી કરોઠ કાર્યાપણ (પાંચ ઇભિયાની ભરાભરનો સોનાનો એક સિક્કો) ખરીને તેણે આવસ્તી નગરીની ઉત્તર દિશામાં જોતાન નામના પરમ રમણીય ઉદ્યાનમાં એક મોટો વિહાર બંધાવ્યો હતો. એ સુંદર વિહાર તેણે બુદ્ધહેવ તથા તેમના શિષ્યોને સમર્પણ કરી હીધો હતો. દરરોજ એ હૃદાર લિઙ્કુડેને તે બોજન કરાવતો હતો. એ ઉપરાંત અસંખ્ય દીનહુંઘી અનાથો તેને બારણેશ્વરી અજ મેળવીને એ હાથે આશીર્વાહ આપતા. અનાથોને દરરોજ આડાર કરાવતો હોવાથી વખ્ચિક સુદર્શ શોઠ ‘અનાથપિંડ’ નામથી એળાખાવા લાગ્યો.

લગવાન બુદ્ધહેવની ઉપાસિકાઓમાં વિશાખા સૌથી સુધુંય હતી. તેના કેવી દાનશીલ સેવિકા એ સમયમાં બીજુ કેાદ નહેઠતી. આવસ્તી નગરીમાં પૂર્વ દિશામાં તેણે ર૭ કરોઠ કાર્યાપણ ખરીને પૂર્ણિરામ નામનો એક પરમ રમણીય વિહાર બંધાવી, બુદ્ધ લગવાનને અર્પણ કર્યો હતો. તેના પિતા મેંડક અંગ હેશના લદ્રીય નગરના એક જાણીતા ધર્મશર્યશાળી શોઠ હતા. આવસ્તી નગરના બીજા એક ધનવાન શોઠ મિગારના પુત્ર પુષ્પયવર્ધક સાથે તેનું લભ થયું હતું.

આપણી આ ચારિત્રનાયિકા સુનાતા એ વિશાખાની નાની બહેન થાય. અનાથપિંડના પુત્ર સાથે તેનું લભ થયું હતું. ધનવાન શોઠની કન્યા હોવાથી સુનાતાના મનમાં ઘણું અભિમાન હતું.

એ કોઈનું કહ્યું માનતી નહિ. સાસુસસરાને ગાંઠતી નહિ અને સ્વામી ઉપર પણ તેની શ્રદ્ધા નહોતી.

અનાથપિંડદના આમંત્રણનું માન રાખીને બુદ્ધહેવ એક હિવસ તેને વેર લિક્ષા કરવા ગયા હતા. અગાઉથીજ તેમને સારુ ચોણ્ય આસન વગેરે સામથી તૈયાર હતી. ભગવાન પદ્માર્થી એટલે અનાથપિંડ તેમનો સત્કાર કરીને આસન ઉપર જોસાખ્યા તથા પોતે સન્મુખ એહા. એ સમયે શેઠના અંતઃપુરમાં ઘણી ગડળડ મચી રહી હતી. જિથે સાહે લડતાં મતુાંયોને અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. ભગવાને પૂજયું: “શેઠલ ! ઘરમાં આટલી બધી ગડળડ શાની છે ? કોઈ માણીમારની માછલી ચોરાઈ ગઈ હોય અને જેવો અગભળાઈ મચી રહે એવી ગડળડ અહીં છે.” અનાથપિંડ હૃદય જોલીને પોતાના હુંઅની વાત બુદ્ધહેવને કહી. તેણે કહ્યું: “ભગવન ! ચાન્દી વાત છે. મારી એક પુત્રવધૂ મોટા ઘરની દીકરી છે. એ મારે વેર આવી છે ત્યારથી ડેઝિને ગાંઠતી નથી. એ ઘણી મિનણું છે. તેના સ્વામીને પણ ગણુકારતી નથી. સાસુસસરાનું અપમાન કરે છે. ભગવાન ઉપર પણ તેનો અનુરાગ નથી. એ કોઈ હિવસ પૂજા પણ કરતી નથી. તેના આચરણથી કંદાળીને અંતઃપુરવાસી સ્વીચ્છા બૂમાયૂમ કરી રહી છે.”

ખરાખ સ્વલ્પાવનાં મતુષ્યો ડંમેશાં વહેભી હોય છે. અનાથપિંડને ભગવાન બુદ્ધહેવની પાસે જતો. જેઇને સુન્દરાએ મનમાં વિચાર્યું કે, મારા સસરા મારી નિંદા કરવા જય છે. એવા વહેમથી એ અંતઃપુરના બારણા આગળ આડમાં ઊલી રહીને બુદ્ધહેવ સાથે અનાથપિંડને શ્રી શ્રી વાત થાય છે તે સાંભળવા લાગી. ભગવાનને બાતમી મળી કે, સુન્દરા છાનીમાની બધું સાંભળી રહી છે, એટલે એમણે અનાથપિંડને કહ્યું: “સુન્દરાને અહીં જોલાવો.” ભગવાનની આજાને માન આપીને સુન્દરા અંહરથી બહાર આવી અને ભગવાનને નમસ્કાર કરી હૃરજ્જિ એठી. ભગવાને તેને સંબોધીને કહ્યું: “સુન્દરા ! પુરુષને સાત પ્રકારની ભાર્યા હોય છે. જેવી કે:—(૧) વધકાસમા (વધકારિણી) (૨) ચોરીસમા (૩) આર્યાસમા (૪) માતૃસમા (૫) લગીનીસમા (૬) સખીસમા (૭) દાસીસમા. તું આ સાતમાંથી કયા પ્રકારની ભાર્યા છે ?”

સુન્દરાએ કહ્યું: “ પ્રભુ હું આપના સંક્ષિપ્ત ઉપદેશનો મર્મ

સમજું શકી નહિ. સરળ ભાષામાં ખુલાસાવાર મને એ ઉપહેશ સંભળાવો. સમજાવ્યા પણી હું ઉત્તર આપીશ.”

ભગવાને કહ્યું: “ત્યારે ધ્યાન દઈને સંભળ !”

સુન્નતા બોલ્યો: “હા પ્રભુ ! સંભળું છું બોલો.”

ભગવાન બોલ્યા: “જે સ્વી હંમેશાં કોધકર્યો કરતી હોય, સ્વામીનું ભૂંડું ચાહનારી હોય, પારકા પુરુષ ઉપર મોહી જઈને પતિનું અપમાન કરતી હોય, ધનદારા અરીદાચલી હોવા છતાં કે અરીદનારનો વધ કરવા ઉત્સુક હોય એવી સ્વીને વધકાલારી કહે છે.

“શિવદ્ય, વેપાર કે ઐતીદારા સ્વામી કે કાંઈ ધન મેળવે છે તેમાનું ચોડું પણ ધન ચોરવાની કે સ્વી ઈચ્છા કરે છે અને લાગ આવે ચોરી પણ કરે છે એટલું જ નહિ પણ ચૂલ્હા ઉપર ચડાવેલા અંધાણમાંથી દાળચોાખા ચોરીને સંતાડી રાખવાનો કે સ્વી યતન કરે છે તેને ચોરીસમા કહે છે.

“જે સ્વી ડોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા કરતી નથી, આપણું સ્વભાવની હોય છે, એટલે કે આડું આધારીધા વગર અને સાડું પહેર્યોએદ્વા વગર કેને ચેન પડતું નથી, કેની વર્ણાંજું ક કર્શા છે, પ્રકૃતિ ઉચ્ચ છે, જે અગ્રિય અને કર્શા વ્યવહાર કરે છે અને સ્વામીની ઉપર પોતાની મોટાઈ દાખવે છે તે સ્વી પુરુપની આચ્છાદનમા ભાર્યા કહેવાય છે.

“જે સ્વી સર્વહા પતિનું હિત ચાહનારી હોય છે, માતા એવી રીતે પુત્રનું રક્ષણુ કરે છે તેવી રીતે કે સ્વી પ્રાણ સાટે પોતાના પતિની રક્ષા કરે છે, જે સ્વી પતિએ કમાયવા ધનનું ચતુનપૂર્વક રક્ષણુ કરે છે, તે સ્વી માતૃસમા ભાર્યા કહેવાય છે.

“જે સ્વી લગિનીની પેઠે સ્વામીની ઉપર સ્નેહ અને લક્ષ્મિ રાખે છે અને જે લજનાપૂર્વક સ્વામીની આજા સુજાય ચાલે છે તે સ્વી લગિનીસમા ભાર્યા કહેવાય છે.

“ધણું સમય પણી મળવા આવેલી સણીને જેયાથી સણીને જે પ્રમાણે આનંદનો અનુભવ થાય છે તેવીજ રીતે જે સ્વી પતિને જેતાંજ આનંદમભ થઈ જાય અને કે કુળના ગૌરવનું રક્ષણુ કરનારી શીલવતી અને પતિત્રતા હોય તે સ્વી સણીસમા ભાર્યા કહેવાય છે.

“ સ્વામી મારી નાંખવાને તૈયાર થયો હોય તોપણું જે સ્વી પ્રસંગચિત્ત ભક્તિપૂર્વક સ્વામીની ગેરવત્સંહૃદી સહન કરે, સ્વામીના ઉપર જરા પણ કોધ ન કરે, જે સ્વભાવથીજ કોધ વગરની હોય અને સ્વામીને વશ રહીને ચાલનારી હોય તે સ્વી દાસીસમા ભાર્યા કહેવાય છે.

“ વધકા, ચોરી અને આર્થિકમા એ ત્રણું પ્રકારની સ્વીએ હુઃશીલા, કર્દીશ સ્વભાવની અને સ્નેહહીન હોય છે. મૃત્યુ પછી તેમનો નરકવાસ થાય છે.

“ માતા ! ભગીની, સખી અને દાસીસમા શીલવતી સ્વી હમેશાં સારાં કામોદાં નિમજ્જ રહેનારી અને સંચમવાળી હોય છે. મૃત્યુ પછી તેઓ સ્વર્ગદેશિકમાં ગમન કરે છે.

“ હે સુન્દરા ! મુરુંયોને એ સાત પ્રકારની સ્વી હોય છે. તું અમાંથી કયા પ્રકારની છે ? ”

સુન્દરાએ નાચતા પૂર્વક જવાબ આપ્યો : “ હે પ્રભુ ! આજથી મને મારા સ્વામીની દાસીસમા ભાર્યા તરીકે ગણુંલે.”

ત્યાર પછી બોજન કરી ભગવાન જેતવનના વિહારમાં પાછા ઇથી સુન્દરા એ દિવાનથી સાસુસસરા ઉપર ભક્તિ રાખવા અને તેમની સંવાચાડરી કરવા લાગી. સ્વામીના ઉપર અત્યંત અદ્વા, ભક્તિ અને પ્રેમ રાખીને છાયાની માઝક તેની વશવર્તિની થઈ. દાસદાસીએ ઉપર છાકરાંએના જેવો પ્રેમ રાખવા લાગી. હવે તેના આચરણુથી ઘરનાં તથા પડોશનાં બધાં માણુસો સંતુષ્ટ રહેવા લાગ્યાં.

આ ઉપરથી વાચક બહેનો સમજુ શકો કે, ભગવાન યુદ્ધ-હેવની સ્વીનતિ ઉપર કેટલી બધી પ્રીતિ હતી. સ્વીએને ભગવાને જે અમૃતમય ઉપહેશ આપ્યો છે તે પ્રમાણું જે આપણી ભગીનીએ અને કન્યાએ વર્તશે તો સંસારના અનેક પાપતાપથી બચી જશે અને તેમનો સંસાર શાંતિનિકેતન બની જશે. કુસંપને લીધે જે કુદુંઘોમાં કલહાંભિ સળગી રહ્યો હશે ત્યાં આગળ જે યુદ્ધ ભગવાનના આ ઉપહેશનું રમરણું કરવામાં આવશે તો ત્યાં અપૂર્વ શાંતિ-સુધાની વૃદ્ધિ થશે.

ઔદ્ધવુગમાં સુન્દરાએ મહાસાધી તરીકે સારી પ્રતિક્ષા મેળવી હતી.



## ૧૫—નકુલમાતા

એક બૌદ્ધધર્મની સુખ્ય ઉપાસિકા હતી. તેણે પોતાના પતિને આપેલો ઉપદેશ ઘણો એધા જનક છે અને એ ઉપરથી જણાઈ આવે છે કે, એને ઉપાસિકા વર્ગમાં અચરસ્થાન કેમ મળ્યું હતું.

જર્ણ દેશમાં શિશુમાર ગિરિમાં બુદ્ધદેવ રહેતા હતા. ત્યાં તે વખતે નકુલપિતા નામનો એક ગૃહસ્થ બહુ માંદો હતો. તેનો મરણુકાલ સમીપ છે એમ સર્વને લાગ્યું, ત્યારે તેની પતનીએ તેને કહ્યું: “હે ગૃહપતિ ! સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામો એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપાંચાસંક્રિતયુક્ત મરણ હુઃખારક છે, એવું ભગવાને કહ્યું છે. હે ગૃહપતિ ! કદાચિત તમારા મનમાં એવી શાંકા આવશે કે, ‘મારા મૂઆ પછી નકુલમાતા છાડાયાનું પાલન કરી શકશો નહિ, પ્રપાંચનું ગાડું હાંકી શકશો નહિ;’ પરંતુ એવી શાંકા તમે મનમાં લાવશો નહિ; કારણુંકે મને સુતર કાંતવાની કળા આવશે છે અને મને ડાન તૈયાર કરતાં આવશે છે. એના વડે હું તમારા મરણ પછી છાડાયાનું પોષણ કરી શકીશા. માટે હે ગૃહપતિ ! આસંક્રિતયુક્ત અંતઃકરણુથી તમારું મરણ ન થાય એમ હું ઈચ્છા છું. હે ગૃહપતિ ! તમને બીજી એવી શાંકા આવવાનો સંભવ છે કે, ‘નકુલમાતા મારા મરણ પછી યુનર્વિવાહ કરશો;’ પરંતુ આ શાંકા તમે છાડી હો. હું આજ સોળ વર્ષથી ગૃહસ્થ અધ્યાર્થીનત (ઉપોસથીત) પાળું છું; તે તમને ખબર છેજ. તો પછી હું તમારા સૃત્યુ પછી વિવાહ કેમ કરીશ ? હે ગૃહપતિ ! તમારા મરણ પછી ‘હું બુદ્ધ ભગવાનનો અને લિક્ષુસંધનો ધર્મોપદેશ શ્રવણ કરવા નહિ જાઉ’ એવી તમને શાંકા આવવાનો સંભવ છે. પણ તમારી પાછળ પહેલાં પ્રમાણેજ બુદ્ધનો ઉપદેશ સાંભળવામાં આરે ભાવ રહેશો, એની તમારે આતરી રાખવી અને

કોઈ પણ પ્રકારે ઉપાધિ સિવાય મરણ આવવા હો. હે ગૃહપતિ ! તમારી પાછળ ‘હું બુદ્ધ ભગવાને ઉપહેશેતું શીલ યથાર્થ’ રીતે નહિ પાણું’ એવી તમને શાંકા આવવાનો સંભવ છે; પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંનીજ હું પણ એક છું, એ તમે ખાતરીથી સમજજો. માટે કોઈ પણ પ્રકારની ક્રિકર વગર મરણ આવવા હો. હે ગૃહપતિ ! ‘મને સમાધિલાલ થયો નથી, તેથી તમારા મરણથી હું બહુ હું:ખો થઈશ,’ એમ તમે સમજશો નહિ. જે કોઈ બુદ્ધોપાસિકા સમાધિલાલવાળી હશે, તેમાં ની હું એક છું એમ સમજજો અને માનસિક ઉપાધિ છોડી હો. હે ગૃહપતિ ! ‘બુદ્ધધર્મનું તત્ત્વ મને હજુ સમજાયું નથી’ એવી પણ તમને કદાચિ શાંકા આવશે; પરંતુ જે તત્ત્વજ્ઞ ઉપાસિકાઓ છે, તેમાંનીજ હું એક છું, એમ ચોક્કસ ધ્યાનમાં રાખો અને મનમાંની કાળજી કાઢી નાખો. ’

આ પ્રમાણે નકુલમાતાના ઉપહેશથી તેના પતિ-નકુલ-પિતાના મનતું સમાધાનથયું અને તેનો વ્યાધિ વેળાસર શર્મ્યો. દોગમાંથી સારો થયા પછી તે બુદ્ધના દર્શન સારુ ગયો, ત્યારે તેને બુદ્ધહેવે કહ્યું: “હે ગૃહપતિ ! તું મોટો પુષ્યશાળી છે. નકુલમાતા જેવી ઉપહેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી ઝી તને મળી છે. હે ગૃહપતિ ! ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની જો એક છે. આવી પત્ની તને મળી એતારું મહાભાગ્ય છે.”

આ એક દષ્ટાંત ઉપરથી બુદ્ધ ભગવાન ખીંચોની ચોણ્યતાની ડેટલી કદર કરતા, એ સહજ સમજ શકાય છે. વળી બુદ્ધ ભગવાન જેવા મહાજ્ઞાની, તપસ્વી અને સિદ્ધ રાજ્યિ જેને માટે આવા સારા શરૂ હો. ઉચ્ચારે તે સન્નારીમાં ડેટલા બધા સફુલુંણા હશે તેની પણ કદ્યના વાચક બહુનો કરી શકશો.\*



\* ‘શાનસુધા’ પત્રમાં પ્રગટ થયેલા ‘બુદ્ધધર્મ અને સંધ’ નામના દેખમાંથી સાલાર ઉકૂંત.



## ૧૬—બ્રહ્મદત્તા

આ સભારી વારાણુસીના રાજની કુમારી હતી. એ ઘણી સુંદર અને ભણેલીગણેલી હતી. તેનું પાખિઅહણુ કરવા માટે દેશદેશાવરના રાજાઓ તલપાપડ થઈ રહ્યા હતા; પરંતુ અંદરાદત્તાએ લભ નહિ કરવાનો સંકલ્પ કર્યો હતો. બૌદ્ધશાસ્ત્રનું અધ્યયન કરીને શાસ્ત્રની આલોચના કરવામાં લુણ ગાળવાની તેને ધૂચા હતી. આખરે લગવાન કશ્યપ જ્યારે ઋપિપત્તાનમાં વાસ કરવા આવ્યા હતા, ત્યારે એ લાગ જેઠને રાજકુન્યા અંદરાદત્તા તેમની પાસે ગઈ અને પ્રાર્થના કરી કે, “મારી ધૂચા આપની પાસે બૌદ્ધ ધર્મનો ઉપહેશ અહણુ કરવાની છે.” લગવાન કશ્યપની પાસે શિક્ષણ મેળવીને રાજકુમારી અંદરાદત્તાએ તપશ્ચિયો કરવાનું આરંભ કર્યો.

એ વખતે રાજકુમારીના પ્રેમાંકંદ્રી રાજકુમારોએ તેને ચિરકોમારવત અંગીકાર કરતાં રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એણે કોઈની વિનિતિ ઉપર ધ્યાન આપ્યું નહિ. આખરે તેમણે બળ-પૂર્વક તેનું હરણુ કરી જવાનો નિશ્ચય કર્યો; પરંતુ એ હંદો રાજકુમારીના આશ્રમમાં જઈ પહોંચ્યા ત્યારે રાજકુમારી પોતાના અફ્ઝુત ચોગખળથી આકાશમાર્ગમાં ચરી ગઈ. તેનો આ ચમત્કાર જેઠને રાજકુમારો સ્તરધ થઈ ગયા અને તેને પરણુવાની મિથ્યા આશા છાડી દઈને વીલે મેંએ પોતપોતાને વેર પાછા ગયા.

અંતરીક્ષમાં ચઢું એ ચોગમાં મોટી સિદ્ધિ ગણ્યાય છે. એવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજકુમારી અંદરાદત્તા ધન્યવાદને પાત્ર છે.





## ૧૭—ક્ષેમા



ક સમયે ભગવાન યુદ્ધહેવ શ્રાવસ્તી નગરીમાં નિવાસ કરી રહ્યા હતા. એ અરસામાં પ્રસેનજિત અને અધ્યાદતા નામના એ રાજાઓમાં વાદવિવાદ જોખો થયો. અને એટલો બધો વધી પડ્યો કે એ રાજાઓની વચ્ચમાં ચુદ્ધ થવાનો પ્રસંગ આવી પહેંચ્યો. એજ સમયમાં દૈવસંચોગથી પ્રસેનજિત રાજને ત્યાં એક કન્યા અને અધ્યાદત રાજને ત્યાં એક પુત્રનો જન્મ થયો. બંને રાજાઓએ સૂચના કરી કે આ બંને બાળકોનો વિવાહ થઈ જાય તો આપણો વિવાદ બંધ થઈ જાય અને ફરીથી મૈત્રી સ્થાપન થાય. બંને જણાએ એ વાત કખૂલ રાણી અને ચુદ્ધની તૈયારીએ બંધ પડી. બિલકુલ શૈશવ અવસ્થામાં—ઘોડિયામાંથીજ પ્રસેનજિતની કન્યા અને અધ્યાદતના પુત્રની સગાઈ થઈ ગઈ. પ્રસેનજિતની કન્યાનું નામ ક્ષેમા હતું. પ્રસેનજિતે તેને ધર્મ તથા નીતિનું ડાચું શિક્ષણું આપ્યું હતું. વિવાહ કરવા ચોગ્ય ડાંમરની થઈ લારે ક્ષેમાએ રૂપી જણાવી દીધું કે, “ મારે લગ્ન કરવું નથી. આખી જિંદગી સુધી કૌમારવત પાળીને ધર્મશાસ્ત્રનું અદ્યયન કરવાની મારી ઈચ્છા છે.”

કન્યાની આવી પ્રતિજ્ઞા સાંભળીને પ્રસેનજિત રાજ ધણા ડાઠ વિચારમાં પડ્યો. એના મનમાં ચિંતા થવા લાગી કે, રાજ અધ્યાદતના મનમાં એવો શક ઉત્પન્ન થશે કે, “ મેંજ ક્ષેમાને એહું ખહાનું કાઢવાનું શીખું” હશે. મહામહેનતે તો કન્દિયાનું મેં કાળું કર્યું હતું. પાછી આ અણુધારી પંચાત કચાંથી આવી?

આવા આવા વિચારો પ્રસેનજિત રાજને આકુળન્યાકુળ કરી નાખવા લાગ્યા. તેણે અધ્યાદત રાજને ખાનગી રીતે પત્ર લખ્યો કે, તમે જલદી આવી જઈને તમારા પુત્રનું લગ્ન ક્ષેમા સાથે

કરાવી જાઓ. તત્ત્વજ્ઞાનની પિપાસુ ક્ષેમાને આ વાતની શુસ્પણું અખર પડી ગઈ. તરતજ તે લગવાન યુદ્ધહેવની પાસે ચાલી ગઈ. લગવાન યુદ્ધહેવ એ સમયે જે તવનમાં બિરાજતા હતા. યુદ્ધહેવે જેથું કે ક્ષેમા ખરેખર તત્ત્વજ્ઞાન અને ધર્મોપહેશ પ્રાસ કરવાને યોગ્ય છે, એટલે તેમણે પંડે એ રાજકુમારીને ઉપહેશ આપવો શરૂ કર્યો. યુદ્ધહેવના ઉપહેશના પ્રલાવથી ક્ષેમા બૌદ્ધધર્મનું તત્ત્વ શીખી ગઈ અને પદ્મરિપુષ્પોના પ્રલોકનને વશ કરી શકી. આ પ્રમાણે તે એક આદર્શ વિહુબી અને સાધ્વી બની. થાડા સમય પછી તેનાં સગાંસંબંધીઓ આશ્રમમાં આવીને તેને ખળ-પૂર્વક ઘેર લઈ ગયાં. પ્રસેનજિત રાજ ક્ષેમાના લગ્નની તૈયારી-એ કરવા લાગ્યો. ધીમે ધીમે લગ્નનો હિવસ પણ આવી પહેંચ્યો. પુરોહિતે વર અને કન્યાનો હાથ પકડીને બંનેને લગ્નના પવિત્ર બંધનમાં બાંધવા સારુ મંત્રોચ્ચારણ શરૂ કર્યું. એટલામાંજ લગ્નના સુંદર પાઠલા ઉપર બિરાન્દી ક્ષેમા પાઠલા સર્મેત ધીમે ધીમે ડાચી થઈને આકાશમાર્ગમાં ડડવા લાગી. આકાશમાં ડાચે ગયા પછી તેણે વિવિધ પ્રકારના ચ્યામતકાર બતાવ્યા. એ ઉપરથી સરેને ક્ષેમાની અપૂર્વ શક્તિ અને સિદ્ધિની આતરી થઈ. વિવાહના મંદ્યમાં એકઢાં થચેલાં બધાં સ્વીપુરુષો આ દસ્ય જેઠને અવાડ અને સ્તરથ થઈ ગયાં. ત્યાર પછી બધાએ સવિ-નય પ્રાર્થના કરીને ક્ષેમાને આકાશમાર્ગમાંથી નીચે ઉતારી. હવે તેની આગળ લગ્નની વાત કરવાની ડોઇની હિંમત ચાલી નહિ. લગ્ન બંધ રહ્યું અને ક્ષેમા પિતાની આજા લઈને પાછી તપશ્ચયી કરવામાં તલ્લીન થઈ ગઈ. પ્રાણ્યાયામ, કુંભક આદિ યૌગિક હિયાઓ વડે ક્ષેમાએ આકાશમાં ડાંચા થવાની શક્તિ પ્રાસ કરી હતી; પરંતુ એ તો ઘણી સાધારણ સિદ્ધિ હતી. લગવાન યુદ્ધહેવ શ્રીમુખે કહી ગયા છે કે, ક્ષેમાએ આકાશમાં ચંડવા કરતાં પણ બધાએ પ્રશાસને યોગ્ય શિક્ષણ પ્રાસ કર્યું હતું.

નિવોષુ શું છે, મૃત્યુ પછી આત્માની શી દશા થાય છે, વગેરે તરવોનું રહસ્ય ક્ષેમાએ પોતાના પિતા પ્રસેનજિત રાજને ધણી ઉત્તમ રીતે સમજાઓયું હતું. ધન્ય છે એવી કન્યાને !!



## ૧૮-કુવલયા



કે વખત ‘જિરિ બંધુ સંગમ’ના દિવસે શ્રાવસ્તી નગરીમાં એક મોટી ઉનાણી થઈ રહી હતી. એ વખતે દૂર દેશાવરથી સ્વીપુરુષો આવીને શ્રાવસ્તી નગરીમાં એકઠાં થયાં હતાં. એ પ્રસંગે દક્ષિણાપથમાંથી એક વારાંગના પણ ત્યાં આવી હતી. તેનું નામ કુવલયા હતું. તેણે આવીને ભરીસલામાં પૂછ્યું: “મારા સૌંદર્યનું આકર્ષણું રોકી શકે એવા કોઈ પુરુષ આ નગરમાં છે ?”

કુવલયા અરેખરી અપસરા જેવી સુંદર હતી. તેના સૌંદર્યની જણમાં અનેક પુરુષો ઇસાઈને પાયમાલ થઈ ચુક્યા હતા, એટલે તેના સુખમાંથી આવા અહંકાર સૂચક શણ્ણો નીકળે એ સ્વાભાવિક હતું.

એ મેળામાં આવેલા એક પુરુષે જવાણ આપ્યો: “હા, ગૌતમ નામનો એક શ્રમણ છે.”

એ વાત સાંભળતાં કુવલયા જેતવનમાં ગઈ. ત્યાં આગળ યુદ્ધહેવ તપસ્યા કરી રહ્યા હતા. યુદ્ધહેવની સન્મુખ જધને તેણે ચોતાનું સૌંદર્ય ઘટાડીને વેશ્યાને છાજે એવા નાચનખરાં કરીને યુદ્ધહેવના ચિત્તાનું આકર્ષણું કરવાનો પ્રયત્ન કર્યો; પરંતુ જેણું કુવલયાનું શારીરિક સૌંદર્ય અનુપમ હતું, તેવાં યુદ્ધહેવનું આધ્યાત્મિક સૌંદર્ય પણ અનુપમ હતું. એમ કહેવાય છે કે યુદ્ધહેવની અમાનુષી શક્તિના પ્રભાવથી કુવલયાનું સૌંદર્ય એકદમ નાચ થઈ ગયું. ઇપ્લાવણ્યવતી અને લરણુવાનીમાં મસ્ત બનેલી એ શુભતી એકદમ એસી વર્ષની યુછી બની ગઈ. તેના શરીર ઉપર કરચિલિયો વળી ગઈ, મેં કદ્દુપું થઈ ગયું. યુદ્ધ લગ્બાન જેવા પુષ્યાત્મા મનુષ્યના સંસર્ગમાં આવતાં વારજ એ નર્તકીને ચોતાના પાછલાં પાપકમોનો પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ પશ્ચા-

તાપની વેહનાથી તેનું હૃદય વીધાઈ જવા લાગ્યું. તેણે તરતજ જુદ્ધહેવના અરણમાં સાણાંગ ફંડવતુ પ્રણામ કર્યો તથા પોતાનાં પાપોતું પ્રાયશ્ક્રિત સૂચવવાની વિનતિ કરી. તેનું હૃદય શાંતિ મેળવવા ઉત્સુક ઘનન્યું.


જુદ્ધહેવ અરેખરા બક્તાવત્તસલ હતા. પરમ પતિતપાવન મહાત્મા હતા. જુદ્ધહેવે તેના ઉપર ઘણી હયા આણીને જાતે તેને શિક્ષણ અને ઉપહેશ આપવાનું આરંભ કર્યું. જુદ્ધહેવના ઉપહેશથી તેનું અરિત્ર બિલકુલ સુધરી ગયું તથા તેમના શિક્ષણુથી થાડા સમયમાં એ પરમ વિહૃષી બની ગઈ. પાછળથી બૌદ્ધપરિવાજિકા તરીકે જનસેવા કરીને તેણે સારી જ્યાતિ મેળવી હતી.

## ૧૯-શુક્લા

શુક્લા

ક હું પિતાવસ્તુ નગરમાં શુક્લા નામની એક ઘણી સુંદર અને શુષ્ણુવતી નારી રહેતી હતી. એ બૌદ્ધ ધર્મ પાળતી હતી. એક તો તેનું સૌંદર્ય અપૂર્વ હતું અને બીજું એ કે એ પોતાના પિતાની અઠળક દોલતની એ એકલી વારસ હતી. એવી સુંદરીનું પાણિશહણુ કરવાને અનેક રાજકુમારી ઉત્સુક રહેતા હતા; પરંતુ શુક્લાના કાન ઉપર બચ-પણુથીજ જુદ્ધહેવના નિર્બાધુધર્મ અને વૈરાગ્યતત્ત્વનો અમૃતમય ઉપહેશ પડી ચુક્ક્યો હતો. પિતાના અતુલ વૈભવનો ત્યાગ કરીને તેણે થાડા સમયમાં આદશાં તપસ્વિની તરીકે પ્રસિદ્ધ મેળવી. બૌદ્ધધર્મમાં એવી હંતકથા ચાલે છે કે તપસ્યા કરતાં કરતાં એણે એવી ઉત્ત્રત કરી હતી કે તે આખરે ‘અર્હત’ પદ પામવાને ભાગ્યશાળી થઈ હતી. તેનું જાંડું તત્ત્વજ્ઞાન તથા તેનો ભધુર સારદૃપ ઉપહેશ સાંભળ્યાથી અનેક રાજકુમારોની મોહનિદ્રા જાડી ગઈ હતી. બૌદ્ધશાસ્ત્રમાં તેનું અગાધ પાંડિત્ય હતું. તેની વિદ્યા જેઠને મોટા મોટા આક્ષણુ પાંડિતો પણ આશ્રયચક્તિ થઈ જતા. અધ્યયન, અધ્યાયન, તપ, દાન અને અતિથિસત્કાર આદિ સત્કારોમાં રાતદિવસ નિમજ્જ્ઞ રહીને શુક્લા માનવજીવનનું સાર્થક કરી ગઈ છે.

## ૨૦-ખેમા (ક્ષેમા)



દ્રોહેશમાં સાગર નગરમાં રાજના ધરમાં એનો જન્મ થયો હતો. જન્મથીજ તેના અંગની કાંતિ સુંદર હતી. માતપિતાની એ ઘણી લાડકી હતી. વિવાહ ચોણ્ય વયની થઈ ત્યારે એનું સૌંદર્ય ઘણું ખીલી નીકળ્યું અને એના ડ્રેપની પ્રશાંસા સાંભળીને અનેક ક્ષત્રિય રાજકુમારો તેની સાથે લગ્ન કરવાનો અભિવાષ રાખવા લાગ્યા. તેમણે મદ્રાધિપતિની પાસે માગાં પણ મોકલવા માંડ્યાં. કોસલ દેશના લોકપ્રિય રાજ બિંબિસારે પણ ઐમાનું માગું મોકલ્યું.

રાજ બિંબિસાર બુદ્ધહેવનો પરમ કાક્ત હતો. ધર છોડી અરણુથમાં નીકળી પહુંચા પછી રાજગૃહ નગરમાં એ રાજ સાથે બુદ્ધહેવનો મેળાપ થયો હતો. અને એમણે બાધિસત્ત્વને સમજવીને પાછા સંસારમાં મોકલવાનો પ્રયત્ન કર્યો હતો; પણ બુદ્ધહેવે પોતાનો પરિચય આપીને ધરણાર છોડવાનો ઉદ્દેશ જણ્યાંથો કે, “હું મનુષ્યનું હાથને શામાવવાનો ઉપાય શોધી કાઢવા માગું છું.” ત્યારે એમણે એમને જવા દીધા અને પ્રાર્થના કરી કે, “રાજકુમાર ! તમને જગતના ઉદ્ધારનો માર્ગ જડી આવે તો સૌથી પહેલાં તમારે માર્ગ વિહાર-દાન સ્વીકારવું પડશો.” સારાંશ એ કે ગૌતમબુદ્ધના પ્રથમ શ્રાવક તરીકે તેની ગણુતરી હતી. એવા ચોણ્ય રાજના ભાગાથી પ્રસન્ન થઈ મદ્રાને પોતાની શુષ્ણુવતી કર્યા એને આપી. ક્ષેમા હવે કોસલેશ્વરની પટરાણી બની.

ક્ષેમાના સુખનો હવે પાર રહ્યો નહિ. ચોણ્ય પતિને પ્રામથ્યાથી એના સહિતુંનો પણ વિકાસ થયો. સાંસારિક સુખમાં એના કેટલાંક વર્ષ લીતી ગયા પછી, બુદ્ધહેવ સિદ્ધિ પ્રાપ્ત કર્યો પછી પોતાના એક હંજર શિષ્યો સહિત રાજગૃહ પથાર્યો. રાજ બિંબિસાર તેમનાં ફરશને ગયા અને અ રૂપ્ય ૫૦.૦૦ ને પોતાને

દેર જોજન કરવા નિમંત્રણું કરી આવ્યા. યુદ્ધહેવ રાજમહેલમાં પદ્ધાર્યો ત્યારે બિંબિસાર રાજાએ વેળુવન નામનો પોતાનો સુંદર ખગીશો તથા વિહાર યુદ્ધહેવને તથા લિક્ષુસંઘને અર્પણું કરી દીધાં. યુદ્ધહેવે એ વેળુવનમાં ઘણું સમય સુધીનિવાસ કર્યો હતો. ક્ષેમાએ યુદ્ધહેવના શુણની તથા એમના ઉપહેશની ઘણી પ્રશંસા સાંભળી હતી; પણ કોઈ દ્વિવસ એમનાં દર્શને ગાંધી નહોતી. કારણ એ હતું કે ક્ષેમાને પોતાના સૌંદર્યનું ઘણું અભિમાન હતું. યુદ્ધહેવને સૌંદર્ય પ્રત્યે અભિકૃત્ય નહોતી, એટલું નહિ પણ એ પોતાના ભાપણોમાં સૌંદર્યના ઘણું હોય બતાવતા. આથી અને શંકા રહેતી કે, “મારા રૂપની સૌ કોઈ પ્રશંસા કરે છે પણ ભગવાન એમાં કાંઈ જોડાયાં પણ કાઢશો તો ! ” એ વિચારથી જ્યારે વેળુવનમાં જવાનો પ્રસંગ આવતો, ત્યારે કાંઈ ને કાંઈ ણહાતું કાઢીને એ વાતને ઉડાવી હેતી.

ખીલું તરફ રાજ બિંબિસારને એવો વિચાર આવતો કે, “હું યુદ્ધહેવનો પરમ લક્ષ્ય, શુલ્હેવ મારા ઉપર કૃપા કરીને મારા ઉદ્ઘાનમાં બિરાજે છે અને મારી પટરાણી એમનાં દર્શને પણ ન જાય એ કેનું એચોંય ગણ્યાય ? કોઈ પ્રકારે એવી યુક્તિ કરવી જોઈએ કે જેથી પટરાણીના ભગવાનમાંથી સૌંદર્યની ખુમારી જતી રહે અને ગૌતમબુદ્ધ તરફ તેને ભક્તિ ઉત્પન્ન થાય.”

આખરે એણે એક યુક્તિ શોધી કાઢી. તેણે પોતાના દરખારમાંના ભાટચારણને બાલાવીને કહું કે, “તમે વેળુવનના સૌંદર્યનું વર્ણન મધુરી કવિતામાં રચાવ્યું. સંગીત અને પ્રભા-વશાલી કવિતાની અસર પાપાણું હૃદય ઉપર પણ થાય છે. ભાટને સુખેથી વેળુવનની પ્રશંસા સાંભળીને રાણીને એ સુંદર ઉદ્ઘાન જેવાની ઉત્કંઠા થઈ અને તેણે રાજની પરવાનગી માગી. રાજને તો એટલું જોઈતું હતું. તેણે પ્રસંગ થઈને રજ આપી અને કહું કે, “એટલું ધ્યાનમાં રાખજો કે વેળુવન સુધી જાઓ છો તો પણી ભગવાન યુદ્ધહેવનાં દર્શન કર્યો વગર પાછાં નહિ અવાય.”

ક્ષેમાએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. રાજાએ પોતાના નોકરોને

કહી રાખ્યું હતું કે, “રાખ્યી પોતાની ખુશીથી બુદ્ધદેવના દર્શાને જાય તો ઘણ્ણી સારી વાત; નહિ તો તમે એમને કહેનો કે, ‘અમને રાજની આજા આપને દર્શાન કરવા સારુ લઈ જવાની છે.’ ગમે તે પ્રકારે દર્શાન કરાવીનેજ લાવનો.”

રાતદિવસ અંતઃપુરમાં રહેનારી એ રમણીય બાગને જેઠને ઘણ્ણી પ્રસન્ન થઈ. એના ચિત્તને ઘણ્ણી શાંતિ વળી. પક્ષીઓના મધુર ગાનથી એના કાનને તૃસુ થઈ. પુષ્ટળ ચાલ્યા છતાં એને જરાયે થાક જણ્યાયો. નહિ. પાછા ફરતી વખતે નોકરો. એને એવે રસ્તે લાંબ્યા કે જ્યાં બુદ્ધદેવ બિરાજતા હતા. બુદ્ધદેવે તેને પોતાની તરફ આવતી જેઠને પોતાની ઋદ્ધિના બળ વડે એક સ્વર્ગીય સૌદર્યની પૂતળી ભલ્લા કરી. એ પૂતળી હાથમાં પંખો લઈને બુદ્ધદેવને વાયુ નાખી રહી. ક્ષેમાદેવીને એ દસ્ય જેતાં વારજ વિચાર આપ્યો કે, “મારા કરતાં અનેકગણી સૌદર્યવતી આ સુંદરી બુદ્ધદેવની સેવા કરી રહી છે અનેહું તો એમનાં દર્શાન સુધ્યાંત કરવા ગઈ નથી. ઘિંધાર છે મારા જીવતરને.” ક્ષણ્ણમાત્રમાં એના રૂપનો ગર્વ જતો રહ્યો. આટલું વિચારતાંજ તેની વૃત્તિએ બહારના સુખ ઉપરથી ભગીને અંતર્મુખી થઈ. તે બુદ્ધદેવની પાસે જઈને પગે લાગી. થોડી વારમાં તેણું જેણું કે પેલી તરણું કી મધ્યમ અવસ્થાને પ્રાપ્ત થઈ છે. વળી થોડી વાર પછી તેને ઘરડી ડાશી બનેવી જેઠ. તેનું રૂપ નાશ પામી ગયું હતું, અંગ ઉપર કાંતિ નહોંતી, વાળ ધોણા થઈ ગયા હતા, શરીર કદ્રૂંપું થઈ ગયું હતું, બળ રહ્યું નહોંતું, દાંત પડી ગયા હતા, કમર વળી ગઈ હતી; થોડી વાર પછી તેણું જેણું તો એ ડાશી મરણું પામેલી.

અલિમાનમાં છકેલી પોતાના રૂપ આગળ સંસારને તુચ્છ ગણુનારી ક્ષેમાને વિચાર આપ્યો: “શું મારા શરીરની પણ છેવટે આજ ગતિ થશે? હું કેવી મૂર્ખ છું કે, આજાનમાં આટલું બધું આયુષ્ય શુમાર્યું?” હવે તેણું બુદ્ધદેવનું શરણું લીધું. બુદ્ધદેવે તેને ઉપરેશ આપીને ધર્મનું રહસ્ય સમજાયું. ક્ષેમા તીવ્ર ઋદ્ધિની અને વિહુષી તો હતીજ. અહંકારનાં પડળ ભિતરીજવાથી હવે એને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરતાં વાર ન લાગી. થોડા સમયમાં તેને સંસાર ઉપર વૈરાગ્ય ભાગન્યો. અને તેણું વિધિ-પૂર્વક બેરી પહુંચાયું કર્યું. બેરી થઈને તેણું એક જાથા ગાઈ કે, “જે પ્રમાણું ચોતે તૈયાર કરેલા જળામાં કરોળિયો ક્રસાય છે,

તે પ્રમાણે ગૈલીક સુખને વળગી રહેનારા લોકો જ-મરણના ફેરામાં પડે છે; પણ અનેકી લોકો એ પ્રવાહમાંથી પાર જતરીને પ્રવજ્યા અહૃણુ કરીને કામથી ઉત્પત્ત થનારા સુખનો નાશ કરે છે.” ત્યાર પછી અર્થ, ધર્મ, નિરુક્તિ અને પ્રતિબાન એ ચાર પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત કર્યાં. ‘પટિસંભિદ્ધ શાસ્ત્ર’માં પૂર્ણું સાક્ષાત્કાર થયા પછી તેણે ‘અર્હત’ પદ પ્રાપ્ત કર્યું અને બુદ્ધહેવની ધર્માનુસાર પ્રવજ્યા લેવા સારું પતિની આજા મેળવવા ગઈ.

રાજ તેને જેતાંજ સમજ ગયો કે, રાણી ‘અર્હત’ પદને પામી છે, છતાં પુછ્યું: “કેમ, બુદ્ધહેવનાં દર્શન કરી આવ્યાં?”

રાણીએ કહ્યું: “આપ લગવાન બુદ્ધનાં દર્શન કરવા વારંવાર જાઓ છો, પણ તે ઉપરચાટિયાજ. મેં તેમનાં દર્શન પૂર્ણંડે કર્યાં છે અને આપના કરતાં વધારે સારી રીતે એમને ઓળાખી શકી છું. મહારાજ ! મને પ્રવજ્યા લેવાની રજ આંયો.”

કુલો પરીક્ષાનો દિવસ ! અસાધારણ દ્ર્યવતીને રનેહાળ પતિનો સદાને માટે ત્યાગ કરવાનો પ્રસંગ છે ! રાણીએ “હેવી, ધર્મં સારું સારું” કહી તરતાજ રજ આપી અને એક સેનાના મ્યાનામાં એસાડીને લિક્ષુણીસંઘના નિવાસસ્થાનમાં મોકદી આપી. બુદ્ધહેવે તેના ગુણુની પરીક્ષા કરીને ‘મહાપ્રજ્ઞાવતી’ની ઉપાધિ થી તેને વિભૂષિત કરી.

થેરી થયા પછી પણ અસાધારણ દ્ર્યવલાવણ્યને લીધે તેને કુમારો લઈ જવાના ધર્ણા પ્રયત્નો પાપીએ તરફથી થયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની લાલચમાં ક્રસાયા વગર એણે શુદ્ધ અનુભૂતિયુક્ત સાત્ત્વિક લુબન ગાળણું હતું.

થેરી ગાથામાં ૧૩૬ થી ૧૪૪ સુધીના શ્લોક તેના રચેલા છે. બુદ્ધહેવે તેની ગણુના આદર્શ લિક્ષુણીએમાં કરી છે.





## ૨૯-ઉત્પલવણી



તમણુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એક શાહુકારના ઘરમાં એનો જન્મ થયો. હતો. તેના શરીરનો વણું નીકોાત્પલના અજગર્ભના જેવો તેજસ્વી અને કાંતિમાન હતો. એટલે જન્મતાંવાર રજ માતપિતાએ તેનું નામ ઉત્પલવણું પાડ્યું.

દિવસ જતા ગયા તેમ એશુકલ પક્ષના ચંદ્રમાની પેઠે વધવા લાગી અને ડંમરમાં આવી ત્યારે એનું સૌંદર્ય અને ખાસ કરીને એનો કમળ સરખો વણું બધાંનું દ્વારાન એંચવા લાગ્યો. જંબુદ્ધીપના અનેક રાજ્યાધિપતિઓના રાજકુમારોએ તથા અનેક ધનવાન શૈદીયાઓએ તેના પિતા પાસે માગાં મોકલ્યાં. ઉત્પલવણુનો પિતા હવે મોટા વિચારમાં પડ્યો. બધાને ખુશ કરવા એ અસંભવિત હતું. એકને રાજી કરવા જાય તો બીજાનો સાથે હુસ્મની બાંધવી પડે એમ હતું. એ ઘણું મૂંઝાવા લાગ્યો. આખરે ખાંડું વિચાર કરીને એણે એક શુક્તિ શોધી કાઢી; પણ એ શુક્તિ અમલમાં આણી શકાશે કે નહિ તે સંબંધમાં એને ખાતરી નહોંતી.

આખરે પોતાની અમૂંઝણું કન્યાની આગળ જણ્ણાવી તેનો અભિપ્રાય પૂછવા સારુ એ ઉત્પલવણુની પાસે ગયો. ઉત્પલવણું ચતુર હતી; પોતાના લમ્બસંબંધથી ડેવી વિષમ સ્થિતિ જાલી થઈ છે અને એના માતપિતા ડેવા ગુંચવાડામાં પણ્ણાં છે એ કચારનીયે જણ્ણું ચૂકી હતી, પણ વિનયનો આતર આગળ પડીને એણે પિતાની રૂખરૂ એ વિષય છેજ્યો નહોંતો. આજ પિતા તેનો પાસે આવ્યા એટલે તેણે જાઈને સત્કાર કર્યો તથા અણ્ણામ કરીને એમને એસવાતું આસન આપ્યું. પિતાનું ઉદાસ મુખ જોઇને તે સમજુ ગઈ કે આજે પિતાજીના હૃદય ઉપર મોટો ભાર આવી પડ્યો છે અને એ એજ હલડો કરવા, હૃદય આલી કરવા

સાડજ એ મારી પાસે આવ્યા છે. ચિંતાનું કારણ શું છે તે કળી જતાં પણ એને વાર લાગી નહિ; છતાં એણે પૂછ્યું: “ બાધુ ! આપને શું થયું છે ? આજ આપનો ચહેરો જાતરી કેમ ગયો છે ? ” પુત્રીના આ કોમળ અને હૃદયસ્પથી શાંદોએ પિતાના હૃદયને આધાત કર્યો. મહાપ્રયત્ને મનને સ્થિર રાખીને એમણું કહ્યું: “ હીકરિ ! આજકાલ હું શી અમૂળણુમાં પડ્યો છું, એ તું કળી શકી હોઈશ, એમ હું ધાડં છું. જાણુંકીપના અનેક રાજ-કુમારો અને શૈઠ લોકોનાં તારે સાડ માગાં આવ્યાં છે. તું જાણું છે કે હું એ બધાની ધર્યા પૂરી કરી શકું એમ નથી. તારા જેવી સુંદર અને વિહુષી કન્યા ગમે તેને વગરવિચારે હું આપી શકીશ નહિ. તારા લઘનનિમિત્ત મોટો અધ્યાત્મા થવાનો મને ભય રહે છે; માટે મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. ”

ઉત્પલવણ્ણાએ કહ્યું: “ પિતાજ ! ફરમાવો. આપે કર્યો ઉપાય શોધી કાઢ્યો છે ? સંકોચ ન રાખો. હિંદ પોલીને વાત કરો. ”

પિતાએ કહ્યું: “ મારો તારા ઉપર ફેયો અને કેટલો ગધો પ્રેમ છે એ તું જાણું છે, એટલે તારે માટે એ સૂચના કરતાં મારા હૃદયમાં કેટલું હુંખ થતું હુશે તેની તને કલ્પના આવી શકશે, છતાં સંયોગો જેતાં મને બીજે કોઈ માર્ગજ સૂઝતો નથી. કહેણેન, તું સંસાર લયને પ્રવન્ધ્યા લેવાને તેયાર છે ? ”

છેલ્લું વચ્ચેન ઉચ્ચારતાં પિતાના જીવને કાંઈ કરાર વલ્યો. ઉત્પલવણ્ણાએ પિતાનાં વચ્ચેનો ધ્યાનપૂર્વક સંસ્કર્યાં તથા તેમના સુખ ઉપર થતા ફેરફારતું બારીકીથી અવલોકન કર્યું. પોતાને લીધે પિતા કેવી સંકદામણુમાં આવી પડ્યા છે તે વાત તેના સમજવામાં આવી. ધર્યા સાહુસથી તથા કુમારીસુલબ દિવ્યતાથી એણે કહ્યું: “ બાધુ, આપ જરાયે મૂંઝાશો નહિ. હું સારા કુળની કન્યા છું. મારા પિતાનું એમાં કલ્યાણ હોય તેજ કામ મારે કરવું જોઈએ અને એજ હું કરીશ. ” વાત એહતી કે ઉત્પલવણ્ણા પૂર્વજન્મની પણ સંસ્કારી કન્યા હતી. પૂર્વજન્મોમાં તેણું ગોતમશુદ્ધના પૂર્ણિવતારે પદ્મોત્તર યુદ્ધની સારી ચેઠે સેવા-આકરી કરી હતી. એ વખતે પદ્મોત્તર યુદ્ધે એક લિક્ષુણીને ઋદ્ધ-મતી કહીને આગળ પડતું સ્થાન આપ્યું હતું. તે વખતથી એના મનમાં પણ એવું ઉચ્ચ સ્થાન પ્રાત કરવાની અભિલાષા ઉત્પજી થઈ હતી. એ દ્વિવસથી એણે સાહુસંતની ધર્યી સેવા કરવા માંડી

હતી તથા પુષ્કળ દાન હેવા માંડચાં હતાં અને અનેક પ્રકારનાં સત્કરો કરીને મરણ સમયે બગવાનને એજ પ્રાર્થના કરી હતી કે, “મને પણ ઋદ્ધિમતી બિક્ષુણીનું મહાન પદ પ્રાપ્ત થને.” શુલ્ષ અભિલાષા, ચોંચ પ્રયત્ન કરવામાં આવે તો એક જન્મમાં કે અનેક જન્મમાં પણ ફળવતી થયા વગર રહેતી નથી. અનેક જન્મો બાદ ગૌતમખુદના સમયમાં ઉત્પલબ્ધિના જીવનમાં ઉપર વર્ષાવેલો પ્રસંગ પ્રાપ્ત થયો. પિતાળાએ તેને પ્રવન્નયા બ્રહ્મણુ કરવાની ઈચ્છા જણાવી. પૂર્વજન્મના સંસ્કારોની ઉત્તે-જનાથી કુમારી ઉત્પલબ્ધિએ પ્રસંજિસે એ પ્રસંગને વધાવી લીધો અને બિક્ષુણી બનવાતીયાર થઈ.

પિતાનાં ચક્રમાં અશ્રુ ભરાઈ આવ્યાં, અંતઃકરણમાં સ્નેહ ભેટરાઈ ગયો. અને એમના સુખમાંથી શાશ્વત પણ નીકળી શક્યો નહિં. તેણું પ્રેમપૂર્વક પુત્રીને હૃદય સરસી ચાંપીને એના શુલ્ષ વિચાર માટે ધન્યવાદ આપ્યો તથા પોતાની સાથે બિક્ષુણીસંઘ-માં લઈ જઈને પ્રવન્નયા આપાવી.

ઉત્પલબ્ધિને નવીન આશ્રમ ઘણ્ણો ગમી ગયો અને તેને લાગ્યું કે મોહમાયાના બંધનમાંથી સુક્ત થઈને સ્વતંત્ર વાતાવરણમાં આવી.

ઉપસંપદ પ્રાપ્ત કર્યા પછી તેણું આધ્યાત્મિક ઉત્ત્રતિ માટે અભ્યાસ કરવાની શરૂઆત કરી. ઉપસંપદ એટલે શું તે પણ આ સ્થાને સંશોપમાં સમાનવલું અસ્થાને નહિં ગણ્યાય. ઉપસંપદાના યોગથી બિક્ષુ અને બિક્ષુણીસંઘની એક નિયત પ્રકારની વ્યવસ્થા થવા પામતી. પ્રવન્નયા લીધાથી તો બિક્ષુણીસંઘમાં દાખલ થવાની પરવાનગી માત્ર મળતી, પણ સંઘમાં દાખલ થતાં જ સંઘના બધા હક્ક એકદમ મળી જતા નહોતા. અતુલબ અને ચોંચતા પ્રાપ્ત થયા પછી ‘ઉપસંપદ’ આપવામાં આવતી અને ત્યાર પછીજ બિક્ષુ કે બિક્ષુણીને સંઘને લગતી સર્વ બાખતોમાં મત આપવાનો અધિકાર મળતો. અસ્તુ! સંઘમાં રહીને ઉત્પલબ્ધિએ નિપિંટક-ખોદ્દ ધર્મશાસ્ત્રના સુખ્ય ચાંચાનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેણું સીલા સંપદ પ્રાપ્ત કરી અને સમાધિ-લાવનાનો સાક્ષાત્કાર કરવાને માર્ગ ચડી. બૌદ્ધ ધર્મમાં ‘ઉપો-સથ’ ની કિયા થાય છે. ઉપવસથને દિવસે જે સ્થળે બિક્ષુ ડેનો

સંધ એકડો થાય તેને ઉત્પલબ્ધિશાળાર (પાલી ઉપોસથાળાર) કહે છે. ચૌદશ અને પૂર્ણિમાને દિવસે એ સ્થાનની વ્યવસ્થા કરવાનું કામ બિક્ષુ અને બિક્ષુણીઓને માથે વાસાફરતી આવતું. એ દિવસે 'પ્રતિમોદ્ધ' અંથનો પાઠ થતો. બિક્ષુક અને બિક્ષુકોએ ડેવા નિયમથી રહેવું જોઈએ અને ડેવી આ પનીઓથી અગ્નિલું જોઈએ, એ સંધારી ઉપહેશ એ અંથમાં આપેલો છે. કોઈ બિક્ષુ કે બિક્ષુણી-એ એમાંનો કોઈ નિયમ તોડ્યો હોય તો એ મેળાવડામાં સંધ-સ્થવિર તેને જાણો કરીને અપરાધ કણૂલ કરાવતો અને એને માટે સંધ જે સંજ ઠરાવે તે લોગવાવતો.

ઉત્પલબ્ધિશાળાને દિવસે 'પ્રતિમોદ્ધ' સંભળવાને ઘણી આતુર રહેતી અને ઉપોસથશાળાને વાળીજૂડીને સાંજ કરતી તથા દીવો વગેરે લાવીને મૂકૃતી. એ દીવાની જ્યોતિ પાસે એસીને એ ધ્યાન ધરતી. એ પ્રમાણે ધ્યાન ધરીને તેજના વિસ્તૃત સ્વરૂપ-ને પોતાના ઝૂદ્યામાં ઉતારીને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી, સમાધિદશાનો અભ્યાસ કર્યા પછી એણે પ્રજા સંપાદન કરી અને પછી અહીંતપદનો સાક્ષાત્કાર કર્યો. અહીંતપદનું ઇણ પ્રાપ્ત થયા પછી તેને ઝંકિસિદ્ધ મળી ગઈ અને ચમત્કાર કરવામાં એ પારંગત થઈ ગઈ.

એક દિવસ ભગવાન ગૌતમખુદે 'યમ કપાટિ હારિય' નામનો ચમત્કાર કર્યો. એવટો ચમત્કાર, અર્થાતું લિઙ્ગ સ્વભાવવાળી એ વસ્તુએને એકજ સમયે એકડી બતાવવી તેનું નામ 'યમ કપાટિ હારિય' ચમત્કાર છે. જે દિવસે બુદ્ધહેવે એ ચમત્કાર કર્યો તેજ દિવસે બિક્ષુણી ઉત્પલબ્ધિએ પણ સિંહનાદ કર્યો કે, "શુદ્ધદેવ ! આપના પછી હું પણ એક ચમત્કાર કરી બતાવીશ" અને પોતાના એ કથનને સિદ્ધ પણ કરી બતાવ્યું.

ત્યાર પછી એક દિવસ શાસ્ત્ર-બુદ્ધહેવ જેતવનમાં સંધની સામે એસીને બિક્ષુણીઓને એમની ચોણ્યતા પ્રમાણે જુદા જુદા સ્થાનમાં ગોડવવા લાગ્યા. તે સમયે ઉત્પલબ્ધિનો વારો આવતાં બુદ્ધહેવ તેના એ સિંહનાદનો ઉલ્લેખ કરીને તેને માટે ઝંકિ-મતી બિક્ષુણીના એક પદની ચોજના કરી. આ પ્રમાણે ઉત્પલબ્ધિની અનેક જન્મની ધર્છા પરિપૂર્ણ થઈ.

થેરી ગાથામાં એની રચના છે. ઈન્દ્રિયોને વશ થઈ વિષય-

દોહુપ થવાથી મનુષ્ય કેટલી અધોગતિઓ પહોંચે છે, કેવી શોક-જનક સ્થિતિમાં પહુંચે છે, એ જરતાવવાનો. તેની ગાથાનો ઉદેશ છે. ઋદ્ધ અને અલિક્ષા પ્રાસ થયા પછી ડેવો આનંદ અને સુખ મળે છે તે પણ તેણે વણુંયું છે. મારે તેને લલચાવીને ધર્મના માર્ગમાંથી વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એણે મારને ખાંખેરી કાઢ્યો હતો કે, “મેં તૃપ્તિને છાડી દીધી છે. તમનો નાશ કર્યો છે. હે માર ! હું એવી છું. હે પાપી ! મેં તારો પણ નાશ કર્યો છે. તારી ભગ્નાર નથી કે મને પવિત્રતાના ધર્મમાંથી ખર્સેડી શકે.”

ક્ષેમા લિક્ષુણીની બરોભર એની ચોંચતા ઔદ્ધ અંથોમાં માનવામાં આવી છે.

## ૨૨-મુક્તા (મુત્તા)



વસ્તી નગરીમાં એક સુપ્રસિદ્ધ પ્રાણીણુના કુદુંબમાં એનો જન્મ થયો હતો. એ જન્મ-પર્યંત કુમારી રહી હતી અને વીશ વર્ષની ઉંમરે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પિતૃગૃહનો ત્યાગ કરીને શ્રમણી અથવા થેરી બની હતી. સ્વયં મહાપ્રભાપતિ ગૌતમીએ તેને ઉપસંપદા અથવા ધર્મદીક્ષા આપી હતી. મહાપ્રભાપતિ ગૌતમી પાસે તેણે જાંચા પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન મેળણું હતું. વડીલ લિક્ષુણીએ તરફ એ ઘણેણું પૂજન્યભાવ રાખતી અને તેમની સેવાશુદ્ધા કરતી. તેની લક્ષ્ણ અને ધ્યાન ધરવાની પદ્ધતિથી યુદ્ધહેવ ઘણું પ્રસન્ન થયા હતા. યુદ્ધહેવની સહાયતાથી મુક્તા થોડા સમયમાં ‘અર્હત’ પદને પામી હતી. મુક્તા-એ પોતાને સંભોધન કરીને એક ગાથા રચી છે, જેનો ભાવાર્થ એવો છે કે, “હે મુક્તે ! જ્યારે લાગ કર્યા ત્યારે અથવા જ્યારે શુલ્ક ક્ષણું આવી મળે ત્યારે જેવી રીતે રાહુથી ત્રસાયલો ચંદ્ર શુલ્ક થોગ મળતાં પોતાને મુક્ત કરે છે તેવી રીતે તું પોતાને સંસારના બંધનોમાંથી મુક્ત કર. મુક્ત મન વડે ઋણમુક્ત થઈને જીવન ધારણું કર.”



## ૨૩—શૃગાલમાતા



ઓ

હ ધર્મમાં શ્રદ્ધાવાળી અને શ્રદ્ધાનાજ બળ  
વડે મહાન બનેલી કોઈ બિકુણી હોય તો તે  
શૃગાલમાતાજ છે.

એમ કહેવાય છે કે પદ્મોત્તર બુદ્ધના  
સમયમાં હંસાવતી નગરીમાં એ રહેતી હતી  
અને શાસ્ત્રા બુદ્ધદેવના ધાર્મિક વ્યાખ્યાનોથી એના હૃદયમાં  
અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. ત્યાર પછી એક દિવસ વિહારમાં  
ધર્મકથા થઈ રહ્યા પછી બુદ્ધદેવે બિકુણીએના ચોંઘતા પ્રમાણે  
વિભાગ પાડ્યા, ત્યારે એક બિકુણીને શ્રદ્ધાવતી બિકુણીએનામાં  
પ્રથમ સ્થાન મળેલું જોઈને આગલા જન્મમાં પોતાને પણ એવું-  
જ પહેલે મળે એવી એણે મંજુષ્ઠ મંજુષ્ઠ રાખી હતી.

શુલ્ક વાસના જન્મભાંતરમાં પણ કુઝયા વગર રહેતી નથી.  
એ સિદ્ધાંતાનુસાર લગવાન ગૌતમબુદ્ધનો આવિર્ભાવ થયો. તે  
સમયમાં રાજગૃહ નગરમાં એક શ્રેષ્ઠ કુળમાં એણે જન્મ ધારણ  
કર્યો. લગ્ને લાયક વય થતાં કુળ, વિદ્યા અને શુણ્ણામાં એના  
સરખા એક શુલ્ક સાથે એનો વિવાહ કરવામાં આવ્યો. ગૃહિણી  
ધર્મનું તેણે ચોંઘ રીતે પાલન કર્યું. એને એક પુત્ર અવતયો  
તેનું નામ શૃગાલ પાડયું.

શૃગાલને લગવાન બુદ્ધે ગૃહસ્થનાં કર્તાંયકમાં સંબંધી એક  
અત્યાંત હૃદયસપશી અને સુંદર ઉપહેશ આપ્યો છે. પોતાના  
પિતાની આજાનુસાર એ તરુણ શુલ્ક દરરોજ સવારે શહેરની  
ખાંડાર જઈને સ્નાન કરીને પૂણ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઉપર  
અને નીચે એમ છાંચે દિશાઓને લીને કપડે અને લીના કેશ  
સહિત નમસ્કાર કરતો. એક દિવસ એવી અવસ્થામાં બુદ્ધ શુલ્ક  
અને મહિયા અને દિશાનો અરો અર્થ સમજાવ્યો. અને તેને

વંદન કરવું એટલે એ કે એ ખાસ દિશા વડે જે જુદા જુદા સાર પ્રગટ કરવામાં આવ્યા છે, તેના ઉપર આસ્થા રાખવી તથા એ શુભ હેતુઓના રક્ષણું સારું રાતહિવસ પ્રચાસ કરવો અને એને અનુસરીને ગૃહસ્થાશ્રમ ચલાવવો એતું નામજ દિશાઓની પૂજા છે. એ ઉપરદેશની અસર સુવક શૃગાલ ઉપર એટલી અખી થઈ કે, એ ભગવાનનો ઉપાસક બન્યો અને પ્રસિદ્ધ પાંચ્યો. એ પુત્રને લીધે એની માતા શૃગાલમાતા તરીકે પ્રખ્યાત થઈ.

પુત્ર પાંચેથી ભગવાન બુદ્ધ અને એમના સંઘ સંબંધી માહિતી મેળવી તેણે સંઘમાં પ્રવેશ કર્યો. સંઘમાં દાખલ થયા પદ્ધી તેણું શાં શાં સત્કરો કર્યાં તેતું વિવરણું મળતું નથી, પણ એટલું જણ્યાય છે કે સંઘમાં રહીને એણે શ્રદ્ધાનો ગુણું બહુ ખીલવંયો હતો.

એક દિવસ એ વિહારમાં ગઈ હતી. એ સમયે શાસ્ત્રા દશ બળ—બુદ્ધદેવ ધર્મંકથા કરી રહ્યા હતા. એ વખતે શૃગાલમાતા શ્રદ્ધાપૂર્વક એકાશચિત્તે તેમનો ધર્મોપહેશ સાંભળી રહી હતી અને એ કાર્યમાં એ એવી તહ્વીન થઈ ગઈ કે ભગવાનના તેજસ્વી શરીર ઉપર તેતું ધ્યાન લાગ્યો ગયું. ભગવાને જેણું કે એ સાધીની શ્રદ્ધા પૂર્ણતાને પહોંચી ગઈ છે, એટલે એમણે એને એ ધ્યાન બળ વડે અર્હતની પદ્ધતી આપી.

એક દિવસ જેતવનમાં બુદ્ધ ભગવાન બિક્ષુણીઓના તેમની ચોગ્યતા પ્રમાણે વર્ગ પાડવા લાગ્યા, ત્યારે તેમણે શૃગાલમાતાના નિઃસીમ શ્રદ્ધાવાળી બિક્ષુણીઓમાં અચ્યાનક આપ્યું. આ પ્રમાણે પૂર્વજન્મોની અલિલાપા શૃગાલમાતાના આ જીવનમાં સક્રણ થઈ.

## ૨૪-ઉત્તરા



એ તું જીવનચરિત્ર થેરી તિણ્યા (જુઓ પૃષ્ઠ ૬૪)ને મળતું નિઃસીમ હોય છે. એણે પોતાની ગાથામાં લખયું છે કે, “મન, વચન અને કર્મને મેં સાધનાદ્વારા સંયમમાં રાખ્યાં છે અને તૃપ્યાનો સમૂહાગો નાશ કરીને નિર્બાણનું સુખ પ્રાપ્ત કર્યું છે.” એણે અર્હતપ્રદ પ્રાપ્ત કર્યું હતું.



## ૨૫-મંડપદાયિકા



બુદ્ધસેવિકા લગિનીનું નામ જન્મસમયે શું  
હતું તે જાણ્યામાં નથી આવયું. ‘અપદાન’માં  
તેનું નામ મંડપદાયિકા લખવામાં આવ્યું  
છે. દીક્ષા લીધા પછી અથોર્ટ ‘ઉપસાપદા’  
મેળાયા પછી તેનું એ નામ પાડવામાં આવ્યું  
હાય એમ લાગે છે. વૈશાલી નગરીમાં એક  
ધનવાન ઉમરાવના કુદુંબમાં તેનો જન્મ થયો.  
હતો. તેનો ખાંધો ઘણો હૃદધૂષ હતો. તેનો વિવાહ એકનવયુવક  
ઉમરાવ સાથે થઈ ગયો. અને એ ઘણો પ્રેમપૂર્વક પતિની સેવા  
કરવા લાગી. એક દિવસ બુદ્ધ ભગવાન વૈશાલી નગરીમાં પદ્ધાયો  
ત્યારે તેમના મધુર ઉપદેશના શ્રવણુથી બૌદ્ધધર્મ ઉપર તેની શરૂઆત  
એક અને એ બુદ્ધદેવની શિષ્યા બની; પરંતુ એ સમયે તે ગૃહ-  
સ્થાશ્રમધર્મનું યથાવિધિ પાલન કરતી હતી. એક દિવસ મહા-  
પ્રજાપતિ ગોતમીનું ત્યાં આગળ પદ્ધારવું થયું અને તેમણે ત્યાંની  
ઓચ્ચાને ધર્મોપદેશ આપ્યો. એ દિવસે સંસારનો ત્યાગ કરવા-  
ની ઈચ્છા એના મનમાં પ્રબળ થઈ પડી. તેણે પોતાના સ્વામી  
આગળ એ ઈચ્છા પ્રકટ કરી, પરંતુ તેણે પોતાની સંમતિ આપી  
નહિ. એથી એ પતિત્રતા સ્વી પોતાનાં સાંસારિક કર્મો કરતી ગઈ  
અને સાથે સાથે ધર્મના રહસ્યનું પણ એકાશચિત્તે ચિંતન  
કરતી ગઈ. એક દિવસ એવું જન્મયું હે એ સત્તારી રસોડામાં  
રસોઈ કરી રહી હતી, એટલામાં એક મોટા લડકો થયો અને એ  
તાપથી વાસણું એક મોટા કડાકા સાથે કાઢી ગયું. લોજન ખરું  
અળીને રાખ થઈ ગયું. આ નળ્યા ખનાવથી પૃથ્વીમાંની સર્વ  
વસ્તુઓનું કષણું ગુરપણું તેના સમજવામાં આવ્યું. એ દિવસ-  
થી એના ચિત્તમાં ખરો વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે સુંદર વખા-  
ભૂષણ અને રત્નાલંકારો પહેરવાનું છોડી દીધું. તેના પતિએ એમ  
૬૨

કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે વિનયપૂર્વક જણાઓયું કે, “સ્વામીનાથ ! સંસાર ઉપરથી મારી આસક્તિ જાઈ ગઈ છે. હવે વિષયવાસના અને સુખવૈલબમાં મારું ચિત્ત જરા પણ ચોટનું નથી.” તેનો પતિ પણ સંસ્કારી યુલુષ હતો. પતનીની અભિલાષા-ને અનુસરીને એ તેને મહાપ્રભાપતિ ગૌતમીની પાસે લઈ ગયો અને નાગતાપૂર્વક નમસ્કાર કરીને કહ્યું: “આ મારી ધર્મપત્ની છે. સંસાર ઉપર અરુચિ ઉત્પજ્ઞ થવાથી એને લિક્ષ્ણા થવાનું મન થયું છે. આપ એને દીક્ષા આપો.”

त्यार पछी ते धनवैबुवमां उछरेली मंडपदायिकाचे यथाविधि बोद्धधर्मांनी दीक्षा लीधी अने रातहिवस शुरुनी आजा सुजभ धर्मानुसारे सेवन अने पालन करवानु आरंभयु. आखदे ये ‘अहंत’ पह पाभीने मनुष्यहेह सार्थक करी गध.

‘શેરી ગાથા’ માં આ સાધવીની એકશ્લોકી રચનાને પ્રથમ સ્થાન મળ્યું છે. એ શ્લોકમાં સાધવી પોતાને સંભોધીને કહે છે કે, “હે શેરીકે ! (જાનવૃદ્ધ બિકુણી) ચોળા (પગ સુધી પહોંચે એવું સાધુઓને પહેરવાનું વસ્તુ) દ્વારા આપા શરીરને ટાંકીને સુધે સૂઈ રહે-અર્થાત વાસનાશન્ય થઈને શાંત ભાવ ધારણું કર; કુમકે ડોધ ઘડામાં જળ ન હોય અને એને ચૂલા ઉપર મૂક્યો હોય તો એમાંથી ખળખળ અવાજ થતો નથી, તેવી રીતે તારી વાસનાઓનો વિકાર પણ શરીર ગયો છે.”

## २६—अन्सतरा तिष्या

ઓ દ્વારા નામાંકિત થયેલી આ એક ખીજ સાથે રમણી હતી. બેરી થયા પછી તે ઉપસમા પાણ્યા સુધીના એના અવન સંખ્યાથી વિશેષ હક્કાંકત મળી આવતી નથી. એણે રચેલી ગાથાને ભાવાર્થ નીચે સુઝાય છે.

“હુ તિથ્યા ! ધર્મયુક્ત થા. ધર્મના કાર્યમાં ચોતાને લગાડ. શુભ ક્ષણને તું ચાલી જવા હેતી નહિ; કારણુંકે જે લોકોએ શુભ ક્ષણને નકારી શુમારી હીધી છે—દૈનિક જવા હીધી છે તે લોકો તેને સંબારીને શોક કર્યો કરે છે અને નરકમાં પડે છે.”

## ૨૭-તિષ્યા (તિસ્સા)



નો જન્મ કપિલવસ્તુમાં શાકચ વંશમાં થયો હતો. રાજકુદુંખની મહિલાઓની એ અહેનપણી હતી. એમની સાથે સુખવૈલબમાં એનો સમય વ્યતીત થયો હતો. મહાપ્રાણપતિ ગોતમીએ જ્યારે સંસારત્યાળું ને બિકુણીવત લીધું ત્યારે તિષ્યા પણ એમની સાથે બિકુણી બની. પ્રણ નક્ષત્ર ચુક્તા તિષ્યા અથવા પુષ્ય નક્ષત્ર ઉપરથી એનું નામ પડયું છે. સંસારત્યાગ કર્યા પણી એણે તત્ત્વવિચિત્વનમાંજ જીવન વ્યતીત કર્યું હતું અને અંતમુખી વૃત્તિ રાખી હતી. ભગવાન બુદ્ધને એને દર્શન આપને ને ખોધ આપ્યો હતો. તે એણે પોતાની ગાથામાં ગૂઢ્યો છે.

“ હે તિસ્સે ! શિક્ષણદારા તું પોતાને શિક્ષિત બનાવ. તું ચોગને અર્થીત શુલ ક્ષણને ફેંગટ જવા ફરિશ નહિ. સર્વ ચોગમાંથી અર્થીત બધનમાં છીટી થઈને આ લોકમાં અથવા પૃથ્વીમાં અનાસવા એટલે કે પાપશૂન્ય થઈને વિચરણ કર. ”

## ૨૮-સંધા

એ ની કથા થેરી ધીરાને મળતી છે અર્થીત બુદ્ધહેવના ઉપસ્થિતિ દેશથી તેને જ્ઞાન અને વૈરાગ્ય બિપન્ન્યાં હતાં અને ધર્મનું ચિંત્વન કરતાં આપદે અર્હતપદ પ્રાપ્ત કર્યું હતું. એણે રચેલી ગાથામાં એ પોતાના ત્યાગનું વર્ણિન નીચેના શાખામાં કરે છે:—

“ તન્યું છે ગૃહ, પુત્ર પશુ આહિ સંપદ,  
તન્યાં છે વળી રાગદેષ, અવિદ્યા વિપદ;  
કથો છે સમૂળો નાશ જીવનની સમસ્ત તૃપ્તિઓનો,  
મળવી છે શાંતિ આજે નિર્વાણુમાં. ”



## ૨૯-ધર્મદિના



ગલા ચરિત્રમાં રાજ બિંબિસારનો કંધ પરિ-  
ચય અમે આપી ગયા છીએ. એ રાજને એક  
પરમ ઈષ મિત્ર હતો. તેનું નામ વિશાખ હતું.  
વિશાખ બુદ્ધહેવનો પરમ લક્ષ્ણ હતો અને એ  
ધર્મના માર્ગમાં એણે સારી ઉજ્જ્વલિ કરી હતી.  
ધર્મદિના એ પરમ શ્રદ્ધાવાન ઉપાસકની સહધર્મચારિણી હતી.  
સહભાગે તેનો પતિ જેવો શ્રદ્ધાળુ અને લક્ષ્ણ હતો તેવોજ પ્રેમી  
પણ હતો. ધર્મદિના પણ પરમ સુંદરી, વિહૃપી અને સહાચારી  
હોવાથી એ પ્રેમને પાત્રજ હતી. પતિપત્ની એકથીન પ્રત્યેના  
અપૂર્વ પ્રેમની સાંકળથી બંધાયલાં હતાં. રાતહિવસ પતિને પ્રસન્ન  
રાખવો, એને ગ્રિય હોય એવાં કાર્ય કરવાં, મધુરી વાતો કરીને  
એના કાનને તૃસ કરવા એજ તેના જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો.  
હન્દુ સુધી ધર્મદિનાને બુદ્ધપ્રત્યે લક્ષ્ણ ઉત્પજ્ઞ થઈ નહોઠી. વિશાખ  
પણ પત્નીની સ્વતંત્રતામાં આડે આવે એવો પતિ નહોઠો. એણે  
પરાણે બુદ્ધહેવનો ધર્મ પાળવવાની પત્નીને આજા ન આપી. એને  
આતરી હતી કે ધર્મદિના મારી આપેલી સ્વતંત્રતાનો હુલુપ્યોગ  
કરે એવી નથી. એને પોતાને બુદ્ધહેવની શક્તિનું લાન થશે એરથે  
એ એમનાં દર્શન કરવાની ઈચ્છા કરશે. વિશાખના મન ઉપર  
ધીમે ધીમે બુદ્ધહેવના ઉપહેશની વધારે ને વધારે અસર થવા  
માંડી. એ એમનો શિષ્ય બન્યો. એને આધ્યાત્મિક માર્ગમાં એક  
એક પગથિયું આગળ ચડતો ગયો. જેમ જેમ ધર્મની પ્રાસિ થતી  
ગઈ તેમ તેમ સંસારની આસક્તિ એછી થતી ગઈ; છતાં પણ  
પોતાની સ્નેહાળ પત્નીને એછું ન આવે તેને માટે એ બનતો  
પ્રયત્ન કરતો. ધર્મ સાધતાં સાધતાં એ તીવે પગથિયે, અર્થોત,  
અનાગામિ ક્રણ ઉપર પહોંચવા આવ્યો. એ કિથિતિએ પહોંચનાર-  
ને જન્મમરણનું ફુખ ટળી જાય છે.

એ સ્થિતિમાં વિશાળ એક દિવસ ઝુદ્ધદેવની ભધુર વાણી સાંભળીને ઘેર આવ્યો. પ્રેમમૂર્તિ ધર્મહિન્ના પતિના આવવાની વાટ જેતી દાદરમાં સામી મળી, પણ આજે વિશાળે તેને પ્રેમ-પૂર્વક બોલાવી નહિ. દરરોજના નિયમનો આજ લંગ થતાં તેણું કેમળ સ્વરે પતિને પૂછ્યું: “વહાલા! આજે તમે મારી સાથે વાતચીત કેમ ન કરી? આજ મને આદિગન કેમ ન આપ્યું? શું આજ મારાથી કાંઈ અપરાધ થયો છે?”

વિશાળે ઉત્તર આપ્યો: “હેઠિ! તારો કાંઈ અપરાધ થયો નથી; પરંતુ આજથી હું કીને રૂપર્શ કરવાને તથા સ્વાહિષ લોજન કરવાને યોગ્ય રહ્યો નથી. જે નવા આશ્રમમાં મેં પ્રવેશ કર્યો છે, તેમાં એ બધા લોગવિલાસનો નિષેધ છે. તને યોગ્ય લાગે તે પ્રમાણે કર. આ ધરમાં રહેલું હોય તો એ તારું છે, ઝુશ્શીથી રહે. પિતાને ઘેર જવાની ઈચ્છા હોય તો મારી ના નથી. જેટલું દ્રવ્ય તથા દાળના લઈ જવા હોય તેટલા લઈ જા.” ધર્મહિન્નાની સહન-શીતલતાની હડ આવી રહી. જે પતિની કિંદળાપર્યંત સેવા કરી રહી હતી, જેના પ્રેમમાં એ ગાંડીઘેલી બાનીને આ લોક અને પરવોાકને પણ વીસરી ગઈ હતી તે આજે આવા શાળ્હો કાડે! તેણે વિનય-પૂર્વક કહ્યું: “વહાલા! મારાથી એ એમાંથી એક પણ માર્ગ અહણું થવાને નથી. મને ધન, રત્ન તથા વૈભવનો મોદ નથી. આપની પાછળ એ બધું હતું. આપ મારો ત્યાગ કરીને સાથું બનવા તૈયાર થયા છો, તો હું પિચેરમાં જઈને વૈભવ લોગવું એ અસંભવિત છે. આપ મને પણ પરવાનગી આપો. હું પણ સંસારનો ત્યાગ કરીને ઝુદ્ધદેવનું શરણ લઈશ અને ધર્મમાર્ગની પ્રવાસી બનીશ.”

વિશાળે કહ્યું: “તારી ઈચ્છા વ્યાજથી છે. હું પ્રસ્તુત ચિંતે તને લિક્ષ્ણાણી ધનવાની રજા આપું છું.” એ પ્રમાણે કહીને સુવર્ણના મ્યાનામાં બેસાડીને તેણે ધર્મહિન્નાને લિક્ષ્ણાણોના મફાનું ચોકલી. ત્યાં આગળ તેણે દીક્ષા લીધી. ત્યાં રહ્યા છતાં પણ એને પતિપ્રેમ અને પતિસુખમાં ગાળેલા આનંદમય દિવસોનું સ્મરણ થઈ આવતું. એ સ્મરણો પોતાના નવા આશ્રમને નહિ છાને અને આકયાતિમક ઉજ્જતિની આડે આવશે એમ ધારી એણે પોતાની ઉપહેશિકા તથા ઐલુ થેરીઓને કહ્યું: “બહેનો! આવી લીડવાળી જગ્યામાં રહેવાથી મારા આત્માને શાંતિ મળતી નથી. મને એકાંત-વાસ ધણો ગ્રિય છે; માટે આપ રજા આપો તો હું કોઈ નાના

સરખા ગામડામાં જઈ વસું.”

લિઙ્ગુણીએ તેને એકાંત સ્થળમાં મોકલી આપી. એ શાંત, એકાંત અને રમણીય સ્થળમાં ધર્મહિન્નાને ધણેં આનંદ આવ્યો. હ્યાન ધરવાને માટે એવાંજ સ્થળો અનુકૂળ હોય છે. ત્યાં આગળ એણે ઈદ્રિયોની વૃત્તિનું દમન કરવાનો અસ્યાસ કર્યો. હ્યાન ધરતાં ધરતાં એ થોડા સમયમાંજ ‘અહોત’ પદ્ને પામી. જન્મમરણુના ચકમાંથી એ બચી ગઈ. ત્યાર પછી એણે વિચાર કર્યો કે, “મારે અહીંયાં એકાંત સ્થળમાં જીવન ગાળવું વૃથા છે. હવે હું કોઈ મોટા નગરમાં જાઉં તો પણ માર્દ ચિત્ત ચેણે એમ નથી તથા મારા સત્કાર્યમાં વિદ્ધન આવી શકે એમ નથી; બદલે રાજગૃહમાં ગયાથી હું બુદ્ધહેવના ચરણુની સેવા કરી શકીશ અને મારાં સંગાંસંખ્યીએ તથા અજ્ઞાનપાશમાં પડેલી મારી લગિની-એને ઉપરેશદ્ધારા લાલ પહોંચાડીશ.” એવા શુલ ઉંદશથી એ રાજગૃહ નગરમાં ગઈ. ત્યાં ગયા પછી તેના પતિ વિશાખને ખખર પડી કે ધર્મહિન્ના પાછી આવી છે. એના મનમાં શાંકા થઈ કે, “જન્મથીજ સુખ અને વૈલખમાં ઉછરેલી હોવાથી એનાથી લિઙ્ગુણીનું સાધન નિયમો નહિ પળાયા હોય અને એ કંટાળીને અહીં મારી પાસે આવી હશે.” એ એને મળવા સાર્દ ગયો. અને એકાંતવાસમાંથી પાછા ઝરણનું કારણું પૂછ્યું. તેના ઉત્તરમાં જ્યારે ધર્મહિન્નાએ પોતાનો હેતુ સમજાવ્યો. ત્યારે એ ધણેં પ્રસંગ થયો. પછી એણે પત્નીના ધર્મજ્ઞાનની પરીક્ષા લેવા સાર્દ તત્ત્વજ્ઞાન સંખ્યીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. જેટલી સહેલાધીથી કોઈ કમળના ઢાંડાને હરી વડે કાંગી નાખે તેટલીજ સહેલાધીથી ધર્મહિન્નાએ પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર ધણીસરણતાથી અને જલહીથી આપ્યો; ધર્મના પાંચ થાંબલા (રૂપ, વેદના, સંસા, સંસ્કાર અને વિજ્ઞાન) હોય છે તે સમજાવ્યું. ધર્મના વણ માર્ગ સંખ્યી પ્રશ્નના ઉત્તર આપ્યા અને પછી આગળ પોતાના અધિકાર ઉપરાત વિશાખ પ્રશ્ન કરવા ગયો, ત્યારે ધર્મમાર્ગમાં આગળ વધેલી ધર્મહિન્નાએ સમજાવ્યું કે, “આચુધ્યમનું વિશાખ ! આપની જાનેદ્રિયથી અગોચર એવા પ્રશ્નોના ઉત્તર તમને આપવાની મારામાં શક્તિ નથી. હાખલા તરીકે નિર્વાણ, અદ્વાર્યનાં કર્ત્વંય, નિર્વાણ પછી શું થાય છે ? નિર્વાણમાં અંતે સુખ શું મળે છે ? વગેરે પ્રશ્નોના બુલાસા કરવા એ અધર્દ છે. તમે લગવાન બુદ્ધહેવની પાસે જઈ-

ને એ પ્રક્રિયા કરો અને એ જે ઉત્તર આપે તે ચિત્તમાં ઠસાવો.”

વિશાળે સધળો વૃત્તાંત ભુદ્ધહેવની આગળ કહી સંભળાવ્યો. એ વૃત્તાંત સંભળીને ભુદ્ધહેવ ઘણું પ્રસંગ થયા અને કહેવા લાગ્યા કે, “મારી એ છાકરીના મનમાં ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળના થાંભલાઓની તૃપ્તિ નથી.” એમ કહીને તેમણે ધર્મની એક ગાથા સંભળાવી: “જેને લવિષ્ય, ભૂત કે વર્તમાન કોઈ પણ કાળના બંધનો સાથે સંબંધ નથી, તેનેજ અકિંચન કહે છે. જે કોઈ એવા અર્થમાં અકિંચન અને નિરાસકત હોય છે, તેનેજ હું પ્રાણણું કહું છું.” ભુદ્ધહેવ ધર્મહિત્નાના જ્ઞાનની ઘણી પ્રશંસા કરીને કહ્યું: “વિશાળ! ઉપાસિકા, બિક્ષુણી ધર્મહિત્ના ઘણી મોટી પડિતા અને મહા પ્રજ્ઞાવતી છે. તું મારી પાસે પૂછવા આવ્યો હોત તો હું પણ તને ધર્મહિત્નાએ આપ્યા છે, એજ ઉત્તર આપત. તેણે જે અર્થ કહ્યો છે તે ખરો છે. તેનેજ તું ધ્યાનમાં રાણજો.”

ત્યાર પછી એક હિવસે કેતેવનમાં શાસ્ત્રા (ભુદ્ધહેવ) બિરાજયા હતા. બિક્ષુણીસંધ ત્યાં એકડો થયો હતો. બિક્ષુણીએને તેમની ચોચ્યતા પ્રમાણે જુદા જુદા વર્ગમાં ભુદ્ધહેવ જોડવી રહ્યા હતા. ઐદ્ધધર્મના નવે અંગમાં ધર્મહિત્ના પ્રવીણુ હતી. જીવાત્મા છે કે નહિ, જીવાત્માને કેવી રીતે ઓગળાય, આયોના ધર્મનાં આડ અંગ કયાં? સંસ્કાર એટલે શું? વગેરે અધરા પ્રશ્નાનો તેણે ખુલાસો કર્યો હતો, તથી ભુદ્ધહેવે બિક્ષુણીસંધમાં તેને સુણ્ય સ્થાન આપ્યું. ધર્મની કથા કરવા માટે તે પ્રસિદ્ધ થઈ હતી. પોતાના સુન્દર વ્યાળયાન વડે એ અનેક શ્રોતાઓના ચિત્તનું ધર્મની તરફ આકર્પણું કરતી. એણે પોતાની કેટલીએ બહેનોને ધર્મકથા કહેવામાં પ્રવીણુ કરી હીધી હતી. શુક્લા, બટકેશી વગેરે તેની શિષ્યાઓ હતી.

જનસમાજને શિક્ષણ આપવાનું અને ધર્મમાર્ગમાં લાવવાનું કાર્ય ધર્મહિત્નાએ ઘણી ઉત્તમ રીતે સંપાદન કર્યું હતું.

એની રચેલી એક ગાથાનો સારાંશ એવો છે કે, “સરોન્ય શાંતિની તૃપ્તિ જ્યારે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ચિત્તમાં લાસના રહેતી નથી અને જીવ ઉચ્ચ માર્ગ જોડવા માંડે છે.”



## ૩૦-મुक्ता (મुत्ता) बीजी

એ કૌશલ હેશના ચોધાઈક નામના હરિદ્ર પ્રાણશુણી કન્યા હતી. વય પ્રાપ્ત થયા પછી એક કૂળડા પ્રાણશુણ સાથે તેનું લગ્ન થયું. સ્વાભાવિક રીતે એમનો સંસાર સુખી નીવજ્યો નહિ. કૂળડો સ્વામી સુકૃતાને માર પણ મારતો. આખરે સંસારથી કંટાળી સ્વામીની રણ લઈને સુકૃતાએ પ્રત્રન્યા લીધી હતી. એણે જે ગાથા રચી છે તેમાં સ્વામીનો પરિત્યાગ કરીને સુખી થયાની કથા છે. એ લખે છે કે, “ સુકૃતા ખરેખર સુકૃત થઈ છે. ત્રણ પ્રકારના કુળજી-પણુથી એ સુકૃત થઈ છે. જાખળીમાં ડાંગેર ખાંડતી વખતે વાંકાં વળતું પડતું, એ જાખળી વાંકી હતી. મારે પોતાને વાંકાં વળતું પડતું અને પતિ તો કૂળડા હતાજ. એ પ્રમાણે ખાંયણી, સુશાળ અને પતિથી છૂટી થઈને વાસના ઉપર જય મેળવીને હું જન્મ-મરણુથી સુકૃત થાડાં છું.”

સંસારમાં જરામરણના માર્ગ પણ સહજ નથી પરંતુ વાંકાં છુંકા છે. આત્મજાનકારી એ માર્ગમાંથી પસાર થઈને સુકૃતા અર્હત્પદને પામી.

## ૩૧-થેરી વિશાખા

એ તું જીવન થેરી ધીરાને ભળતું છે. અર્હત્પદ એણે પણ પ્રાપ્ત કર્યું હતું. એણે પોતાની ગાથામાં કલ્યાણ છે કે, “ યુદ્ધહેવની આજા પ્રમાણે ચાલને. એમના આહેશ પ્રમાણે ચાલયાથી તમારે કઢી પસ્તાવું નહિ પણ. માટે જલહીથી પગ ધાઈને નીચે ફૂર એકલાં બેસોા.”

એણે પોતાના ઉપહેશ અને ઉદાહરણુથી બીજી પણ સ્વીએને બૌદ્ધધર્મની અનુગામી બનાવી હતી.



## ૩૨-સુમના-કૌશલકુમારી



જુલગવાનના સમયમાં આવસ્તી નગરીમાં એ જન્મી હતી અને કૌશલહેશના રાજાની ભણિની થતી હતી. પ્રસેનજિત રાજાને બુદ્ધહેવે એક વખત અમૂહ્ય ઉપહેશ આપ્યો હતો. એ ઉપહેશનો આરંભ એવી રીતે થતો હતો કે, “આ સંસારમાં ચાર પ્રાણી એવાં છે કે જેની ઉપેક્ષા કરવી ન જેઠાં. રાજા, સર્પ, અભિ અને લિક્ષુ એ ચાર મહત્વના પદાર્થ છે કે, જે ભલાઈ પણ ધાર્યી કરી શકે છે અને હાનિ પણ અત્યંત પહોંચાડી શકે છે.” એ ઉપહેશ સાંલળીને સુમનાના મનમાં વૈરાગ્યના અંદુર કૂટ્યા હતા. પરંતુ એ વખતે એવી દાહી જીવતી હતી. અનેનો એકબીજા પ્રત્યે અપૂર્વ સ્નેહ હતો. દાહીની સેવા કરવાના હેતુથી તેણે એ સમયે સંસારનો ત્યાગ કર્યો નહિ. દાહીના મૃત્યુ પછી સુમના પોતાના ભાઈ કૌશલહ્યાધિપતિને લઈને બુદ્ધ ભગવાનના વિહારમાં ગઈ અને કિંમતી શેતરંજુઓ તથા શાલહુશાલા વગેરે સાધુઓને લેટ ધર્યા. ત્યાં આગળ તેણે ઝરીથી બુદ્ધહેવનો ઉપહેશ સાંલળ્યો અને સંસારનો ત્યાગ કરીને શેરી જની તથા તત્ત્વજ્ઞાનનું ચિંતન કરતાં નિર્વાણપદને પામી.

## ૩૩-સુમના (પહેલી)



તિના પીડનથી અને સંતાનોના કલેશથી સંસાર ઉપરથી તેનું ચિત્ત જાહી ગયું હતું અને શેરી જની હતી. એનું જીવન શેરી તિષ્યાને મળતું આવે છે. એણે પોતાની શેરીમાં લખ્યું છે કે, “આ હુઃઅમય જીવનમાં જાહીને જેઠાં કોણ ઝરીથી જન્મ લેવાની ધંઢા રાખે? માટે જન્માતરની તૃપ્તિ ત્યા દઈને તું શાંત ચિત્ત વિચર,”



## ૩૪-ધર્મા

આવસ્તી નગરીમાં એક પ્રતિષ્ઠિત કુદુંખમાં જન્મી હતી. તેનું લમ પણ યોગ્ય પતિ સાથે થયું હતું. બોદ્ધધર્મના સિદ્ધાંતોએ તેના કુમળા મગજ ઉપર ધાણી સારી અસર કરી હતી અને તેથી તેણે સંસારનો ત્યાગ કરવાનો વિચાર ચુવાવસ્થામાંજ કર્યો હતો, પણ તેના સ્નેહાળ પતિએ બેરી થવાની અનુમતિ આપી નહિ, એટલે તેની હ્યાતીમાં ધર્મા પરિવાજિકા બની શકી નહિ; પરંતુ વિધવા થયા પછી તે પરિ-પ્રાજિકા બની હતી. એક હિવસલિક્ષા માળી આવ્યા પછી એ વિહારમાં પાછી ફરતી હતી એવામાં શરીરનું સમતોલપણું નહિ સચ્ચાયાથી રસ્તામાં પડી ગઈ. એ બનાવથી તેની અંતરદૃષ્ટિ બિઘડી; તેણે તત્ત્વજ્ઞાનનો ભાંડો અભ્યાસ કર્યો અને સાધનાક્ષારા અર્હત-પદને પામી. એણે રચેતી ગાથામાં એ કથાનો ઉલ્લેખ છે. એ લાંબે છે કે, “લિક્ષા માગવા સારુ હાથમાં હંડ લઈને, હુર્ઝણ પગે હું રસ્તામાં ચાલતી હતી, તેવામાં હું ભૂમિ ઉપર હળી પડી. આ નાશવંત દેહને કેટલું બધું હુઃઅ લોગવવું પડે છે તે એકદમ્ મારી અંતરદૃષ્ટિને દેખાઈ આવ્યું અને હેહતું દમન કરીને મારો આત્મા મુક્તા થયો.”

## ૩૫-મેત્તિકા

તું બીજું નામ સુમેખલા હતું. સુમેખલાતું નામ અપ્સરાની દાન અંથમાં પણ મળી આવે છે. રાજગૃહ નગરમાં એક પ્રસિદ્ધ પ્રાણીણું કુદુંખમાં તેનો જન્મ થયો હતો. વૃદ્ધ વયમાં તેણે ગાથાની રચના કરી છે. તેની ગાથા ચિત્રાની ગાથાને તદ્દન મળતી આવે છે. કુદુંખ થાડાક શાણ્ણોનાજ ફરક છે.



## ૩૬—અમિસ્રપ નંદા



જુલગવાનના સમયમાં કપિલવસ્તુ નગરીમાં, શાકચવંશી શૈમકણની માનીતી પત્નીના ગર્ભ-માં તેનો જન્મ થયો. હતો. તેના અસાધારણ લાવણ્ય અને સૌહર્યને લીધે તે અલિસ્રપ નંદા નામથી પ્રસિદ્ધ થઈ હતી. શાકચ વંશના એક કુમાર ચારબૂત સાથે તેનું લમ થયું હતું, પણ દેવયોગથી લમને હિવસેજ તેના પતિનું ભર્ત્યું થયું અને નંદા વૈધવ્યને પ્રાપ્ત થઈ. વિધવા થચા પછી તેનાં માતપિતાએ તેની છંચા વિરુદ્ધ તેને સંસારનો ત્યાગ કરવાની ઝેરજ પાડી; પરંતુ પરિ-પ્રાણિકા ઘન્યા છતાં પણ નંદાનું સૌહર્ય માટેનું અલિમાન નાશ પામ્યું નહોંતું. એને રાતદિવસ બીજી રહેતી ડેઝુદ્ધ લગવાન જે પોતાનું આ અલિમાન જાણ્યી જશે તો અવશ્ય ઠપકો આપશો. એ ઠપકાના લયથી એ કરી યુદ્ધ લગવાનની સમીપમાં જતી નહિ. યુદ્ધ લગવાનને હિવ્ય જ્ઞાનકારા તેના અંતરની વાતની ખળર પડી ગઈ. તેથી તેમણે એક હિવસે બધી લિક્ષુણીએને ઉપહેશ લેવા સારુ બોલાવવાનો મહાપ્રાણપતિને આદેશ કર્યો; પરંતુ નંદા શરમ-ને લીધે યુદ્ધહેવની આગળ ઉપસ્થિત થઈ નહિ. તેણે પોતાના પ્રતિનિધિ તરીકે એક બીજી સીને મોકલી. પરંતુ યુદ્ધ લગવાને જાણ્યાંયું કે, “આજે પ્રત્યેક લિક્ષુણીએ જાતેજ આવયું પડશો.” એ આજા સંભળીને નંદાને આવવાની ઝેરજ પડી. યુદ્ધ લગવાને એના દેખતાં એક અત્યાંત સુંદર રમણીને વૃદ્ધ બનાવી હીધી. એ ચમતકાર જોઈને નંદાને પોતાના ઝ્રય ઉપર જે અલિમાન હતું તે એકદમ નષ્ટ થઈ ગયું. તેને અત્યાંત પશ્ચાત્તાપ થયો. યુદ્ધ લગવાને એને એ સમયે અમૃત્ય ઉપહેશ આપશો. એ ઉપહેશને પ્રતાપે તેને અંતરીન પ્રાપ્ત થયું અને તે અર્હતપ્રદને પામી ગઈ. નંદાએ પોતાનું ચરિત ગાથામાં વર્ણાયું છે.



## ૩૭-સુમુત્તિકા (સુમંગળી માતા)

એ ખીનું અરં નામ સુમુત્તિકા હતું; પરંતુ થેરી ગાથાના ટીકાકારોએ તેનો ઉલ્લેખ સુમંગળની માતા તરીકેજ કર્યો છે, તેથી એમે પણ તેને એજ નામથી ઓળખાવી છે. શ્રાવસ્તી નગરીમાં એક દરિદ્ર કુદુંખમાં એનો જન્મ થયો હતો. એને એક નળકાર સાથે તેનું લમ થયું હતું. એનો પુત્ર સુમંગળ ધણેણ જાની અને સંસારત્યાળી સુપ્રસિદ્ધ સાધુ-થેરબન્ધો હતો. એનો સ્વામી એની સાથે ધણી નિર્હૃતાથી વર્તતો હતો. એ લખે છે કે, “મારા સ્વામી ચોતે બનાવેલી છનીના કેવી મને નળું ગણે છે. કામ પડે તો મને વેચતાં સુધ્યાં અચકાય નહિ. થેરી થયાથી હું એ બધા રોગ, હોષથી અચી છું અને સ્વતંત્રપણે વિચરણ કરું છું તથા વૃક્ષની છાયા તળે એસીને ધ્યાનમનું થઈ જાઓ છું.”

## ૩૮-જયંતી (જેન્તી)



શાલી નગરમાં લિંઘથીના રાજકુદુંખમાં એનો જન્મ થયો હતો. બુદ્ધ લગવાનનો ઉપહેશ સાંલ-ગીને તેણે અર્હતપદ પ્રાપ્ત કર્યું હતું. ચોતે રચેલી ગાથામાં એ જણુાવે છે કે, “જે જે સાધનોદ્વારા, ને જે માર્ગથી મનુષ્ય પરમ નિર્વીણુને પ્રાપ્ત કરે છે, તે તે બધાં સાધનોં અને માર્ગોં મેં બુદ્ધ લગવાનના આદેશથી પ્રાપ્ત કર્યા છે. એ ઉપહેશથી હું લુવનની અસારતા સમજુ શકી છું. આજ જન્મમરણુનો ધ્વંસ થયો છે; હવે મારો પુનર્જન્મ થશે નહિ.”

મનની એકાશતા, જિજાસા, ઉધોગ, આનંદ, પ્રશાંતતા, સમાધિઅને અટળતા એ સાત ચુણુની સમાણિ જયંતીએ પ્રાપ્ત કરી હતી એમ એણે રચેલી ગાથા ઉપરથી સમજુ શકાય છે.



## ૩૯—અર્ધકાશી

કાશી


ના પૂર્વજનમની કથા એવી છે કે, કશ્યપખુદ્ધના સમય-  
માં એક સુપ્રતિષ્ઠિત કુલીન કુદુભમાં તેને જન્મ થયો  
હતો અને ધર્મનું જાન થયા પછી વૈરાગ્ય પ્રાપ્ત થવાથી બિક્ષુણી  
બની હતી; પરંતુ એક વાતે પોતાનાથી એક વડિલ બિક્ષુણીને  
વેશ્યા કહીને ગળ હીધી તેથી તેની અધોગતિ થઈ અને ગૌતમ-  
ખુદ્ધના સમયમાં તેને કાશી નગરીના એક ધનવાન અને સમૃદ્ધિ-  
વાન ગૃહસ્થને ઘેર જન્મ લેવો પડ્યો; અને આગલા જન્મના  
દ્વારાને લીધે ત્યાં તેને પોતાને વેશ્યા થયું પડ્યું. વેશ્યાના ધંધામાં  
તેણું એટલું બધું ધન પેઢા કર્યું કે અદ્ધી કાશી નગરી ઉપર  
તેની માલિકી હતી અને તેને લીધેજ તે અર્ધકાશી નામથી એળ-  
ખાઈ છે. પાછળથી પોતાના પાપી લુવન માટે પદ્ધતાપ થતાં,  
તેણું આવસ્તી નગરીમાં ભગવાનને પોતાનો સંહેશો કલાવ્યો. અને  
તેમના સાંનિધ્યમાં જવાની રણ માગી. ખુદ્ધ ભગવાને તેને પાતાની  
પાસે મોલાવીને ધર્મનો ઉપરોક્ત આપ્યો, જેથી તેને અંતર્જાત પ્રાપ્ત  
થયું. ધર્મશાસ્ત્રનું પૂર્ણ રહસ્ય જાણ્યા પછી તે અર્હતપ્રફને પામી  
ગઈ. એણું પોતે રચેલી ગાથામાં વર્ણિત્યું છે કે—

“ આપા કાશીની વિદ્યારી કેટલી મારી હી હતી. કાશીવાસી  
લોકો એટલું ધન તો મારા પગ આગળ અર્ધદ્વિતીય ધરતા, પરંતુ  
એ રૂપ વેચવાનો મારો ધંધે ચાલ્યો. ગયો છે. મને હવે તેના  
ઉપર તિરસ્કાર જીપણ્યો. છે. હવે મેં જન્મમુત્યના દેરાને ટાણ્યો  
છે; હવે મને કાંઈ પણ ડર નથી. હું ખુદ્ધહેવના શાસનને માનું છું  
અને મેં ત્રણ વિદ્યા પ્રાપ્ત કરી છે.”

ભુક્તિને માટે કે જ્ઞાન આવશ્યક છે તેને બૌદ્ધધર્મમાં ત્રિવિદ્યા  
કહે છે. પાપનું મૂળ, કેવા ઉપાયથી પાપ ફૂર થાય અને કેવી રીતે  
સાધનાથી નિર્ણય પ્રાપ્ત થાય એ ત્રણ વાતનું જાન પ્રાપ્ત કરલું તેને  
ત્રિવિદ્યા કહે છે.



४०-चित्रा



જગુહ શહેરમાં એક કુલીન ગૃહસ્થને વૈર  
એનો જન્મ થયો હતો. જ્યારે તે પુણ્ય વય-  
ની થઈ ત્યારે તેણે એક દિવસ રાજગૃહના  
દરવાળ આગળ બુદ્ધદેવને ઉપદેશ આપતાં  
નેયા. તેમના મધુર ઉપદેશની ચિત્રાના ચિત્ર  
ઉપર ધાણી અસર થઈ, તેથી તેણે મહાપ્રભ  
પતિ ગૌતમી પાસે હીક્ષા લીધી. ધણાં વર્ષો સુધી ધ્યાનમનું  
રહેવાથી એ અર્હતપ્રદને પામી હતી. તેણે પોતાની ગાથામાં  
લગ્નયું છે—

“હું ઘણી હુર્ણાળ, જ્વાનિયુક્ત અને કૃશ હોવા છતાં પણ હાથમાં લાડળી પડીને પર્વત ઉપર ચંદું છું. મારા ખલા ઉપર બિક્ષાની જોળી લટકી રહી છે. હું અડકેની સામે થઈને જીવનને ટકાવી રહી છું અને હ્યાનમજ થઈને એંધકારને હુર ઠંડાલું છું.”

## ४१—पूर्णा ( पुण्णा )

०५५०

શ્રાવણી નગરીના એક વધુિકની કન્યા હતી. મોટી  
વધુિકની થયા પછી એણે મહાપ્રાજનપતિ ગૌતમીને મોંઅ  
ધર્મકથા સાંભળીને જાન મેળાયું હતું અને પાછળથી દીક્ષા લઈને  
શ્રી બની હતી. ખુદહેવે ગંધકૃતીમાંથી તેને ધર્મનું દિવ્યજ્ઞાન  
સમજાયું હતું. તેણે એક ગાથા ગાઈ છે કે, “હે પૂર્ણ ! પૂર્ણિમા-  
ને દિવસે ચંદ્રમા ક્રોણી રીતે પૂર્ણ કલાંચે પહોંચે છે તેલી રીતે  
ધર્મથી તું પોતાના લુલને પૂર્ણ કર ! અને પરિપૂર્ણ પ્રશાદ્વારા  
અજ્ઞાનરૂપી અંધકારને વિઘેરી નાખ.”

પૂર્ણ પણ અહોતપદને પ્રાસ થઈ હતી.



## ૪૨-અમયમાતા



તું મૂળ નામ પદ્માવતી હતું. ઉજખચિની નગરી-માં તેનો જન્મ થયો હતો. ત્યાં આગળ એ વારાંગનાનો ધંધો કરતી હતી. રાજ બિભિસાર તેના ઇપલાવજ્યની વાત સંલખીને તેના ઉપર મુખ થઈ ગયો. અને તેને ખોલાવીને પોતાની કામવાસના ચરિતાર્થ કરી. શ્રાદ્ધ વર્ષત પછી એણે બિભિસાર રાજને સંદેશો કહાવ્યો કે, “હું આપનાથી સગર્ભા થઈ છું.” રાજએ કહેવરાયું કે, “જો પુત્ર અવતરે તો એને મોટો થયા પછી મારી પાસે મોકલી આપણે.” યથાસમયે પદ્માવતીએ એક પુત્રને જન્મ આપ્યો. અને તેનું નામ અભય પાઠવામાં આવ્યું. પુત્ર સાત વર્ષનો થયો એટલે માતાએ તેને તેના પિતાનું નામ કહ્યું તથા બિભિસાર રાજ પાસે મોકલાવી આપ્યો. રાજને તેના ઉપર ઘણે પ્રેમ ઉત્પન્ન થયો. અને તેમણે એ બાળકને રાજકુદુંઘના ધીન બાળક સાથે ભાઘરવા દીધો. કુમાર અભય ઘણે બુદ્ધિમાન, સદાચારી અને ધાર્મિક નીકળ્યો. પાછળથી તેણે બૌદ્ધધર્મની દીક્ષા લઈને ધર્મ-પ્રચારક તરીકેનું જીવન ગાળવા માંડયું. તેના ધર્મોપદેશની તેની માતા પદ્માવતી ઉપર પણ ઘણી સારી અસર થઈ. તેણે પોતાનાં અધમ આચરણનો ત્યાગ કર્યો અને સંસારની મોહમાયા છોડી દઈને ધર્મોચરણું માંડયું. એ પ્રમાણે સત્કરોથી અને બૌદ્ધધર્મના આદેશ પ્રમાણે ચાચાથી તેનું જીવન શુદ્ધ અને પાપસુક્ત થયું તથા તેણે આખરે અર્હત્પદ પ્રાપ્ત કર્યું. પુત્ર અભયકુમારે તેને શો ઉપદેશ આપ્યો અને તેની પોતાના ઉપર શ્રી અસર થઈ એવૃત્તાંત તેણે પોતે રચેલી ગાથામાં ટૂંકમાં વર્ણાવ્યો છે.

એ ગાથા ઉપરથી જણાય છે કે પુત્રે માતાને આ દેહની ક્ષણું ભંગુરતા અને ભવિનતાનું લાન કરાવ્યું હતું. એણે કહ્યું હતું:

“ માતા હેહના સૌદર્યના અલિમાનને લીધે તમે પતિત જીવન ગાજયું છે, પણ જરા એ હેહને પગથી માથા સુધી નિહાળીને વિચાર તો કરી જુઓ ! શિરના ફેશથી તે પગનાં તળિયાં સુધી એ આખું શરીર હુંદ્યથી ભરેલું નથી ? એમાં લોહી, માંસ વગેરે સૂગ બેડ એવા પદાર્થ સિવાય બીજું શું છે ? ” એના ઉત્તરમાં માતાએ પુત્રને ખાતરી આપી હતી કે, “ પુત્ર ! તારું કથન સત્ય છે. આજથી મારી બધી હુંધોસનાઓને મેં જડમૂળથી ઉઝેડી નાખી છે. હવે હું શાંત અને નિવૃત્તિપરાયણું થઈ છું. ”

## ૪૩-અભયા



જીવન શહેરમાં એક કુલીન ગૃહસ્થને ઘેર તેનો જન્મ થયો હતો. આગલા ચરિત્રમાં વર્ષાવેલી પદ્માવતી (અભયમાતા) તેની બાલ્યાવસ્થાની સખી હતી. અભયમાતાએ જ્યારે સાંસારનો ત્યાગ કરીને શેરી-પદ અહણું કશું ત્યારે અભયાએ પણ તેનું અતુસરણું કશું હતું. એ પણ શેરી બનીને સણીની સાથે રાજગૃહ નગરીમાં સાધીઓના મહિમાં વસતી હતી. સમશાનમાં જઈને હાઠકાંઓએ અને જોપરી-ઓના સામું એકાશચિત્ત જોઇને એ હેહની અને સાંસારિક સુખ-વૈભવની નશ્યરતા પોતાના હૃદયમાં લસાવતી હતી. એણું ગાથામાં પોતાને સંખોદીને કદ્યું છે કે, “ હે અભયા ! આ હેઠ કે એને પૃથ્વીના લોકો સુખનો ભંડાર અને સારદૃપ ગણે છે તે ક્ષાણુભંગુર છે. એ હેહને હેઠને હું સ્થિર, નિત્ય અને સારદૃપ એ પદાર્થ છે તેને પ્રાપ્ત કરીશ. યુદ્ધદેવના શાસનથી હું હુંઘના મૂળનો નાશ કરીશ અને તૃપ્યાનો ક્ષય થવાથી જગતનાં બધાં હુંઘ અને પ્રાસનો નાશ થશો. ”

આ રીતે આત્મચિત્વનથી તેણે અર્હતપદ પ્રાપ્ત કશું હતું.





## ૪૪-સામા (શ્યામા)

કુદી કુદી કુદી

કુદી કુદી શાર્ણથી નગરીમાં એક ધનવાન ગૃહસ્થના ધરમાં એનો  
કુદી કુદી જન્મ થયો હતો. કૌશાર્ણથીના રાજની રાણી સામા-  
વતી તેની અત્યાંત પ્રિય સખી હતી. રાણીના મૃત્યુથી સામાને  
ધણ્ણાજ શોષ થયો. અને સંસાર ઉપરથી વૈરાઘ્ય બિપજવાને લીધે  
એણું બેરીપદનો સ્વીકાર કર્યો; પરંતુ સાધી થયા છતાં પણ તે  
શોષને સમાવી શકી નહિ અને મોહનું નિવારણ થયા વગર  
આધ્યાત્મિક ઉત્તુતિ થઈ શકતી નથી. એક દિવસ બુદ્ધ લગવાનના  
મુખ્ય શિષ્ય આનંદનો ધર્માપદેશ સાંભળ્યાથી તેનો મોહ નિવૃત્ત  
થયો. અને તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. તૃપણા, હૃદયન્દ્વાળા અને  
જીવનની ચંચળતા ચાલી ગયાથી સામાચ્ચે ફર્જિલ અર્હતપ્રદ પ્રાપ્ત  
કર્યું. તેણે પોતાનો એ અનુભવ સ્વરચિત ગાથામાં વર્ણિત્યો છે.

## ૪૫-ઉત્તમા (પહેલી)

કુદી કુદી

કુદી શા કુદી વર્તી નગરીમાં એક ખબનચીની કન્યા તરીકે તેનો  
કુદી કુદી જન્મ થયો હતો. પુષ્ટ વયની થતાંવાર પટાચારા નામ-  
ની વિદ્ધાથી બેરીનો ઉપદેશ સાંભળ્યાથી એ પણ સંસારનો ત્યાંગ  
કરીને બેરી અની ગઈ હતી અને આખરે અર્હતપ્રદને પામી હતી.  
પોતાનો એ અનુભવ જણાવતાં એ ગાથામાં કહે છે કે, “શાંતિની  
શોધમાં હું ચાર પાંચ વિડાર છેદી દઈને અરણ્યમાં ચાલી ગઈ, પણ  
એથી મારા ચંચળ ચિત્તને શાંતિ વળી નહિ. આખરે ‘આ જીવન  
તફન અસાર છે’ એવો જેનો ઉપદેશ છે એવી એક લિક્ષુણીનાં  
મને દર્શન થયાં. સાત દિવસ સુધી એક આસને હું ધ્યાન ધરીને  
બેઠી અને અપાર સાધના સાધી. આઠમે દિવસે મારો અંધકાર  
દૂર થઈ ગયો, પ્રકાશ મંકરી નીકળ્યો. અને મેં સુદ્ધિત મેળવી.”



## ૪૬-ઉત્તમા (વીજી)

એ હું કૌશલ દેશનિવાસી એક આદ્ધારુની કન્યા હતી. એક દિવસ ધર્મપ્રવાર કરતા કરતા ખુદ્ધ લગવાન કૌશલ દેશમાં આવ્યા. ત્યાં આગળ એમનો ધર્મપ્રવાર સંભજયાથી ઉત્તમાના મનમાં વૈરાગ્ય ઉત્પત્ત થયો. અને તેણે જાંસારનો ત્યાગ કરીને લિક્ષ્માણીવત ધારણું કર્યું. ત્યાં આગળ એકાંતમાં ધર્મચિંતન કર્યાથી તથા પ્રભ્યાચર્યાંપૂર્વક લુબન ગાજ્યાથી એ અર્હતૃપદને પામી. એણે પોતાનો અનુભવ ગાથામાં કવિતાદ્વારા ગાયો છે.

## ૪૭-દંતિકા

એ શ્રાવસ્તીના રાજપુરેહિતની કન્યા હતી. મહાપ્રભાપતિ ગૌતમીએ તેને દીક્ષા આપી હતી. એક દિવસ તે પોતાના મહની બહાર ભાભી હતી, એવામાં એણે એક હાથીને નહીમાં સ્નાન કરીને પાછો ફરતો જેયો. તેના મહાવતે તેનો પગ નીચો વાળવાનો હુકમ આપ્યો, એટલે હાથીએ તે પ્રમાણે કર્યું અને મહાવત તેના ઉપર પગ મૂકીને હાથીની ગરદન ઉપર ચડી એઠો.

વનપશુને આવી રીતે ડેળવાયલો તથા પોતાના સ્વામીની આજા માનતો જેઠને દંતિકાને એકાંતરીન ઉત્પત્ત થયું. તેણે ઘોર અરણ્યમાં એકાંત સ્થળમાં જઈને આત્મચિંતન કર્યું અને ખૌદ્ધધર્મની દીક્ષા લઈને આત્માનો ઉદ્ધાર કર્યો. તેણે પોતાનું આ શુવનચરિત ગાથામાં સુંદર રીતે વર્ણિતયું છે.

હાથણીને દંતિકા કહે છે. હાથીને જેઠને એને જાન ઉત્પત્ત થયું, એટલા માટે એ દંતિકા નામથી ઓળખાઇ છે.



## ૪૮-શુક્રા ( શુક્રલા )



જગૃહ નગરમાં એક પ્રસિદ્ધ વણિકના ઘરમાં  
તેનો જન્મ થયો હતો. બાદ્યાવસ્થામાં તેને  
સારાં શિક્ષણ આપવામાં આંયું હતું. યોવન  
પ્રાસ થયા પછી ખોદ્ધધર્મનું રહેસ્થ તેના  
અણુવામાં આંયું અને તે બુદ્ધેવની ગૃહસ્થ શિષ્યા થઈ. ત્યાર  
પછી પ્રસિદ્ધ ઉપરેશિકા બેરી ધર્મદિલ્લાનાં એધજનક ધાર્મિક  
વ્યાખ્યાન તેના સાંભળવામાં આવ્યાં અને તેણે ગૃહસ્થાશ્રમનો  
ત્યાગ કરીને દીક્ષા લીધી. અસાધારણ વિદ્વત્તાને લીધે તેને ૫૦૦  
લિક્ષ્ણીઓની ઉપરી બનાવવામાં આવી. એ ૫૦૦ લિક્ષ્ણીઓ-  
ના સંઘને સાચે લઇને બેરી શુષ્ઠાએ ઘણા હિવસ સુધી ખોદ્ધ-  
ધર્મના પ્રચારતું કાર્ય કર્યું હતું. તેની અમૃતમયી વાણી સાંભ-  
ળીને અનેક શોકથર્સ્ત મનુષ્યોને આખાસન મળતું હતું, અનેક  
પાપીઓ સત્યમાર્ગના પ્રવાસી અન્યા હતા. તેનો ધર્મોપહેશ  
થતો તે વળતે સાંભળનારાં ઝીપુરોથે મંત્રમુખ થયાં હોય તેમ  
શાંત અને સ્વરસ્થ થઈને એકાશચિત્તે સાંભળ્યાજ કરતાં.

અનેક મનુષ્યોના આત્માને શાંતિ આપનાર ઉપરેશિકા શુષ્ઠા-  
ના જીવનને ધન્ય છે !

## ૪૯-મિત્રા

કચ વંશમાં તેનો જન્મ થયો હતો. અપદાનમાં તેનું  
નામ નાલમાલિકા પણ લખેલું છે. પ્રજાપતિ ગૌતમીની  
સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો હતો; અને ધર્મશાસ્ત્રનું  
અધ્યયન તથા એકાંતમાં ધર્મચિત્તન કર્યાથી તેણે અહીંતૃપદ પ્રાસ  
કર્યું હતું. એણે ગાથા રચેલી છે. એણે વ્રતવિધાન પણ ધણ્યાં કર્યાં હતાં.



## ૫૦—શૈલા ( સેલા અથવા શૈલજા )



આલવીપતિની કન્યા હતી. ‘સંયુક્ત નિકાય’ ચંથમાં પિતાના નામ ઉપરથી એને ‘આલવિકા’ નામ આપ્યું છે. એના પિતાને બુદ્ધહેવનાં વચનોમાં શ્રદ્ધા ઉત્પજ્ઞ થયાથી એ ગૃહસ્થ ઉપાસક બન્યા હતા. આલવી નગરમાં જયારે બુદ્ધહેવ પદ્ધાર્યો હતા, ત્યારે પિતાની સાથે રાજકુમારી શૈલા પણ એમનો ઉપહેશ

સાંભળવા ગઈ હતી. બૌદ્ધધર્મ ઉપર એને પણ શ્રદ્ધા ઉત્પજ્ઞ થઈ અને એ એમની શિષ્યા અની. ત્યાર પછી ધર્મશાસ્કોનો અભ્યાસ અને જિજાસા વધતાં એણે સંસારનો ત્યાગ કરીને લિક્ષુણીવૃત્તિનો સ્વીકાર કર્યો. એ અવર્થભાંતે તેને અંતરદિષ્ટ પ્રાસ થઈ અને મન, વચન, કર્મ વડે વાસનાઓને હાણી ફરજને એ અર્હતપદને પ્રાસ થઈ.

આલવી નગરી શ્રાવસ્તીથી ત્રોસ ચોજન (૧૨૦ ગાઉ) અને કાશીથી બાર ચોજન હતી. પાછળી વચનમાં શૈલા શ્રાવસ્તી નગરીમાં નિવાસ કરતી હતી અને ત્યાં આગળ વનમાં એક વૃક્ષ નીચે એસીને તપસ્યા કરતી હતી. એ વખતે માર એની તપસ્યામાં ભંગ કરાવવા સારુ ચુસે વેશો આવીને કહેવા લાગ્યો: “સુકુમારિ! આવા એકાંત જંગલમાં શા સારુ વાસ કરી રહ્યાં છો? એમાં શું વળવાતું છે? આ દુનિયામાંથી તમારો ઉદ્ધાર કદાપિ થવાનો નથી. સંસારમાં છો. ત્યાંસુધી સુખ લોગવી લો, નહિં તો પાછળથી પસ્તાવું પડશો.”

શૈલા ઘણ્ણો વિવેકી અને સમજુ હતી. એ સમજુ ગઈ કે નિરીષુપદ પ્રાસુકરતાં મને રૌકી વિપયવાસનામાં ઇસાવવા સારુ મારજ અહીં આવ્યો છે, એને ખખર નથી ફે મેં તો અર્હત-

પદ પ્રાપ્ત કર્યું છે અને એની માચાળળમાં હું ઇસાડાં એમ નથી. એણે ઉત્તર આપ્યો:—

“ તું એને સુખ કહે છે, એ સંસારના વિષયલોગ તો શુણ અને ભાલાની પેઠ મનુષ્યના દેહપિંડને વીધી નાખે છે. એવી જાતના સુખની મારી આગળ જરાયે ગણુતરી નથી. એવા અસાર સુખ તરફ મારું ચિત્ત જરું નથી. લોગ લોગવવાની મારી વાસના મરી ગઈ છે. અજાનરૂપી અંધકારનો નાશ થયો છે, માટે ડે માર ! તારું અહીં કાંઈ ચાલે એમ નથી.”

## ૫૧-ઉભિરિ



હું એ હું નો જન્મ શ્રાવસ્તી નગરીમાં એક વણુકને વેર થયો. હું હતો. એ ઘણી સુંદર હતી. એના સૌંદર્યથી સુધ્ય થઈ જઈને કૌશલ દેશના કૃત્રિમ રાન્ધે તેની સાથે લગ્ન કર્યું. થાડા સમય પછી ઉભિરિએ જીવા નામની એક કન્યાને જન્મ આપ્યો. એ કન્યા અત્યંત સૌંદર્યવતી હતી. તેના ઉપર રાન્ધને પણ ઘણી પ્રીતિ ઉત્પન્ન થઈ. પરંતુ માતપિતાને આનંદ આપનારી એ કન્યા આજા હિવસ જીવી નહિ. તેના મૃત્યુથી ઉભિરિને અત્યંત શોષક થયો. એ દરરોજ સમશાનમાં જઈને રૂઢન કરવા લાગી. એક હિવસ ભગવાન બુદ્ધદેવને ત્યાં આગળ જઈ પહોંચ્યા અને પૂછ્યું: “હે સુંદરિ ! તું ‘એ મારી જીવા’ કહીને શા સારુ રહ્યા કરે છે ? તારા જેવી હન્દરો માતાની હન્દરો જીવાએ આ સમશાનમાં મૃત્યુશથ્યામાં સૂતેલી છે, માટે સમજ ન અને શાંત થા.”

બુદ્ધ લગવાનના એટલા આશાસન-વાક્યથી ઉભિરિની મોહનિદ્રા જાડી ગઈ. તેના શોકનું નિવારણ થઈ ગયું અને અંતરમાં શાંતિ ઉત્પન્ન થઈ. સંસાર ઉપરથી મમતા ઉડાવી લઈને એ બુદ્ધદેવને શરણે ગઈ અને રીતસર દીક્ષા લઈને થેરી બની તથા આખરે અહૂંત્પદને પામી. થેરી ગાથામાં તેનો સ્વાતુભવ કવિતામાં વર્ણિયેલો છે.



## ૫૨-મદ્રા કાપિલા



તમખુદ્ધના સમયમાં સાગલ નામના ગામમાં કોશિક પ્રાણીણુના કુદુંબમાં તેનો જન્મ થયો હતો. એ પ્રાણીણુની અવસ્થા બહુ સમૃદ્ધિવાળી હતી, એટલે ભદ્રાનો બાદ્યકાળ ઘણા સુખ અને વૈલખમાં ગયો. યૌવનાવસ્થા પ્રામ થતાં તેનું લગ્ન મગધ દેશમાં તીર્થ ગણ્યાતા પ્રાણીણી નામના એક ધનવાન ચુવક સાથે થયું. એ ચુવકનાં એ નામ હતાં-કાકશ્યપ અને પિપળી. કપિલની પુત્રી હેવાથી કપિલા-કાપિલાનિ એવા નામથી ભદ્રા પ્રસિદ્ધ થઈ છે. મહાકાકશ્યપ અને ભદ્રાનો એકથીલ પ્રત્યેનો અત્યંત પ્રેમ હતો. એમનો સંસાર ઉત્તમ પ્રકારે ચાલતો; કેમકે રૂપ, વય, સફુશુદ્ધ અધામાં બજે એકથીલાની સમાન હતાં. આથી કરીને એમની પ્રેમગંડ ધણીજ મજબૂત બંધાઈ હતી. એમનો અસાધારણ પ્રેમ આખા ગામને માટે આદર્શરૂપ થઈ પડ્યો હતો. જાનપ્રાસિમાં અને લોકસેવામાં એમનો સમય વ્યતીત થઈ રહ્યો હતો.

એવામાં ગૌતમખુદે ધર્મપ્રચારનું કાર્ય આરંભયું. અનેક તરણો ગૃહસ્થાશ્રમના મોહને તિલાંજલિ આપીને બુદ્ધદેવને શરણું આવ્યા અને ધર્મપ્રચારના પવિત્ર કાર્યમાં જોડાયા. એ ધાર્મિક આંહોલનના સમયમાં ભદ્રાના પતિએ પણ પતિતતા સ્નેહમૂર્તિ પત્નીના પ્રેમપાશને તોડીને ગૃહત્યાગ કર્યો અને ગૌતમનો શિષ્ય બન્યો. જતી વખતે પોતાની બધી મિલકત પ્રિયતમા ભદ્રાને સેંપી. ભદ્રાએ એ અઠળક સંપત્તિલઇને મોજ-શોખમાં લુબન વ્યતીત કરવાનું ઉચિત ન ધાર્યું. પોતાના પતિએ સર્વસંગ પરિત્યાગ કરીને પ્રવન્યા લીધી, એટલે એણે પણ બધી સંપત્તિ સગાંસંબંધીઓને વહેંચી આપી અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને પતિનું અનુસરણ કર્યું. ભર યુવાવસ્થામાં સંસારનાં સુખને લાત મારીને ભદ્રા બિક્ષુણી બનવા તૈયાર થઈ.

લગ્નવાન ખુદે બિક્ષુસંઘની તો સ્થાપના કરી હતી; પણ બિક્ષુણીસંઘ ત્યાં લગ્ની સ્થથપાયો નહોતો. કાશ્યપ તો સંઘમાં દાખલ થયો. પણ બદ્રાઓ તો પાંચ વર્ષ સુધી બિક્ષુણીઓની પાસે રહીને ધર્મનું શિક્ષણ મેળવ્યું.

પાંચ વર્ષ પછી મહાપ્રલાપતિ ગૌતમીએ બિક્ષુણીસંઘની નિયમપૂર્વક સ્થાપના કરી. એ અણર સાંકણીને બદ્રા પ્રસન્નથથડ અને બિક્ષુણીસંઘમાં તેણે પ્રવેશ કર્યો. પ્રવલયા લીધા પછી ઉપસંપદ પ્રાપ્ત કરી અને પછી ઉત્તરોત્તર અધિકાર પ્રાપ્ત કરીને એ અર્હતપદને પામી. એ સ્થિતિએ પહેંચયા પછી પૂર્વજન્મોનું તેને સમરણ થયું.

પેલી તરફ મહાકાશ્યપ પણ ખુદ્દસંઘમાં ખડુ પ્રસિદ્ધિને પાઠ્યો. સંઘમાં જે બંધનો ઢીલાં પડી ગયાં હતાં, તેને દશ કરવાનું કામ અને હાથેજ થયું હતું. ગૌતમખુદ્ધના પરિનિવોણું પછી મહાકાશ્યપેજ પાંચસો બિક્ષુણીની મહાસલા ભરીને ઐદ્ધયાસનમાં સુધારો કરીને એક અંથકારમાં જોડીન્યા હતા. મહાકાશ્યપ જેવી રીતે બિક્ષુસંઘનો આગેવાન બન્યો, તેવીજ રીતે બદ્રા બિક્ષુણીસંઘમાં સૌથી જાંચે સ્થાને પહેંચ્યી. ધર્મની કથા કહેવામાં પણ તેણે કુશળતા અને પ્રસિદ્ધ મેળવી.

એક દિવસ જેતવનમાં ખુદ્દહેવે બિક્ષુણીઓને તેમની ચોગ્યતા પ્રમાણે પદવી આપવાને સમારંભ કર્યો ત્યારે એમણે બદ્રાને પૂર્વજન્મની સમૃતિવાળી બિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપ્યું. એ પ્રમાણે બદ્રાની અનેક જન્મની અલિકાયા પૂર્ણ થથડ.

શરી ગાથામાં ૬૩ થી ૬૬ સુધીના શ્લોક તેના રચેલા છે. એ ઉપરથી બદ્રાનો પતિ પ્રત્યેનો પ્રેમ અને તેની ધાર્મિક વૃત્તિઓનો પરિચય મળે છે. પોતાના પતિને એ “ખુદ્ધિના પુત્ર અને વારસ” તરીકે સંભોધે છે. ત્રણે વિદ્યાના અધિપતિ હોવાથી અને સાચા પ્રાણીનું તરીકે ઓળખાવે છે. પોતાનો પરિચય આપતાં એ કહે છે કે, “કાશ્યપની ચેઠ મેં પણ ત્રણે વિદ્યા પ્રાપ્ત કરી છે; ભર્ત્ય ઉપર જય મેળવ્યો છે; સેના સહિત મારનો પરાલવ કર્યો છે; એટલે મારો આ છેવટનો જન્મ છે. જગતમાં સંકટો ધણ્યાં છે એ વાત સમજુને અમે બંનેઓ પ્રવલયા લીધી અને ત્યાર પછી ક્ષીણ્યાસવ (અહંત) બનીને, ઈદ્રિયોનું દમન કરીને શાંત

બનીને અમે નિવૃત્ત થયાં છીએ.”

બદ્રા મહાભાગ્યશાળી કી હતી. પતિની સાથે સંયસ્ત બેંબું, એના બધા કાર્યમાં સ્વતંત્રપણે મદ્દ કરવી અને સાથેજ અહંતું પદ તથા નિર્વાણુ પ્રાપ્ત કરબું એ ઉત્તમ પ્રકારનો સહચાર સાખીને એણે સહધર્મિણી અને સહચારિણીપદ સાર્થક કર્યું હતું.

## ૫૩-સોમા

**ત** નો જન્મ રાજગૃહ નગરમાં રાજ બિંબિસારના પુરોહિતની કન્યારૂપે થયો. હતો. શુવાવસ્થા પ્રાપ્ત થતાં ખુદુદેવનો ઉપદેશ તેના સાંભળવામાં આવ્યો. અને તે ગૃહસ્થ શિષ્યા બની. ત્યાર પછી ધર્મજિજ્ઞાસા વધારે પ્રબળ થવાથી તે લિક્ષ્ણણીસંઘમાં દાખલ થઈ. એક દિવસ તે જેતવનમાં જઈને એક વૃક્ષ નીચે ધ્યાન ધરીને એડી હતી. ત્યાં આગળ માર આવીને તેને ચલિત કરવા સાર્દ કહેવા લાગ્યો:—

“ શું કર્પિયોના જેવા ક્રણની તું આશા રાખે છે ? એ ક્રણ તો ધાણું હુર્લાલ છે. હે રમણિ ! તાર્દ કામ તો એ આંગળીઓ વઠે ભાતના દાણું ચાંપી જોવાનું છે. આ કામ તારા જેવી સુંક્રમાર અગળાનું ન હોય !”

પરંતુ દફ્પતિજસોમાએ પ્રતયુત્તર વાળ્યો કે, “ હે માર ! કી-ન્નતિમાં જન્મ પામવાથી ધર્મસાધનામાં મને કેવી રીતે અડચણું પડવાની હતી ? માર્દ ચિત્ત જે સ્થિર અને દફ હોય, જે મારી ધર્મદાષ્ટ ઊંઘઠેલી હોય, જે મારા ચિત્તમાં શાનનો ઉદ્ય થયો હોય, તો નારીજન્મ મને કોઈ પણુ પ્રકાર વિનન્દ્રય થઈ પડવાનો નથી; માટે તું મને સંસાર ઉપર મોહ ઉપનાવવાનો મિથ્યા પ્રયત્ન છાડી દઈને ચાહ્યો ના.”

શ્રીગાથામાં ૬૦,૬૧ અને ૬૨મા શ્કોઝની રચના તેની છે.





## ૭૪-વિમળા

એ ક વારાંગનાને પેટે, વેશાલી નગરમાં તેનો જરૂર થયો। હતો. વિમળા મોટી થઈ ત્યારે માતાના કુસંગની અસર તેના ઉપર પણ પડી અને વિષયવાસના ચરિતાર્થ કરવાની ઈચ્છા તેનામાં પ્રબળ થઈ પડી. એવામાં એક દિવસ યુદ્ધ ભગવાનના પરમપ્રિય શિષ્યોમાંના એક પૂજ્યપાદ મહા મોખાલાન લિક્ષા માગવા સાડ તંયા આગળ થઈને જતા હતા. એ લિક્ષના સૌંદર્યથી વિમળા સુંઘ થઈ ગઈ અને સાંજે તેમના આશ્રમમાં જઈ, અનેક પ્રકારના સુખવૈલલ અને લોગવિલાસની લાલચ બતાવી; પરંતુ એ લિક્ષનું મન જરા પણ ચાલ્યું નહિ. તેણે વિમળાને ધણોંજ ડપડો આપ્યો તથા ઉપદેશ આપીને તેના મલિનહૃદયને વિમળ બનાવ્યું. વિમળાને પછી પોતાના કૃત્ય માટે ધણોંજ પસ્તાવો થવા લાગ્યો અને તે બૌદ્ધધર્મની ગૃહસ્થ ઉપાસિકા થઈ. પાછળથી તેણે લિક્ષણી-મત ધારણ કરીને હુલ્લંબ અહંતપદ પ્રાપ્ત કર્યું. પોતાનું ચરિત્ર તેણે શરીરી ગાથામાં નીચે પ્રમાણે વર્ણિંદ્યું છે:—

“ વણ્ણ, રૂપ, ભાગ્ય, યશ, અને યૌવનના ગર્વથી હું છકી ગઈ હતી. એ વખતે સત્ય વસ્તુ મારા જણાયામાં નહોંતી આવી. અંગ ઉપર સુગંધીવાળા પહાર્યોનો લેપ કરીને તથા સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરીને, એક પારધિની પેઠે હું મારી જળ ફેલાવીને બારણ્ણ આગળ બેસ્તી હતી. રસ્તે જનારા પુરુષોના ધર્મનો નાશ કરવા સાડ હું કેટલી જાતના છળપત્ર્યાં કરતી હતી! પરંતુ આજે ફેશ મૂંડાવીને તથા ભગવાં વસ્ત્ર ધારણ કરીને હું લિક્ષા માગી રહી છું, વૃક્ષની નીચે બેસીને શુદ્ધ ધ્યાન ધર્યું છું. મતુંધ્યોને અને હેવોને બાંધી રાખનારાં બધાં બંધનોમાંથી હું હવે સુકૃત થઈ ગઈ છું. મારા પ્રાણુને નશો ચડાવનારા આસવો-ને શરીરમાંથી કાઢી નાખોને હું આજ નિવોણુસુખ અનુભવું છું”



## ૫૯-વડુદેસી



એ તું ગોત્રનામ જાણ્યામાં આંધું નથી. ડેવદહ નગરમાં તેનો જન્મ થયો હતો અને તે મહા-પ્રભાપતિ ગૌતમીની ધાત્રી હતી. જ્યારે મહા-પ્રભાપતિ ગૌતમીએ સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેણું પણ એમનું અનુસરણ કર્યું; પરંતુ પચીસ વર્ષ સુધી તેનું ચિત્ત એકાશ થઈ શક્યું નહિ તથા વિવયભેાગની લાલસા તેના હૃદયમાંથી જડ-મૂળમાંથી નીકળી ગઈ નહિ. આપુરે ધર્મદિનાનો ઉપદેશ સંભન્યાથી તેની અધમ વાસનાઓનો નાશ થયો અને તેને અંતરદિન પ્રામણ થઈ. પોતે અંતર્જાન ડેવી રીતે પ્રામ કર્યું, તેનું વર્ણન તેણું થેરી ગાથામાં ૬૭ થી ૭૧ સુધીના શ્વોકમાં કર્યું છે.

## ૬૦-સીહા (સિંહ)

લિચ્છી રાજ્યોના સેનાપતિએ સિંહ ઉપાધિથી એ-ગ્રંથાતા હતા. સીહા એ સમયના વૈશાલિના સેનાપતિની ભાણેજ થતી હતી. કુમારી દશામાંજ તે થેરી થઈ હતી. સાત વર્ષ સુધી તેણું ચિત્તને કાણૂમાં લાવવાનો ઘણેલા ચત્ન કર્યો પણ સફળતા ન મળી, ત્યારે નિરાશ થઈને તેણું ગળે ઝાંસે ખાંધને જીવનનો અંત આણુવાનો સંકદ્ય કર્યો; પરંતુ ગળે ઝાંસે ખાવા જતી હતી તેજ વખતે તેનું ચિત્ત એકદમ સંયમ-માં આવી ગયું અને તેને અંતર્જાન ઉત્પત્ત થયું. થેરી ગાથામાં ૭૭ થી ૮૧ સુધીના શ્વોક તેના રચિલા છે.



## ૫૭—સુંદરી નંદા

એ

સુંદર યુવતીનો જન્મ મહાપ્રણપતિ ગૌતમીના ગર્ભમાં થયો હતો, એટલે એ બુદ્ધ ભગવાનનાં ખણેન થાય. રાજકુટંખમાં જન્મ અને મહાપ્રણપતિના હાથનો ઉછેર, એટલે નંદાને કેવું શિક્ષણ મળયું હશે તેનું અતુમાન તો વાચકો કરીજ શકશે. એને લોકો ‘જનપદ કલ્યાણી’ નામથી એળખતા.

બુદ્ધહેવના ઉપદેશથી પોતાના ભાઈ નંદ અને ભત્રીના રાહુલે પ્રવન્યા લીધી, ત્યાર પછી થોડા હિવસમાં પિતા શુદ્ધોદનનું મૃત્યુ થયું. માતા, મહાપ્રણપતિ અને ભાલી યરોધરાએ પણ બિક્ષુણીપ્રતિને અંગીકાર કર્યું. એ વખતે સુંદરી નંદાના મનમાં પણ વિચાર આવવા લાગ્યો કે, “આજ હિવસ સુધી મેં સંસાર અને સંસારિક સુખ જીવાય બીજા કશાનો વિચાર કર્યો નથી. આ સંસાર તો ક્ષણુભાગુર છે. સંસારનું સુખ તો આજ છે ને કાલ નથી. મારા મોટાભાઈ રાજપાટનો ત્યાગ કરીને બુદ્ધ થયા છે, તેમના પુત્ર રાહુલે પણ સંસારનો ત્યાગ કર્યો છે. મારા ભાઈ નંદ, માતા મહાપ્રણપતિ તથા રાહુલ માતાએ—ભધાંએ સંસારથી વિરક્ત થઇને તેનો ત્યાગ કર્યો છે, તો હું એકલી આ રાજમહેલમાં રહીને શું કરીશ? મારે પણ સંસારનો ત્યાગ કરીને દેહનું સાર્થક કરવું જોઈએ.” એ પ્રમાણે અંતરના તીવ્ર વૈરાગ્યને લીધે નહિ, પણ સગાંસંખાંધીએ પ્રત્યેના પ્રેમને લીધે તેણું બિક્ષુણીપ્રત લીધું. બિક્ષુણી બન્યા છતાં પણ તેને પોતાના સૌંદર્ય માટે ઘણું અભિમાન હતું. ઇપવતી ઓઝો માટે બુદ્ધહેવને અણુગમો છે, એ વાતની એને અખર હતી. એથી એ કદી બુદ્ધહેવ પાસે જતી નહિ. જ્યારે જ્યારે એમની કથા કે ધર્મોપદેશ સંભળવાનો વારો આવે ત્યારે એ કાંઈ ને કાંઈ ખણાનું કાઢીને મહમાં રહી જતી અને પોતાને બદલે બીજું કોઈ બિક્ષુણી-

ને મોકલતી. એને લય હતો કે યુદ્ધહેવ એના રૂપને વચોડશે, રૂપના ગર્વ માટે એને ધમકાવશે. યુદ્ધહેવ બિક્ષુણ્ણીસંઘના કામમાં ખાસ કાળજી રાખતા હતા. પોતાના સંઘમાંની દરેક સભારી આધ્યાત્મિક માર્ગમાં કેટલી ઉજ્જ્વલિ કરે છે તેની પોતે ખખર રાખતા. એમને ખખર હતી કે, નંદાને રૂપલાવણ્ણયનું અલિમાન છે, સુખ અને વૈલબ્યમાં ઉછરેલી છે, એ અલિમાન એના માંથી એકદમ લોચ થઈ લય એ પણ અસંભવિત છે; એટલા માટે એક દિવસ તેમણે આજા આપી કે, “આજના ઉપહેશમાં તો નંદાએ જાતેજ આવવું પડશે. બાળ કોઈ બિક્ષુણ્ણીને મોકલવે નહિ ચાલે.” હું તે નંદાને જવું જ પડયું. યુદ્ધહેવ એવી રૂપગર્વવતી સ્વીચ્છાને ડેકાળું આણુવા માટે માચા રચતા. નંદાએ જે સમયે યુદ્ધહેવને સાણાંગ દંડવત્ત કર્યો, તે સમયે તેણું જેણું કે એક અલૌકિક લાવાણ્યવતી સ્વીહાથમાં પંચો લઇને શાસ્ત્રાને વાયુસંચાર કરી રહી છે. એ નેર્ધને નંદાને વિચાર આવ્યો: “હું મારા રૂપના અલિમાનમાં અહીં આવતી નહોતી, પણ આ રમણી મારા કરતાં કેટલી વધારે ખૂબસૂરત છે. એ તો એકાશચિત્તો યુદ્ધહેવની સેવા કરી રહી છે.” યુદ્ધહેવ તેના મનના વિચારપરિવર્તનને પારખી ગયા અને તેને ઘરં જાન આપવાનો ઠીક સમય આવી લાગ્યો છે એવું જણાતાં ઉપહેશ આપ્યો કે, “આ શરીર તો માંસ અને રક્તથી લિસ હાડકાંનો કિલ્લો છે. જરા અને મૃત્યુ એમાં રાન્ય કરે છે.” ત્યાર પછી આ શરીરની ક્ષણાલું શુરતા વિસ્તારથી સમનવી અને ખરે વિજય દેહાસક્તિ છોડીને નિર્વાણુપદ પ્રાસ કરવામાં છે એ વાત એના ચિત્તમાં ઠસાવી.

એક દિવસ જેતવનમાં સંઘનો ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવાન યુદ્ધહેવ આસન ઉપર બિરાજેલા હતા. આજે ‘નામસંમતા-કરણુ’નો સંક્રાર થવાનો હતો. એ સમારંભમાં કોઈ બિક્ષુ કે બિક્ષુણ્ણીનું સન્માન કરીને એને ખાસ ઉપાધિ આપવામાં આવતી. એ દિવસે કોઈ એક બિક્ષુ ધર્મ સંબંધી વ્યાખ્યાન આપીને પોતાની વિક્રતાનો પરિચય આપતો. આજના સમારંભમાં બિક્ષુણ્ણીઓને તેમના શુણાતુસાર પહીની આપી. નંદાનો વારે આવ્યો ત્યારે તેમણે તેને ‘ધ્યાનસંપજ્ઞ’ અને ‘ધ્યાનાલિષ્ટત’નું પદ આપ્યું અને એ વર્ગની બિક્ષુણ્ણીઓમાં અગ્રસ્થાન આપી તેની અલિલાખા પૂછ્યું કરી.

શ્રી ગાથામાં નંદાએ ગાયેલી ગાથા ઘણી હૃદ્યસ્પર્શીં છે. બુદ્ધદેવના ઉપદેશને અતુસરી, વારંવાર પોતાની જાતને ઉદ્દેશીને એ કહે છે: “ નંદા ! રોગ, અશુચિ, સડો અને હુર્ગંધ એ બધા થી ચુક્ત આ શરીરનું નિરીક્ષણ કર ! અશુલ લાવનાની લાવના કર અને ચિત્તમાં એકાશતા આણુ. શરીરની જે હકીકત છે તેજ તારી પણ છે. તારી જે ગતિ તેજ શરીરની ગતિ છે. શાંત, સ્વસ્થ ચિત્તે તું રાતહિવસ એનો વિચાર કર. એમ કચોથી સૌદર્યની ચુલામીમાંથી સુક્ત થઈને, પોતાની અજ્ઞાના બળ વડે તને માર્ગ મળી આવશે અને ચિંતા જતી રહેશે. શાશ્વત સત્યનો વિચાર કચોથી તથા પ્રમાદ છોડી દઈને, શરીરની બહાર અને અંદર શું છે, તેનો વિચાર કચોથી, આજ ક્ષણે તારી કાચાની માયા જતી રહેશે અને આજ ને આજ પ્રાણુ અદ્યાત્મ રાજ્યમાં વિરાજશે. આજ તું અપ્રમતા, સુક્ત, શાંત બનશે. એજ ખર્દું નિર્વાણ છે.”


## ૫૮-મિત્તકાલી ( મિત્રકાલી )

એ નો જન્મ કુરુરાજ્યમાં એક આણણુને ઘેર થયો હતો. એ નથી. એટલું જણાયું છે કે બિક્ષુણી થયા પછી પણ સાત વર્ષ સુધી તે પોતાના સ્વભાવને વશ કરી શકી નહોતી. તેનો સ્વભાવ ઘણું કળિયાએં હતો. સાથે રહેનારી બિક્ષુણીએ સાથે તે વારંવાર કલહ કચી કરતી; પરંતુ પાછળથી તેનામાં ધર્મનું દિંય જાન ઉત્પન્ન થયું અને ઘણી સુશીલ તથા શાંત પ્રકૃતિની બની ગઈ. શ્રી ગાથામાં હરથી ૯૯ સુધીના શ્લેષક તેના રચેલા છે.





## ૫૯-નંડુત્તરા



દ્વારા વાનના સમયમાં કુલે રાજ્યમાં કર્મા  
સર્વમ નગરમાં એક આશ્રમથું બમાં તેનો  
જન્મ થયો હતો. ઘણાં સારું શિક્ષણ મેળગયા  
પછી તેણું જેનોના સંખમાં પ્રવેશ કર્યો હતો.  
તેનામાં વ્યાજ્યાન આપવાની શક્તિ ધર્ણી સારી  
હતી. જેનું ભર્મનો પ્રચાર કરવા સારું તેણું  
ભાર્તવર્ષના વાણીઓના ભ્રમણ કર્યું હતું. એક વર્ષન  
પ્રસિદ્ધ બૌદ્ધભર્મનો પંડિત મદા મોણગવલાન સાથે તેનો મેળાપ  
થયો. જેનેની વચ્ચે ધર્મશાસ્ત્ર સંગાધી ચચ્ચી થઈ. શાસ્ત્રાર્થમાં  
નંડુત્તરાનો પરાજ્ય થયો અને મદા મોણગવલાનની સલાહથી  
તેણું બૌદ્ધભર્મની દીક્ષા લીધી. બૌદ્ધભર્મના એક ઉત્તમ અભ્યાસી  
સાથે શાસ્ત્રાર્થમાં જિતરસાર ચીમાં તત્ત્વજ્ઞાન કેટલું બધું હથે, તેની  
કલ્પના થઈ શકે એમ છે. વૈરીગયાનાં દુઃખ થી દ્વારા સુધીની  
ગાથાઓ તેની રચની છે, જેનો સારાંશ આ પ્રમાણે છે:—

**પૂજતી**—અધિ, ચંદ્ર, સૂર્ય આહિ સર્વ દેવતાને.

**જતી**—નરી-તીર્થમાં નિયમિત રીતે સ્ત્રાન કરવા.

**પાળતી**—કેટલાંએ વત અર્ધા શિર ઉપર કોષ કરીને.

**રચતી**—ભૂમિશાસ્યા આપી રાત આઢાર તજુને.

**સજતી**—સ્ત્રાન કરીને વિલેપન કરીને સુંદર પોશાક.

**પ્રાસ કર્યો**—આખરે ધર્મ, ગૃહ તજુને વિચદં છું બધે.

**સમજ**—કેચા હેહનું મૂહ્ય કાંઈ નથી. કાગનાઓ ચાલી ગઈ.

**સાધ્યો**—ભવક્ષય; ઉણેડીને ધર્યાઓ અને વાંચનાઓ.

**છોડી દીધી**—સર્વ બાધાઓ, ચિત્ત શાંત છે. સાધના સફળ છે.



## ૬૦-સકુલા



તમખુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એક આઘણુને વેર એણે જન્મ ધારણુ કર્યો હતો. થેરી ગાથામાં અનું નામ પહુલા પણ લખેલું છે. એની સાંસારિક સ્થિતિ ધણી સારી હતી. ડાઈ વાતનું હઃઅ તેને નહોતું. યુદ્ધહેવે અનાથપિડદના જે તવનના વિહારનો સ્વીકાર કર્યો, તે સમયે સકુલાને એમનાં પુણ્ય દર્શન થયાં. એના હૃદયમાં યુદ્ધહેવ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બોદ્ધધર્મમાં પણ શ્રદ્ધાનું ધાળ્યું મહત્વ ગાયું છે. ધર્મના ઉપદેશની તેના અંતઃકરણ ઉપર સારી અસર થઈ. સાંસારનાં ભધાં સુખ તેને મનથી તુચ્છ લાગવા લાગ્યાં. પારલોકિક સુખને શોધવા તે નીકળી પડી અને યુદ્ધહેવના લિક્ષુણીસંધના સમાગમમાં આવી. ત્યાં એને શાંતિ મળી. સાંસાર ત્યાજ લિક્ષુણી બની. ત્યાં રહ્યાથી એના મનમાં ઉલ્કાસ આવ્યો, કર્તાંયલાભવના સતેજ થઈ, લિક્ષુકોના પરમ નૈતિક જીવનથી અંતરવૃત્તિએ શુદ્ધ થઈ. એમ કર્યોથી એ થોડા સમયમાં અર્હતપદને પામી. ત્યાર પછી એની ધ્યાના હિંયદિષ્ટ પામવાની થઈ. બોદ્ધધર્મમાં પણ યોગને માન્યો છે અને એ યોગના બળ વડે મતુષ્યને જુદા જુદા પ્રકારની ઝડ્ધિ મળે છે, એવું તેઓ માને છે. એ ઝડ્ધિને ‘અલિજા’ કહે છે. અલિજા છ પ્રકારની છે. એમાંની એક અલિજાનું નામ હિંયદિષ્ટ અથવા હિંય ચક્ષુપાસિ છે. એ સિદ્ધિ પ્રાપ્ત થયાથી યોગ સંબંધી વિચાર કરવાને માટે મતુષ્યની દિષ્ટ ચર્મચક્ષુ કરતાં વધારે સુક્મ થઈ જાય છે. એ દિષ્ટને લીધે તેને કયાંય રોકાનું પડતું નથી. એ શક્તિ વડે મરણ પછી મતુષ્યની કેવી ગતિ થઈ છે તે પણ યોગી જાણી શકે છે. મહાત્મા ગૌતમખુદે પોતે એ શક્તિનો ઉપયોગ ધણી વાર કર્યો હતો. અને એ અલિજા પ્રાપ્ત કરવાનું લિક્ષુણીએને પણ શીખ્યું હતું.

સફુલાએ પણ ખંતથી એ સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલું જ નહિ પણ એ સિદ્ધિ ધરાવતી બિક્ષુણીઓમાં અત્રસ્થાન પ્રાપ્ત કર્યો.

થેરીગાથામાં એની રચના છે. આત્મચરિત વણ્ણવતાં એ કહે છે કે, “ ગૃહસ્થાશ્રમમાં ગૃહિણી તરીકે રહેતી હતી તે સમયે મેં એક બિક્ષુ પાસે ધર્મની કથા સાંભળી. અચ્યુત નિવોષુપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા મારા હૃદયમાં ઉત્પન્ન થઈ. ધનધાન્ય, પુત્રપુત્રીનો ત્યાગ કરીને, કેશલુંચન કરીને મેં પ્રત્યજ્ઞા લીધી. મેં વિચાર્યું કે આ સંસારમાં હવે મારો વાસ નથી. શિક્ષણુદ્ધારા મારે ઉચ્ચ માર્ગે ગમન કરવાનું છે. રોગ-દોષને મેં ત્યજ્ઞા અને સર્વ પ્રકારના આસવતું દમન કર્યું. પૂર્વજન્મતું સમરણ થયું. મારાં હિંયચક્ષુ ઊઘડાયાં. એ બધું વિશુદ્ધ વિચાર અને સાધનાનું પરિણામ હતું. મતુષ્યતું સમય જીવન સંસ્કારોનો સંબળ હતો. એ સંસ્કારની પાર જઈને મેં મતુષ્યના કર્મ અને બંધનનો હેતુ જોયો. હવે સર્વ પ્રકારનાં બંધનોને તોડી નાખીને, પાપનો ત્યાગ કરીને શાંત મને મેં નિવોષુનો પુલ એળંયો છે.”

## ૬૧—સુજાતા થેરી

નો જન્મ સાકેત નગરમાં એક વણ્ણિક કુદુંખમાં થયો હતો. એનો પિતા રાજ્યનો કોપાધ્યક્ષ અને ધર્મધનવાન હતો. મોટી વયની થયા પછી તેના પિતાએ પોતાનાજ ક્રેવા એક કુળવાન કુદુંણના ચુવક સાથે તેતું લમ કર્યું હતું. તેમનો ગૃહસંસાર ધર્મા સુખમાં ચાલતો હતો. એક દિવસ એ સુંદર વખાલાકાર પહેરીને, અંગ ઉપર ચંહનનો લેપ કરીને તથા દાસીઓને સાથે લઈને અંજન વનમાં ચિત્તવિનોદ કરવા સારુ ગઈ હતી. ત્યાં આગળ અનેક પ્રકારની મનોરંજક રમતો રમીને એ પાછી આવતી હતી, એ વખતે યુદ્ધહેવનાં દર્શન થયાં. યુદ્ધહેવને મુખેથી મુક્તિતત્ત્વ સાંભળ્યાથી તેને સંસાર ઉપર વૈરાગ્ય ઓપન્યા. અને સાકેતનગરમાંજ થેરી થઈ.

થેરીગાથામાં ૧૪૫ થી ૧૫૦ સુધીના શ્વોક તેના રચના છે.



## ૬૨-સોણા

વસ્તી નગરીમાં એક કુળવાન ક્ષત્રિયના ઘરમાં એને શ્રા જન્મ થયો હતો. લગ્ન થયા પછી એક કુશળ ગૃહિણી તરીકે તે પ્રસિદ્ધ પામી હતી. તેને સંપત્તિ અને સંતતિ અને પુષ્ટણ હતાં. દશ પુત્રપુત્રીઓની માતા હોવાથી કોડો તેને ‘ખડુ પુત્રિકા’ પણ કહેતા. બાળકોને શિક્ષણ આપવામાં તથા સદાચારી અનાવવામાં તેણે ખડુ શ્રમ લીધો હતો. એ કાર્યમાં એણે પોતાની બાધી સંપત્તિનો ઉપયોગ કર્યો હતો. એને આશા હતી કે આ પુત્રો વૃદ્ધાવસ્થામાં એની સેવા રશો, પરંતુ એ આશામાં એને નિપણતા મળી. એના પતિએ રા પહેલેથી પ્રવજ્યા લીધી હતી. પુત્ર અને પુત્રવૃથી સત્તાવારી સોણુને સંસારમાં શરણું લેવા યોગ્ય ણીનું હોઈ રથાન ૧ જહયું. સંસારનાં સુણેની માયા તોડીને, જનસેવાની વ્રત-પરિણી લિખુણી જનવાનો તેણે સંકદ્ય કર્યો. લિખુણીસંઘમાં ગાંઠ થઈને તેણે ખુદહેવતું શરણું લીધું.

સુખ અને વૈભવમાં ઉછરેલી હોવાથી શરૂઆતમાં તો સંઘના નેથેમો એને ખડુ વસ્તુમાં લાગ્યા, પણ સંયમ વટે એણું એ નિયમો-કુ પાતન કરવાની ટેવ પાડી. પુત્રોની વર્તણું કથી તેને કોઈક પાર એદ થઈ જાવતો. એ એદ હુર કરવાને માટે એણે ‘ક્રતિ-ગાડાર’ નામનું એક વ્રત કરવા માંડયું. એ વ્રત કરનારને આ માનવી કાયાની અત્રીસ પ્રકારની અવસ્થાનું વારંવાર રમરણ રવાનો નિયમ હતો. એકાંતમાં એસીને એ રમરણ કરતી કે, એરીર ડેશ, નખ, દાંત, ચામડી, લાંદકાં વગેરે વગેરેનું બનેલું ; એમાંથી લાંદી, થૂંક, પઢ્ય, મળ, મૂત્ર વગેરે ગંધા સૂગ ચદે વા પદાંથી નીકળે છે, વગેરે વગેરે. એ પ્રમાણે વિચાર કર્યોથી હીર પ્રત્યેનો જોક છુટી જતો. અને વૈરાજનો ઉદ્યય થઈ, ચિત્ત-ન જગૃતિ આવતી. એ વ્રતથી સોણાના હૃદયનું શાલ્ય હુર થયું.

એ વ્રતની ખાતર એણે ઘણું જગરણું કીધાં. હવે દોકેઓ  
અને 'બહુપુનિકા' કહેવું છોડી દીધું અને 'આરથવીયો' નામથી  
યોલાવવાનું આરંભ કર્યું. એક ક્ષણની કુરસદ મળતી તે એમાં  
પણ એ પોતાનું વ્રત આદરતી. એક વાર લિક્ષુણીએ કામ પ્રસંગે  
ખાદી જતી હતી, ત્યારે સોણુાને પાણી ભર્યું 'કરવાનું' કામ  
સાંપત્તી ગઈ. એ કામને સારુ રસોડામાં જતી વખતે પણ તેણે  
પોતાનું નિત્યકર્મ છાડ્યું નહિ. આધ્યાત્મિક માર્ગમાં પૂર્ણતા  
પ્રાપ્ત કરી રહી હતી, એટલામાં બુદ્ધદેવે એક ગાથા ગાઈ કે,  
“ ઉત્તમ ધર્મ પાજ્યા વગર સો વર્ષ સુધી જગ્યા કરવું, તેના  
કરતાં ઉત્તમ ધર્મને એજાળીને એક ક્ષણું જગતું એવધારે સારું  
છે. ” સોણુાએ દિવ્યજ્ઞાન દ્વારા એ ગાથા સાંભળી. ઉનામણુામાં  
પાણી ગરમ કરવાનું કામ એને ડેકાણે રહ્યું અને એના હૃદયમાં  
એ ગાથા સાંભળતાંવારજ એવું પરિવર્તન થયું કે, એ અહૃત-  
પદને પ્રાપ્ત થઈ. અહૃતપદની તે પ્રાપ્તિ થઈ પણ લિક્ષુણીએ  
પાછી આવતાં વઠશે એની એને ચિંતા થવા લાગી. થયું પણ  
એમજ. એદી વારમાં લિક્ષુણીએ પાછી ફરી અને પાણી ગરમ  
નહિ મળવાથી સોણુાને હપ્કો આપ્યો. સોણુાએ શાંતપણે ઉત્તર  
આપ્યો: “ બહેન ! તમારે અગ્નિની સાથે શું કામ છે. નહ્યાવાની  
ઇચ્છા હોય તો એસો હું ભર્યું પાણી તમારે માટે લાખું છું. ” એમ  
કહીને એ ચૂકા પાસે ગઈ અને પાણીમાં હોય ઘાલી નુંએ છે, તો  
અખળતું પાણી તૈયાર હતું. એક ઘડામાં પાણી કાઢ્યું, પણ  
એટલામાં નુંએ છે તો ઉનામણે ફરીથી લારાઈ ગયો છે. કેવો  
ચમત્કાર ! સંઘમાં બધાને ખાતરી થઈ ગઈ કે સોણુા અહૃત-  
પદને પામી ગઈ છે. તેમણે નામ્રાંશું સોણુાની પાસે ક્ષમા માગી.

બુદ્ધદેવે તેણી ચોણ્યતાનુસાર ‘વીર્યવતી લિક્ષુણી’એના  
વર્ગમાં તેને ઉચ્ચ સ્થાને મૂક્યો.

એકાંત ધર્મસાધનાના બળે સોણુાએ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું  
અને જનમરણુના હેરામાંથી સફાને માટે બચી ગઈ.



## દૃઢ-મદ્દા કુંડલકેશા

ના ગુંગળાદાર સુંદર કેશને લીધે એ ભદ્રા  
કુંડલકેશા કહેવાતી હતી. એક વખત એ  
જૈનધર્મ પાળતી હતી તેથી એનું ખીંચું નામ  
'પુરાણું નિર્બંધી' પણું છે.

એના જીવનચરિત્રમાં કાંઈક વિચિત્રતા  
છે. એનો જન્મ રાજગૃહ નગરમાં એક ધન-  
વાન વણિકને ઘેર થયો હતો. ચુવાવસ્થાને પ્રામ થતાં વણિકન્યા  
ભદ્રા પોતાના પુરેહિતના પુત્ર સાર્થકના ઉપર મોહી પડી. પરંતુ  
તેના કમનસીએ પ્રાણીણું પુત્ર સાર્થક ખરાણ ચાલચલણું નો હતો.  
એક દિવસે ચોટી કરવાના અપરાધ સારુ રાજા તરફથી તેને એવી  
સંજ કરવામાં આવી કે, એને સિંહના પાંજરામાં પૂરીને સિંહ  
પાસે ક્ષાડી ખવરાવવો. ધાતક સિપાઈઓ તેને વધ્યભૂમિ તરફ લઈ  
જતા હતા, એવામાં ભદ્રાની દિદિ તેના ઉપર પડી અને તેણે પોતાના  
પ્રેમની વાત પિતાને જણ્ણુંબી. તેના ધનવાન પિતાએ રાજ્યના  
અમલદારોને પુષ્કળ લાંચ આપીને સાર્થકની સંજ માઝ કરાવી  
અને તેનું લઘ પોતાની પુન્રી સાથે કર્યું.

સાર્થક કુચરિત્ર હતો. ભદ્રાનાં ધરેણુંની ચોટી કરવાના ઈરાદા-  
થી તેણે એક વખત કપટપૂર્વક કંધું કે, "વહાલિ ! એક વેળા  
મારા ઉપર મોટી આકૃત આવી પડી હતી. તે વખતે મેં પર્વતના  
શિખર ઉપર વસનારા એક દેવતાની માનતા માની હતી કે, હું  
સંલેઠ આપનાં દર્શન કરવા આવીશ; માટે તું સુંદર વખ્તાલાકાર  
પહેરીને મારી સાથે ચાલ. આપણે પર્વતના શિખર ઉપર જઈને  
દેવતાને પગે લાગી આવીએ." બણે જણુંં પર્વત ઉપર ચદચાં, પછી  
ભદ્રાને જન્યારે ખખર પડી કે સ્વામી તો તેને વખ્તોચન કરીને  
મારી નાખવા માગે છે, ત્યારે તેણે કંધું: "સ્વામીનાથ ! આ અલ-

કાર તમારા છે, આ જીવન પણું તમારું છે, મારો વધ શું કામ કરો છો ? તથા અલંકાર કઈને નાસી જવાનો ધરાહો શું કામ રાખો છો ? ” પરંતુ હૃદ સાર્થકના પથ્થર જેવા સખત હૃદય ઉપર તેની કાંધ અસર થઈ નહિ. તેણું પોતાનો વિચાર બદલ્યો નહિ. ત્યારે ભદ્રાએ પોતાનો જીવ બચાવવા સારુ થીજુ એક શુક્લિત શોધી કાઢી. તેણું કહ્યું : “ પ્રાણુનાથ ! મને મારીજ નાખવી છે, તો મારી એક વિનિતિ સ્વીકારેના. મને છેલ્લી વખત પ્રેમપૂર્વક આપને આલિંગન આપવા હો. ” સાર્થક તેનો સ્વીકાર કર્યો અને આલિંગન સારુ હાથ પહોળા કર્યો એટલે ભદ્રાએ તે હૃદને ધક્કો મારીને પર્વત ઉપરથી ગંભડાવી મૂક્યો. સાર્થક નીચે પડ્યો એટલે એ પર્વતમાં વસતા હેવતાએ ભદ્રાની સમયસૂચકતાની ઘણી પ્રશ્નાંસા કરી. એ પ્રશ્નાંસને લઇને ટીકાકાર ધર્મેપાલ લેણે છે કે, “ પુરુષ શું બધી જગ્યાએ પંડિતાઈ બતાવી શકે છે ? રમણી પણ કામ પડ્યે વિચક્ષણ પંડિતાઈ બતાવી શકે છે ? ”

ત્યાર પછી ભદ્રાએ વિચાર્યું કે, “ મારે હવે ઘેર પાછાં જવું એ મિથ્યા છે. હું અહીંથી જ સંસારનો ત્યાગ કરીશ.” એ ઉદેશથી એ કૈનોના નિર્ગંથ સંપ્રદાયમાં સામિલ થઈને લિખુણી બની. ત્યાંની સાધ્વીઓએ તેને પૂછ્યું : “ તું કથી શ્રેણીમાં દીક્ષા લેવા માગે છે ? ” એણું કહ્યું : “ સૌથી જાચા પ્રકારની. ” ત્યાર પછી તેમણે કાંસકા વતી તેના સુંદર વાળ કાપી નાખીને દીક્ષા આપી. પરંતુ પાછા જયારે તેના વાળ જગ્યા ત્યારે ગૂંચાંવાળા જણ્ણાયા. તેથી તેઓએ તેનું નામ કુંડલકેશા પાડ્યું. સાધ્વીઓના આશ્રમમાં રહીને ભદ્રાએ જેનધર્મશાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાનમેળન્યું, પરંતુ એથી તેને સંતોષ ન થયો, એટલે તેમની સંગત છાડીને એ બહાર નીકળી પડી. શાસ્ત્રાર્થ કરવાની તેનામાં અફુલત શક્તિ આવી હતી. રસ્તામાં કે કે વિદ્ધાન પંડિતો મળ્યા તેમની સાથે ધર્મ સંબંધી વાદવિવાદ કરવા લાગી; પરંતુ એની શાંકાઓનું સમાધાન કરે એવો કોઈ પણ પંડિત તેને મળ્યો નહિ. ત્યાર પછી તે એવું કરવા લાગી કે કે ગામમાં જય તે ગામની ભાગોળ આગળ રેતીનો ઠગલો કરીને એમાં એક છોડવો હાટી અને ગામનાં છોકરાંઓને કહેતી કે, “ તમે અહીંયાં રમ્યા કરજે અને કોઈ શાસ્ત્રી, પંડિત કે સંન્યાસી મારી સાથે શાસ્ત્રાર્થ કરવાની છચ્છા બતાવે તો એને આ છોડવાને પગ તળે કચરી નાખવાનું કહેજો. ”

એમ કહીને એ ગામમાં ધર્મપ્રચાર સારુ જતી અને આઠ દઢાડા ખંડી ગામની લાગોળે આવીને જોતી અને પોતાના છોડને સહી-સલામત હેખીને એને ઉપાડી લઈને આગળ પ્રવાસ કરવા લાગતી.

એક હિવસ ભગવાન બુદ્ધદેવનો શિષ્ય સારિપુત્ર ત્યાં આગળ થઈને જતો હતો. તેના દીઠામાં એ હગલો અને પુષ્પનો છોડ આવ્યો. તેણે છોકરાંએ પાસેથી સર્વ વૃત્તાંત જણ્ણી લઈને કહ્યું: “ આ છોડને ચયાદી નાણો.” સાંજે ભદ્રાએ આવીને જેણું તો છોડ ચયાદાઈ ગયો છે, એટલે તે સારિપુત્રની પાસે જઈને પૂછ્યા લાગી: “ આપ મારી સાથે શાખાર્થ કરવા તૈયાર છો ? ” સારિપુત્ર હા કહી, એટલે ભદ્ર આવસ્તી નગરીમાં જઈને અનેક વિક્રમાને પોતાનો અને બૌદ્ધ સાધુનો વાદવિવાદ સાંભળગવા સારુ તેહી લાવી. ભદ્રાએ પૂછ્યું: “ મહારાજ ! પહેલાં પ્રશ્ન કોણું કરશો ? આપ કે હું ? ” સારિપુત્ર ઉત્તર આપ્યો: “ સાધિ ! પહેલાં તમેજ પ્રશ્ન કરશો. પદ્ધતિથી હું પ્રશ્ન કરીશ.” ભદ્રાએ અનેક પ્રશ્નો કર્યો. તેના ઉત્તર સારિપુત્ર સંતોષકારક આપ્યા, એટલે ભદ્રાને શાંત થવું પડ્યું. છેવટે સારિપુત્ર કહ્યું: “ ભદ્ર ! તમે ઘણું પ્રશ્ન કર્યો, હવે મને એકજ પ્રશ્ન પૂછવાની રણ આપશો ? ” ભદ્રાએ સંમતિ દર્શાવી એટલે સારિપુત્ર પૂછ્યું: “ એકમ નામ કિમ् ! જેને આપણું એક કહીએ છીએંતે શું છે ? ” આ સાદા પરંતુ ગણન પ્રશ્નનો ઉત્તર ભદ્રાથી હેવાઈ શકાયો નહિ. તે ગલારાઈ ગઈ અને કહેવા લાગી: “ ભગવન્ ! મને અભર નથી ” એ ઉપરથી બૌદ્ધ સાધુએ કહ્યું: “ તને આ વાતની અભર નથી તો તું બીજું શું જણુંતી હોઈશ ? ” એમ કહીને તેને પોતાના ધર્મનો ઉપદેશ આપ્યો. ભદ્ર એ સાધુને ચરણે પડીને કહેવા લાગી: “ ભગવાનને શરણું આવું છું ” સાધુ સારિપુત્ર કહ્યું: “ ભદ્ર ! મારે શરણું ન આવશો. મતુષ્યો અને હેવતાએમાં એષ એવા મહાપૂજ્ય અમારા શુરૂ ભગવાન બુદ્ધદેવ છે તેને શરણું જાણો.” ભદ્રાએ તેની સલાહ પ્રમાણે બુદ્ધ-દેવ પાસે જઈને ધર્મીપદેશ અહણું કર્યો અને ઘણું થોડા સમયમાં તેણે અર્હત્પદ પ્રાસ કર્યું. થેરીગાથામાં ૧૦૭ થી ૧૧૧ સુધીના શ્વેષક તેના રચેતા છે.





## ૬૪-પટાચારા



પટાચારા એક ધતિહાસપ્રસિદ્ધ રમણી છે. ખૌદ્વધમં-  
માં બિલુણી બનતાં પહેલાં એતું નામ શું હતું, તે  
નણવામાં આવ્યું નથી. શ્રાવની નગરીમાં એક  
શોહિયાના ઘરમાં તેનો જન્મ થયો હતો. પટાચારા  
જ્યારે થૈવનને પ્રાસ થઈ ત્યારે તેનાં માતપિતાએ  
પોતાની ન્યાતના એક ધનવાન વણિકના પુત્ર સાથે તેનું લભ  
કરવાનો વિચાર કર્યો. પરંતુ પટાચારા તો એ પહેલાં બીજ  
ન્યાતના એક ચુંબક સાથે પ્રેમસૂત્રથી બંધાઈ ચૂકી હતી,  
એટલે તેણું પિતાની ઇચ્છા સુજગ્ય એ ધનવાન વણિકપુત્ર સાથે  
વિવાહ કરવાની ના કઢી. એ વખતમાં નાતનાનાં બંધનો હાલ-  
ના કેટલાં દશ નહોંતાં; તો પણ પોતાની કન્યા પોતાનીજ ન્યાત-  
ના એક તવંગર બુલાવાને પરણવાને બદલે પરન્યાતના ગરીબ  
ચુંબક સાથે લભ કરે એ વાત પટાચારાનાં માતપિતાને પસંદ  
પડી નહિ. તેમણે પટાચારાના વિચારને અનુમતિ આપી નહિ,  
એટલું જ નહિ પણ એને સાણ્ટ ઠપકો આપ્યો.

પટાચારાએ જ્યારે જેણું કે માતપિતા મારી પોતાની ઇચ્છા-  
નુસાર લભ નહિજ થવા હે, ત્યારે તે એક દિવસ શુસ રીતે પોતા-  
ના મનપસંહ સ્વામીને લઈને પલાયન કરી ગઈ. તે હંપતી હૂર  
હેશાવરમાં જઈને વસ્થાં એને વિધિપૂર્વક લભ કરીને સુખપૂર્વક  
જીવન વ્યતીત કરવા લાગ્યાં. એ હૂર હેશાવરમાં પટાચારાને એ  
પુત્રસંતાન જન્મ્યાં. માતપિતાનો ત્યાગ કરીને પટાચારા ચાલી  
આવી હતી; છતાં પણ માતપિતા ઉપરનો તેનો સ્નેહ ઓછો થયો  
નહોંતો. ધણ્ણા લાંબા જમય સુધી વહાલાં માબાપથી વિભૂતી રહેવા-  
ને લીધે તેને હવે દેશમાં જવાની ઇચ્છા થઈ. તેણું પતિને પોતા-  
ની ઇચ્છા જણ્ણાવી. પતિએ તેની ઇચ્છાને માન આપીને હેશમાં  
પાછા જવાનો સંકદ્ય કર્યો. પતિ એને એ પુત્રને લઈને પટા-

ચારા દેશમાં આવતી હતી, એટલામાં એક હુર્ધિટના બની. પટા-  
ચારાના પ્રિય પતિને રસ્તામાં સર્પે દંશ દીધો. અને રસ્તામાંજ  
તેનો પ્રાણ છૃઠી ગયો. પટાચારાના બજે પુત્ર હજુ ફૂધુપીતાં  
બાળક હતાં. અલાગિની પટાચારા એ મહાકષ્ટ સહન કરીને  
કરુણાજનક વિલાય કરતી કરતી પુત્રોની સાથે રસ્તો કાપવા  
લાગી; પરંતુ તેના ઉપર ખીલ વધારે મોટી આદેત આવી પડી.  
પોતાના નાના બાળકને એક જાડ તળે સુવાડીને પટાચારા કંઈ  
કામ સારુ જરા હુર ગઈ એટલામાં એક જગતી પક્ષી આવીને  
એ બાળકને લઈને જાડી ગયું. આઠલું હુઃખ પણ પૂરતું ન હોય  
તેમને ઉપર એક વધારે વિપત્તિ આવી પડી. તેનો ખીલે પુત્ર-  
તેના લુલનો. એક માત્ર આધાર-તે પણ નથી જાતરતી વખતે  
પાણીના પ્રવાહમાં તણ્ણાઈ જઈને મરણ પાર્યો.

પટાચારાના શોકનો પાર રહ્યો નહિ. એ ગાંડી થઈ ગઈ.  
છેલ્લી હુર્ધિટના જે સ્થળે બની હતી તે સ્થાન શ્રાવસ્તી નગરથી  
ઘણું હુરનહેલું. ગમે તે પ્રકારે એક વાર શ્રાવસ્તી નગરમાં જઈને  
માતપિતાનાં દર્શન કરવાની તેને ઈચ્છા થઈ; પરંતુ નસીબ ચાર  
ઉગલાં આગળજ ચાલતું હતું. શ્રાવસ્તી નગરમાં ગયા પછી  
પટાચારાને ખખર પડી કે તેનાં માતપિતા એક દિવસ વાટોગિ-  
યામાં ઘર તૃઠી પડવાથી, ઘરની નીચે ચંગાઈ જઈને મરણ  
પાર્યાં છે.આ સમાચાર સાંભળતાંવારજ પટાચારાના હોશકોશ  
બિલડુલ જાડી ગયા. એ ખરેખરી ઉન્માહિની થઈને આખા શહેર-  
માં ફરીને નેરથી પોતાના હુઃખની કહાણી ગાવા લાગી:—

ઉમો પુત્રા કાલંકતા પંથે મહ્ય પતિ સતો ।

માતા પિતા ચ ભાતા ચ એકચિત કસ્તિમન્દિશયરે ॥

એ સમયમાં ભગવાન બુદ્ધહેવ શ્રાવસ્તી નગરીમાં વાસ કરતા  
હતા. તેમના ભહિમાની તથા તેમના નવા ધર્મની કથા ચારે  
તરફ પ્રસરી ગઈ હતી. શોકાતુર રમણી પટાચારા ગોતાની શોક-  
કથા કહેતી કહેતી અશ્રુધારથી તેમનાં ચરણ્ણારવિંદ પ્રક્ષાલન  
કરતી બુદ્ધ ભગવાનના ચરણ્ણમાં જઈને પડી. કેવળ પટાચારાજ  
નહિ પણ ખીળાં પણ અસંખ્ય હુઃખી ખીપુરુષો આશ્વાસન  
દેવાને તથા ધર્મોપહેશકારા શોકસંતસ હૃદયને શીતળ કરવા માટે  
બુદ્ધહેવ પાસે જતાં. બુદ્ધહેવના પવિત્ર ચરિત્ર તથા મનુષ્યો  
ઉપરની કરુણાએ સર્વેનાં ચિત્તને તેમની તરફ આકૃષ્ટ કર્યાં હતાં,

પટાચારા ન્યારે બુદ્ધ હેવની પાસે ગઈ ત્યારે હ્યાણું બુદ્ધહેવેલી મીઠાં વચ્ચેનોથી તેને સતકાર કર્યો અને તેને જોવો અમૂહ્ય મધુર ઉપહેશ આપ્યો કે એ પોતાનું સધગું હું ખ એકદમ વીસરી ગઈ. એ ઉપહેશમાંનું એક વચ્ચન ‘ધર્મપદ’ અંથમાં સમાયલું છે. ‘જન્મ અને મૃત્યુ નોયા વગર સો વર્ષું સુધી જીવવા કરતાં તેનું ખડું રહુસ્ય સમજીને એક દિવસ પણ જીવન ધારણું કર્યું હોય તો તેનું કેળ અધિક છે.’

પટાચારા હુંવે સંસારત્યાળી ‘થરી’ લિક્ષુણી બની. જન-સમાજની સેવા કરવામાં તથા તેમને ધર્મોપહેશ આપવામાં તેણે પોતાનું જીવન સમર્પણ કર્યું. સેંકડો શોકાતુર રમણીએ પટાચારા પાસે ઉપહેશ સાંભળવા આવતી, તેના ઉપહેશ અને દિવાસાધી તેઓ શોકા સમયમાંજ પોતાનું હું ખ વીસરી જતી અને પટાચારાનું શિષ્યત્વ અદ્દણ કરતી. પિટક અંથ વાંચતાં જણાઈ આવે છે કે એક વખત પાંચસો સ્ક્રીએની સલામાં પટાચારાએ એવો સરસ ધર્મોપહેશ આપ્યો હતો. કે એ સ્ક્રીએ બુદ્ધહેવના નવા ધર્મની દીક્ષા લીધી હતી. પોતાના વ્યાખ્યાનકારા એકજ સાથે આટલી મારી સંખ્યા ઉપર આવી ગંભીર અસર કરવાનું સહભાગ્ય માત્ર શોકાજ પુરુષ વક્તાએને પ્રામ થયું હશે. કોઈ પણ હેશના ધર્મસમાજના ધર્મિણાસમાં બૌદ્ધધર્મમાં દીક્ષા પામેલી ‘થરી’ (સ્થવિરા અર્થોત શાનવૃદ્ધ) લિક્ષુણીએના જેટલી પ્રલાવશાળી રમણીએની કથા વાંચવામાં આવતી નથી.

‘થરીગાથા’ નામના પુસ્તકમાં પટાચારાની સરળ પ્રાકૃત ભાષામાં રચેલી અનેક ગાથાએનો સંબળ છે. અઢીહન્દર વર્ષું પૂર્વે ભારતવર્ષની સ્ક્રીએના કેવી સરસ રચના કરી શકતી હતી તેનું લાન એ ગાથાએ વાંચવાથી થાય છે. એ અંથમાં પટાચારાના જેવી બીજી પણ હર ‘થરી’એની રચેલી ગાથા છે.

એક વખત જેતવનના વિહારમાં ઉત્સવ શરૂ થયો. બુદ્ધહેવે આસન ઉપર બિરાળને લિક્ષુણીએને યોગ્યતાનુસાર પદવી આપવા માંડી. પટાચારાનો વારો આવ્યો ત્યારે વિનયધરા લિક્ષુણીએમાં તેને અગ્રસ્થાન આપ્યું.

ઉત્તમ ધર્મકથાકાર તથા સંધનાયિકા તરીકે પટાચારાની જ્યાતિ સર્વત્ર પ્રસરી ગણ હતી.



## ૬૫—ચંદા



ક અત્યાંત હરિદ્ર પ્રાણથુના ઘરમાં તેનો જન્મ  
થયો હતો. એક વખત એના જામાં કોઈ ચીપી  
ત્યાગ પ્રસથો અને તેનાથી તેના માતપિતા વગેરે  
સર્વે સગાંસંગાંધી ભરણું પામ્યાં. ચંદા પાંસે  
ઉદ્દરનિર્વાહનું ણીણું કોઈ સાધન નહિ હોવાથી,  
તેણે લિક્ષાવૃત્તિનો આશ્રય લીધો. એક દિવસ  
પરમ સાધ્વી પટાચારા બોજન કરીને પોતાની શિષ્યાઓ અહિત  
એડી હતી, ત્યાં ચંદા આવીને ડાબા. તેણી કંગાલ અવસ્થા જોઈને  
પટાચારાની શિષ્યાઓને હથા ભાપળ અને તેમણે પોતાના ભાગ-  
માંથી બચેલું બોજન તેને આપ્યું. તેમના આવા પરોપકારી  
આચરણથી ચંદા ઘણી પ્રસન્ન થઈ અને તેમને વિનાયપૂર્વક નમ-  
સ્કાર કરીને તેમની પાંસે એક કોરાણે જઈને એડી.

એ વખતે શેરીએમાં શાસ્ત્રસંબંધી ચર્ચા ચાલી રહી હતી.  
ચંદાને ધર્મશાસ્ત્રની વાતમાં ઘણો રસ પણ્યો. તેને પણું અવન-  
ભરણુના ઈરામાંથી છુટવાની તીવ્ય છંદા થઈ અને એ છંદા પૂર્ણ  
કરવાના ઈરાદાથી સંસારનો ત્યાગ કરીને તેણે લિક્ષાણી નતને  
અંગીકાર કર્યું. પટાચારા કેવી વિહુપી અને પરમ જ્ઞાની સાધ્વી.  
ના રાતદિવસના સમાગમથી તથા તેના અમૃતમય ઉપદેશથી  
ચંદાને થોડા સમયમાં અંતર્શીળ પ્રાપ્ત થયું અને ત્યાર પછી  
યથાર્થ સમયે તે અહીંત્પદને પામી.

‘શેરીગાથા’માંના ૧૨૨ થી ૧૨૬ સુધીના શ્વોકો ચંદાના  
રચેતા છે.



## દુદુ-વાશિષ્ઠી

શાલી નગરમાં એક ધનાળ્ય અને વૈભવશાળી આખ્યણું કુંભમાં તેનો જન્મ થયો હતો. પોતા-નાજ જેવા ધનવાન અને પ્રતિષ્ઠાવાન કુળના એક ચુંબક સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું હતું. વાશિષ્ઠીને પતિ ઉપર ઘણો પ્રેરણ હતો. જનેનો સંસાર ઘણું સંપર્માં સુખપૂર્વક ચાલતો હતો. બાળ સમયમાં વાશિષ્ઠીએ એક નુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. હવે એ હંપતીના સુખનો પાર રહ્યો નહિ; પરંતુ વિધાતાની કળા વિચિત્ર છે. એ પ્રેમી હંપતીના નેત્રમણી સમાન એ બાળક ચાલવા ચોણ્ય થયો. તે સમયે વિકરાળ કાળનો ચાસ થયો. એના મૃત્યુથી માતરિતા જનેને દારુણ શોક થયો.

સગાંવહાલાંએ વાશિષ્ઠીના પતિને આશ્વાસન આપવામાં દોકાયાં હતાં તેવામાં લાગ સાધીને વાશિષ્ઠી ઘરભારનો ત્યાગ કરીને અરણ્યમાં નીકળી પડી. ફરતી ફરતી એ મિથિલા નગરીમાં આવી પહોંચી અને ત્યાં આગળ મહાસંધમી, પૂજયપાદ લગવાન જુદ્ધદેવનાં તેને દર્શન થયાં. તેમના દર્શનમાત્રથી તેનો શોક જતો રહ્યો અને અંતઃશાંતિને સારુ તેણે ભગવાન પાસે ઉપદેશ માપ્યો. તથા બિલ્ખુણીસંધમાં દાખલ થવાની ઇંચ્છા દર્શાવી. ભગવાન જુદ્ધદેવે તેને બિલ્ખુણી-સંધમાં દાખલ કરી તથા આવશ્યક સંસ્કારપૂર્વક તેને દીક્ષા આપી. સ્વયં જુદ્ધદેવને સુખેથી ધર્મનું રહસ્ય શીખ્યાથી વાશિષ્ઠી ઘણું બાળ સમયમાં અર્હતપ્રદને પામી ગઈ.

શ્રીગાથામાં ૧૩૩થી ૧૩૮ સુધીના શ્વોકમાં તેણે પોતાનું આત્મચરિત વર્ણિયું છે.



## ૬૭-અનોપમા (અનુપમા)

એ ને જન્મ સાડેત નગરમાં એક શેડને લાં થયો હતો. એના અનુપમ રૂપલાવણ્યને લીધે ખોડો તેને અનુપમા કહેતા. તેના સૌંદર્યથી સુગ્રથ થઈને અનેક રાજકુમારો, પ્રધાન-પુત્રો તથા શેડિયાઓ તેના હાથની માગણું કરતા. અનોપમાના પિતાને તેણો અનેક પ્રકારની લાકચો અતાવતા. અનોપમાએ એક દિવસ પિતાને કહ્યું કે, “હું સર્વાશ્રેષ્ઠ પાત્રને વરીશ.” ત્યાર પછી એણે યુદ્ધ ભગવાનના ચરણુકમળનો આશ્રય લીધો. યુદ્ધ ભગવાને તેને ધર્મનો ઉપહેશ કર્યો અને અંતર્ગત પ્રાસ થવાને માટે જે સાધન કરવાનું હતું તે સમજાવ્યું. ત્યાર પછી યુદ્ધ ભગવાનની આજાથી તેણે બેરીપદ સ્વીકાર્યું. બિકૃણી થયા પછી સાતમે દિવસે તેણે અર્હતપદ પ્રાપ્ત કર્યું.

શેરીગાથામાં ૧૫૧ થી ૧૫૮ સુધીના શ્રોક તેના રચેતા છે.

## ૬૮-ઉત્તરા (વીજી)

એ ને જન્મ શાવસ્તી નગરીમાં એક ક્ષત્રિય કુટુંબમાં થયો. એ હતો. યુવાવસ્થા પ્રાસ થયા પછી પટાચારાના ઉપહેશથી તેણે બિકૃણીવત ધારણ કર્યું હતું. એક દિવસ પટાચારાએ શીખયેતી પદ્ધતિ પ્રમાણે ધ્યાન ધરવા સાડ એ એકાંત સ્થળમાં જઈને આસન વાળીને એકી તથા સંકદ્યપ કર્યો કે, “જ્યાંસુધી મારા હૃદયને બધી જલતના આસવોના અધિકારમાંથી સુકૃત નહિ કરું, ત્યાંસુધી હું અહીંથી ઊડીશનહિ.” એ પ્રમાણે દશ સંકદ્યપ કરીને તેણે ધ્યાન ધર્યું અને થોડા સમયમાં અહૃતપદ પ્રાપ્ત કર્યું. શેરીગાથામાં ૧૭૫ થી ૧૮૧ સુધીના શ્રોક તેના રચેતા છે.



## ૬૯-ગુપ્તા



નો જન્મ શ્રાવસ્તી નગરીમાં પ્રાણણું કુદુંખ-  
માં થયો હતો. કુમારી અવસ્થામાંજ તેણું  
માતપિતાની સંમતિથી સંસારત્યાગ કરીને  
થેરીવત અંગીકાર કર્યું હતું.

શ્રુતાવસ્થાના પ્રલાવને લીધે એકદમ તેનું  
મન સંયમમાં આંથું નહિ. સાંસારના લોગવૈભવ જોઈને તેનું  
ચિત્ત એ તરફ આડખોતું. એવે સમયે બુદ્ધ લગવાને તેને દર્શન  
આપીને કલ્યાં કે, “હે ગુપ્તે! પુત્રપુત્રીવર્ગેરેના સુખની આશાનો  
ત્યાગ કરીને કુમારી દશામાંજ તેં સંન્યાસ અહણું કર્યું છે. પરમ  
તત્ત્વ પ્રાસ કરવાને સારુ હવે તારે સાધના કરવી જોઈએ અને  
ચિત્તને વશ રાખવું જોઈએ. મનુષ્યોના પ્રલોકનમાં ઇસાઈ પણ્યા-  
થી તારે સેકડો વખત જન્મમરણુના ઝેરામાં પડલું પડશે; માટે  
કામનો નાશ કરીને, આત્મા ઉપર વિજય મેળવીને સહાયરણ-  
પૂર્વક ચાલ. જીવનનાં અસાર કર્મોનો ત્યાગ કરીને હુઃખ ઉપર  
વિજય મેળવ. હે બિલ્ખણિ! સંસારની આસક્તિનાં બધાં બધનોને  
તોડી નાખ. રાગ, દ્રેપ, માન, અપમાન, અવિદ્યા અને ઉદ્ઘતા-  
ઇનો ચિત્તમાંથી સમૂળગો નાશ કર; એટલે હુઃખ તને પીડા  
આપી શકશે નહિ. જીવનનું રહસ્ય જાણીને તું સુનર્જન્મની  
ઉપાધિમાંથી સુક્તા થા.”

બુદ્ધ લગવાનના આ સુમધુર ઉપદેશની તેના ઉપર ધણી  
પ્રયત્ન અસર થઈ. તરતિજ તેણું અર્હતપ્રદ પ્રાસ કર્યું.

થેરીગાથામાં ૧૬૩ થી ૧૬૮ સુધીના શ્રોક તેના રચેલા છે.



## ૭૦-વિજયા

કુંઠાલાણ  
કુંઠાલાણ જગૃહ નગરમાં કોઈ ક્ષત્રિયને ઘેરતેનો જન્મ થયો હતો.  
કુંઠાલાણ માટી થથા પછી રાજરાણી ઐમા સાથે તેનાં બહેનપણું અંધાયાં. ઐમાએ જ્યારે સંસારનો ત્યાગ કરીને શૈરીપદ અહણ કર્યું, ત્યારે વિજયાને વિચાર આવ્યો કે, “મારી જખી રાજકૈલવ છાડીને બિક્ષુણી બની શકે, તો હું પણ એમ શા માટે ન કરું? અનેક હુઃખીથી ભરેલા આ ચંસારમાં શા સારુ પડી રહું?” એમ વિચારીને એ પણ શૈરી બની. ઐમાએ એને ધર્મનું તથા બિક્ષુણી-આનાં કર્મોનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે ચાહ્યાથી તથા એકાશચિત્તે અલ્યાસ કર્યાથી એ અર્હતપદને પામી હતી.

શૈરીગાથામાં ૧૬૪ થી ૧૭૪ મા શ્વોષ સુધીની રચના એની છે. એમાં એ પાતાનો ધાર્મિક અનુભવ વણું વે છે કે, “મનની શાંતિ અને વિચારો ઉપર કાબૂ મેળવવા સારુ હું મારો એકાંતવાસ છાડીને બલદાર આવી અને જેતરેઝેતર ફરી. ત્યાર પછી હું બિક્ષુણી ઐમાની પાસે ગઈ અને તેની આગળ મારા ચિત્તને ડામાડોળ કરી મૂકનારી શંકાએ જણાવી. તેમની પાસેથી હું હુઃખું કારણું સમજ અને ધર્મ શીખી; વળી શ્રેષ્ઠ તત્ત્વો તથા ઈદ્રિય ને ખલનું નિરાન જાપણું. ધર્મના આઠ માર્ગ અને ષુદ્ધની આજાએં પણ શીખી. બિક્ષુણીની આજા માનીને સાધનામાં ચિત્ત પરોંયું. રાત્રીને પહેલે પહેલાર્જ પૂર્વજન્મનાં સમરણેણું ઉદ્ય થઈ આવ્યાં અને રાત્રીના બીજા પહેલારમાં દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયાં. ત્રીજે પહેલારે આ ચિત્તમાંથી અંધકારનો નાશ થઈ ગયો. આ પ્રમાણે મનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરીને જાંડી સાધનામાં હું સાત દિવસ સુધી ઐડી. સાતમે દિવસે મારો અંધકાર ચાહ્યો ગયો.”



## ૭૯—ચાલા



ગધ હેશના નાતક નામના ગામમાં અનો જન્મ  
મ થયો હતો. એની માતાનું નામ સુદૃપ્સારી  
હતું. પ્રાણણી સુદૃપ્સારીનો પુત્ર જારીપુત્ર  
હતો. સારીપુત્રે સંસાર ત્યાળીને પોતાના  
જાનને લીધે થર-સાધુ તરીકે ઘણ્ણીજ જ્યાતિ મેળવી હતી.  
બુદ્ધભગવાનના આગેવાન શિષ્યોમાં તેની ગણુતરી હતી. મોટા-  
ભાઈએ સંસાર ત્યલુને ખૌદ્વધમનો સ્વીકાર કર્યો, ત્યારે ચાલા  
અને તેની બીજી એ બહેનોએ વિચાર કર્યો કે, “મોટાભાઈ  
જેવા જાની અને વિચારશીલ પુરુષે જે ધર્મ અને આશ્રમનો  
સ્વીકાર કર્યો છે, તેમાં અવસ્થય કાંઈ ઉત્તમ તત્ત્વ હોય જેઠાં.  
એ ધર્મ અસાધારણુ હોવો જેઠાં. અમે પણ ભાઈનુંજ અનુસરણ  
કરીશું.” એમ વિચારીને એ વણે બહેનોએ સંસારનો ત્યાગ કરીને  
થેરીત અંગીકાર કર્યું. તેમની યુવાવસ્થા અને સૌંદર્યને જેઠાં  
‘મારે’ તેમને લલચાવવા અને સંસારની જળમાં ફ્રસાવવાને  
ધણેણું થતન કર્યો. મારની સાથેનો પોતાનો વાતીલાપ થેરીગાથા-  
માં ચાલાએ વર્ણુંયો છે.

સાધુપથને અનુસરી, ઈદ્રિયદમન કરી, શાંતપદ અને સંયમનું  
સુખ પ્રાપ્ત કરી એ લિક્ષ્ણી જગતનાં હુંએને ત્યલુને એઠી હતી;  
એવામાં મારે આવીને તેને પ્રશ્ન કર્યો: “શા ઉદેશથી શિર  
મૂંડાયું છે અને ચીર ધારણ કર્યું છે? શ્રમજીના જેવો વેશ શા  
સારુ ધારણ કર્યો છે? પાખંડીઓના દળમાં તું શા સારુ હાખલ  
થઈ છે? કયું ઇણ મેળવવાની તારી આશા છે?”

ચાલાએ ઉત્તર આપ્યો: “પાખંડી તો એ છે કે, જેએ જાન-  
દિષ્ટીન છે, ધર્મનું તત્ત્વ જાળુતા નથી અને મૂખું છે. શાકચ-  
કુળમાં જન્મેલા નરશ્રેષ્ઠ મને ઉપહેશ આપીને બધી બાબતોનું

શિક્ષણ આપણું છે. હુઃખનું કારણ તથા હુઃખ શાથી જાય છે, તે હું શીખી છું. આરોના ધર્મનાં આડ અંગનું શિક્ષણ પણ મેં મેળાંથું છે. એ ગુરુહેવની વાણીને અનુસરીને હું જગતમાં વિચરણ કરું છું. તથા ગતની સેવા કર્યાથી મેં ત્રિવિદ્યાને પ્રાપ્ત કરી છે. મારી લોગની તૃપ્તિ મરી ગઈ છે; અંધકાર ચાલ્યો ગયો. હે. હે માર! તું અહીંથાં હણ્ણાયો છે. ચાલ્યો જા.

## ૭૨—વડુઠમાતા

જીએ

એક ગુજરાતી ભગીની હતી. એનો જન્મ નર્મદા નદીના પલિત્ર તટ ઉપર ભર્યા (ભૂગુકચ્છ) નગરમાં એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તેને વડુઠ અથવા વર્ધક નામનો એક પુત્ર હતો. અને એના નામ ઉપરથી એ પણ વડુઠમાતા તરીકે આળાય છે. એક બિક્ષુણીનો ધર્મપદેશ સાંભળીને તેને વૈરાણ્ય ઉત્પન્ન થયો. અને પોતાના એકના એક પ્રિયપુત્રને કોઈ સંભાંધીને સોંપીને તેણું બિક્ષુણી-ત્રત થફણ કર્યું. તેનો પુત્ર વર્ધક માટે થયા પછી માતાનાં દર્શન કરવા સારુ એક વખત બિક્ષુણીએના આશ્રમમાં ગયો. માતાએ ત્યાં આવવા સારુ ઠપકો. આપીને નીચે પ્રમાણે ઉપહેશ આપ્યો: “હે એટા વર્ધક! આ લવરૂપી ઘાડા જંગલમાં તું કાંશાં મારતો કર્યો ન કરીશ. એટા, કરી કરીને જન્મમરણું પામવાને લીધે જે હુઃખ ઉત્પન્ન થાય છે, તે તું વહેણી ન લઈશ. અરા સુખી તો એજ લોકો છે કે, જેમણું જ્ઞાન વડે બધા સંશય દૂર કર્યો છે; જેઓ શાંત, સંયમી અને આસક્તિ રહીત થઈને આ જગતમાં વાસ કરે છે. અધિયો સદા એજ માર્ગ જાય છે, માટે તું પણ એજ માર્ગ થફણ કરને ધર્મમાં ચિત્તને પરોાવ.”

માતાના ઉપહેશથી સંસાર ઉપરથી સધળી આસક્તિ કાઢી નાખીને પુત્ર વર્ધક પણ વિહારમાં ગયો. અને ત્યાં આગળ એકાંતમાં એકાશચિત્તે ધર્મનું ચિંત્વન કર્યાથી અર્હતપદને પાર્યો.

માતાપુત્રનો વાદવિવાદ થેરી વડુઠમાતાએ ૨૦૪ થી ૨૧૨ સુધીના શ્વોક દ્વારા થેરીગાથામાં વણ્ણુંયો છે.



## ૭૩-ઉપचાલા

પણ સાધુ સારીપુત્રની અને આગલા ચરિત્રમાં વર્ણાય બેલી સાધી ચાલાની બહેન હતી. એણે પણું ભાઈના સાધુ થયા પછી સંસારનો ત્યાગ કરીને બિક્ષુશ્વિત્વત ધારણું કર્માણું હતું. શ્રીગાથામાં એની રચના છે. એ સત્યમાં શ્રદ્ધાવાળી, સંયમ ધારણુંપૂર્વક, સાધુએને મળતી શાંતિ પ્રાપ્ત કરીને ધર્મમાં નિમજ્જ્ઞ હતી; એવે સમયે માર તેને ધર્મના માર્ગમાંથી ચણાવવા સારું એની પાસે ગયો અને કહેવા લાગ્યો:—

“તને આ મહુષ્યજન્મ પસંદ નથી? જીવને લોગવવા યોગ્ય સુખ અને લોગવિલાસ નહિ લોગવે તો પછી પસ્તાવો થશે.” ઉપચાલા તો જાની હતી. મારની પ્રપંચબળગમાં ઈસાય એવી ન હતી. એણે કહ્યું: “જે જન્મયો છે, તેને ભરવાનું જરૂર છે. માણસને હાથે હાથપગ કાપી નાખાવા, કેહ થવું અને વધ થવો આહિ અનેક જાતનાં હુંઘ અને લાગેલાં હોય છે. શાકયુકૃગમાં જન્મેલા યુદ્ધ અત્યારે જાત છે, એમણું મને ઉપહેશ આપ્યો છે, તે વડે હું જન્મને જીતી ગઈ છું. હુંઘ શાશ્વત ઉત્પજ્ઞ થાય છે અને શાથી જય છે, એ આયોના અષ્ટાંગ ધર્મને હું જાણું છું.”

## ૭૪-શિશુ ઉપચાલા

સાધી ઉપચાલાની નાની બહેન હતી અને એમની માર્કિંગ સાધી થઈ હતી. એને પણ માર લલચાવવા સારું આવ્યો હતો; પરંતુ મારને ધર્મનો ઉપહેશ આપીને એણે વિદ્યાય કાયો હતો.

શ્રીગાથામાં ૧૬૬ થી ૨૦૩ સુધીના શ્વોઙ એના રચેલા છે.



“ હેડકું, કાચયો, સાપ, મગર, ઈત્યાદિ પાણીમાં રહેનારાં સર્વ પ્રાણીઓ, સ્વર્ગેજ જવાનાં છે કે શું ?

“ અકરાં મારનારા, કુલ્લર મારનારા, માછલાં મારનારા કોળી, પારધી, ચોર, કાંસીની શિક્ષા થધ હોય તે માણુસો અને ખીન પાપી લોડો સ્નાન કર્યોથી પાપકર્મથી સુક્રત થશે કે શું ?

“ હેથાદ્ધાણુ ! આ નદીઓ જે તારં પાપ વહીને લઈ જશે, તો તે સાથે પુણ્ય પણ લઈ જશે, એટલે તારં પુણ્ય પણ જશે.

“ માટેહ થાદ્ધાણુ ! જે પાપના લયથી તું નિત્ય આ પાણીમાં જતરે છે, તેજ પાપ તું કરીશ નહિ. અમસ્તો ઠાંડીથી તારા શરીરને હુઃખી શા માટે કરે છે ?”

પુણિષુકાનો આ ઉપદેશ સાંલળીને, થાદ્ધાણ સંતુષ્ટ થયો. અને એક વચ્ચ લઈને તેની પાસે આવ્યો. અને તેને કહ્યું : “ હે પુણિષુકે ! તેને કુમારોથી સુમારો વાજ્યો, માટે આ વચ્ચ હું તને આપુછું.”

પુણિષુકા બોલી : “ હે થાદ્ધાણુ ! તારં વચ્ચ તારી પાસેજ રહેવા હે, હું તે લેવા ધર્યાની નથી. તું જે હુઃખી બીતો હોય, તને હુઃખ અગ્રિય હોય, તો એકાંતમાં કે લોકસમૂહમાં તું પાપકર્મ કરીશ નહિ.

“ જે તું પાપકર્મ કરે છે અગર કરીશ તો ગમે ત્યાં નાસી જઈશ, તેપણું તું હુઃખી સુક્રત થવાનો નથી.

“ જે તું હુઃખી બીતો હોય, તને જે હુઃખ અગ્રિય હોય, તો તું યુદ્ધને અને તેના સંઘને શરણે જા. શીલના નિયમ પાળવાથીજ તારં કદ્યાણ થશો.”

આ ઉપરથી તે થાદ્ધાણ બૌદ્ધમતાનુયાયી થયો. સાધ્વી પુણિષુકાના ઉપદેશથી સન્મારો ચેલો એ થાદ્ધાણ આગળ જતાં મોટો સાધુ થયો, ત્યારે તેણે ઉદ્ગાર કાઢ્યા કે, “ પહેલાં હું માન નામનોજ થાદ્ધાણ હતો; પરંતુ હું ખે અરો થાદ્ધાણ થયો છું. કારણ હું વૈવિધ ( બૌદ્ધધર્મમાં કહેલી ત્રણ વિદ્યા જાણુનારો ) છું, વેહસંપત્ત અને જ્ઞાનસંપત્ત છું. હું પુરેહિત ( સ્વસ્તિ સુખના લાભવાળો ) છું, સ્નાતક ( સુક્રત ) છું, ધન્ય છે ! વિપથગા-મીઓને સત્પથગામી કરનારી પુણિષુકા જેવી દેવીઓને !\*

\* ‘ ગ્રાનસુધા ’ પૃ. ૨૪, અંક ૧૧ માના એક લેખમાથી સાલાર ઉકૂટ.



## ૭૬—અંબપાલી ગળિકા



ઝુભગવાન એક વખતે વૈશાલી નગરમાં અંબ-  
પાલી ગળિકાના આભ્રવનમાં વિશ્રામ કરતા  
હતા. અંબપાલીને તેમનાં દર્શન કરવાની  
ઇચ્�ા થઈ અને તેથી એ બળીયામાં ગઈ.  
તેનાં વસ્ત્રાલૂપણું સામાન્ય હતાં હતાં પણ તેનું  
સૌંદર્ય ધારું મનોહર લાગતું હતું. તેને આવતી જોકુને યુદ્ધ ભગવાન  
પણ ક્ષણિવાર તેના સામું એકીએકી જેઈ રહ્યા. તેના સૌંદર્યને માટે  
મનમાં ને મનમાં પાતે એલવા લાગ્યા: “આ સ્વી કેવી પરમ સુંદરી  
છે ! મોટા મોટા રાજઓ પણ તેના રૂપ અને લાવણ્ય ઉપર  
મોહિત થઈ જઈને તેને વશ થઈ જાય છે, તો પણ એ કેવી ધૈર્ય-  
વાળી અને શાંત છે. તેના સ્વભાવમાં ચંચળતા જણાતી નથી. જગત-  
માં એવી સ્વીએ હુર્ભલ હોય છે.” અંબપાલી આવીને યુદ્ધદેવ-  
ની પાસે એડી. યુદ્ધદેવ તેને ધર્મસોપહેશ આપીને તેના ચિન્તમાં  
રહેલી જરા સરખી ચંચળતા પણ એકદમ હર કરી નાણી. તેના  
હૃદયમાંની વાસનાઓનું તેમણે મૂળમાંથી જ ઉચ્છેદન કરી નાણ્યું.  
તેનું હૃદય પીગળી ગયું. ધર્મ ઉપર તેનો દઠ વિશ્વાસ થયો.  
યુદ્ધદેવને શરણે આવીને એ ગળિકાએ કહ્યું: “હે પ્રભો ! કાલે  
આપ શિષ્યમંડળી સાથે મારે ઘેર લિક્ષા કરવા પધારશો તો હું  
ધાર્યોન ઉપકૃત થઈશ.” યુદ્ધદેવ મૌનલાવે સંમતિ રદ્દાવી.

એટલામાં એ નગરના કેટલાક ધનવાન ચુંબકો સુંદર રથમાં  
આભ્રવનમાં આવી પહોંચ્યા. એ લોકો રંગબેરંગી વસ્ત્ર અને  
કિંમતી અદંકારાથી ભૂલિત હતા. યુદ્ધદેવ પોતાના લિક્ષાશિષ્યોને  
એ ચુંબકો ભતાવીને કહ્યું: “બુઝો, આ લોકો કેવા ઠાડથી આવ્યા  
છે ! જાણું કે દેવતાએ ભૂમિ ઉપર કીડા કરવા આવ્યા હોય એવા  
લાગે છે.” તેમણે આવીને યુદ્ધદેવને પ્રણામ કર્યો તથા પોતાને  
ત્યાં લોજન કરવા પધારવાનું નિમંત્રણ કર્યું; પરંતુ યુદ્ધદેવ પહેલે-

થીજ ગણ્યિકાનું આમંત્રણ સ્વીકારી ચુક્યા હતા, એટલે તેમને એ ધનિક શૈદિયાઓને ના કહેવી પડી. એ શૈદિયાઓની એવી દિચ્છા હતી કે, યુદ્ધદેવ ગણ્યિકાનું આમંત્રણ પાછું ઠેલે. તેમણે એટલા સારુ ઘણી દલીલ કરી અને દલીલથી ન ફાળ્યા ત્યારે નભ્રતાપૂર્વક ઘણ્યાજ કાલાવાલા કર્યા; લેટની પણ ઘણી લાલચ ખતાવી, પણ યુદ્ધદેવ કાંઈ આજકાલના લોલી આચારો જેવા થોડા હતા કે, એવી લાલચોથી ઘનવાનનું માન રાખીને ગરીબ લક્ષ્ણનો અનાદર કરે ? રાજ્યવૈલખને તો એ પહેલીથીજ લાત મારી ચુક્યા હતા. હવે એમને ઘનની શી પરવા હતી ? તેમણે એ યુવકોને સ્પષ્ટ રીતે કહી દીધું કે, “તમે મને આખું વૈશાલી નગર અર્પણું કરી હો, તો પણ હું અંબપાલી ગણ્યિકાના નિમંત્રણનો અસ્વીકાર કરી શકું એમ નથી.” એ ઘનવાન યુવકો યુદ્ધદેવની વિરાઘ અગ્રણી ઘેર ગયા.

બીજે દિવસે યુદ્ધદેવ પ્રાતઃકાળમાં નિત્યનિયમથી પરવારીને વરણ વચ્ચ પહોંચે, શિષ્યો સાચે અંબપાલીને ઘેર પદ્ધાર્યા.

અંબપાલીએ ગણ્યિકાના ઘંધામાં અઠળક ધન ચેદા કયું હતું. તેનું ઘર એક રાજના મહેલ જેવું ભંય હતું. ઘરની આસપાસ સુન્દર બાળીઓ લાગ્યો હતો. આજ યુદ્ધદેવના સતકારથોં તેણે ઘરને શાણુગારવામાં કાંઈ મણું રાખી નહોતી. જાતનાતનાં લોજનો તેમને સારુ તૈયાર કર્યાં હતાં એ સ્વાહિષ લોજનથી તેણે યુદ્ધદેવને તૃપ્ત કર્યા. લોજન કરી રહ્યા પછી હાથ જેડીને ભગવાન યુદ્ધને નિવેહન કર્યું કે, “મહારાજ ! મારા આ બાળ-બાળીઓ, મહેલ તથા અલંકાર એ બધું હું આપને તથા આપના સંઘને સમર્પણ કરું છું. આ કુરુ ઉપહારનો સ્વીકાર કરીને મારો અલિકાલાપ પૂર્ણ કરો.” યુદ્ધદેવે તેણે પ્રીતિપૂર્વક આપેલા ઉપહારનો સ્વીકાર કર્યો તથા તેને ઘણે ઉત્તમ ધર્માપહેશ આપીને પોતાની શિષ્યા તરીકે દીક્ષિત કરી.

યુદ્ધદેવ એ નગરીમાંથી બીજે સ્થળે પદ્ધાર્યા પણ અંબપાલી ગણ્યિકા નવજીવન પ્રાપું કરીને જનસમાજની સેવા કરવામાં તથા ધર્મનું ચિંત્વન કરવામાં પ્રવૃત્ત થઇ.



## ૭૭—રોહિણી



શાલી નગરીમાં એક ધનાલ્ય પ્રાદીપુને ઘેર અનો જન્મ થયો હતો. ધર્મનું જાન અને યાવ્યાવસ્થામાંજ થયું હતું. સાધુસંત ઉપર તેની વિશેષ ગ્રીતિ હતી. એક દિવસ તેના પિતાએ તેને કહ્યું: “ રોહિણી ! રસ્તામાં શ્રમણ (લિલુક) ચાલ્યો જતો હોય છે તો તું તેને ખોલાવે છે તથા મને કહું છે કે આ શ્રમણના દર્શાન કરો. તું સાટા શ્રમણના ગુણું ગાચા કરે છે, શું તારો વિચાર પણ શ્રમણી થવાના છે કે? શ્રમણ આવતાં વારજ તું તેને અજ્ઞાતાન કરેછે. એ લોકો તને શા સારુ એટલા અધા પ્રિય છે ! એ લોકો આળસુ અને પારકાના ફાનથીજ પેટ ભરનારા, લોલી અને જાર્ઝ જાર્ઝ ભાવાના શોખીન હોય છે, તેવાએ ઉપર તને ગ્રીતિ કેમ ઉત્પન્ન થાય છે ? ” એના ઉત્તરમાં રોહિણીએ કહ્યું કે, “ પિતાજ ! આપે આનો આ પ્રશ્ન ઘણીવાર પૂછ્યો છે. આજે હું આપની આગળ એ સાધુઓના અદ્ભુતુણાનું, તેમના ડાપણનું તથા તેમનાં સત્કારોનું થોડું કિંબાદ વિવેચન કરીશ.

“ એ લોકો આપને નિરુદ્ધમી અને આળસુ હેખાય છે, પરંતુ અદ્દ જોતાં તેઓ હરરોજ ઉત્તમાત્મ કર્મ કરે છે. તેઓ રાગક્રોપના નાશ કરે છે, તેથી તેઓ મને પ્રિય છે. પાપનાં કે ગ્રાણ ભૂળ છે, તેને તેઓ જગ્મૂળશ્રી ઉદ્ગેરી નાખે છે. તેઓ શુદ્ધ ચિત્તવાળા અને પાપરૂન્ય છે, તેથી તેઓ મને આટલા અધા પ્રિય છે. તેમનાં કાચા, મન અને વચન પવિત્ર હોય છે, તેમનું લુલન પુષ્યકર્મમય છે. એવા સાધુઓ હે પિતાજ ! કોને પ્રિય ન લાગે ? વળી એ લોકો શાસ્ત્રમાં પ્રવીણ અને ધર્મમાં દક્ષ છે, એમનું લુલન પણ આર્થશાસ્ત્રને અનુકૂળ છે, તેઓ એકાશચિત છે, તેથી હું તેમને ચાહું છું. એમનો ભ્રમ દૂર થયો છે, એમની ઈદ્રિયો સંયમમાં

આવી છે, તેઓ હુઃખનું નિહાન જાણે છે, તેથી એ અમણેં ઉપર મને પ્રીતિ ભાપકે છે. ગામના રક્તામાં થધિને રોજ થય છે તો એ કોઈના સામું ભાંચી નજરે જેતા નથી. લોગવૈલવ અને સંપત્તિ તરફ તેઓ ઉપેક્ષા રાખે છે. પોતે કોહારમાં ધનધાન્યનો સંચય કરતા નથી, પરંતુ જે સારડુપી ધન છે તેની શોધ કર્યી કરે છે, એટલા સારુ તેઓ મને પ્રિય લાગે છે. સાનારુપાને કદી સ્પર્શ કરતા નથી, જે કંઈ મળી આવે છે તેનાથી શુજરાન ચલાવે છે, જુદા જુદા દેશો અને જુદાં જુદાં કુદુંબામાંથી આવીને તેઓ એકડા થયા છે અને એક બીજી ઉપર સ્નેહ રાખીને હળીમળીને રહે છે. એ ગુણેંને લીધે અમણું મને પ્રિય લાગે છે.”

શાહિષ્ણીનો એ ઉત્તર સાંભળીને પિતા ધણુા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા: “તારા જેવું કન્યારતન મારા ધરમાં ઉત્પન્ન થયું તેથી હું પોતાને ધન્ય ગાયું છું. યુદ્ધ ભગવાનમાં, ધર્મમાં અને સંધમાં તારી અત્યારે અદ્વા અને લજીએ. તને આ ઉત્તમવિચાર ઉત્પન્ન થયો છે એ તારા આગલા જન્મનાં પુષ્ટયનો પ્રભાવ છે. અમે પણ આજથી અમણેની સેવાચાડરી કરીશું, કેથી અમે પણ પુષ્ટ પુષ્ટયનો સંચય કરવા પામીશું.” ત્યાર પછી શાહિષ્ણીએ કહ્યું કે, “પિતાજી! જે ખરેખરજ આપને હુઃખ અપ્રિય થઈ પડ્યું હોય અને પાપનો રડ લાગતો હોય, તો બૌદ્ધધર્મના સંધના ચરણનો આશ્રય હો અને તેના ઉત્તમ ઉપહેશ પ્રમાણે સહાચારથુક્ત જીવન ગાણ્યા, એટલે તમારું જીવન સક્રણ થશો.”

પુત્રીના ઉપહેશથી માતાપિતાએ બૌદ્ધધર્મના અંધનું શરણું લીધું, સહાચારથી અને ધર્મચિંતનથી તેમનાં પાતકનું નિવારણ થયું અને તેઓ શ્રોત્વિયસ્તનાતક થયા.

શાહિષ્ણી પણ માતાપિતાને ઉપહેશ આપ્યા પછી બેરી થધ અને પોતાના જીવન અને કર્મના પ્રતાપે અર્ડતપદને પામી ગઈ.





## ૭૮—સુંદરી

નારસ નગરમાં, સુન્દરિ નામના એક યાદ્વાણુના ધરમાં  
તેના જન્મ થયો હતો. તેના અપ્રતિમ સૌંહર્યને લીધે  
લોડા તેને સુંદરી કહેતા હતા. સુંદરી માટી થઈ તારે નાના  
ભાઈનું ભર્તું નીપણ્યું. અના પિતાને અથી ઘણ્ણું જોડા ધા લાગ્યો.  
અને એ શોકવિદ્વળ ચિત્તો ચારે તરફ ફરવા લાગ્યો. એવામાં  
એક દિવસ બેરી વાશિધીનાં તેને દર્શન થયાં. સુન્દરિને એમને પૃથ્યું  
હે, “મેં સાંભળ્યું છે કે આપનાં તા ધણ્ણાં ચાંતાન મરણ પામ્યાં  
હતાં અને તમે રાત્રિદિવસ રૂધન કરતાં હતાં, પરંતુ હવે તમે એ  
ખધા ડાંડા શોક-પરિતાપને અમાવાસે શાંત થઈને ગેડાં છો,  
તેનું શું કારણું ? ”

વાશિધીએ ઉત્તર આપ્યો: “હા, એકણે નહિ, પાંચસાત  
નહિ, પણ ચેંડાએ પુત્રો અને સાંભધીઓ તેં અને મેં આગલા  
જન્મોમાં જોયાં છે; પરંતુ એ યાદ્વાણ ! જન્મ અને મરણને કેવી  
રીતે ટાળી શકાય એ હું શીખી છું, તેથી શોક અને હુઃઅને  
લીધી હું હવે હરતી નથી.” સુન્દરિને પૃથ્યું: “હેવિ ! તમારી વાત  
સાચી છે. તમને એ જાન કર્યાંથી મળ્યું ? કેના ધર્મોપદેશથી તમે  
આવી સુંદર આર્થિકસનભરી વાણી મોદી રહ્યાં છો ? ”

વાશિધીએ કહ્યું: “યાદ્વાણ ! મેં એ સર્વ જ્ઞાન યુદ્ધ ભગવાન  
પાસેથી મેળવ્યું છે. હાલમાં પાંત મિથિલા નગરમાં ગિરાવે છે અને  
લોડાને ધર્મહીક્ષા હધને તેમનાં હુઃખાનું નિવારણ કરે છે. એ  
ભગવાનના સુખેથી ‘નિરૂપધિ’\* ધર્મનું રહસ્ય સાંભળ્યા પછી  
મને ધર્મનું યથાર્થ જાન ઓપણ્યું અને માતા તરીકેનો મારો  
શોક વિસારે પહ્યો.”

\* ‘નિરૂપધિ’ ધર્મ અહીં નિર્ધારિત ધર્મના અર્થમાં વધ-  
રાયો છે. પુનર્જન્મનો ઝેરો ટો એવા ઉપાયો જેમાં હોય તેને પણ  
‘નિરૂપધિ’ ધર્મ કહે છે.

સુન્નતને પણ એ સમયથી બુદ્ધહેવ તરફે શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેણું તેમની પાસે જઈને દીક્ષા લીધી. એ સમાચાર બનારસ શહેરમાં સુન્નતની પતની પાસે પહોંચ્યા ત્યારે તેને ઘણું શ્રોણ થયો; પરંતુ સુંદરીએ કણું કે, “પુત્રશોકને લીધે પિતાજીએ સંસારનો ત્યાગ કરીને સંન્યસ્ત બદ્ધણું કર્યું છે, તો હું પણ બ્રાતૃશોકને લીધે પિતાનું અનુસરણું કરીને શ્રેરીવત ધારણું કરીશ.”

સુંદરીની માતાએ તેને ધનવૈલવની ઘણું લાલચ બતાવી પણ તે પોતાના સંકલ્પમાં હઠ રહી, એટલે માતાએ તેને સંસારત્યાગ કરવાની રજી આપી. કુમારી અવસ્થામાંજ સુંદરીએ દીક્ષા લીધી. ત્યાં આગળ એકાગ્રચિંત ધર્મજ્ઞાખનો અભ્યાસ કર્યોથી તથા શાસ્ત્રાનુકૂળ આચરણ કરવાથી તે અર્હત્પદને પામી. ત્યાર પછી એ ગુરુની આજ્ઞા લઈને બીજુ કેટલીક બિક્ષુણીઓની સાથે ધર્મોપદેશ કરવા નીકળી પડી. તેના ઉપદેશથી તેની માતા તથા બીજા કેટલાંક સગાંસંંબંધીઓએ પણ બુદ્ધહેવનું શરણું લીધું.

શ્રેરીગાથામાં ૩૧૨ થી ૩૩૭ સુધીના શ્રોણ તેના રચેલા છે.

## ૭૯—ચાપા

॥ ૧ ॥ યા કિલ્લાની હક્ષિણુમાં કે વનભૂમિ છે તેને એક લાગ અતિ પ્રાચીન કાગમાં બંકડાર દેશના નામથી પ્રસિદ્ધ હતો. એ દેશમાં નાલ નામના એક ગામડામાં એક પારધીના ઘરમાં ચાપાનો જન્મ થયો હતો. ચાપાએ જ્યારે ચૌવનમાં પ્રવેશ કર્યો, ત્યારે ઉપક નામના એક સંસારત્યાગી બિક્ષુએ (બૌદ્ધ અથવા જૈન ધર્મનો નહિ) ચાપાના પિતાના ઘરમાં બિક્ષા સાર્દ આશ્રય લીધો હતો. એ પ્રકારના બિક્ષુએને આળુવક કહેતા હતા. આળુવક ઉપક, ચાપાના ઉપર પ્રેમથી આસક્ત થઈ ગયો. અને તેના પિતાની રજી માગીને તેની સાથે પરણ્યો. ઉપકે સંન્યસ્તા-શ્રમનો ત્યાગ કરીને ઘણું દિવસ સુધી સૂર્ય પકડનારા વ્યાધનું કામ કર્યું. પાછળથી ઉપક બૌદ્ધધર્મ બદ્ધણું કરીને શેર-સાધુ થયો. ચાપા પણ શ્રેરી-સાધ્વી બની. શ્રેરીગાથામાં ૨૬૧ થી ૩૧૧ સુધીના શ્રોણ તેના રચેલા છે. એમાં એણે પોતાના પતિની કથા કહી છે,



## ૮૦—શુભા (સોનીની કન્યા)

૧૦૦૦

એ એક સોનીની કન્યા હતી. તેનો નિવાસ રાજગૃહમાં હતો. એ ઘણી સૌંદર્યપત્રી હોવાથી એનું નામ શુભા પાડવામાં આવ્યું હતું. એની બુદ્ધિ ઘણી તીવ્ર હતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો તુપણું પુષ્પળ હતી. એક દિવસ બુદ્ધહેવ રાજગૃહમાં પધાર્યો ત્યારે શુભા એમનાં હર્ષન કરવા સારુ ગઈ અને પ્રણામ કરીને એક બાળું બેસી ગઈ. બુદ્ધહેવને નીતિસંખ્યા એના જાંચા વિચારે તથા વિકસિત જ્ઞાનની ખગર પડી એટલે એમણે એને ધર્મોપહેશ આપ્યો. ધરમાં રહીનેજ એણું ઘણો વખત સાધના કરી, પરંતુ સંસારની જગતણ ધાર્મિક ઉત્તેસમાં બાધક જણુતાં મહાપ્રલપતિ ગાતમી પારે હીક્ષા લઈને જાંધી બની.

એ પ્રસંગનું વર્ણન કરતાં એ પાતે રચેતી ગાથામાં કહે છે, “ ચૌવનમાં ધોળાં વસ્ત્ર પહેરીને એક વાર દું ધર્મકથા સંબંધવા ગઈ હતી. મારા અપ્રમત્ત ચિત્તમાં એ સમયે જલ્દનો ઉદ્ઘાટય થયો. મારા મનમાં ધર્માંકામ અને બોગ પ્રત્યે દારુળ વૈરાગ્ય ઉત્પજ્ઞ થયો. સંસારમાં ચારા કરતાં જેટલી વિપચિંદ્યો નહૃવાનો સંભવ હતો તેનો મેં વિચાર કર્યો અને એ સંસારનો ત્યાગ કરવાની દિચ્છા થઈ. પછી મેં જ્ઞાનિ, દ્વારા, ગામ, ઐતરો અને બોગની બધી સામચીઓના ત્યાગ કર્યો. જેટલું તજવા લાયક હતું તે બધાનો ત્યાગ કરીને પ્રત્યક્ષયામાં પ્રયાણ કર્યું. શ્રદ્ધાપૂર્વક સંન્યાસિની વત પાજ્યાથી સુંદર સંદર્ભ શરીરી. મારી વિષુલ સંપત્તિ સાસું મેં જાંખ્યું પણ નહિ. સોનાડ્યાનો એક વાર ત્યાગ કર્યો પછી કર્યો સાધુપુરૂષ એના તરફ ફરીથી જાંબે છે? સોનાડ્યાથી કદી ચિત્તને શાંતિ મળતી નથી. અમણુને ચિત્તમાં (ધર્મદ્યો) વિત મળે છે, તેની સરખામણી આર્થિકમાં થીન કશા સાથે થાય એમ નથી. \*

\* \* કે લોડો ધન વડે છકી ગયેલા અને મારા છે, તેઓના મનમાં ઘણો કલેશ રહે છે, કેમકે ધનના લોલને લીધે બધા એકણીની

ઉપર શત્રુદે આકાંક્ષા કરે છે. એ લોકો લોગવિલાસમાં નિમન્મ છે, તેમને બહુ હુંઅ વેઠવાં પડે છે. મૃત્યુ, ડેદખાનું, વેદનાઓ, શોંક, આદ્દિત અને વિલાય એ બધું તેમને વેઠલું પડે છે. હે જ્ઞાતિ-બધુઓ ! તમે શત્રુદ્ય થઈને મારા ચિત્તને લોગવિલાસમાં શા માટે ઇસાવવા માગો છો ? માથું મૂંડાવી હું પ્રવન્નયા કરું છું, બિક્ષુણીઓના જેવાં ચીર પહેરું છું, વૈરઘ્�યર બિક્ષા માગીને એ કંઈ મળે છે તેથી નિર્વીહ કરું છું. મારાં લૂગડાંમાંથે થીંગડાં વાગેલાં છે. આ પ્રમાણે હું ગુહલીન સંન્યાસિની બની છું. મોટા ઋપિઓ મર્યાદાએ તથા સ્વર્ગલોક અજ્ઞેના લોગવિલાસોનો ત્યાગ કરે છે. સુકૃતાચિત અને ક્ષેમમય થઈને તેઓ ખૂટે નહિ એવું સુખ પામે છે, માટે મને બ્લાગમાં ફરીથી મમ ન થવા હો, એથી આ લવ-સાગરમાંથી મારું પરિત્રાણ નહિ થાય. કામવાસનાઓ શત્રુ છે, હણુનારી છે અને સળગતા અમ્ભિની પેડે બાળી નાખનારી છે.

\* \* \* મોહવશ થઈને કામડ્યો શીચડમાં આ પુઢ્યીમાંના ધણું સ્વીપુરુષો પડે છે. તેમને ખગર નથી કે જન્મમરણુનો ક્ષય શાથી થાય છે; કામવશ થઈને મનુષ્યો હુર્ગતિને માર્ગ જાય છે અને એમ કરીને પોતાને હાથે પોતાના પગ ઉપર કુલાડો મારે છે.”

આ પ્રમાણે બહુ વિસ્તારથી મધુરી વાણીમાં કામનાઓ અને લોગવિલાસથી મનુષ્યને કેટલી હાનિ પહોંચ્યે છે તેનું વર્ણન કરી ફરીથી સંસારણધનમાં ન ઇસાવાનો નિશ્ચય કર્યો અને એકાચ ચિત્તે લાગલાગટ ધર્મની સાધના કરી. આઠમે હિવસે લગવાન બુદ્ધે અને એક વૃક્ષ નીચે તપદયા કરતી નેહ. પોતે ઘણુાજ પ્રસન્ન થયા અને પોતાના શિશ્યોને કહેવા લાગ્યા: “ જુઓ ! પેલી સોનીની કન્યા શુભા વૃક્ષના મૂળ આગળ ધ્યાનમાં નિમન્મ થઈને એડી છે. ધર્મને લીધે તેણું શાંતિ પ્રાપ્ત કરી છે. જગતનાં બધાં હુંઅ એ વીસરી ગઈ છે. ઉત્પલવણીની પાસે દીક્ષા લઈને એણે પ્રવન્નયા ધારણું કર્યો આઠમો હિવસ છે. ધર્મ અને વિવિધાથી ભૂપિત થયેલી વિનયી શુભાને જુઓ ! આજ તેનું મૃત્યુ હુર ગયું છે. અત્યાર સુધી દાસી હતી, હવે એ સુકૃત, જિતેદ્રિય નિર્મળ બિકુણી બની છે. એનાં બધનો છૂટી ગયાં છે. હવે પાપહીન બની ગઈ છે.”

એમ કહેવાય છે કે બુદ્ધ લગવાનને સુઝે આવી પ્રશાંસા સાંભળીને દ્યુર અદ્દ હેવતાઓ પણ ઘણુા પ્રસન્ન થયા. તેમણે સુવર્ણકાર-હહિતા શુભાની પૂજા કરી.



## ८९—शुभा जीवकंबवनिका

एक धण्डा प्रसिद्ध आद्यात्मनी कन्या हुती। राजगृह नगरमां तेनो जन्म थयो। हुतो। अनो हेह धण्डा वाटहार अने सुंहर हुतो। युद्धदेव राजगृहमां भिरारता हुता ए वधते एंबें पासे हीक्षा लीधी हुती अने रासारनो त्याग कर्त्या वगर धरमांज धर्मसाधना करती हुती। माधवी ईद्रियोना सुणो प्रत्येक अरुचि उत्पन्न थतां अने वैराग्यथी राती शांतितुं लान थतां ए महाप्रज्ञपति गौतमीना स्थापेला अक्षुण्णीसंघमां हाखल थए।

भिरिसार राजना वैह ज्वके राजगृह नगरमां एक सुंहर पुगीयो। अनाव्यो। हुतो। ए उद्यानमां पुष्कर आंणानां वृक्ष हेवाची ए आभ्रकानन नाभथी प्रसिद्ध हुतुं। साधुमतुप्योने धर्मसाधना करवाने ए एकांत भनेहारी स्थण धलुं अनुकूल हुतुं। युला एक हिवस त्यां ज्वरही हुती, ते वधते एक सुंहर, स्वच्छंही, धूर्त् युवक तेने भज्यो। अने शुलाना सुंहर इप्थी लक्ष्याने तेनो मार्ग रोकीने ज्वेलो। शुलाच्च तेने कह्युः “ लाई ! भें गारो शो अपसाध कर्त्यो छ ? शा माटे मारो मार्ग रोके छ ? प्रवक्तिता स्त्री साथे आवुं अधम आचरण शा सारू करे छ ? हे भेत्र ! कोई पण्यु पुरुषे एवुं करवुं घटतुं नयी। भें मारा पवित्र गुरुल्ल पासेथी एवुं शिक्षणु मेणव्यु छे। एज पवित्र अद्वयर्थवतमां अमे बिक्षुण्णीसंघनी परिवाक्षिकाच्चा टेवायती छीअ। शा माटे तुं मारो मार्ग रोकीने ज्वेलो छे ? हुं शुद्ध हुं, तारू मन भेलुं छे। हुं वासनाथी मुक्ता हुं, तारा हुद्यमां अधम वासनाच्चा लरेली छे। हुं पापलोगशून्य हुं, तो पधी तुं मने हेरान करवा सारू शा माटे ज्वेलो छे ? ”

ए युवक पोतानी वासना तृप्त करवा सारू तेनु मन पोतानी तरक्क वाणवानो प्रयत्न करवा लाय्यो। ए उद्देश्यी तेणु सहातु-

ભૂતિ અને લાલચ ખણે બતાવવા માંયાં અને કહ્યું: “તું નિષ્પાપ  
શુદ્ધતી છે ! તું શા માટે બિક્ષુણી બની છે ! લગવાં વબ્ર કાઢી નાખ ;  
આ રમ્યવનમાં ચાલ આપણે રમીએ. કુસુમિત વૃષ્ણો મધુર સુગંધ  
પ્રસારી રહ્યાં છે. આ બેસતી વસંત ઋતુ છે; ચાલ આપણે પુષ્કળ  
સુખ લોગવીએ. પવનના હુલાબ્યાથી કુલવાળાં વૃષ્ણો મૃળથી તે  
દોય સુધી હાલી રહ્યાં છે ! એકલી આ વનમાં ગયાથી તને શું  
સુખ મળવાનું છે ! નાના પ્રકારના મૃગ અહીંયાં ફરે છે, મસ્ત  
હાથીએ અહીં ફરી રહ્યા છે. આવા હારેણુ ભયંકર વનમાં તું  
એકલી શા માટે જાય છે ? સુવર્ણના જેવી જગમગતી સ્વચ્છ અના-  
રસી સાડી પહેરીને ચિત્રરથમાં બેસીને, હે સુંદર ! તું અપ્સરાની  
ફેડે આ વનમાં ભ્રમણુ કર ! હે કિન્જરલોયને ! મને આ સંસાર-  
માં તારા જેટલું પ્રિય કોઈ નથી. હું તારે હાસ છું. હું તારી સાથે  
સાથે આ અગીયામાં ફરીશ. મારું કહ્યું માનીને મારે ઘેર ચાલીશ  
તો મહેલચાં નિવાસ કરવાનો મળશે, હારીએ. સેવામાં હાજર  
રહેશે. ઝીણી જનારસી સાડી પહેરીશ, ગળામાં કંઠાએ ધારણુ  
કરીશ, સુખ ઉપર ચુગંધી પદાર્થ ચોણેલા હણે અને તારું આણું  
અંગ મોતી અને હીરાના હાગીનાએથી શાખુગારવામાં આવશે.  
સુખના પલંગ ઉપર, અતારે છાંટેલા, કોમળ બિધાના અને સુંદર  
ચાહરે તથા નવા આશીકા અને મચ્છરદાનીવાળી સેજ ઉપર  
તને સૂલાનું મળશે. આ હુનિયામાં કોઈને ન મળે એવું એકેલા  
કમળ જેવું અંગ અદ્ભુત વણે શા સારુ સૂક્ષ્મી નાખે છે”

શુભાએ તેને ઉત્તર આપ્યો: “ભાઈ ! તને મારી ઉપર આટલો  
બધો અનુરાગ શાને ડિપન્યો છે ? આ મારું શરીર તો શાખપુરી  
છે. આ મારું કલેવર તો રમશાનની મારીમાંજ વધારો કરનારું  
છે, તો પણી એ શરીર ઉપર તું ભાન ભૂલી જઈને આટલો બધો  
માણ કેમ પામી જાય છે ?”

પરંતુ આ શષ્ઠેની એ ધૂર્ત ઉપર કાંઈ અસર થઈ નહિ. એ  
અતિશાય કામાસકત હતો. શુભાની કમલ સરખી આંખ, હરિણી શી  
ચાલ એ બધાનું પ્રશંસાપૂર્વક વર્ણન કરીને એણે પ્રેમભિલા માણી.  
શુભાએ એ વખતે જરા ચુસ્સે થઈને કહ્યું: “ કુમાર્જ જવા માગે  
છે ? ચંદ્રમા સાથે રમવા માગે છે ? મેરુ પર્વતને ફૂદી જવા માગે  
છે ? યુદ્ધ-સુતાને પોતાના ધરમાં રાખવા માગે છે ? મૂર્ખ ચાલદ્યો  
જા ! મને લોગવિલાસ લોગવવાની નૃષ્ણુ જરાયે નથી. મારે આ

લોકનાં કે સ્વર્ગલોકનાં સુખ નથી જોઈતાં. ધર્મનું પાલન કર્યાથી એ વાસનાઓ. મારામાંથી કચારનીયે મરી ગઈ છે. સણગતા અંગારાની સમાન અને જેરના પ્રાલાની સમાન ગળ્ણિને મેં વિષયવાસનાઓને અમૃતાણી તળ હીધી છે. મારે તારી પાસેથી કાંઈ નથી જોઈતું. જેને મારા જેવું સત્યનું જ્ઞાન ન થયું હોય, જેનો ગુરુ ચાતે કોઈ શિખાઉ હોય તેવી ખીની આગળ જઈને તું આ બધી લાલચો. બતાવને: મારી આગળ તો તું પરાજિત થયો છે. મારું ચિત્ત સાઝું છે. સુખહુઃખ કે પ્રેમ કશાની મને પરવા નથી. આ જન્મને હું અશુભ ગણ્ય છું. સંસારના કોઈ સુખમાં મારું ચિત્ત ચોટતું નથી. હું બુદ્ધદેવની શ્રાવિકા છું. ધર્મના આડ અંગમાં મારી ગતિ છે. હું અપાપશૂન્ય હું છું. અનાગાર-સુખમાં મારી રતિ છે. મેં સુંદર ચિત્રવિચિત્ર લાકડાનાં પૂતળાંઓ ઘણું જોયાં છે. શુક્લાપૂર્વક ખાંધેલી હોરી અને ખીલી વડે તેઓ બલતળતના નાચ રમે છે; પરંતુ એ હોરીઓ અને ખીલીઓ કાઢી કે તો એ પૂતળાંઓ હીલી પડીને વિખરાઈ જય છે. એ વખતે એનાં હરેક અંગ બુદ્ધાં પડી જય છે. એવી સ્થિતિમાં એના કથા અંગને લોકો નીરાપવાની છંચા કરે છે? એજ અમાણું નરહેઠ પણ ધર્મ વિના હીસો પડી જય છે. કહેણ જોઈએ, ધર્મશૂન્ય હેઠ રક્ષા શકે જરૂર કે? બધું નિષ્ઠળ છે. હીવાલની ઉપર હળતાણથી રંગેલું એક સરસ ચિત્ર હોય અને મનુષ્ય ભૂલમાં એનેજ સાચું સમજુ લે, માચાને વશ થઈને સ્વર્ગમાં સુવર્ણનું વૃક્ષ બુદ્ધ અને તેને લેવાને લલચાય, એમ છે! અંધ! મારામાં આરોપણું કરેલા ડૃપ ઉપર સુંધર થઈને તું કેમ નાઢક એના પ્રત્યે ધાય છે? મારી આ આંખ ઉપર તું સુંધર થઈ ગયો છે? એને તું કમળ વગેરેની ઉપમા આપે છે? એ વાસ્તવમાં શું છે? એક પોલા વૃક્ષમાં જોડવેલા એ હડા છે. એમાં આંસુ-રૂપી કેટલાએ પરપોટા ઉત્પન્ન થાય છે. એવી આંખોમાં તો તેને શું ગમી ગયું છે? તેમ છતાં મારાં આ લોચનનીજ તને છંચા છે ને? કાંઈ હરકત નહિં, લે, આ આંખ." એમ કહીને તેણું ચાતાની આંગળી વડે પોતાનો ડાળો એંચી કાઢીને એ કાચી પુરુષના હાથમાં મૂક્યો અને કુરીથી કદ્દું: "હે પુરુષ! ચક્ષુનો તું આદર કરતો હતો તે લે. હવે તો તારી તૃપ્તાનો નાશ થયો ને?" તેનું આ સાહસિક હૃત્ય જોઈ, પેલો. માણુસ ગલરાઈ ગયો. અને સાણંગ નમસ્કાર કરીને ક્ષમા માગીને કહેવા લાગ્યો: "હવે હું

શુદ્ધ અધ્યાત્રિણીનું અપમાન કહી નહિ કરું. તને તારી દષ્ટિ કરીથી પ્રામ થાઓ ! મારો અપરાધ ક્ષમા કરો. તે મારા પાપને સખત ડાખ હીથે છે. સળગતા અભિને મેં છાતી સરસો ચાંઘેઓ છે. હલા-હલ તેરી સાપને મેં હાથમાં પડજ્યો છે. હાય ! બિકુણી ! મારી શી વલે થશે ? મને ક્ષમા કરો. ”

બિકુણી શુલાએ પોતાનાં સત્કરોથી સુદ્ધિત્ત પ્રાપ્ત કરી. બિકુણી-એં ઉપર આ પ્રસંગો ન આવે એટલા માટે તેમણે એકલાં રહેણું નહિ એવો જુદ્ધદેવે વિચારપૂર્વક નિયમ કર્યો હતો.


શુભાના ચરિત્ર ઉપરથી જણુંધ આવે છે કે, કોમળ રીતનિ પણ પોતાના શિયાળનો લંગ થવાનો પ્રસંગ આવે ત્યારે કેવું હુંએ સહન કરી શકે છે તથા તેનું અંતઃકરણ દઠ હોય તો કોઈ પણ પાપી તેનું સતીત્વ લંગ કરવાને શક્તિમાન થતો નથી.

## ૮૨—ચારુમતી

**આ** સન્નારી ચક્રવર્તી રાજ અશોકની પુત્રી હતી. અશોકે તેને ધારું સારું શિક્ષણ આપ્યું હતું. બૌદ્ધર્મનું પણ તેને ઉચ્ચ પ્રકારનું જ્ઞાન હતું. ઈ. સ. પૂર્વે ૨૫૦ માં અશોક રાજ નેપાલના તીશ્વોની યાત્રા કરવા સારું ગયેા હતો, તે સમયે ચારુમતી તેની સાથે હતી. ત્યાં આગળ તેણે દીક્ષા લીધી અને બિકુણી બની. તેના પતિતું નામ દેવપાલ ક્ષત્રિય હતું. સંસારના અનેક સુખ અને વૈકલ્પનો ત્યાગ કરીને પવિત્ર સંન્યાસિની વત એણે પસંદ કર્યું હતું. પિતા અશોક નેપાળની યાત્રાએથી પાછા ફર્યો પણ એ તો નેપાળમાંજ એક મહમાં રહી. પતિ માટે તેને ધારું ભક્તિ હતી. એ ભક્તિને કાયમતું મૂર્તિસ્વરૂપ આપવાના હેતુથી તેણે દેવપદ્મનામતું નગર વસાન્યું હતું. અશોકે એ નગરમાં પાંચ મોટા સ્તુપ બાધાવીને એની ગણુના તીર્થસ્થાનો-માં કરી હતી. આ સ્તુપ તથા ચારુમતીએ બાધેલા બીજાં પવિત્ર સ્થાનો હજુ સુધી મોજુદ્દ છે અને ચારુમતીએ ગાળેલા ધર્મ-જીવનની સાક્ષી પૂરે છે. એનો મઠ પણ પશુપતિનાથની ઉત્તરે હજુ સુધી દીઠામાં આવે છે.



## ૮૩-ઇસિદાસી (ક્રદિપિદાસી)



જનવિની નગરીમાં એક સહાચારી પ્રતિષ્ઠિત અને ધરનવાન વેપારીને ઘર એનો જન્મ થયો હતો. એ પિતાની એકની એક કન્યા હોવાથી પુષ્પળ લાડમાં જાઈ રહી હતી. પિતાએ એને ડાચા પ્રકારનું શિક્ષણ પણ આપ્યું હતું. એક સમયે સાડેત નગરના એક વણિક એના પિતાને ઘર જઈને એતું માણું કર્યું. ગુણુવાન વર જોઈને ઈસિદાસીના પિતાએ પ્રસન્નતાપૂર્વક એનું લમ કરી હીધું. ઈસિદાસી સાસરે ગઈ. પિતાને વેરથી મળેલા સારા શિક્ષણને લીધે તે દરરોજ અવારસાંજ ભજ્ઞાપૂર્વક સાસુસસરાને પ્રણામ કરતી. એમની સેવાશુશ્રૂયા કરતી તથા ઘરનું બધું કામકાજ કરતી. હિયેર, નાણુંં વગેરે બીજાં અગાઉંએ ઉપર પણ રનેહ રાખતી અને તેમને પોતાની પાસે બેસાડીને લાડ લગાવતી. ઘરમાં કે અજ હતું, તેમાંથી બિકુઢ, અભ્યાગત વગેરે કેને કે કંઈ આપવાનું હોય તે રીતસર આપતી. અવારના પહોરમાં વહેલી ડાડી ઘરનું કામકાજ કરી નાહીયોધિને અટપટ પતિની પાસે જતી અને તેને સંતોષવાનો પ્રયત્ન કરતી. દાસીની પેઠે પતિની આગળ દાતળુપાણીની સાગથી, તેલ, આરસી વગેરે મૂકતી અને પોતાને હાથેજ પતિને સંબન્ધવતી. એકના એક પુત્રની ભાતા પોતાના પુત્રને જેટલાં લાડ લગાવે, તેટલાંજ લાડ એ પૂર્ણ ભમતાપૂર્વક લગાવતી. પોતાને હાથે સ્વાહિષ બોન્ન રંધીને પતિને જમાડતી અને તેમનાં વાસણું પણ માંજ નાખતી. કોઈ હિવસ પતિની સાથે જાચે સ્વરે બોલતી નહિ. દાસીની પેઠે ચાત-હિવસ તેની સેવામાંજ નિમન રહેતી; પરંતુ આ જન્મમાં સુશીલ પ્રતિમતા અને વિહૃપી હોવા છતાં પણ સાતમા આગલા જન્મમાં એળે વ્યબિચારનો મહાહોષ કર્યો હતો. એ ગંભીર પાપનું પ્રાય-ક્રિત સ્વી કે પુરુષ જનેને જન્મજન્માંતર સુધી કરવું પડે છે. એ

પાપની સંજરૂપે આ જન્મમાં ઇસ્રિદાસીને પતિભક્તિનું કૃળ મજયું નહિ. આટલી સેવા અને પ્રેમ બતાવ્યા છતાં પણ અનો પતિ અનો ઉપર પ્રસન્ન થયો નહિ. એક દિવસ એણે પોતાનાં માતપિતાને કહ્યું: “ હું ઇસ્રિદાસીની જેઠે સંસાર માંડવાનો નથી. હું ધરણાર છોડીને દૂર જતો રહીશ.” માતપિતાએ કહ્યું: “ ઇસ્રિદાસી તો સારી પંડિતા છે; આગસ શું છે તે તો જાણુંતી નથી. પ્રાતઃકાળમાં વહેલી જરૂર છે. એવી સુશીલ પતની તને કેમ ગમતી નથી, હીકરા?”

ઉત્તરમાં ઇસ્રિદાસીના પતિએ જગ્યાવ્યું: “ એણે મારું કાંઈ બગાડયું નથી; પણ હું એની સાથે રહેવાનો નથી. મને વિદાય આપો, હું પાછો નહિ આવું.” સાચુસસરાએ ઇસ્રિદાસીને પૂછ્યું: “ વહુ ! કહો તો અરં કે તમારાં બેનાં મન ઓંચા શા કારણથી થયાં છે ? અમારાથી કોઈ વાત છુપાવશો નહિ. એવો તે શો અપરાધ થયો છે કે પતિ તને છોડીને જતો રહેવા માગે છે ? ”

ઇસ્રિદાસીએ દિલ ઝાલીને કહ્યું: “ મારાથી ભૂતમાં પણ કોઈ હોપ થયો નથી; મેં કોઈ દિવસ એમને કઢવો શરૂદ કર્યો નથી. એમ છતાં એમને મારા પ્રત્યે શા સારુ કંટાળો ભાપન્યો છે તે હું કહી શકતી નથી.”

ત્યાર પછી સાચુસસરાએ તને કહ્યું: “ વહુ ! તું તો સ્વરૂપ-વતી અને શુણુમાં લદ્દી જંબી છે, પણ છોકરાને કોણું જાણું શાથી તારા પર અણુગમો ભાપન્યો છે, તો તું તારે પિંચેર ન.” એમ કહીને એમણે સુવની ખાતર પુનરઘને પિતૃગૃહે વિદાય કરી.

ઇસ્રિદાસી કે જ્ઞાતિમાં હતી તે જ્ઞાતિમાં એ સમયે પુનર્વિભન્ન રિવાજ પ્રયત્નિત હતો, એટલે એના પિતાએ એને એક ખીલ વરને પરણુંબી. એ પણ ધનાલ્ય પુરુષ હતો. ઇસ્રિદાસીએ પોતાના સ્વભાવ પ્રમાણે એની પણ પુષ્પકળ સેવા કરી, પરંતુ એક માસ પછી એનું પણ ચિત્ત ક્ષયું અને તેણે પણ તેને વગર વાંકે છોડી હીધી. ત્યાર પછી એક દિવસ એક દીન દરિદ્ર સંયમી લિખારી શુભક માગવા સારુ ઇસ્રિદાસીના પિતાને ધેર આવ્યો. તેને તેમણે કહ્યું: “ આ લિખુકની ઓળી અને કમંડળ ફેંકી દધને મારા જમાઈ બનો.” એણે ચુવલીના પિતાની પ્રાર્થના સ્વીકારી અને પંદર દિવસ સુધી પતિપતની સુખે રહ્યાં. પછી પેલા જમાઈએ કહ્યું: “ મને મારી ઓળી અને કમંડળ પાછાં આપો, હું તો લિક્ષા

માર્ગનેજ મારા જીવનનો નિર્વાહ કરીશા.” એ સાંભળીને ધસિ-  
હાસીનાં માતપિતા તથા સંગાંસં બધીઓઓ કહ્યું: “તમે ઘરમાંજ  
રહો. કે કાંઈ માગશો તે આપીશું.” તેણે કહ્યું: “મારા એકલાનું  
પેટ ભરવા નેટલું તો મને ગમે તે પ્રકારે મળી આવે એમ છે, તે  
ખચી હું શા મારે અહીં રહું? વળી એ પણ નિશ્ચિત છે કે હું ધસિ-  
હાસી સાથે એકજ ઘરમાં કહી પણ રહેવાનો નથી.” હુઃઅની બિચારી  
ધસિહાસી! એની શી અવસ્થા! એક પતિતાને છાંઝે એવી રીતે  
તન, મન, ધનથી સેવા કર્યો છતાં એક પણ પતિઓ તેને સંધરી  
નહિ. પતિ ઘર છાંઝીને ચાહ્યો ગયો, એટલે એણે માતપિતાને  
કહ્યું: “મારા હુઃઅ અને શરમનો પાર રહ્યો નથી, હવે તો મને  
મરવા હો કે સંસારનો ત્યાગ કરવાની રણ આપો.” એવામાં  
જિનદાતા નામની પ્રસિદ્ધ બિક્ષુણી લિક્ષા માગતી માગતી ત્યાં જઈ  
પહોંચયો. એ પરમ વિદુષી હતી તથા ધર્મશાસ્કાને સારી રીતે બાળ-  
નારી હતી. વિનય-પિઠક નામના પ્રસિદ્ધ બૌદ્ધાથનો એણે જાણ  
અભ્યાસ કર્યો હતો. ધસિહાસીએ તેનો સત્કાર કર્યો; તેને બેસવા-  
ને મારે આસન બિશ્વાસી આપ્યું તથા પગે લાગીને બિક્ષા કરવી.  
લોજન કરીને એ બિક્ષુણી તૃપ્ત થઈ એટલે એણે કહ્યું: “મારો  
વિચાર સંસારનો ત્યાગ કરીને પ્રવન્યા લેવાનો છે.” તંના પિતા-  
એ એ સાંભળીને કહ્યું: “યુદ્ધ વેર રહીને પણ તું ધર્મ પાળી શકે  
છે, સાધુતા સાધી શકે છે અને સાધુ તથા દિજજનોની સેવા  
કરી શકે એમ છે.” પરંતુ ધસિહાસીને સંકદ્ય હઠ હતો. એણે  
કહ્યું: “ના, પિતાજી! મારે આ જન્મમાં કે હુઃઅ વેઠું પડ્યું  
છે, વગરહોંએ કે અપમાન ચાંડન કરવું પડ્યું છે, તે અવસ્થય  
પૂર્વજન્મના કાઈ ગંભીર હોપની અનું છે; મારે હું સંસારનો  
ત્યાગ કરીને, રાતહિવસ ધર્મની સેવામાં રહીને પૂર્વજન્મનાં  
પાપનો ક્ષય કરીશા.”

પિતાને હવે પુનીના ઉત્ત્રત માર્ગના પ્રથાણુમાં વિજ્ઞ નાખ્યું  
ચોય લાગ્યું નહિ. તેમણે કહ્યું: “એટા! જ ત્યારે. ઝુદ્ધદેવ નર-  
એક થયા છે. એમના ઉપરેશને અતુસરીને ધર્મલાલ કર; નિર્વાણ  
પ્રાસ થવાથી તું નિપ્પાપ થઈશ.” માતપિતા અને જાતિજનોને  
નમસ્કાર કરીને ધસિહાસી વિદ્યા થઈ. તીવ વૈચાય ઉત્પત્ત થયેલો  
હોવાથી અને જાંચા પ્રકારનું શિક્ષણ તો પહેલેથીજ પ્રાસ હોવાથી  
સાત હિવસની અંદર એણે ત્રિવિદ્યા પ્રાસ કરી લીધી. એનું વ્રત

પૂર્ણ થયું. પૂર્વજન્મો એની આગળ સ્પષ્ટ હેખાવા લાગ્યા. સાતમા જન્મમાં એણે વ્યલિયારનો મહાન અપરાધ કેવી રીતે કથો હતો અને તેના હંડુંઘે ખીંદ છ જન્મોમાં કેટલું હુઃખ વેહલું પહુંચ, એ બધી વાતનું તેને જાન થયું. એ જાન થયા પછી તેની હૃદયવેદના તદ્દન શાંત થઈ. એક જન્મમની ભૂતથી એણે આ જન્મમાં પણ પુષ્કળ હુઃખ વેહલું; પણ સત્કર્મ તથા સત્સંગના પ્રભાવથી આ જન્મમાં આગલા જન્મોમાં પાપ બાળી નાણ્યાં, એટલુંજ નહિ પણ અનંત પુષ્યનો સંચય કરીને નિર્વાણુને પ્રાપ્ત થઈ.

શૈરીગાથામાં વિસ્તારથી પોતાનેજ સુધે એણે આ ધતિહાસ વર્ણિયે છે.

## ૮૪—ઇશાનહેવી

એ કાશ્મીરના રાજ અલીકની રાણી હતી. રાજતરંગિણી અતુસાર ડલિને ૧૭૬૬ વર્ષ થયાં. એ સમયમાં અલીક રાજ હતો. એ ઘણોથશર્વતી અને હિંય પ્રભાવવાળો રાજ હતો. કાશ્મીર દેશની સુધ્યવસ્થા એણેજ કરી તથા એના સુશાસન-ને લીધે દેશની આવક તથા મહત્ત્વ વધી. પોતાના પરાક્રમ અને પ્રભાવથી ઉપાર્જન કરેલી સંપત્તિથી તેણે કેટલાએ અગહાર બધાવ્યા હતા. તેની રાણી ઇશાનહેવી પણ ધર્મપરાયણા હતી. એણે દરવાજ અને હસ્તિશાલાએની સમીપ ઉચ્ચ પ્રભાવવાળા કેટલાએક ચક બનાવ્યા.





## ૮૯-સુમેધા

સ્તાવતી નગરીમાં કૌચ રાજની પરાણીના  
ગર્ભમાં તેનો જન્મ થયો હતો. સુમેધા બાળ્યા-  
વસ્થાથીજ બુદ્ધિમતી અને સારાં કાર્યોમાં ભતિ  
રાજનારી હતી. શ્રમણ ધર્મની વિધિઓ એ બાળા  
ચતુંઘૂર્છ પાળતી. એ અનિશ્ચીલવતી, અનેક  
શાસ્કોમાં પ્રવીણુ, જરસ વ્યાખ્યાન આપનારી  
અને ધર્મમાં નિમસ રહેનારી કન્યા હતી. એવી  
સુશીલ અને વિહૃપી કન્યાને રાજ અનિકર્તની સાથે પરણ્યાવવાની  
તંના માતાપિતાની ધન્યા હતી. અનિકર્ત રાજ પણ તેના ઉપર  
પ્રેમમુખ હતો; પરંતુ સુમેધાને તો નાનાપણુંથીજ પોતાની જાગીઓ-  
સહિત બિદ્ધુણીઓના મહિમાં જવાનો શોષ હતો. અત્સમાગમને  
લીધે તંતું જીવન ધાર્મિક જન્મનું હતું, અટલેતની ધન્યા ગુરુકસ્થા-  
શ્રમની મોહળળમાં પડવાની નહોતી. એક દિવસ તેણું નઅતા-  
ઘૂર્છ જાતપિતાને જણાન્યું હે, “આપ દૂરા કરીને મારી વિનિતિ  
સાંભળો. મારી ધન્યા નિર્ણય પ્રાસ કરવાની છે. હું આ જગત  
અને પરલેાકને અનિત્ય જગ્યા છું. આ શરીરનાં બધાં સુખ તુંછ  
છે. જોગવિલાસથી સુખ તો ધણું થોડું મળે છે અને અસર્તાખ  
તથા હુઃખ ધણું પ્રાસ થાય છે. કદવા જેર કેવા કામકોણ ઉપર  
ને લોકા મોહિત થાય છે, તે લોકા મૂહ હોય છે. એ લોકો અધો-  
ગતિમાંજ પોતાનું જીવન વ્યતીત કરે છે. એ મૂર્ખાઓને મન,  
વચ્ચન અને કર્મને સંયમમાં રાખતાં આવડતું નથી. એ પ્રજાદીન  
લોકાને ખખર નથી હે, હુઃખ શાથી અટકાવી શકાય છે; એટલુંજ  
નાદિ પણ જ્યારે તેમને મોહનિદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરવા-  
માં આવે છે, ત્યારે પણ તેઓ જગતા નથી અને શીખવ્યા છતાં  
પણ તેઓ શીખતા નથી. ચાર આર્થ સત્યોનું લાન એમને કહી  
થતું નથી. પૂજય બુદ્ધહેવે જે સત્યો આપણુને શીખવ્યાં છે, તેને

ધણું લોકો જાણુતાં નથી. એમને તો જન્મવાનું સુખ જેઠાચે છે. વળી એ બધાં સ્વર્ગ મેળવવાની ઈચ્છા રાખે છે, પણ એમને અજર નથી કે સ્વર્ગનું સુખ પણ શાખ્ત નથી. એ પણ અનિત્ય અને ચંચળ છે અને એક દિવસ જતું રહેશે. સ્વર્ગસુખ ભોગવ્યા પછી પણ પાછા જન્મમરણના ચકમાં આવવું પડે છે, જોનો એ લોકો વિચાર નથી કરતા. એ લોકોનો ચાર પ્રકારનો વિનિપાત-પણી થાય છે; અર્થાત् નરક, પશુજન્મ, પ્રેતજન્મ અને રાક્ષસજન્મ એ ચારમાંથી એક પ્રકારની ગતિ ભોગવવી પડે છે. કંટલાકને એ પ્રકારની ઉચ્ચ ગતિ અર્થાત् મનુષ્યજન્મ અને દેવતાજન્મ મળે છે. વિનિપાત થયા પછી આ સંસારની મોદનળગમાંથી છુટકારો પણ મળતો નથી અને પ્રવન્યા પણ લેવાતી નથી. નિશ્ચય મનુષ્યની અધોગતિ થાય છે; માટે હે માતપિતા ! મારી ઈચ્છા તો દશ પ્રકારના ગળવાળા બુદ્ધહેવના વિધાન અનુસાર પ્રવન્યા લેવાની છે.

“ બુદ્ધહેવનાં દશ બળ આ પ્રમાણે છે:—(૧) સત્ય અને અનુત્થનું જ્ઞાન, (૨) કર્મના ઉદ્ભબ તથા પરિણામ, (૩) ઈષ્ટ સાધનમાં પદૃતા, (૪) ભૂતજ્ઞાન, (૫) પ્રવૃત્તિની ગતિ અને કાર્ય, (૬) મનુષ્યની આત્મશક્તિ, (૭) વિનય સાધવાનો માર્ગ, (૮) પૂર્વજન્મ, (૯) દ્વિત્ય ચક્ર અને (૧૦) સુક્રિત. જન્મમરણને નાશ કરવાની ઈચ્છા હવે તો મને થઈ છે. આ અનાર શરીરનાં ‘સાંસારિક’ સુખ મારે જેઠતાં નથી. લવની ગંધી તૃપણું માને રાક્ષિને હું તો સંસાર ત્યજુને પ્રવન્યામાં ચાલી જઈશ. અશુભ કાળ જતો રહ્યો છે; બુદ્ધહેવના જન્મથી શુલ ક્ષણું આવી પહોંચ્યી છે. મારી ઈચ્છા હું કે આ જન્મમાં અદ્વિતીય અને શીલધર્મનો કદી ત્યાગ ન કરૂં. હવે હું ભૂગી મરીશ, પણ આ ઘરમાં ભોજન નદિ કરૂં.”

સુમેધાને સુઝેથી વારંવાર આવી ને આવીજ સંસારત્યાગ કરવાની વાત સાંભળ્યાથી તેની માતાનું હૈયું ભરાઈ આવ્યું. એ શાકળ કરવા લાગી. પિતાને પણ ઘણી વેહના થઈ અને સુમેધા ઘરતી પર પડી હતી, ત્યાંથી એને ઉડાડિને શિખામળું આપવા લાગ્યા કે, “દીકરિ ! ભાડ, જરા વિચાર તો કરી નો. મેં ઇપ, ગુણ અને સંપત્તિમાં યોગ્ય પતિ સાથેજ તારો વિવાહ કરવાનો વિચાર કર્યો છે. રાજ અનિકર્તના કરમાં તને સમર્પણું કરવાનો મારો અલિલાખ છે. એ રાજ પણ ઇર્ષાર્વક તારો. સ્વીકાર કરશે અને તને પતરાણું જનાવીને પ્રેમાર્વક રાખશે. અદ્વિતીય, પ્રવન્યા અને

શીતધર્મ ધર્માં કઠિન છે. હે પુત્રિ ! આ યૌવનમાં તું પ્રભુતા અને ધર્મનીથર્થના લોગ અને સુખ પ્રાપ્ત કર; રાજ્યનો ઉપલોગ કર.” સુમેધાના ચિત્ત ઉપર પિતાના આ ઉપહેશની કાંઈજ અસર થઈ નહિ. તેણે દઠતાપૂર્વક કહ્યું: “હું આ અસાર સંસારને હવે ભજવાની નથી. હું તો હવે પ્રત્રન્યા ધારણુ કરીશ. એમ નહિ કરવા હો, તો એના કરતાં મરણને પસંદ કરીશ. આ હેઠળ જેને તમે પરણુવવા માગો છો, જેને રાજ અનિકર્તા પ્રેમપૂર્વક પોતાનો જનાવવાની ધર્ઢા રાખે છો, તે શું છે ? એ તો ગંધ મારતો, ભયાંકર અપવિત્ર પદાર્થ છે. શબ્દની પેઠે મળમૂળનું એ ઘર ત્યાગ કરવા લાયક છે. એને તો રૂવામી કેવી રીતે અહણુ કરશે ? માંસ અને લોડીથી ટાંકેલા આ ચિંહનેજ તમે હેઠળ કહો છો ને ? એ તો ક્રિડાઓનું ઘર છે. ગીધ આદિનું લોજન છે. એને તો કોણુ કન્યાદાનમાં આપી શકે ? ‘વિજાન’ જતું રદ્યા પછી આ શરીર શમશાનમાં નાઓ હેવામાં આવે છે, ત્યારે ફેંકી હીથેલા જૂના લાડકાં જેટલી એની ડિંમત છે. જાનીજનો પણ એના જામું જીવાનું પસંદ કરતાં નથી. તેઓ બીજા જીવોના લક્ષ્યરૂપ આ હેઠળે છોડી હથને સ્નાન કરીને ચાવદ્યા જય છે. માબાય પણ એજ કરેછે, તો બીજાનું તો પૂછુંન શું ? લાડકાં અને નાડીઓથી ભરેલા આ હેઠળ્યો ઘરમાં બધે ઠેકાણે અપવિત્રતા, ગંદકી ભરેલી છે. એનો તો વળી આદર કોણુ કરે ? આ હેઠળે જોઉકેલી ઉથલાવી નાખવામાં આવે, તો એની અંદરથી એવી આસદ્ય હુર્ગિંધ નીકળે કે, પોતાની જનેતા પણ ત્યાંથી હૂર નાસે. આ તો તમારું શરીરરૂપી પૂત્રણું છે. હેઠળ એ તો જન્મ અને મૃત્યુમય પદાર્થ છે. એને જન્મ લેતાં પણ હું હુંથાય છે; માટેજ મારી વિવાહ કરવાની સુદીલ ધર્ઢા નથી.

“લભ કરીને સંસારનું સુખ લોગવવા કરતાં તો હું સોવર્ષ સુધી દરરોજ લાલા ખાસીને મને મારી નાખે તે વધારે પસંદ કરં. જુદ્ધહેવનો પવિત્ર ઉપહેશ જાણુનાર માણુસને લાલાના ધા ખમવા સહેલા છે. આ સંસારના લાંબા ઝેરામાં મૃત્યુ ફરી ફરીને આવે છે. હેવજન્મ, નરજન્મ, પશુચોનિ, અસુરહેઠ, પ્રેતરૂપ એ પ્રમાણે કર્માતુસાર અનેક જન્મ ધારણુ કરવા પડે છે અને અનંત હુંથાય વેઠવાં પડે છે. હેવજન્મ ધારણુ કર્યાથી પણ નિર્વાણ મળતું નથી. જન્મમરણના ઝેરામાંથી છાટવા માટે જે માણુસ જુદ્ધનાં વચ્ચે પાણે છે, તેજ નિર્વાણ પામે છે. આ અસાર લોગવિલાસથી શું

વળવાનું છે ? પિતાજી ! હું તો આજેજ ઘરનો ત્યાગ કરીને ચાલી જઈ છું. જિલ્લા કરેલા લોજનની સમાન એ ખધા લોગવિલાસ ધૂણું કરવા ચોણ્ય છે. એ અસાર વસ્તુ મારે નથી જોઈતી.”

પિતાપુત્રી વરચે આ ગ્રમાણે વાર્તાવાપ ચાલી રહ્યો હતો, એવામાં અનિકર્ત રાજ પણ પોતેજ પસંદ કરેલી કન્યાને મળવા તથા લગ્નની બાબતમાં તેની સંમતિ લેવા સાર્ડ્સ્પ્રેમપૂર્વક એ નગરમાં આવી પહોંચ્યો. સુમેધાએ એના આવ્યાની પણ પરવા ન કરતાં પોતાના નિશ્ચય અનુસાર લાંબા કાળા અંભોડાને છરી વડે કાપી નાખ્યો. અને ખધાની વાતચીતને રોકીને ધ્યાનમનું થઈ ગઈ. એકાચચિંતને એ જગતની અનિત્યતા સંધારી વિચાર કરવા લાગી. રાજને નગરમાં પેસતાં સુમેધાના વિચારો જાળ્યામાં આવ્યા, એટલે એ જે સ્થળે સુમેધા ધ્યાન ધરી રહી હતી ત્યાં ગયો. અને પોતાના સુવર્ણ તથા મણિમાળિકથી અદંકૃત દેહ વડે હાથ નોરીને ચાચના કરવા લાગ્યો:-

“આ યૌવનકાળમાં તો હે સુંદરિ ! તું મારી રાણી થા અને ધન તથા વૈભવનું સુખ લોગવ. આ હુનિયામાં લોગ અને સુખ હુર્લિબ પદાર્થ છે. તું શાંતિપૂર્વક રાજ્યસુખ લોગવ. મરણમાં આવે તેને હાન આપ. મારો આખો અન્નનો તારા હાથમાં રહેશે. તારા મનમાં જિલ્લા વિચાર આણુવા છોડી હે. ને, તારાં માતપિતા તારા સંસારત્યાગની વાત સંભળીને મરવા પડ્યાં છે !”

સુમેધાએ કહ્યું: “મારે તમારાં સુખ અને વૈભવ નથી જોઈતાં. મને એમાં જરાયે મોહુ રહ્યો નથી. લોગની વાસનામાં મને હવે ન ધેલેલશો. લોગમાં તો હુંખ લોગવ્યા વગર છુટકોજ નથી. તમે ભારતવર્ષનો પ્રાચીન ધર્તિહાસ કેમ વીસરી જાઓ છો ? ચારે દીપના અધિપતિ મહારાજ માંધાતા કેવા શ્રેષ્ઠ પુરુષ હતા ? એમના જેટલું ધન તથા વૈભવ કેણી પાસે હતાં ? છતાં પણ એ નરપતિ મરી ગયો. અને તેની લાલસા આ હુનિયામાં તો પૂરી ન થઈ. હશે દિશાઓમાં ઝીરતનનો વરસાદ વરસે તોપણું લોગવિલાસથી કોઈને તૃસુ થતી નથી. એ બધું ત્યલુને મનુષ્યો મરી જાય છે. હે ભૂપ ! લોગ તલવાર સમાન છે, લોગ શૂલ સમાન છે, લોગ નાગની ફૈણ સમાન છે, લોગ અમિનીજાળની પેઠે ખાળનારા છે, આ રૂપ હાડકાંના માળા જેવું છે, લોગ અને સુખ અનિત્ય

અને અધૃવ છે, હુઃખપ્રદ અને મહા જેરીલાં છે, તપાવેલા કોણં ના હળના જેવાં છે. એ તો સહા પાપનોન ઉદ્ઘાર કરે છે. વૃક્ષ ઉપર ચઢીને કણ તોડવા જતાં માણુસ પડી જય છે, એજ પ્રમાણે કામલોગનું છે. માંસનો દુકડો કેવા આર્દ્ધ પક્ષીઓ જેવી રીતે પરસ્પર લાધ કરે છે એજ પ્રમાણે ભોગની આખતમાં બને છે. ઉધાર મારીને કોઈ ચીજ લાભ્યા હોઈએ તે જેમ પાછી ન આપીએ ત્યાં સુધી ઉફરાવો રહે છે, તેમજ ભોગના સંખ્યમાં છે. એ ભોગ સ્વમની પેડ છેતરનારા છે. કામલોગ તીવ્ર આણુસમા, હારણ રોગજેવા અને વિસ્ક્રોટક સમા છે. તપાવેલા અંગારા સમા એ ભીપણ છે. પાપ અને મૂર્ત્યુમય હોવાથી લયાનક છે. આ કિંહરીમાં મેળતાલ્યાં એવાં અનેક હુઃખ આવી પણ છે, અનેક આચ્યાણે નહે છે; મારે મને સંસારમાં જરાયે વિશ્વાસ નથી રહ્યો. તમે વેર વદ્યો. મારા માશામાં જયારે આગ લાગી રહી છે, ત્યારે બીજું કોઈ સને શું કરી શકવાનું હતું ! જરા અને મૂર્ત્યુ મને બાંધવા આચ્યાં છે. હું તેમનો નાશ કરવાને તત્પર રહીશ.” આ પ્રમાણે કહીને સુમેધા ઘર ગયાર નીકળવા લાગી. જેથું તો ઉમરા ઉપર બેઝીને માતપિલા અને રાની અનિકર્ત દ્વારા રહ્યાં છે. એ જેઠિને સુમેધાને એમના આજાન અને મોઢ ઉપર હથ્યા આવી. મોઢવથા થઈને રૂહન કર્યાથી કેટલી હાનિ થાય છે, સંસાર કેવો અનિત્ય છે, હુઃખથી ભરેલો છે એ બધુ ભર્મસ્પશી ભાષામાં સમનલંઘું. રાની અનિકર્તને પણ સમનલંઘું કે, રાનીઓને સંસારમાં રહ્યાથી બીજા રાની, અભિ, ચોર અને જળનો લથ રહે છે. એ ઉપરાંત પણ બીજાં અનેક શરૂઆથી ભરેલા સંસારમાં ઇસાઈ રહેવાની હંચા કેણું કરે ? મોક્ષ આમે હોવા છતાં બંધનમાં પડવાનું કેણું પસંદ કરે ? આ સંસારમાં કામનાઓની સાંકળથી તમે બંધાયવા છો. એ સાંકળને તોડી નાખીને તમે વાસનાઓને હાયાવો. ઇસી ક્રીને કહું છું કે, ભોગમાં અતિશય અને પાર વગરતું હુઃખ છે. ચિત્ત સહા ચિંતાઓથી ભરેલું રહે છે. એ અધૃવ કામલોગનો ત્યાગ કરો. એનાથી ડેવલ હુઃખજવાનું છે, બીજું કાંઈ નથી. અજર ધર્મમાર્ગ આ રહ્યો. જે કામનાઓ થોડા વખતમાં જૂની પડી જય છે તે કામનાઓ—વાસનાઓને લઇને તમે શું કરશો ? એ કામનાઓ તો મૂર્ત્યુ અને વ્યાધિઓને આણુશે અને ઇસી ક્રીને જન્મ કેવો પડશો. ધર્મનો માર્ગ અજર, અમર, શોક વગરનો,

અમૃતમય, શાનુહીન, રોક્ટોડ વગરનો, કોઈ ખસેડ નહિ એવો  
અને અદૃષ્ટ તથા લય વગરનો છે. એ અમૃતમય માર્ગ કેટલાએ  
દોકોએ પ્રાસ કરો છે, આજ પણ કેટલાએ દોકો પ્રાસ કરી રહ્યા  
છે; પરંતુ જેમના ચિત્તમાં ઉત્સાહજ નથી, તેમના ભાગ્યમાં એ  
માર્ગમાં જવાનું કંઈયે લાગાયું નથી. આ પ્રમાણે કહીને સુમેધાએ  
પોતાનો કાપી નાખેલો અંબોડો અનિકર્તાની સમક્ષ મૂક્યો.

રાજ અનિકર્તાને સુમેધાના અગાધ જ્ઞાન તથા તીવ્ર વૈરાગ્યની  
ખાતરી થઈ ગઈ હતી. તેણે સુમેધાનાં માતપિતાને વિનિતિ કરી  
કે, “સુમેધા સત્યના માર્ગમાં જવા માગો છે; આપ એને ખુશી-  
થી જવા હો.” માયાપ્ર વિદ્યાય આપી સુમેધા શોક અને લય-  
રહિત થઈને લિઙ્ગાણીર્દ્યે ગંડાર નીકળી પડી. પહેલેથીજ ઉચ્ચ  
શિક્ષણ પાંચલી હતી અને પણી ધર્મમાર્ગમાં પડી, એટલે સહ-  
ગુરુના ઉપહેશથી અંતર્નાનતી છ વિદ્યાએ તેણે જવાહી પ્રાસ કરી  
લીધી. પોતાના પૂર્વજન્મેનાનું પણ એને જ્ઞાન થયું. ત્યાર પણી ખુદ-  
દેવના અરણુમાં એચ્છાને તેણે ચાંપૂર્ણ થાંતિ એને નિર્વીણું પ્રાસ કર્યાં.

શ્રીરાગાશામાં ૪૪૮ થી પયર સુધીના શ્વેંક તેના રચેલા છે  
એને તેમાંથી એના ઉત્ત્ર વિચારોનો યથાર્થ પરિચય મળી આવે છે.



## ૮૬-સંઘમિત્રા

દુર્ગા

આ જથી લગભગ અહી હુલર કરતાં વધારે વર્ષ પૂર્વે ભારતવર્ષના એક હિંજીયી સાંઘાટના ઘરની કન્યા સાંચારના ધનવૈભવને તુચ્છ ગણીને ધર્મનેજ વરી હતી અને આખી જિંહાંથી સુધી કુંવારી રહીને ધર્મપ્રચારના કાર્યમાંજ તેણે પોતાનું અમૃત્ય લુધન અર્પણ કર્યું હતું. આજે પણ એ વાત સંભારતાં આપણુંને આનંદ થાય છે. આજે ભારતના એ ગૌરવ-મય શુગની પ્રાતઃસ્મરણીય રાજકુન્યાનું લુધનચરિત્ર લખીને અમે અમારી લેખિનીનું સાર્થક થયું ગણીએ છીએ.

એ રાજકુમારી મહાપ્રતાપી રાજધિરાજ અશોકના વંશમાં ઉત્પત્ત થઈ હતી. એક મત એવો છે કે, એ એમની કન્યા હતી અને એજ મતતનું અવકાંખન કરીને અમે આ ચરિત્ર લખ્યું છે. અંગેજ ઇતિહાસવેત્તા વિન્સેંટ ક્રિમથ એને અશોકની સગી ખણેન ગણે છે. ઉજ્જવન નગરીમાં એનો જન્મ થયો હતો. એના ભાઈનું નામ મહેંદ્ર હતું. એને લાઈભણેન નાનપણુમાં ઉજ્જવિની નગરીમાંજ વાસ કરતાં હતાં. ત્યાર પછી ઈ. સ. પૂર્વે રદ્દટમાં અશોક મગધના સાંઘાન્યનો. સાંઘાટ બનીને મહેંદ્ર અને સંઘમિત્રાને લઈને પાટલીપુત્ર નગરમાં આવી વસ્યો. હાલ જ્યાં આગળ પટના શહેર છે, ત્યાંજ પહેલાં પાટલીપુત્ર નગર શોભા આપી રહ્યું હતું. એ વખતે એ નગરોની રમણીયતા અને સુખસમૃદ્ધિમાં ફોક્ષ વાતનો અભાવ નહોતો. અનેક જાતના લોકો ત્યાં વસતા હતા. ચિત્રવિચિત્ર રાજમહેલા, ખગીચાઓ, શૈઠિયાઓની હવેલીઓ અને તરેહ તરેહની વસ્તુઓનાં ચૌટાઓ જેનારાઓને આશ્ર્ય-ચક્ષિત કરી નાખતાં હતાં. એ નગરનાં ખીપુરોએ મહેંદ્ર અને સંઘમિત્રાનું રૂપાલાવણ્ય તથા એમની અતુપમ મૂર્તિના દર્શન કરીને અતિશાય આનંદ પ્રગટ કરવા લાગ્યાં. મહારાજ અશોક ૧૬૪

અજે ભાઈઓનની માનસિક તથા આધ્યાત્મિક ઉજ્જ્વલિ સારુ તેમને સારી કેળવણી આપવાનો પૂરતો બંદોખસ્ત કર્યો.

અહીંથાં જગતવિખ્યાત રાજ અશોકના લુચનચરિત્રને લગતી એએક વાતો જણાવવી જરૂરની છે. અશોક ચંદ્રશુમના પુત્ર બિંહુસારનો છોકરો હતો. રાજપુત હોવા છતાં એનો ચહેરો કરૂંયો હતો, એટલા સારુ રાજ એને બહુ ચાહતા નહિં. એમ જણાય છે કે પિતા એને સાવકી માની અવગણના એને તિરસ્કારને લીધે ધાર્મિક અશોક પણ યોવનમાં અતિશય સ્વાથી એને અધાર્મિક નીવડચો હતો. તેની રક્તાપિપાસા એને કુરતાને લીધે એ ચંડાશોક અર્થોત્ યમ્ભૂત નામથી ઓળખાતો હતો. દાંતકથા એવી છે કે, યમરાજનું અતુકરણું કરીને એળે એક નરક-પુરી બંધાવી હતી. અપરાધીએને એ ભયંકર પુરીમાં કેદ રાખીને મારવામાં તથા પીડવામાં આવતા એને અનેક તરેહનાં હુંઘ દધને રિખાવી રિખાવીને મારી નાખવામાં આવતાં. આવું હોવા છતાં પણ એજ અશોકમાં અસાધારણ શક્તિ એને નાના પ્રકારના સહશુણ પણ જણાતા હતા. રાજ બિંહુસારે પુત્રને પોતાનાથી હુર રાખવા સારુ તેને ઉજજ્વલિનીનો સૂચો નીરયો હતો. ત્યાં આગળજ હેવી નામની એક તરણી રમણીની મનમોહક મૂર્તિનાં દર્શનાં કરીને એ તેના તરફ આકર્ષણી એને તેની સાથે પરણ્યો. ત્યાર પછી પિતા બિંહુસારનું મુત્સુ થયું, એટલે ભાઈના લોહીથી હાથ ખરડીને અશોક પિતાના રાજ્યસિંહાસન ઉપર એડો. અશોકનો રાજ્યાલિષેક ઈં સ૦ પૂરો ર૬૬ માં થયો.

મહારાજ બન્યા પછી અશોક કલિંગ દેશના રાજ સાથે ઈ. સ. પૂ. ર૬૧ માં એક ભીષણ યુદ્ધ કરીને કલિંગ દેશ અથવા ઓડિસસાને પોતાના તાખામાં લીધો. એ યુદ્ધમાં લાખ નરહત્યા થઈ હતી. એ ભયંકર હત્યાકાંડનું સ્મરણું થતાંજ અશોકનું પથ્થર-તું હૈયું પણ પીગળી ગયું એના હૃદયમાં વૈરાગ્યનો ઉદ્ય થયો. પુષ્યકર્મીનો ઉદ્ય થતાં પાપીએની પાપવાસનાનો એમજ એકદમ ક્ષય થઈ જય છે એને એમનું પાપી લુચન એક નવોજ સારો પલટો ખાય છે. એ સમયથી અશોક પારકું રાજ્ય લીતી લેવાની ઈચ્છા બિલકુલ છોડી દીધી. ત્યાર પછીથી અશોકના લુચનમાં આધ્યાત્મિક શક્તિની ગુંઠ કિયા શરૂ થઈ. એક મહા-પ્રતાપી, શક્તિશાળી બૌદ્ધ સંન્યાસીએ અશોકના હૃદય પર કાઢ્યું,

જમાવ્યો. જેતણેતામાં તેના જીવનમાં મહાપરિવર્તન થઈ ગયું. પૌદ્રધર્મની દીક્ષા અણણું કરીને મહાપુરુષ ખુદુદેવના મહાન આદર્શને તેણે સ્વીકાર્યો. વિશ્વપ્રેમશ્રી તેનું હૃદય પરિપૂર્ણ થઈ ગયું.

એ સમયમાં પૌદ્રધર્મનો પ્રચાર બહુ જેરમાં ચાલી રહ્યો હતો. પૌદ્રધર્મના ઉપદેશકો વિશ્વપ્રેમનો પ્રચાર કરીને ચાગયજી અને પશુવધનું અંદળ કરી રહ્યા હતા. તેમના ઉપદેશથી જીવનિંદા ગહું અટકી હતી. નીચલી જલિયાને જાંચ વર્ણના વાસશી ઘણાવવાને યણું એમણે ઘણે. પ્રયત્ન કર્યો હતો. ગૈત્રી, કરુણા અને “અદિના પરમો ધર્મ” એ વણ પ્રેમમંત્રની વાણીનો ઘણ ચારે તરફ થઈ રહ્યો હતો. એ પ્રેમ અને કરુણાની વાણી મહારાજાન અશોકના હૃદય સુધી પહોંચી અને તેમણે પૌદ્રધર્મની દીક્ષા દીધી. દીન, હસ્તી નરસારી અને પશુપક્ષીઓનાં હુણ અને કલેશથી એતું હૃદય પીગળી ગયું અને તેમનાં સંકટતું નિવારણ કરવા સારું એણે પાતાનો રાજલાંડાદ ખુલ્લો ભૂકચો. નવ કરોડ અને આડ લાખ સુવર્ણસુદ્રાઓ પુષ્યમાં વાપરવામાં આવી. પશુપક્ષીઓના દેશોનો ઈલાજ કરવા સારું હવાખાનાં બાંધાયાં. જાન, ધર્મ અને નીતિની ઉત્ત્રતિ તથા તેમના કુખ્યની પૂર્ણ સારું અશોકે નેટલા ઉપાય કર્યા હતા, તેટલા ઘણું શ્રાડા રાજ કે બાદશાહોએ કર્યો હશે.

એવા મહારાજાની દેખરેખ નીચે સંઘમિત્રા અને રાજકુમાર મહેંદ્ર ભાઈઓ હતાં. બંને ભાઈઓને જેતાં વારજ તેણું એક ઝૂલની સુંદર એ કળીઓ. છોય બંગ લાગતું હતું. બંનેનો સ્વભાવ ઘણેલું ગીઠો હતો. અશોકનો બંગનો ઉપર અત્યાંત પ્રેમ હતો. બંને જણું સાથેજ અનેક વિષયોનું શિક્ષણ મેળવી રહ્યાં હતાં. ભાઈ ડેળવણીથી સંઘમિત્રાનું હૃદયકમળ ભીલી ઉઠયું. તેણે નિર્મણ જાન પ્રાપ્ત કર્યું અને તેના હૃદયમાં ધર્મભાવ જગૃત થયો. એ વખતે સંઘમિત્રાની વય ૧૮ વર્ષની અને મહેંદ્રની ૨૦ વર્ષની હતી મહારાજ અશોક મહેંદ્રને યૌવરાજ્ય પહ ઉપર અભિષિક્ત કરી પાતે બિલું બનવાનો સંકલ્પ કર્યો હતો; પરંતુ એટલામાંજ ખુદુદેવના પવિત્ર આત્માએ બંને ભાઈઓને ધર્મપ્રચારનું મહાન પ્રત અણણું કરવા સારું આમંત્રણ મોકલ્યું. એ વખતે પૌદ્રધર્મના એક આચાર્યો મહારાજ અશોકને કહ્યું:-

“ રાજન! જેમણે ધર્મની આતર પુર કે સુતીને અર્પણ

કથોં છે તેજ પૌદ્રધર્મના ખરા મિત્ર છે. ”

આચાર્યની એ વાણીએ અશોકના હૃદયને સ્પર્શ કર્યો. તેણું સ્નેહપૂર્વ નથને સંધભિત્ર અને મહેંદ્રના તેજસ્વી સુખ તરફ લેયું અને પછી પૂછ્યું: “ કેમ, તમે બિક્ષુધર્મ સ્વીકારવા તૈયાર છો? ”

અને આઇધળેન પિતાના સુખમાંથી નીકળેલાં એ વચ્ચેનો સાંલળાને પોતાનું ધનસાગ્ય ગણુંવા લાગ્યાં. ધન અને ઐશ્વર્યમાં બિદ્રેલાં હોવા છતાં પણ સંન્યસ્તધર્મ અદ્ભુત કરીને બિક્ષુ અને બિક્ષુણી બનીશું અને કરુણામય યુદ્ધદેવના દ્વારામય ધર્મનો પ્રચાર કરવા સાડું આત્મઅલિદાન આપીશું, એના કરતાં આ પૃથ્વીમાં બીજું વધારે સુખ કર્યું હોઇ શકે? એવા નિયારથી બંને લાઘળાંને વધું પ્રકૃતિલત વહને મહારાજ અશોકને જણાવ્યું: “ પિનાળ ! આપની આજા મળતાંવારજ અમે એ મહાન વત અદ્ભુત કરીને મનુષ્યજગતનું કરીશું. ”

મહારાજાનાધિરાજ અશોકે એજ વખતે બિક્ષુઓના સંધને જાણુંવા દીકું હે, “ આજે મેં લગવાન તથાગત યુદ્ધદેવના પવિત્ર ધર્મને સાડું મારાં લાડકાં પુત્ર અને પુત્રીને અર્પણું કથોં છે. ”

ત્યાર પછી મહેંદ્ર અને સંધભિત્રા પૌદ્રધર્મની પ્રચલિત પદ્ધતિ અનુસાર દીક્ષા અદ્ભુત કરીને બિક્ષુ અને બિક્ષુણી બન્યાં. ધર્મપાલી અને આચુપાલી નામની એ બિક્ષુણીએઓ સંધભિત્રાને ઉત્તમરૂપે બિક્ષુણીએઓની સાધનાના ડોડા વર્તનાનું શિક્ષણ આપવા માંડયું.

આદ્દીયાં જાણુંવાનું જરૂરતું હે કે, મહાત્મા યુદ્ધદેવના ધર્મમાં સર્વર્સ્વ ત્યાગી સંન્યાસી અને સંન્યાસિનીને ને વર્ગ હોતો. તેજ બિક્ષુ અને બિક્ષુણી નામથી આગામ્યોતો. એ બિક્ષુ અને બિક્ષુણીએ પરણતાં નહિ, પરંતુ કઠોર વરાણ્યત ધારણું કરીને રાતદિવસ ધર્મસાધન અને જીવોના કદ્વાણુંની ચિંતામાં ગુંથાયલાં રહેતાં. સંધભિત્રાએ બિક્ષુણી બનીને બધી જતનાં સુખની લાલસા છોડી દીધી અને વાસના ઉપર જ્ય મેળવીને ધર્મસાધન કરવા માંડયું.

બિક્ષુણીએને સાધારણ રીતે ઉપદેશ આપવામાં આવતો હે, “ તૃપ્ણાનો ત્યાગ કરો. જોડામાંજ સંતોષ માનો. જોડા મોજ-શોઅથી દૂર રહો અને એકાંતમાં રહીને ધ્યાનધારણા તથા ધર્મની સાધના કરો. આગસનો ત્યાગ કરી મહેનતુ બનો. અલિમાન તળ દઈને સુશીલા, વિનયી અને નાનુ બનો. અને બધાની સાથે

સહૃભાવ સાચવીને સંતોષપૂર્વક જીવન ગાળો. ખૌદ્ધ તપસ્થિતની-એઓએ શુદ્ધાચારપૂર્વક ચોતાના વ્રતનું પાલન કરવું જોઈએ. ”

લિંગુ અને લિંગુણીઓને કેવા પ્રકારની સાધના કરવી પડતી હતી, તે બાબતમાં વિદ્યાન બંગાળી લેખક શ્રીસુત સત્યેદ્રનાથ ઠાકુર લખે છે: “ વિષયવાસનાથી વેગળા રહીને લિંગુએઓએકાંતમાં પંચભાવનાની સાધના કરવી પડતી. મૈત્રી, કરુણા, સુક્રિત, અશુભ અને ઉપેક્ષા એ ભાવનાના પાંચ પ્રકાર હતા.

“ દેવતા હો કે મનુષ્ય હો, બધા જીવો સુખી થાએઓ; શશ્વતું પણ લંબું થાએઓ; બધા રોગ, શોક અને પાપતાપથી સુક્રત થાએઓ, એવા પ્રકારનો શુભ વિચાર કરવો એને મૈત્રી ભાવના કહે છે. ”

“ હુઃખીનાં હુઃખ પ્રત્યે લાગળી-હિલાસેજ બતાવવી, શું કંધાથી જીવોનાં હુઃખ નાશ પાએ અને સુખ વધે એનો રાતદિવસ વિચાર કરવો એને કરુણા કહે છે.

“ ભાગ્યવાન મનુષ્યોના સુખે સુખી થબું, તેમનાં સુખ અને સૌભાગ્ય સ્થાથી થાએઓ એવો વિચાર રાખવો એને સુક્રિત ભાવના કહે છે.

“ શરીર વ્યાધિનું ઘર છે, વીજળીના ચમકારાની પેઢે ક્ષણસ્થાથી છે, અંઝવાના જળ જેલું મિથ્યા છે અને મળમૂત્ર, પડવગેરે ગંદા પદાર્થથી ભરપૂર છે, માનવજીવન જન્મમુત્યુને અધીન છે, હુઃખમય અને ક્ષણુલંગુર છે એવો વિચાર કરવો તેને અશુભ ભાવના કહે છે.

“ બધા જીવ બરાબર છે, કોઈ પ્રાણી જીવ પ્રાણી કરતાં વધારે પ્રીતિ કે વધારે તિરસ્કારને પાત્ર નથી; ણળ, હુર્ણગતા, દ્રેષ, ભમતા, ધન અને ગરીણાઈ, યશ, અપયશ, જીવાની અને ઘડપણ, સુંદર, અસુંદર, બધા શુણું અને બધી અવસ્થાઓ સમાન છે એવી સાર્થક ભાવના રાખવી તેને ઉપેક્ષા કહે છે.”

હરરોજ સવારે અને સાંજે આવા ડાંચા પ્રકારના વિષયોનું ચિંત્વન કયોથી નરનારીઓ ધણા ડાંડા ભાવમાં દૂણી જાય અને તેમનાં મન અતિશય ઉજ્જત થાય, હૃદય વિશાળ થાય એ વાત તો સહેજે સમજ શકાય એવી છે. એ સાધનામણ્યાલીને લીધેજ સુન્નતા, વિશાખા વગેરે અનેક ખૌદ્ધ રમણીઓએ ઉજ્જત જીવન પ્રાસ કર્યું છે. રાજકન્યા સંઘમિત્રા પણ એ સાધન કરવા લાગી અને ધીમે ધીમે ધાર્મિક જીવનની એકે એકે જાંચી સીડીએ ચઠવા લાગી.

સંઘમિત્રાનો મોટોભાઈ મહેન્દ્ર બગ્રીશ વર્ષની વચે ધર્મ-પ્રચારને સારુ સિંહલદીપમાં ગયો. સિંહલદેશના રાજ તિષ્ઠ મહેન્દ્રનું આધ્યાત્મિક જ્યોતિથી પ્રકાશિત થયેલું શાંત સુંદર સ્વરૂપ જેઠને વિશ્વમય પાણ્યા અને અત્યાંત શ્રદ્ધા અને આદર-પૂર્વક તેને પોતાને ત્યાં રાજ્યો. સિંહલનાં હન્દો સ્વીપુરુષો મહેન્દ્રનો ઉપરેશ સાંભળીને બૌદ્ધધર્મ થડુણુ કરવા લાગ્યાં.

થાડા દિવસ પછી સિંહલની રાજકુમારી અનુલાંચે પાંચસો સખીઓ સહિત બિક્ષુણીવત વેવાનો સંભલપકયો. એ વખતે મહેન્દ્રને લાગ્યું કે, આટલી બધી સ્વીઓને ઉત્તમ રીતે ધર્મનું શિક્ષણ આપવા તથા સિંહલની સ્વીઓમાં ધર્મપ્રચાર કરવા સારુ એક ડેળવાયલી અને ધર્મશીલ બિક્ષુણીની અત્યાંત આવશ્યકતા છે. એટલા માટે એણે પોતાની વહાલી બહેન સંઘમિત્રાને સિંહલ મોકલાવવા સારુ પિતા અશોકને પત્ર લાય્યો. રાજકુમારી સંઘમિત્રાને હવે ધર્મ સિવાય બીજા કોઈ પર્યાવરણ પદાર્થ ઉપર આસક્તિ રહી નહોતી; એટલા માટે એણે જ્યારે સાંભળ્યું કે, ધર્મપ્રચારની ખાતર હુર દેશાવર સિહલદેશમાં ભાઈ મહેન્દ્રની પાસે જરું પડશે ત્યારે એતું હૃદય એકદમ આનંદના સરોવર-સમ થઈ ગયું અને એ સરોવરમાં શાંતિદ્યમી કમગ ખીલી રહ્યાં. પુણ્યશીલા નારીએ પ્રકૃતલ ચિંતે સગાંવહાલાંની માયાળળ કાપી નાખીને, સિંહલ જવા સારુ સમુદ્રગામી વહાણુમાં પગ મૂક્યો.

એની પૂર્વે બીજી કોઈ ભાગ્યશાળી ભારતરમણી ધર્મપ્રચારની ખાતર એટલે હુર દેશાવર ગઈ હતી કે નહિ તે એમે જાણ્યતા નથી; એટલે એ શુભ દિવસ ખરું જેતાં ભારતરમણીઓના ધર્તિ-હાસમાં રમરણુમાં રાખવા ચોણ્ય દિવસ છે, એમાં જરા પણ સંદેહ નથી. અનુમાન કરીએ છીએ કે એ દિવસ ભારતનું વહાણુ કોઈ નૂતન જોરવ અનુભવતું સાગરના તરંગો ઉપર આનંદમાં ડાલતું ડાલતું જરું હશે. સાંભળ છે કે એ દિવસે કિનારા ઉપર વસનારા આર્ય નરનારીઓએ વહાણુના કિનારા ઉપર જાણાં રહીને રાજકુન્યાના મસ્તક ઉપર પુષ્પવૃદ્ધિ કરી હશે.

સંઘમિત્રા સિંહલદેશમાં જઈ પહોંચ્યા પછી તેની તેજસ્વી સુખસુદ્રા, તપસ્વિનીનો વેશ અને અપૂર્વ ધર્મભાવ જોયાથી ત્યાંના સ્વીપુરુષોનાં હૃદયમાં કેવા પ્રકારની અજીત અને વિશ્વમય ઉત્પજ્ઞ થયાં હશે, તે જાણ્યવાનું આપણી પાસે કાંઈ સાધન નથી. અહાલા-૧૫

રાજી અશોકના જીવનચરિતમાંથી ડેવળ એટલું તો જણ્ણાઈ આવે છે કે, સંઘમિત્રાએ સિંહલહેશમાં જઈનેત્યાં આગળ એક લિક્ષુણી-સંપ્રદાય સ્થાપ્યો હતો. તેના ત્યાગમાંત્રકાર પવિત્ર અનેલા જીવનનો પ્રભાવ સિંહલહેશાસીએ ઉપર ઘણેલા સારો. પણ હું હતો, પણ એ સંભંધી વિશેષ વૃત્તાંત આપણું જણ્ણામાં નથી આવતો; પરંતુ એ સંન્યાસિની રાજકન્યાની બાળતામાં જે થોડીક વાતો જાણી શકત્રા છીએ, તેના ઉપર વિચાર કરવાથી કદમ્પનાના માયામંત્ર-કાર મનમાં ને મનમાં તેની એક માનસી મૂર્તિ ખડી થાય છે; અને એ મૂર્તિ આગળ આપણે મસ્તક નમાવલું જ પડે છે. જરા વિચાર કરીને જેથાથી જણ્ણાશે કે, ધર્મપ્રચાર કરતાં વધારે ગૌરવ-મય કાર્ય આ જંસારમાં બીજું કાંઈ નથી. આત્મોત્સરી કરીને સત્યની અમૃતમય વાણી મનુષ્યનાનિને સંભળાવવા કરતાં વધારે ઉદ્ઘત કાર્ય રૂપીને માટે કયું હોઈ શકે? લગભગ ૨૧૭૫ વર્ષ પૂર્વે ભારતના એક ચક્કવર્તી મદારાનાધિરાજની કન્યા સંઘમિત્રાએ એ ધર્મપ્રચારના કાય નું ગૌરવ અનુભાવલું હતું અને આડો-અવળો કાંઈ પણ વિચાર કર્યો વગર ધર્મની આતર પોતાનું અમૂર્ખ જીવન સર્મર્ખલું કરી દીધું હતું. જ્યાંસુધી ભારતનો ધતિહાસ કાયમ રહેશે ત્યાંસુધી આપણે એ ભારતરમણીના પવિત્ર નામતું ઉચ્ચારણ કરતાં કરતાં પ્રતિહિત તેના પ્રત્યે ખરા અંતઃ-કરણુંની અદ્ધા અને બિક્ષિત પ્રગટ કરવી પડશે.

મહાવંશ વળેર બૌદ્ધ અંથોમાં સંઘમિત્રાનો ઉલ્લેખ મળી આવે છે. મહાવંશના લેખક લંગે છે કે, “સંઘમિત્રાએ પૂર્ણ-જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હથલહ્લક નગરમાં વાસ કરતી વખતે તેણે ધર્મની ઉન્નતિને સારુ પુષ્પળ પુષ્પય કાયો કર્યાં હતાં અને ૬૬ વર્ષની વયે પરિનિવાણું પદ પ્રાપ્ત કર્યું હતું. સિંહલના રાજાએ અત્યાંત માનપૂર્વક સંઘમિત્રાની અંત્યેષ્ટિ કિયા કરી હતી.

ભારતવર્ષની દરેક મહિનાસૂચ્યક વાતો ઉપર અશ્રદ્ધા રાખ-નાર અંગ્રેજ લેખકો પહેલાં તો ‘સંઘમિત્રા’નો ધતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવાને તૈયાર નહોતાં; પરંતુ હવે તો વિન્સેન્ટ સ્ટિલ્થ જેવા પ્રસિદ્ધ ધતિહાસ લેખક તેનું અસ્તિત્વ સ્વીકારે છે અને પોતાની પહેલાંની ભૂલ માને છે.\*

\* શ્રી. અમૃતલાલ ગુરુના એક અંગાળી લેખ ઉપરથી.



## ૮૭—શ્રીમતી



જ બિંબિસાર યુદ્ધહેવનો પરમ લક્ષ્ણ હતો. એણે એક દિવસ યુદ્ધહેવને ખડુ વીનવીને તેમના ચરણુના નાખની એક કણી મારી લીધી હતી. એ કણીને કાળજીપુર્વક પોતાના રાજમહેલના બગીચામાં દારીને તેના ઉપર એક સુંદર શિલ્પકળાથી વિલૂધિત સ્તૂપ રચ્યો.

સંદ્યા સમયે રાજકુદુંણની વહુદીકરીએ સ્વચ્છ વસ્તુ ધારણ કરી સુકુમાર હસ્તમાં કૃતની છાગડીએ લઈ, એ સ્તૂપ આગળ આવતી અને સોનાનાં ડોડિયાંએમાં દીપક સણગાવતી.

રાજબિંબિસારના મૃત્યુ પછી તેને પુત્ર અનલતશનુ ગાડીએ બેઠો. પિતા જેટલો યુદ્ધલક્ષ્ણ હતો, તેટલોજ પુત્ર બૌદ્ધધર્મને દેખી હતો. તલબારના બળ વિદેશી બૈદિક યઙ્ગો ક્રીધી ચાલુ કર્યો અને તેમાં બૌદ્ધધર્મથી ઘોને સ્વાહા કરી દીધા. તેણે આણા શહેરમાં ઢારે પિટાંયો કે, “આ જગતમાં વેદ, આદ્યાણ અને રાજ એ ત્રણુ ઉપરાંત થીજું કોઈ પૂજા કરાવવાને અધિકારી નથી. જે કોઈ એ વાત ધ્યાનમાં નહિ લે અને તેથી વિરુદ્ધ વર્તશે તેની હું ખણર લઈ લઈશા.”

રાજબિંબિસારને શ્રીમતી નામની એક દાસી હતી. યુદ્ધહેવ પ્રત્યે એને પરમ લક્ષ્ણ હતી. રાજની આજાથી ડરી જઈને નગરવાની અનેક સ્ત્રીપુરુષોએ યુદ્ધહેવની પૂજા કરવી છોડી લીધી, ત્યારે શ્રીમતીનું લક્ષ્ણ હૃદય કંધી જોડયું. એણે તો નિશ્ચય કર્યો હતો કે ગમે તે થશે તોપણ હું મારો નિત્યનિયમ નહિ છોડું. ઢારે પિટાંયો તેજ રાતે શુદ્ધ, શીતળ જળથી સ્નાન કરીને હાથમાં એક થાળીમાં પુષ્પ તથા દીવો લઈને શ્રીમતી રાજમહિષીની પાસે ગાઈ અને સ્તૂપની પૂજા કરવા સારુ જવાનું સંભાયું.

મહારાણીએ ખૂઝતે ખૂઝતે કહ્યું: “તને ખખર નથી કે અજાતશત્રુએ હઠેરો પિટાવ્યો છે કે, ‘જે કોઈ સ્તુપની પૂજા કરશે તેને શ્રીએ ચદાવવામાં આવશે, કાં તો દેશનિકાલ થશે.’”

શ્રીમતી ત્યાંથી નીકળીને ધીમે પગે રાજવધૂ અમિતાની પાસે ગઈ. રાણી એ વખતે શાખુગાર સળ રહી હતી. શ્રીમતીના હાથમાં પૂજની સામચ્ચી જેઠને તેના આવવાનું કારણું સમજું ગઈ અને ઠપકો હેવા લાગી: “મુખ્યા ! પૂજની સામચ્ચી અહીં લાવવાની તારી છાતીજ કેમ ચાલી ? હમણ્ણાં ને હમણ્ણાં અહીંથી ચાલી ન. કોઈ જેશે તો મોટો ગજબ થશે.”

શ્રીમતી બીજી ઓરડામાં ગઈ, તો અસ્ત પામતા સૂર્યના પ્રકાશમાં બારી ખુલ્લી મૂકીને રાજકુમારી શુક્લા પડી પડી કવિતાનું પુસ્તક વાંચી રહી હતી. શ્રીમતીને પૂજની સામચ્ચી સહિત આવેલી જેઠને તે ચમકી ભાઈ અને જટ એની પાસે જથુને ધીમે ધીમે કહેવા લાગી:—

“રાજની આજા તું નથી જાણુતી ? જાણીજેઠને મરણના સુખમાં જવા શા સારુ નીકળી છે ?”

પૂજની થાળી લઈને શ્રીમતી બારણે બારણે રખડી અને પોકાર કરવા લાગી: “હે નગરવાસીએ ! પ્રભુની પૂજનો સમય થયો છે.” એ સાંભળતાંવારજ લોકો લય પામતા અને કોઈ તો એને ગાળો પણ હેતા. શ્રીમતી લોકોની હર્ષણતાનો વિચાર કરીને વિસમય પામવા લાગી.

એમ કરતાં કરતાં દિવસનો છેલ્લો પ્રકાશ બંધ પડ્યો, અંધકાર વ્યાપી ગયો. અને માણ્યુસોની આવળ બંધ પડી ગઈ. ડોલાહલ શરીર ગયો. રાજમહિરમાં આરતીના ઘંટ વાગવા લાગ્યા.

શરહઙ્કરુની એ અંધારી રાતે સ્વચ્છ આકાશમાં અસંખ્ય તારાઓ અખૂદી રહ્યા હતા.

આવે સમયે કોઈ ખુદ્દહેવના સ્તુપ આગળ જઈ શકે એમ ન હતું, પણ એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરા એક મનુષ્યાઙૃતિ જેઠને ચમકી જાયા. આગળ જથુને એમણે જેણું તો રાજના અગ્રીચાના એક ખૂણામાં ધોર અંધારામાં ખુદ્દહેવના સ્તાંભની ચારે તરફ દીપકની જયોત અગમગી રહી છે,

ખુલ્લી તલવાર લઈને સિપાઠાએ હોડતા આવ્યા. જેણું તો એક રમણી સ્તુપની પાસે એઠી છે. એનાં નેત્ર બંધ હતાં અને હોઠ જરા કુરકુરી રહ્યા હતા. રાજના સિપાઠાએ પૂછ્યું: “તું આવી રાતે અહીં આવનાર અને રાજની આજાનું ઉલ્લંઘન કરનાર કોણું છે ?” શ્રીમતીએ મધુર સ્વરે ઉત્તર આપ્યો: “હું ખુદ્ધની હાસી શ્રીમતી છું.”

નાગી તલવાર એ રમણીની ગરદન ઉપર પડી, મંહિરનો એ શ્વેત પથ્થર લોહીથી રંગાંધ ગયો.

શરફની એ સ્વચ્છ રાનિએ આસાદ-કાનનમાં સ્તુપ આગળના એ આરતીના દીવા ચુપચાપ છેલ્લીવાર છોલવાં ગયા. શ્રીમતીનું નામ અમર થઈ ગયું.\*

## ૮૮-ચંદ્રવતી

કાશીરમાં પ્રાચીનકાળમાં ધસવીસન પૂર્વે પ૦૫ વર્ષે ઉપર મિહિરકુળ નામનો એક રાજ થઈ ગયો છે. એ રાજ ધણું પ્રતાપી તેમજ કુર પણું હતો. સિંહલ દેશને તેણું જીત્યો હતો. તેના લુધનના એક પ્રસંગ ઉપરથી એના સ્વભાવનો પરિચય મળ્યો. સિંહલ-વિજય કરીને કાશીર પાછા કુરતાં, કાશીરના દરવાજા આગળ તેણું એક હાથીને અકરમાત્ર પહાડ ઉપરથી સરકી પડ્યો અને ચીસો પાડી પાડીને મરી જતાં જોયો. રાજને એ દેખાવ જેઠિને મળ પડી અને તેણું આજા આપીને અનેક હાથીએને એવી રીતે પહાડ ઉપરથી ધકેલીને મારી નાખ્યા. લુધનમાં એવાં અનેક પાપકર્મ કરનાર એ રાજને પાછળ થી પક્ષીતાપ પણ બહુ થયો. હતો અને પુષ્યે પાપ ઢેલાય એ વિચારથી પુષ્યદાન કરવા લાગ્યો. એ રાજએ શ્રીનગરીમાં મિહિરશ્વર મહાદેવની સ્થાપના કરી. વળી તેણું મિહિરપુર નામનું નગર વસાવી એમાં બહુ અચહાર અંધાર્યા તથા પ્રાણષ્ણુને પુષ્કળ હાન દીધાં.

\* શ્રીલુત રવીન્દ્રનાથ હાકુરના ‘પૂજનરિષ્ટી’ નામના એક સુમસિદ્ધ કાવ્ય ઉપરથી.

એ રાજ એક વખત ચંદ્રકુલ્યા નામની નહીનો પ્રવાહ બીજુ દિશામાં વાળવામાં રોકાયો હતો; પરંતુ માર્ગમાં એક મોટી શિલા પડી હતી તે અડચણું હૃપ થઈ પડી. રાજને લાગ્યું કે મારા પાપને લીધીજ આ વિધન ઉપસ્થિત થયું છે. એણે મત ઉપવાસ આરંભ્યાં અને હેવતાઓને પ્રસન્ન કરવા એક મોટો યજ રચ્યો. હેવતા-એ સ્વભમાં દર્શન દઈને તેને કહ્યું: “હે રાજજ ! આ શિલા ઉપર ભળવાન અદ્ધુતારી યક્ષ વાસ કરે છે; માટે જ્યાંલગી કોઈ પતિ-પ્રતા કી પાતાના હાથનો સ્પર્શ નહિ કરે ત્યાં લગી એ પથથર હઠવાનો નથી. તે સિવાય તો અદ્ભુતા હેવતામાં પણ એ પથથરને ખસેડવાનું સામર્થ્ય નથી.”

સવાર થતાંજ રાજએ ઠંડેરા પિટાવીને પતિવતા કીએને એ શિલા આગળ આવવાનું આમંત્રણ કર્યું. હન્દે ક્ષીએઓ પાતાના પાતિવત્યતું અભિમાન ધરાવતી ત્યાં આવી અને શિલાને સ્પર્શ કર્યો, પણ કોઈનાથી પથથર ખરચ્યો નહિ. એ ગામમાં ચંદ્રવતી નામની એક કુંભારણ પણ રહેતી હતી. એ પણ નહી આગળ આવી હતી. ઉચ્ચ કુળની હન્દે નારીએ નિપ્રથનીવડી ત્યારે એ કુંભારણે આગળ આવી વિનયપૂર્વક શિલાને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાં વાર અટ શિલા ખસવા લાગી. રાજ ઘણું પ્રસન્ન થયો. તેણે તથા હાજર રહેલાઓએ ચંદ્રવતીના પાતિવત્યની સુકૃતકણે પ્રશાંસા કરી. એમ પણ કહેવાય છે કે એ પ્રસંગથી રાજને બીજુ ક્ષીએઓ ઉપર ઘણું કાંધ જોપનયો. અને તેણું તેમનો વધ કરાવ્યો. જમે તેણા, ચંદ્રવતીએ શિયળના પ્રભાવથી કાશમીરના ઈતિહાસમાં પાતાનું નામ ઉજન્ભગ કર્યું છે.



## ૮૯-અમૃતપ્રભા

મુક્તિ પ્રાપ્તિ ગજયોતિપુરના વૈપુષુવ રાજની એ કન્યા હતી. એના લગ્નાં લગ્નાં લખ સમયે પિતાએ સ્વયં વર રચ્યે હતો. અમૃતપ્રભાએ કંદળારના રાજના પુત્ર મેધવાહનને વરમાળા પહેરાવી. મેધવાહન દિવ્ય લક્ષ્ય પુષુદુક્ત રાજપુત હતો. એ કાશીરના રાજસિંહાસન ઉપર જંધિમાન રાજના વાનપ્રસ્થ થયા પછી પ્રભાની પસંહળીથી બેડો હતો. પ્રભ એના ઉપર ઘણી પ્રસન્ન હતી. રાજ જીવહયાનો મહાન પોષક હતો. રાન્યાલિષેકને દિવસે એણે ફંદેરા પિટાવ્યો હતો કે, “આજથી કોઈ પણ મતુષ્ય કોઈ જલતના પ્રાણીની લિંસા કરવા નહિ પામે” પોતાના એ ઠરાવને અમલમાં લાવવા સારું એણે પ્રાણીઓના વધ કરીને શુજરાન ચલાવવનારા કસાઈ વગેરે લોકોને રાજના અજનામાંથી પૂંજુની મદદ અપાવીને ઉપયોગી નિર્દોષ ધાંધાણોમાં લગાડી દીધા હતા. એ રાજના રાન્યમાં યંત્રામાં પણ વીનો ડોમ થતો હતો. અને બલિહાનમાં પશુને બહલે ઉણુકનું પશુ જનાવવામાં આવતું હતું. એ રાજએ મેધવન નામનો એક અથડાર બંધાવ્યો હતો.

રાણી અમૃતપ્રભા ચોણ્ય પતિની સુયોગ્ય સહધર્મિણી હતી. એ પણ પુષુદ્યવાન અને ધર્મપરાયણું હતી. બિક્ષુઓના આરામને સારું એણે અમૃતલબ્ધન નામનો જાંયો વિહાર બંધાવ્યો હતો અને પોતાના પિતાના ગુરુ ‘લો’ નામના સાધુની આજાથી ‘લોસ્તુન્વા’ નામનો એક સ્તૂપ બંધાવ્યો હતો.

અમૃતપ્રભાના દ્વારા તથી પ્રેરાઈ રાજ મેધવાહનની થીજી રાણી ચૂકદેવીએ પણ પોતાના નામથી એક વિશાળ વિહાર બંધાવ્યો, જે વિહારના અરધા ભાગમાં વિક્રાન અને સહાચારી સાધુઓએ નિવાસ કરતા હતા. અને અરધા લાગમાં સ્વી, પુત્ર અને પશુસહિત ગૃહસ્થ લોકો રહેતા હતા. રાજની થીજી એક રાણી ઈદ્ર-દેવીએ પણ એક વિહાર અને ચતુઃશાલ સ્તૂપ બંધાવ્યા હતા.



## ૧૦—વાકૃપુષ્ટા



કૃતિની લીલાભૂમી—નાંદનવન સમાન કાશ્મીરમાં  
વિકભ સંવતનાં ૧૨૬ વર્ષે પૂર્વે તુંઅન નામનો  
એક પ્રતાપી રાજ રાજ્ય કરતો હતો. એ ઘણ્ણો  
પરાડમી, ઉદાર અને દાનશીલ હતો. એની રાણીનું  
નામ વાકૃપુષ્ટા હતું. કાશ્મીરનો ઈતિહાસાલેખક  
કહુલણું લખે છે કે, “એ બને રાજરાણીએ પૃથ્વીને  
એવી રીતે અત્યંત ભૂષિત કરી દીધી હતી, ફેલેવી  
રીતે ગાંગા અને મુગાંકના હુકડાએ શિવળુની જટાને શોભિત  
કરી રાખી છે; અથવા એ બનેએ નાના પ્રકારના વર્ણથી કાશ્મીરને  
એવી રીતે મનોરમ બનાવ્યું હતું કે, જેવી રીતે બીજળી અને  
મેઘ મળીને મેઘધનુષ્યની શોભા ઉપરની કરે છે. એ રાજ એ  
તુંગેશ્વર નામનું શિવાલય બંધાવ્યું હતું. એક વખત પ્રણને  
તડકાતું ધણ્ણ હુઃખ બેઠતી જેઠને એણું સરક ઉપર છાચાવાળાં  
વૃક્ષો રોપાવવાની આસ વ્યવસ્થા કરી હતી. રાજ જેવો પરોપ-  
કારી હતો તેવીજ રાણી વાકૃપુષ્ટા હતી. પોતાની પ્રણને એ સંતાન  
સમાન ગણ્ણૂતી હતી અને એમનાં કષ્ટનું નિવારણ કરવાને  
સદા તર્પર રહેતી.

એ રાજદ્વંપતીનો સંસાર ઘણ્ણા સુખમાં વ્યતીત થઈ રહ્યો  
હતો, એવામાં એમના ઉપર એક લારે વિપત્તિ આવી પડી. ખરા  
રાજનો પોતાની પ્રણના સુખમાંજ સુખ અને પ્રણના હુઃખમાં-  
જ હુઃખ માને છે. રાજદ્વંપતીના ધૈર્ય અને મહત્તમાની પરોક્ષા  
કરવા સારક હૈવે કાશ્મીરની પ્રણ ઉપર મહાન આકૃત નાખી.  
ત્યાંની ક્રણ્ણૂપ જમીનમાં શરદાતુમાં તૈયાર થવા આવેલા પાક  
ઉપર લાદરવા મહિનામાં અકરમાતું એટલો બધો બરફનો વર-  
સાદ વરચયો. કે જાણ્ણો વિશ્વનો સંહાર કરવાને તૈયાર થયેલો સાક્ષાત  
કાળ અહૃતાસ્ય કરી રહ્યો હોય એલું દેખાવા લાગ્યું. હિમ પણ્યાથી  
૧૭૬

અનાજનાં એતરોની સાથે સાથે પ્રજનના જીવનની આશા પણ નાશ પામી ગઈ. એ સુંદર દેશમાં ઘાર ફુકાળ પડ્યો. લોકોને અજ્ઞના સાંસા પડવા લાગ્યા અને દરરોજ હજારો સ્વીપુરુષો કાળના વિકરાળ સુખમાં પડવા લાગ્યાં. પેટની જાગથી વ્યાકુળ થયેલી માતાઓ પોતાનાં લાડકાં ભાગકોના હાથમાંનો જોરાકનો ડેણિયો. ઝુંટવી લઈને આવા તૈયાર થતી હતી. પતિ પત્નીના હાથમાંથી જુવાર પડાવી લેતો અને એવાં અનેક હૃદયવિદારક દસ્ય એ ફુકાળના સમયમાં દેખાવા લાગ્યાં. ઈતિહાસ કહે છે, કે એ સમયે પેટની જવાળાથી પીડાતા ભૂખ્યા મનુષ્યો પત્નીનો પ્રેમ, સંતાનનો સ્નેહ, પિતા પ્રત્યેનો પૂજ્યભાવ-બધું વીસરી ગયા. અલક્ષ્મીના કૃપાકટાક્ષથી એક ડેણિયા ધાનની આતર લોકોએ લાજ, શરમ, અલિમાન, કુળનું ગૌરવ આહિ બધા વિચારોને તિલાંજલિ આપી દીધી. જ્યાં જુંયો ત્યાં હાડપિંજર સમા દેહવાળા મૂર્તિમાન પ્રેતસમા મનુષ્યો એક રૈટલીના ફુકડા સારુ લડી ભરતા દેખાતા હતા. એ લયાંકર ફુકાળનું વર્ષણ કરીને અમે અમારાં વાચકોનો અમૂહ્ય સમય લઈશું નહિ. છપનિયામાં એ લોકોએ અહાર જઈ ગરીબ લોકોની હુર્દાના નિહાળી હશે, તેમને કાશ્મીરના એ લયાંકર ફુકાળની કંઈક કલ્પના આવશે.

કાશ્મીરના સફુલાંયે એ સમયે તુંલન અને વાક્યપુષ્ટા જેવાં પરૈપકારી, દયાળું અને પ્રજલવત્સલ રાજરાણી હતાં. એમણે એવી આપચિના સમયમાં રાજમહેલમાં એસી રહીને મોજમજાહ ઉડાવવાનું અયોધ્યજ ધારું. ફુકાળથી પીડાતા લોકોનો આર્તનાદ એમની છાતીને વીધી નાખવા લાગ્યો. તેઓ અહાર આવ્યાં અને પોતાનો બધો અનનો, પોતાના સઘળા દરદાળીના પ્રજનના હિતને સારુ, ફુકાળિયાંએને અજ આપવા સારુ ખુલ્લા મૂક્યા. રાજરાણી જતે પોળામાં, રસ્તાઓમાં અને ઘેરેઘેર ફરીને ગરીબાને અજ વહેંચવા લાગ્યાં. એમના દર્શનમાત્રથી રૈથતનું હુંખ ચાવ્યું જતું. જંગલ, સમશાન, ગઢી, ચૌદું, ધરખાર કોઈ પણ સ્થાન એવું ન રહ્યું કે જ્યાં રાજરાણીએ જતે જઈને હુંખી લોકોને લોજન નહિ કરાયું હોય. આ પ્રમાણે પ્રજનની સેવા કરતાં કરતાં રાજ્યનો બધો અનનો આતી થઈ ગયો. વળી પેસા અરચીને પણ અરીહવા ધારે તો પણ દેશમાં અજજ ખૂટી ગયું હતું, એટલે રાજ અત્યાંત નિરાશ થયો. હવે એવું ધૈર્ય રહ્યું નહિ.

એક દિવસ ભૂજયોતરસ્યો આયો। દિવસ પરિશ્રમ કરીને રાજ વેર આવ્યો અને પ્રબળનું હુઃખ સાંભારીને ગોટે સાહેવિલાપ કરવા લાગ્યો। અનાં નેત્રમાંથી અશ્વ દઢકડ ટપકતાં હતાં, રાણી વાક્ય-પુષ્ટ એ સમયે શયનગૃહમાં ઈષ્ટહેવને પ્રાર્થના કરી રહી હતી કે, “હે પરમાત્મન! અમારા ઉપર દયા કરો. અમારી ગરીબ રૈયતના હુઃખનો પાર રહ્યો નથી. હે કરણુસાગર! હે હૃપાળ! અમારા સામું બુઝ્યા અને અમનું અન્નતું કષ્ટ નિવારો.” કે સમયે રાણી પ્રાર્થનામાં નિમન્ન હતી તેજ સમયે પતિનો વિલાપ તેને કાને પડ્યો અને એ આકુળબ્યાકુળ થઈને રાજના દીવાનાનામાં ગઈ અને શોક તથા ચિંતાનું કારણું પ્રેમપૂર્વક પૂછવા લાગી. રાજનો આંસુને રાકીને કહ્યું: “હેલિ! મારી તો ખાતરો થઈ ગઈ છે કે આપણું અપરાધથીજ ગરીબ, નિહોય પ્રણ આ અસહ્ય હુઃખ વેરી રહી છે. હાય! મારા જેવા અલગિયા રાજને ઘિંઠાર છે કે જેની આંખ આગળ દયાને પાત્ર અજાણ ટળવળી મરે છે. આ પૂર્ખવીમાં મારી રંક પ્રણને કંચાંય પણ શરણ રહ્યું નથી. આ ઘાર આકૃતમાંથી મારી એ લાડકવાઈ દૈયતનું રક્ષણ ન કરી શકું, તો મારું રાજ અન્યાનું અને લુલ્યાનું સાર્થકજ શુ? મારાથી અન્યાં લાંસુધી મેં જોમને અચાચ્યાં અને અજ વગર મરવા ન દીધાં, પણ ક્ષેત્ર શું કરલું? ક્ષેત્ર તો દેશમાં અસજ નથી રહ્યું. વોર હુઃખસાગરમાં ઇઝેવી મારી આ પ્રણનો ઉદ્ધાર ડેવી રીતે થાય તેનીજ મને હિક્કર છે. સૂર્ય વાહણાંબાથી વેરાયલો હોવાથી અંધકાર છબાઈ ગયો છે અને કાળાંબીની ચારે તરફથી વિશ્વને વેરી લીધું હોય ગયો દેખાવ થઈ રહ્યો છે. અરદ્ધના પર્વતોને લીધે ચારે તરફનો માર્ગ રોકાઈ ગયો છે અને લોકો કહીં આવનું કરી શકતા નથી. માળામાં અંધ કરેલા પક્ષીના જેવી મારી દૈયતની દશા થઈ છે. રાણી! આ હુકળે તો મોટા મોટા ચર-વીર, બુદ્ધિમાન અને વિદ્ધાનોની બુદ્ધિ ચકાવામાં નાખી દીધી છે. વહાલિ! મારા રાજયમાં એવા અનેક ચોણ્ય મુરૂયો છે કે કે ખાહાર જઈને પોતાની સલાહ વડે એનીનોનાં હુઃખ હર કરી શકે, પણ અલ્યારે કોઈની બુદ્ધિ કહ્યું કરતી નથી.

“આવી સ્થિતિમાં શું કરલું એ મને સૂભતું નથી, એટલે મેં સળગતી આગમાં અંપલાલીને હેઠનો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે. મારામાં હવે એટલી શક્તિ નથી રહી કે, મારી નજર આગળ

રૈયતને નાશ પામતી નોઈ શકું અહીં ! ધન્ય છે એ રાજને કે જે ચોતાની પ્રજને પુત્ર સમાન ગણ્ણીને તેમને સુખી બુઝે છે અને ચોતે સુખમાં સૂચે છે.” આટલું કહેતાં કહેતાં રાજનું હૃદય લરાઇ આવ્યું અને એને જેણે દૂમો બાજચો. પલંગ પર સૂક્ષ્મ જઈને મોં ઉપર કપડું ઢાકીને એ ખૂબ રોવા લાગ્યો.

પતિના મનની વચ્ચા રાણી અરોપદર સમજી ગઈ. પતિએ ઘૈર્યનો ત્યાગ કર્યો એ વખતે રાણી વાક્યપુષ્ટાએ હૃદયને કઠળું કર્યું અને પતિને ધીરજ ધરવાનો ઉપદેશ પ્રેમમથી વાણીમાં આપવા માંડ્યાંઓ: “ રાજનું ! પ્રજના ! પાપને લીધે આજ આપની આવી અવળી મતિ થઈ છે કે આપ સાધારણ કાયર મતુપથેના જેવી વાતો કરી રહા છો. વીર પુરુષને ન છાન્યે એવો આત્મહકૃત્યાનો વિચારજ તમને કેમ સૂજચો ? રાજ અસાધ્ય હું હોને હુર ન કરી શકે તો પણી એની મોદાદ શામાં છે ? સત્યવત રાજની આજાનું ઉદ્દ્વાધન કરવાની શક્તિ હેવતાઓમાં પણ નથી. પતિમાં અક્ષિત રાખવી એ જીવોનું વત છે, માંહામાંહે દ્રાઢ અને કુદંપ ન કરવો એ મંત્રીઓનું વત છે અને જર્વ પ્રકારે પ્રજનું પાલન કર્યું એ રાજનું વત છે; માટે છે વતધારીઓમાં શ્રેષ્ઠ ! ઓડો, મારા વચ્ચનને મિથ્યા ન માનશો. પ્રજનાપણ ! ચાલો, આપની પ્રજનું ભૂખમરાનું હુંખ ટળી ગણ્યું એમ સમજો. નિરાશ થઈને પડી રહ્યે નહિં પાલવે. આપણા હેઠમાં પ્રાણું છે ત્યાંસુધી આપણી હૃજ છે કે રૈયતને બચાવવી. એક પણ મતુપથને સુત્યુના સુખ માંથી બચાવી શકીશું તો આપણા અવ્યાનું સાર્થક છે. આપણા બધા પ્રયત્ન જ્યારે નિષ્ઠળ જશો, પ્રજનજનોમાંથી એકેએક કાળના સુખમાં સયદાઈ જશો, ત્યારે એશાક લાચાર થથને આપણે બને ચિતામાં ચરીશું; પણ ત્યાંસુધી નિરાશ થવાની કંઈ આવસ્યકતા નથી. પ્રભુએ આપણી પરીક્ષા લીધી છે. એ પરમ હયાળું પિતા આપની પવિત્ર નિધાનો જરૂર બદલો. આપશો. જો મેં સાચા હિંદુથી પતિસેવા કરી હશે, જે મેં શુદ્ધ મનથી પ્રભુને સેવ્યા હશે, તો એ મને અવસ્ય આ સમયે સહાય કરશો.”

એટલું કહીને રાણી વાક્યપુષ્ટા એકાથચિતો પ્રભુપાર્થનામાં નિમગ્ન થઈ ગઈ. આને એણે નિશ્ચય કર્યો હતો કે, “ પ્રભુને મારી પ્રાર્થનાથી સંતુષ્ટ કરીશા, નહિં તો પતિના પહેલાં હુંજ આ સંસારનો ત્યાગ કરીશા.” રાણીએ કલાકેના કલાકો સુધી દીન પ્રજનાની

આતર પ્રલુની ઉપાસના કરી, પુષ્કળ કરગરી, અસંખ્ય આંસુ પાણ્યાં અને અશરણુના શરણુ દીનાનાથ તેની વહારે ધાયા.

નેતનેતામાં આકાશમાંથી કષ્યૂતરેનો વરસાદ પડ્યો. નાનાં-મોટાં અસંખ્ય કષ્યૂતરેના મૃતહેઠ હુકાળિયાંની પાસે આવીને પડ્યા અને તેમણે અનેક દિવસ સુધી તેનાથી ભૂળ સમાવી.

રાજતરંગિયુક્તિકારનું અનુમાન છે કે એ પતિપત્તા રાણીએ પોતાના પુષ્યપ્રભાવથી કષ્યૂતરના જેવા કોઈ બીજાજ પદાર્થની વૃદ્ધિ કરાવીને પ્રલુનું સંકટ ટાજયું હતું; કેમકે પ્રાણીમાત્ર ઉપર દયા રાખનાર અને અહિંસાનું ગ્રત ધારણુ કરનારાં રાનારાણી અસંખ્ય કષ્યૂતરેની હિંસાનું કલંક પોતાના ઉપર લાગવા હે એ સંભવિત નથી. અમારા અનુમાન પ્રમાણે અતિશય બરક પડવાથી પદ્ધીએ મોટી સંખ્યામાં મરણ પામેલાં હોવાં જેઠાં; અને જ્યાં પેટની આગ હોલાવવાનોજ પ્રશ્ન રહ્યો ત્યાં મનુષ્ય વિધિનિર્ધેધને બહુ વિચાર કરવા રહેતો નથી. એ સંકટના સમયમાં કાશ્મીર-વાસીઓએ કષ્યૂતરના માંસથી ઉદરજવાળા શાંત કરી હોય તો એમાં આશ્ર્ય જેલું કાંઈ નથી. અસરુ !

શોડી વારમાં આકાશ નિર્મળ થઈ ગયું અને રાનના શોકની સાથે સાથે હુકાળની પણ શાંતિ થઈ ગઈ.

રાનએ રાણી વાકૃપુષ્ટાને પોતાની રૈયતની રક્ષક ગણીને ઘણું ધન્યવાદ આપ્યો.

રાણી વાકૃપુષ્ટા પુષ્યની ભૂર્જિ હતી. એણે પ્રાણીઓને માટે ધણી સામથી સહિત બે વિશાળ અગ્રહાર બાંધાવ્યા. ત્યાં આગળ ગરીબાને અને પ્રાણીઓને છુટે હાથે અજ વહેંચવાની ચોજના હતી. સેંકડો વધો સુધી એ અગ્રહારમાં વટેમાર્ગુંએ આશ્રય લેતાં અને રાણી વાકૃપુષ્ટાને આશીર્વાદ આપતાં.

રાન તુંલન છત્રીસ વર્ષ સુધી રાન્ય કરીને ભરણુવાવસ્થામાં પરમધામ સિધાંવ્યા, એટલે પતિપિરહથી પીડિત થઈને રાણી વાકૃપુષ્ટાએ પ્રાણ ત્યાજ દીધ્યા. જે સ્થળે એ પતિપત્તા રાણી સત્તો થઈ હતી, એ સ્થળન હજુ પણ વાકૃપુષ્ટાટીના નામથી પ્રસિદ્ધ છે.

રાનારાણી નિઃસંતાન મરણ પાસ્યાં, પણ એમનો યશ ચિરાજુવ છે.



## ૧૯—દેવસ્મિતા



વરિમતા ધર્મશુસ નામના એક વાણિયાની કન્યા હતી. ધર્મશુસ હેવનગરીને નિવાસી હતો. બાળ્યા-વસ્થામાંજ તેણે કન્યાને પોતાની શક્તિઅનુસાર વાંચતાંલખતાં શીખન્યું હતું. હેવરિમતા ઇપવતી, શુણવતી અને સુશીલ, ધર્માત્મા સ્વી હતી. રામાયણ અને મલાભારતની કથાઓ ઉપરાંત બૌદ્ધ-ધર્મની કથાઓ પણ તે સારી પેડે જાણુંતી હતી. જ્યારે હેવરિમતા નુવાન થઈ ત્યારે ધર્મશુસે તાઅલિમી નગરીના મણિલદ્ર નામના એક ચુંદર અને ધાર્મિક શુલ્ક સાથે એનું લઘ કર્યું. પતિપત્ની-માં ધર્મશુસ મજબૂત પ્રેમ બાંધાયો. હેવરિમતા પતિત્રતા સ્વી હતી. ધરનાં બધાં માણસો એનાથી પ્રસન્ન હતાં. ધર્મનું શિક્ષણ મળેલું છોવાથી એ સાધુસંત અને સાંન્યાસીઓની સેવા અને સહાયતા કરતી હતી. ભૂણ્યોતરસ્યો જે કોઈ જઈ કઢે તેને સત્કારતી. આડોશીપાણોશીની વહુદીકરીઓ પર એનો વિશેપ પ્રેમ રહેતો હતો. એ સવારના પહોરમાં ધર્મશુલી વહેલી જાહેતી અને સ્નાન કરીને સૌથી પહેલાં સાસુ અને ધરની વહેલ સ્વીએને પગે લાગતી. પછી ધરનું કામકાજ કરવામાં ગુંથાતી. સાસુસસરાને એ પોતાના કામકાજ અને સેવાથી એવાં પ્રસન્ન રાખતી કે તેઓ એનેજ ધરની માલિક ગણુંતાં અને એને પૂછ્યા વગર પાણી પણ નહોતાં પીતાં. એ જ્યારે પડોશની સ્વીએને મળવા જતી ત્યારે એમને ધર્મનું શિક્ષણ આપતી. હેવાલયમાં જતીઆવતી તો ત્યાં પણ આલી ટાયલાં અને કાથાફૂથલી કરવાને બદલે ધર્મ અને નીતિ સંબંધીજ વાતચીત કરતી. સાસરે આવ્યા પછી થોડા દિવસોમાંજ એણે બધાંને પોતાને વશ કરી લીધાં. બધાં એને ખરાં આંતઃકરણુથી ચાહતાં હતાં. એનો ધીનાઓ ઉપરનો પ્રેમ તથા ધર્મ ઉપરનો પ્રેમ અને પૂજાપાઠ જોઈને એનાં સાસુસસરા

વારંવાર કહ્યા કરતાં હતાં કે, “આ વહુ અમારા કુળને પવિત્ર અને ઉજાજવળ કરનારી હેવી છે.”

વિવાહ પછી કેટલાંએ વધો સુધી એમનું લુણ આનંદમાં વ્યતીત થયું; પરંતુ એવામાં દેવવશાત એના સસરાનું મૃત્યુ થયું. એમના મરી ગયાથી સાસુને ચંસાર ઉપર વૈરાગ્ય જીપણ્યો અને ઘરખટકાનો બધો લારવહુ દેવસિમતા ઉપર નાખીને, પોતે ઈશ્વર-ભજન કરવા લાગ્યાં. દેવસિમતાએ એ લાર ઘણી ખુશીથી ઉપાડી લીધો. સાંજના પહેરની એ રોજ સાસુને ધર્મસુસ્તકો વાંચી સંભળાવતી હતી. મણિભદ્ર જે આટલા દિવસ બાપના રાન્યમાં સુખચૈનમાં દિવસ ગાળતો હતો, તેને પિતાના મૃત્યુથીજ શોક થયો; કેમકે હવે વેપારની બધી જવાખદારી એને માથે આવી પડી.

મણિભદ્ર ધીરજ ધરીને બાપની જગ્યાએ હુકાને છેડો. એ પણ વાળિયાનો છોકરો હતો એટલે વેપારમાં ઘણ્ણો હેઠિયાર હતો. એના મિત્રો વેપારને માટે પરહેશ જવા લાગ્યા ત્યારે એને પણ સાહસ જેડવાની ઈચ્છા થઈ. દેવસિમતાને પતિના વિદોગથી ઘણું હુઃઅ થયું પણ એ વેપાર તં પતિનો ધંધો છે એને દેશાવર જેણ્યા વગર વેપારની પૂરી માહિતી મળતી નથી તથા પૂરતો. પૈંસા પેટા થતો નથી એવું વિચારીને એણે પોતાનો એહ હૃહયમાં કુપાવી રાખીને પતિને પ્રસન્નવહને વિહેશ જવાની રણ આપી. છુટાં પડતી વખતે પતિપત્નીએ પોતપોતાની વીંટીઓ એકણીને અહલભહલ કરીને પહેરાવી કે જેથી હમેશાં એમને પુરસ્પર પ્રેમનું સમરણ થયાં કરે.

જે દિવસે મણિભદ્ર પરહેશ ગયો. તેજ દિવસથી દેવસિમતાએ બધા અલંકારો ઉતારીને પેટીમાં મૂકી દીધા અને સાદાં વષ્ણ પહેરને એ દિવસો ગાળવા લાગી. ધરના કામકાજથી જયારે પુરસ્પ મળતી ત્યારે તે સાસુ પાસે જઈને યેસતી અને એમની આગળ ધર્મનાં પુસ્તકો વાંચવામાં વખત ગાળતી.

મણિભદ્ર વહાણમાં એસીને કટાહ નામના નગરમાં ગયો. અને ત્યાં હુકાન કરીને વેપારધધો ચલાવવા લાગ્યો. ત્યાં એને એચાર હુરાચારીએ સાથે દોસ્તી બંધાઈ. બપોરે હુકાનમાંથી કુરસદ મળતી ત્યારે એ લોકો સાથે એસીને ઢાડુ પીતા અને ખરાખ અસલ્ય કામોમાં પોતાનો વખત ગાળતા. એ મિત્રો

ઘણ્યાજ હરાચારી, અસહ્ય અને ખરાળ ચાલચલણું ના હતા. એક દેવસ તેઓ દાડ પીને મસ્ત બન્યા હતા ત્યારે સ્ત્રીઓની જ નિંદા કરવા લાગ્યા. મણિબદ્ર પણ નશામાં ચકચૂર હતો. તેણે કહ્યું: “તમે જૂડા છો. સ્ત્રીએ ઘણી ભલી અને સુશીલ હોય છે. મારી સ્ત્રી એટલે બધી સતી છે કે, કોડો એને દેવીની માઝે પૂજે છે.” એ હુષ મિત્રોએ મણિબદ્રના ઘરનું ડામઠેકાણું પૂછી લીધું અને પાછળથી એ કોડોએ એવો હરાવ કર્યો કે તાઓલિસી નગરમાં જઈને, મણિબદ્રની સ્ત્રીને છેતરીને તેનું સતીત્વ ભષ કરવું અને પછી મણિબદ્રને શરમાવવો.

આવો વિચાર કરીને એ હરાચારીએ તાઓલિસી નગરમાં આવ્યા અને એક બુદ્ધ મહિરની ધર્મશાળામાં ઉતારો રાખ્યો. પછી ધીમે ધીમે પોતાના અન્યાયી કામની જણ તેઓ ગૃંથવા લાગ્યા. એમણે વિચારું કે, કોઈ સ્ત્રીની મદદ વગર એવા કામમાં ફ્રાવી શકાય નહિ, માટે એ મહિરમાં એક બુદ્ધ સંન્યાસિની રહેતી હતી, તેને પેસાટકાની લાલચ આપીને પોતાના પક્ષમાં લીધી. એણે જયારે એ કામ પાર ઉતારી આપવાની આતરી આપી ત્યારે એ દરમણોરો ઘણું ખુશ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ જાંયા કુણની વધુ આ સંન્યાસિનીના કંદામણીં નહિ છે, એટલે થોડા દેવસ પછી એમે મણિબદ્રને સ્ત્રીઓની નીચતા અને બેવક્ષાઈ સાબિત કરી આપી શકીશું.”

એ બુદ્ધ સંન્યાસિનીને ખરોળર શીખવીને એ હુષોએ દેવસ્તિતાને ઘેર મોકલી. સુશીલ, પુષ્યવતી દેવી દેવસ્તિતાએ તેને તપસ્તિવિની જાણીને એનો સારો આદરસર્તકાર કર્યો અને દ્વારા લાવીને પૂછ્યું કે, “હે સંન્યાસિન! આજે આપે અહીં પધારવાની તરફી શા માટે લીધી ?”

એ ઢાંગી બુદ્ધ સાધુડી પોતાની મતલબ છુપાવીને બહારથી ધર્મની વાતો કરવા લાગી. દેવસ્તિતાએ એની ધર્મ સંબંધી વાતોથી પ્રસન્ન થઈને એનો ઘણો સત્કાર કર્યો અને કદી કદી આવતાંજતાં રહેવાની વિનિતિ કરી. એ ડાશીને તો એટલું જોઈતું હતું. એણે જાણ્યું કે હવે મારી મનોકામના પૂરી થવાની. એ દેવસથી એ રોજ દેવસ્તિતાને ઘેર જવાઅવવા લાગી.

જયારે પરસ્પર વધારે પરિચય થઈ ગયો, ત્યારે એ બુદ્ધ

સંન્યાસિનીએ વાતવાતમાં દેવસ્તિમતાના બૌવન અને પતિ-વિશેષ સંગાંધી વાત કાઢીને હિકણારી જણાવી. ગિયારી લોળી ચુંબતી આ કર્દશાના છળપ્રથમાં શું સમજે ? એ તો એમજ જણુંતી હતી કે, આ સંન્યાસિની એક બહેનપણી તરીકે વાતો કરે છે અને એને લીપે એણે એની વાતો ઉપર બદ્ધ ધ્યાન ન આપ્યું. એક હિવસ જ્યારે દેવસ્તિમતા એકલી એડી હતી, ત્યારે એણે લાગ નેછાને પેલા કટાલ દેશથી આવેલા ચાર જીવાન બદમાશ વેપારી-ઓને ઈશારા કર્યો અને સતીને કહ્યું કે, “ એ ચુંબકો તારા વિરહથી વ્યાકૃત થઈ રહ્યા છે અને તું એક વાર તેમની તરફ પ્રેમથી જાપે એવી તેમની ઈચ્છા છે.”

બુદ્ધી તપસ્વિનીની આવી હુલ્કી વાત સાંભળીને દેવસ્તિમતા ચમકી ઓડી. હ્યે એને એ હૃદાના આવવાનું ખરં કારણું સમજાયું. તેણે સમયસૂચકતા વાપરીને હસ્તીને કહ્યું: “ હીક, હું કાલે તમારી વાતને જવાબ આપીશ.” બુદ્ધી ચાલી ગઈ અને મનમાં ને મનમાં પ્રસ્ત્ર થઈને ઘણી કુલાદ્ધ જવા લાગી. એને આતરી થઈ કે હ્યે તો સતીને ઇસાવી છે. અલિમાન જાંથે એણે પોતાના બહેમાનોને એ વાત જણાવી. એ લોકો પણ આનંદમાં ગરકાવ થઈ ગયા.

દેવસ્તિમતાએ બુદ્ધીના ગયા પછી બધી હડીકત પોતાની સાસુને કાઢી સાંભળાવી. સાસુએ કહ્યું: “ કાલથી એને ઓટલે ન ચહુવા હઈશ.” પણ દેવસ્તિમતા ઘણી ચતુર હતી. એણે વિચાર્યું કે, એ બધા હરામણોને સન્ન કર્યા વગર ન છોડવા નેછાએ. એણે સાસુને સમજાવીને રાતે એ વાણિયાએને પોતાને વેર બોલાવવાની રણ માગી લીધી.

થાકે હિવસે જ્યારે એ બુદ્ધી આવી, ત્યારે દેવસ્તિમતાએ તેને હસ્તીને કહ્યું કે, “ હીક, એ ચુંબકોને આને અસુક સ્થળે લઈ આવજો. હું એમને પૂછીશ કે તેઓ શા માટે મળવા માગે છે.”

રાતે બધાં સૂઈ ગયાં, એટલે એ વૃદ્ધ સંન્યાસિનીએ એક એક એ આરે ચુંબકોને ઘરમાં પેસાઊયા. એ ઓરડામાં દેવસ્તિમતાએ પોતાના એ વિશ્વાસુ નોકરોને પણ રાજ્યા હતા. તેમના હાથમાં તપાવેલા લોડાના ફૂતરાના પંના હતા. ઘરમાં પેસતાંવારજ એ નોકરોએ એ હુંદોના માથામાં એ ફૂતરાના પંનના ડામ દીધા અને અંધારામાં ઉપરથી એમને નીચે ફેંકી દીધા. એમની ઘણુંજ

હુંશા થઈ. સૂર્ય જિગતા પહેલાં એ લોડે શરમાઇને મંહિરમાંથી ચુપચાપ ચાહ્યા ગયા અને એ બૃદ્ધ સંન્યાસિનીને પણ પોતાની વિગત કહી ન શક્યા. માથા ઉપરના ડામ કોઈ જુઓ નહિ માટે માણે કપડું ભાંધી દીધું.

દેવસ્તિમતાએ થીજે દિવસે એ સંન્યાસિનીને બોલાવીને ખૂબજ ધમકાવી અને કહ્યું કે, “તું આ પ્રમાણે લોડેને છેતરવા માટેજ સંન્યાસિનીને વેશ ધારણું કરે છે ? પિછાર છે તને ! વેશ તો સાધુનો રાખે છે અને ધંધ્યા ઝૂટથીનો કરે છે ! તું ઈંગ્રિજાના કણ જેવી છે કે, જે હેખાવમાં સુંદર પણ અંહરથી કડવું જેર છે. તારા ચાર બદમાશોને તો મેં ખૂબ સ્વાદ ચખાડ્યો છે. હવે બોલ, તારી શી વલે કરું કે, જેથી તારા જેવી ઢાંગી થીએ હુંથી ચેતીને ચાલે ? ”

એ બુદ્ધી ડરી ગઈ અને રોતે રોતે દેવસ્તિમતાને પગે પડી. એની સાસુ વચ્ચે પડી પણ દેવસ્તિમતાએ કહ્યું: “ નહિ, સાસુજ એને તો સળ કરવીજ જેઠાંએ. હુંણેને વાજથી સળ નહિ કરવાથી પાપ વધતું જય છે અને અતે ધર્મકર્મનો લોપ થઈનાય છે.”

આખરે સાસુજની સલાહથી એણે એ બૃદ્ધમંહિરના પૂજારીને બોલાવ્યો અને એ સંન્યાસિનીનું પોગળ વિસ્તારથી કહી સંભળાયું અને તેને સલાહ આપી કે, “ એ ડાશીને હુંથી એ મંહિરમાંથી કાઢી મૂકવી, તેમજ મંહિરના થીજા સાધુ તથા સંન્યાસિનીએ ઉપર ચાંપતી હેખરેખ રાખવી, જેથી તેઓ સંસારી મતુષ્યોના આચરણને બગાડી ન શકે.” પૂજારીએ એમનું કહ્યું માનીને એ ડાકરીને મંહિરમાંથી કાઢી મૂકી.

આ જનાવ જન્યા પછી એ ચાર દિવસે દેવસ્તિમતાને વિચાર આપ્યો કે, એ બદમાશો કંઈ સંચ કરીને પરહેશમાં મારા પતિ ઉપર મારી દાજ ન કાઢે, તેથી એણે પોતાની સાસુને કહ્યું કે, “ ખા ! તમારા સુત્રના સમાચાર ધણ્યા દિવસ થયાં આવ્યા નથી. એ ચારે વાણિયાએ એમના હોસ્ત હતા અને એમને પ્રસાદી ચખાડી છે, એટલે મને શાંકા રહે છે કે એ લોડે મારું વેર એમના ઉપર ન લે ! આપ આજ્ઞા આપો, તો હું પોતે પરહેશમાં જઈને એમનું રક્ષણ કરું અને ક્ષેમકુશળ એમને લઈને પાછી આવું.” સાસુએ પહેલાં જરા આનાકાની કરી, પણ પછીથી વિચાર કર્યો

કે વહુ ધર્માત્મા છે, એને કંઈ પણ વિજ્ઞ આવવાનો સંભવ નથી. પછીથી એમણે વહુને પતિની શોધમાં જવાની રણ આપી.

દેવસ્તિમતાએ સાચુને પગે પડીને આશીર્વોદ લીધો તથા પોતાની દાસીઓને સાથે લઇને પુરુષના વેશમાં વહાણું મેસીને એ કટાલ બાંદરે પહોંચ્યો અને પોતાના પતિની હૃકાનની પાસે મકાન લાટે રાખીને ઠાઠમાઠથી રહેવા લાગ્યો. મણિબદ્રે એને જોઈ; એણું જાણ્યું કે એનો ચેહેરો પોતાની સ્વીના જેવો છે, પણ તેનો વેશ પુરુષનો હોવાથી એને જઈને મળવાનું કે વાતચીત કરવાનું સાહસ એનાથી ન થયું. એણું એમ જાણ્યું કે, આ કોઈ મારા દેશના શૈદ્યાનો પુત્ર છે.

કુસંગને લીધે મણિબદ્ર જુહાજ રંગમાં રંગાઈ ગયો હતો. એના જે ચાર મિન્ટોના અભિમુકીનગરીથી પાછા આવ્યા હતા, તેમણે દેવસ્તિમતા ઉપર વેર કેવાને માટે એની વિરુદ્ધમાં ઘણી અરાધ ગયો મારી અને એમ કરીને મણિબદ્રના મનમાં પોતાની સત્તી સ્વી માટે અરાધ અભિપ્રાય બેસાડ્યો. દેવસ્તિમતા ત્યાં રહીને એ દેશની શીખવા યોગ્ય બધી વાતો શીખી અને પછી એક હિવસ ત્યાંના રાજનીક્યેરીમાં જઈને કહ્યું કે, “ મારા ચાર શુલામોનાસી આવીને આપના રાજ્યમાં સંતાદી ગયા છે. આપ તપાસ કરીને એમને મારે સ્વાધીન કરો. ” એ દેશનો રાજુ સુરસેન ઘણ્ણું ધર્માત્મા અને નીતિકુશળ હતો. એણું આ પરહેશી વેપારીની ઇરિયાદ સાંલળીને કહ્યું: “ તારા શુલામોનો પત્તો હેખાડ, એટલે એમને બાંધી મંગાવીને તારે હવાલે કરીશું. ” દેવસ્તિમતાએ એ ચારેનાં નામ બતાવ્યાં. એ ચારે ખુલ્ફો એ રાજ્યના પ્રસિદ્ધ અને ધનવાન શેઠશાહુકારોના પુત્ર હતા. પહેલાં તો કોઈને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો પણ એમને પકડી મંગાવ્યા પછી રાજુએ પુરુષવેશધારી દેવસ્તિમતાને પૂછ્યું કે, “ એમનેતું દાસ કહેછે એટો મારા રાજ્યના ધનાદ્ય શાહુકારોના પુત્રો છે. તું છેતરાય છે. એમનું આપમાન કરવાની કસૂરમાં તું પોતે કંઈ ઇસાઈ ન જાય. ”

દેવસ્તિમતાએ કહ્યું: “ મારા દાસોના માથામાં ઝૂતરાના પંનાનું ચિહ્ન હોય છે. આ લોકોએ પાદહીની નીચે એ ચિહ્નને સંતાદી દીધું છે. આપ એમની પાદહી ઉત્તરાવીને જાતે જુઓ. કે એ મારા દાસ છે કે નહિ ? ” જયારે રાજની આજાતુસાર તેમની

પાંડીએ ઉતારવામાં આવી ત્યારે એમના માથા ઉપર ખરે-ખાત હુતરાના પંજાનાં ચિહ્નન હેખાયાં. બધા એ ચિહ્ન જોઈને ઘણું આશ્કર્ય પાર્યા. રાજીએ ઘણું વાર એ ચુવકોને એ ચિહ્નનો-ના સણાંધમાં ખુલાસો પૂછ્યો પણ શરમના માર્યા એ ચારે જણું ચૂંધ રહ્યા. પોતાના બચાવમાં એ એક પણ શાળન એલી શકયા.

દેવસ્તિમતાથી હવે ન રહેવાયું. એણે એ પાપીએના અન્યાય-ની તથા તેમને પડેલા મારની વાત મૂળથી માંડીને કહી સંભળાવી. રાજી એની વાત સાંભળીને કોષથી તપી ગયો. અને એ અપરાધમાં એમને ચારેને કેહની સન્ન કરી; પરંતુ જ્યારે એમનાં માણાંપાએ દેવસ્તિમતાને પગે પડીને વિનયપૂર્વક ક્ષમા માગી, ત્યારે એણે રાજીને વિનતિ કરીને એ કોડેની સન્ન માફ કરાવી.

રાજીએ સતી દેવસ્તિમતાના પાતિત્રલઘર્મનાં ઘણું વખાણું કર્યાં અને બહુ ધન તથા અલંકાર આપીને એને માનપૂર્વક તામુલિસી નગરમાં ચિહાય કરી. મણિભદ્ર પણ પોતાની સ્વીતું ચરિત્ર સાંભળીને ઘણેં પ્રસન્ન થયો, તેની બધી શાંકાઓ જતી રહી અને એ પણ પોતાની પતની સાથે ઘેર ગયો.

મણિભદ્રની માતાને જ્યારે દેવસ્તિમતાના બધા વૃત્તાંતની અખર પડી, ત્યારે તેણે વહુને છાતીસરસી ચાંપીને, પોતાના હૃદયને ઠંડું કર્યું અને પ્રસન્ન થઈ જઈને કહ્યું: “ વહુ ! તું હેવી છે. ઈશ્વર તારા સૌભાગ્યને અચણ રાખે. તારા! કેવી હેવીએથી સ્વીનલતિની પ્રતિષ્ઠા વધે છે.” નગરવાલીએ જ્યારે આ સમા-ગ્રાર સાંભળ્યા, ત્યારે તેમના પણ આનંદનો પાર રહ્યો નહિ. દેવસ્તિમતા માટે તેમના હૃદયમાં વિશેષ પ્રેમ ઉત્પન્ન થયો.

જે દેશ અને જે જલિમાં એવી ધર્માત્મા સ્વીએ ઉત્પન્ન થાય છે, તે દેશ અને તે જલિમને ધન્ય છે !



## ૧૨-મારતી

૨૧।

મી શાંકરાચાર્યને વખતે પૌર્ણધર્મના પાશ-  
માંથી હિંહુધર્મને છોડાવવા માટે પ્રયત્ન કરી  
રવ્યા હતા અને પોતાને વેહાંતમત પ્રતિ-  
પાદિત કરવાને દેશમાં ડેકાણે હકાળે ભ્રમણું  
કરી રવ્યા હતા, તે વખતે તેમને એ ધર્મ-  
પ્રચારના કાર્યમાં એક સ્વીએ ઘણી મહદ આપી  
હતી. એ રમણી મંડનમિશ્ર નામના પંડિત-  
ની સ્વી ભારતીદેવી હતી. ભારતી એક મહાન વિહૃણી સ્વી હતી.

મંડનમિશ્ર સાથે શાંકરાચાર્યને એક વખત શાસ્ત્ર સંબંધી  
વાદવિવાદ થયો. એ વાદવિવાદ કરતાં પહેલાં શાંકરાચાર્ય પ્રતિજ્ઞા  
કરી હતી કે, “હું આ વાદવિવાદમાં હાર્દ તો મારે સંન્યસ્ત ત્યજી  
હેવો અને મંડનમિશ્રના શિષ્ય થઈને રહેલું.” અને મંડનમિશ્રે  
પ્રતિજ્ઞા કરી હતી કે, “નેહું વાદવિવાદમાં હાર્દ તો મારે સંસાર-  
નો ત્યાગ કરીને શાંકરાચાર્યના શિષ્ય બનનું.” બને ધૂરંધર પંડિત  
હતા, એટલે એમનો વાદવિવાદ કાંઈ સાધારણું હોય એમતો બનેજ  
નહિં. હવે આ વાદવિવાદમાં મધ્યસ્થ કોણ થાય? બને પંડિતો-  
નો ઝેંસલો આપવાની શક્તિ ધરાવનાર મહાપંડિત કોણું હોય?

પરંતુ એ લોકોને મધ્યસ્થની શોધમાં ઘણે દૂર જતું પડ્યું  
નહિં. મંડનમિશ્રની સ્વી ભારતીદેવીને એ સન્માન આપવામાં  
આંયું. એ ઉપરથીજ સમજ શકાશે કે એ કેટલી વિકાન હશે!

વિવાદ શરૂ થઈ ગયો. ભારતી જ્યમાળા હાથમાં પકડીને એસી  
રહી. એ માળા ડેના ગળામાં અર્પણ કરવી, કોણું એ જ્યમાળા  
પહેલવાને ચોણ્ય છે, એનો એ ધીરજથી નિર્ણય કરતી એસી રહી.  
બનેએ ચોણ્ય મધ્યસ્થના હાથમાંજ પોતાનો કેસ સેંચ્યો હતો.  
ભારતીદેવી પણ પોતાની જવાણફારી સમજતી હતી. તેણે જેથું  
કે સ્વામી મંડનમિશ્ર પોતાના પક્ષનું સમર્થન કરવામાં નિષ્ઠળ

નીવજ્યા છે, એટલે વગર સંકોચે તેણે વિજ્યમાળા શંકરાચાર્યના ગળામાં પહેરાવી દીધી.

સ્વામીને પરાજિત થયેલા જેઠને ભારતીએ કહ્યું: “ હવે મારી સાથે તર્કસુદ્ધમાં અબેસર થાઓ. મને જુતો ત્યારે તમે પૂરા જીત્યા કહેવારો. ” રમણીના સુખમાંથી આવી સ્પર્ધાનાં વચ્ચેનો નીકળયાથી શંકરાચાર્ય ચમકી ગયા.

આખરે શંકરાચાર્ય અને ભારતીદેવી વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયો. ભારતી પ્રક્ષ પૂછતા લાગી; શંકર તેના ઉત્તર આપતા ગયા. પછી શંકર પ્રક્ષ પૂછતા ગયા અને ભારતી તેના ઉત્તર આપતી ગઈ. આ પ્રમાણે રતદિવસ શાસ્ત્રાર્થ કરતાં કરતાં મહિનાઓ વીતી ગયા, પણ ભારતી જરા પણ થાકી નહિ. તેણે શંકરાચાર્યને જીતીને ઊઠાવાનો વિચાર કર્યો હતો. શંકરાચાર્ય પણ તેનું પાંડિત્ય, ધૈર્ય તથા અધ્યવસાય જેઠને સ્તંભિત થઈ ગયા; મનમાં વિચારવા લાગ્યા કે, “ હું ધણા પાંડિતો સાથે વાદવિવાદમાં જીતયો છું પણ આવો શાસ્ત્રાર્થ આજ સુધી ડોધાની સાથે થયો નથી. ” ભારતીદેવી એક પણ પ્રક્ષ છોડતી નહિ. એક દલીલ પૂરી થતી તો આજ દલીલ રજૂ કરતી, પણ એ શંકરાચાર્યને કોઈ પણ રીતે હરાવી શકી નહિ. આખરે ભારતીએ રતિશાસ્ત્ર સંબંધી પ્રક્ષ શરૂ કર્યો, એટલે શંકરે નિરાશ થઈને કહ્યું: “ હું સંસારત્યાળી છું. રતિશાસ્ત્રનું મને જરા પણ જાન નથી. ” ભારતીદેવી જય પ્રાપ્ત કર્યોના હર્ષશ્રી ઊરીને ઊભી થઈ.

પ્રતિજ્ઞા પ્રમાણે પરાજિત મંડનમિશ્ર સંસારત્યાગ કરીને શંકરાચાર્યનો શિષ્ય થયો. ભારતીદેવી પણ સ્વામીની અનુવર્તિની થઈ. શંકરાચાર્યે આ શાસ્ત્રમાં વિજ્યો થઈને ઇક્તા મંડન-મિશ્રને જેળવ્યા એમ નહિ, પણ ભારતીદેવી જેવી વિહૃપી સ્વીને પણ પોતાના પક્ષમાં લીધી. શંકરાચાર્યના ધર્મપ્રચારના કાર્યમાં ભારતી જેવી રમણીઓની મહદની ઘણી જરૂર હતી. ભારતીએ ખરા અંતઃકરણશી શંકરાચાર્યને એ કામમાં મહદ આપી. શંકરાચાર્ય પણ તેની કદર જાણુતા હતા. જીવનની છેલ્લી ઘડી સુધી એ શંકરાચાર્યના કામકાજમાંજ યુથાયદી રહી હતી. શુંગેરીમાં શંકરાચાર્યે તેને માટે એક મંહિર બંધાવી આપ્યું હતું જ્યાં એ પાછલી વયમાં રહેતી હતી.



## ૧૩—મામતી



એ શ્રીમન् શાંકરાચાર્ય સ્વામીના ભાષ્ય ઉપર ટીકા  
કરનાર વિદ્બાન વાચસ્પતિ મિશ્રની પ્રિય પત્રી હતી.  
એ ઘણી વિહૃપી, પતિત્રતા, લગ્નલગ્નતી, વિનાયી, નમ અને જુદ્ધિ-  
શાળી હતી. વાચસ્પતિ મહાશાયની પેડે એ પણ ધર્મપરાયણ  
હતી. પતિને શાશ્વતચીમાં મદદ કરવી એને ભામતી પોતાનું  
મુખ્ય કર્તાંય ગણું હતી.

વિદ્યાનુરાગી લેખકો અને કવિઓ પોતાના કામમાં એવા  
લીન થઈ જાય છે કે, એમને રાતદાણાનું ભાન રહેતું નથી.  
આધુનિક સમયમાં પણ એવા એકાથ ચિત્તવાળા લેખકો અને  
શોધકોનાં દસ્તાવેજ આપણે પાશ્વાત્ય દેશોમાં થણ્ણું જોઈએ છીએ.  
વાચસ્પતિ પણ એવાજ એક વિદ્બાન હતા. ભાષ્ય ઉપર ટીકા  
કરવાના કામમાં એ બિલકુલ તદ્વાની થઈ જતા હતા. એટલે  
સુધી કે જ્યારે એમને ભોજનને માટે સંભારવામાં આવતું, ત્યારેજ  
એ ભોજન કરતા અને ભોજન કરી ચૂક્યા પછી પૂછા એના એ  
કામમાં લીન થઈ જતા.

જે સમયે ભામતી પરણીને સાસરે આવી, તે સમયે પણ  
વાચસ્પતિ મિશ્રની આવીજ દશા હતી. એ વખતે એ શાંકરભાષ્ય  
ઉપર ટીકા રચી રહ્યા હતા. ભાષ્યના અર્થનો વિચાર કરવામાં,  
તેને બીજી અંગે સાથે સરખાવવામાં તથા ભાષ્યનો અર્થ સુસ્પષ્ટ  
કરીને લખી કાઢવામાં તેમનું એટલું બધું ધ્યાન રહેતું કે ધર-  
સંસારનું એમને કાંઈ પણ ભાન નહોતું. એ વખતે મિશ્રજી  
શુખાન હતા અને મિશ્રાણી ભામતી પણ શુખાવત્થામાં પ્રવેશ કરી  
ચૂકી હતી; પરંતુ કામલાલવાસાં કોઈ દ્વિવસ તેમના ચિત્તને ટીકા  
રચવાના કાર્યમાંથી આકર્ષિત કર્યું નહોતું. અને જણ્ણું સાથે  
રહેતાં હતાં, શયનગૃહમાં એસીને પણ વાચસ્પતિ મહારાજ ટીકા

કરવાતું કાચ્યે કરતા અને ભામતી તેમને માટે બધી સામચી તૈથાર કરી આપતી. આ પ્રમાણે પુસ્તકો રચવામાં ભજેની ચુવા-વસ્થા તો વીતી ગઈ અને ગૌઢાવસ્થા આવી પહેંચી, પણ પતિને વાંચવાલખવામાં વિધન આવે એમ ધારીને ભામતીએ સાંસારિક સુખની કદી પણ અભિલાષા કરી નહિ.

આપ્ય પૂર્ણ થવા આવણું એ અરસામાં એક વખત આપી રાતનો ઉનંગરેં કરવાથી ભામતીને જરાક ઊંઘ આવી ગઈ અને વાચસ્પતિ મહારાજ જે દીવાના અજવાળામાં બેસીને ટીકા લખી રદ્દ હતા તે દીવામાં તેલ ન રદ્દાથી દીવો હોલવાઈ ગયો. તરત એમણે માં ઊંચું કદું તો નિદ્રાવશ ભામતી ઉપર તેમની દષ્ટિ પડી. પતિને સૂરેલી જેઠને પહેલાં તો આશ્ક્રીં પામ્યા. પણ પછીથી પ્રેમભાવથી બાલી જઠાયા: “સુંહરિ ! તને ધન્ય છે ! તે આપરે મને લુતી લીધ્યો. તારી મદદથીજ હું આ કામ સમાપ્ત કરી શક્યો છું. તંત્ત મને આ ટીકા રચવામાં જે મહા આપી છે, તથા મારે માટે જે અસાધ્ય પરિશ્રમ ઉઠાવ્યો છે, તેથી પ્રસન્ન થઈને હું આ ટીકાનું નામ ભામતીટીકા રાખું છું.”

આટલું કહીને વાચસ્પતિએ પાતાની ટીકાનું નામ ભામતી-ટીકા પાડયું તથા પતિને ઘણોન આલાર માન્યો.

એકદમ નિદ્રા આવી જવાથી ભામતી ઘણી શરમાઈ ગઈ અને હાથ જેણે પતિને કહેવા લાગી: “પ્રાણુનાથ ! મને નિદ્રા આવી જવાથી આપના કામમાં વિધન પડયું છે, એ મારો હોષ છે. મને એને માટે ઘણો પશ્ચાત્તાપ થાય છે. તમારી સાથે જ્ઞાનચ્છોકરવા-માંજ મારી સર્વ ઇચ્છાઓ તૃપ્ત થઈ છે. હવે સાંસારિક સુખ-લોગની મને ઇચ્છા નથી. આપને લીધે મને જે લાલ મળ્યો છે તેને માટે હું આપની ઘણીજ ઉપકૃત છું.”

વાચસ્પતિ એલાયા: “ધન્ય છે તને સતિ ! તેં મારા હોષ તરફ જરા પણ લક્ષ્ય આપ્યું નથી. છતે પતિએ તારું યૌવન નિરર્થક ગયું તેને માટે તું મારી નિંદા કરતી નથી; બદ્દે જીલટો મારો. ઉપકાર માને છે. ધન્ય છે તારા શાખુપણુને ! તારા જેવી પતિત્રતા અને પતિને પ્રસન્નરાખનારી સ્વીએ ઘણ્ણા થોડા મનુષ્યોના લાગ્યમાં હોય છે.”

ભામતીએ હાથ જેણે કહ્યું: “સ્વામીનાથ ! આપ આવાં વચ્ચે નો કહીને મને શરમાવશો નહિ. પતિની સેવા કરવી એ તો જીઓનો

મુખ્ય ધર્મ જ છે. મેં એમાં અધિક શું કહ્યું છે કે આપ આટલી બધી પ્રશ્નાંસા કરેં છો ? મેં કે કાંઈ કહ્યું છે તે પોતાનો ધર્મ ગણીને કહ્યું છે, વખ્યાણ કરાવવા સારુ નથી કહ્યું. મહારાજ ! તમે તો જાની છો. અધ્યાત્મેવર્ત્ત પુરાણુમાં કહ્યું છે તે તમે જણો છો કે, ‘હેવપૂજા, વત, દાન, ઉપવાસ, જપ, તીર્થસ્તનાન, યજા, આપી પૃથ્વીની પ્રદક્ષિણા, વાસ્ત્વાણ અને અતિથિસતકાર એ બધી વાતો પતિસેવાના સોળમા ભાગની પણ બરાબર નથી’ વળી કહ્યું છે કે, ‘પતિત્રતા સ્વીએ પતિને દેવતુલ્ય ગણીને સદા તેનાં હિતકારી કાચો કરવાં જેઠાએ; કારણું પતિજ તેનો મિત્ર છે, પતિની સેવાશીજ સીનો જન્મ સંક્રાંતાય છે.’ વળી રકંદપુરાણુમાં લખ્યું છે કે, ‘તીર્થસ્થાન કરવાની ધર્યાવાળી સ્વીએએ પતિનું ચરણામૃત પીએ જેઠાએ. કારણું સીને માટે પતિ એજ ભગવાન, વિષણુ અને મહાહેવશી પણ અધિક એષ છે.’ હે સ્વામીનાથ ! આપ તો મહાવિદ્બાન અને શાક્ના પારંગત છો. આપને હું વધારે શું કહું ? સાંસારમાં સીને માટે પતિસેવા કરતાં અધિક સુખ બીજા કશામાં નથી અને એ પતિસેવાજ મેં જણાવી છે, એટલે કાંઈ અધિક કહ્યું નથી.”

પત્નીનાં આવાં મધુર વચ્ચેનો સાંભળીને વાચસ્પતિ મહારાજે ઘણ્યા પ્રસન્ન થઈ જઈને કહ્યું: “પ્રિયે ! તારં કહેનું વાજબી છે. વાસ્તવમાં પતિજ સીનું સર્વસ્વ છે, પણ એવું જાન ઘણ્યું થોડી સ્વીએને હોય છે.”

ધન્ય છે ભામતીની પતિલક્ષ્મિને ! પતિના સહવાસથી એને પણ વિદ્યાનું જ્યસન લાગી ગયું હતું. એમ કહેવાય છે કે એણે કહેપતરુ નામક અંથ ઉપર ટીકા લાખી છે.



## આમ સાહિત્યશૈલી

ગુન-ચારિન્યવર્ધક અને નિહોય આનંદ મેળવી શકાય તેવું ખાહિત્ય જુજ કિંમતથી પૂર્ણ પાડવાના ઉદ્દેશથી, નાની પુરુસ્તકાઓ પ્રસિદ્ધ કરવાનું થએ કર્યું છે. અરીએ પણ સંસ્કારી વર્ગ પોતાની મુંનથી પ્રમાણે નાની શી લાયબેરી વસાની શકે અને આશય છે. જુલાઈ ૧૯૪૮ સુધીમાં નીચે પ્રમાણે પુરુસ્તકો પ્રગટ થયાં છે :

### વર્મ અને તત્ત્વજ્ઞાન

શ્રીનિષ્ઠલસહસ્રનામ-સરળ અર્થ સાચે ...	૧૨૮	૦-૪	૦-૧
સો મુખ્યાંયોનાં લક્ષ્ણો-અથ્ અને સમન્દૃતી સાચે ૪૮	૦-૩	૦-૧	
દગ્ધ-દશ્ય વિવેક-સરળ અનુવાદ સાચે ...	૨૪	૦-૨	૦-૧
યક્ષ અને બુધિઓ-મૂળ શિલોકા સાચે સરળ ભાષામાં ૬૪	૦-૩	૦-૧	
દત્તાચ્છેય-(અવધૂત) દત્તાચ્છેયના ૨૪ ગુરુભોલ્લાં			
સંક્ષિપ્ત વર્ણનન ... ... ...	૮૦	૦-૩	૦-૧
નીતિશાસ્તક-(શીર્ષાંદરિ) સરળ અનુવાદ સાચે	૮૦	૦-૩	૦-૧
વૈરાગ્યશાસ્તક-	૫૯	૦-૪	૦-૧
પ્રેમપનથ-(૧) ગાંધીજીના પોતાના શખોમાં ...	૬૪	૦-૩	૦-૧
પ્રેમપનથ-(૨) રાં શ્રી. વાલલભાઈ જો. હેસાઈ	૧૦૪	૦-૪	૦-૧
શિલ્પમહિસુ: સ્તોત્રમં મૂળ શિલોકા, અનુવય, અથ્ અને ડિપલો સહિત	૫૬	૦-૩	૦-૧
કાળુંડીનારાણુમ-મુખ્યપાઠ કરવા યોગ્ય પ્રાર્થનામેત્રો-અથ્ સાચે ૬૪	૦-૩	૦-૧	
તાત્ત્વની સાધના-દેંદ્ર આચાર્યશ્રી ક્ષિતિગોહન સેનના: ૭૨	૦-૪	૦-૧	
ગીતાસાર-કાકા કાલેશકર: ગીતાનું સંક્ષિપ્ત દોહન ૮૦	૦-૪	૦-૧	
ગીતાપોથી-કાગજહરીગીતાની બાળપોથી-કર્મયોગના			
૧૨૫ શિલોકા, અથ્ તથા વિસ્તૃત સમન્દૃતી સાચે ૧૦૪	૦-૬	૦-૧	
ગીતાસંક્ષિપ્ત-સાંદ્રો શ્રી રમભુ મંડર્યિઃ ધીનાં ત્રણ			
સંક્ષિપ્તનો સાચે ... ... ...	૫૨	૦-૩	૦-૧
અભિન્દુ અભિવ્યક્તિસા- (૧૨ ને ૧૫ અધ્યાય) શિલોકા			
તથા અર્થ સાચે... ... ...	૪૮	૦-૩	૦-૧
ઉત્તરગીતા-તત્ત્વયોગનો સરળ અનુવાદ-મૂળ શિલોકા સાચે ૬૪	૦-૬	૦-૧	
મલ્લિચલમાળા-દ્વારાચાર્ય: સરળ અર્થ, શિલોકા સાચે ૧૯	૦-૧૧૧	૦-૧	
સાન અને કર્મ-દેંદ્ર સ્વામી અદ્રોતાનંદઃ ...	૭૨	૦-૩	૦-૧
પરમ પુરુષાર્થ-દેંદ્ર ..,: માનવલભનોના ડદેશ ૧૨૦	૦-૬	૦-૧	
આર્થ, ઘોઝ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોનો			
સમન્દ્ય-સેંદ્ર પંડિત પદેચરદાસ દોશી ...	૪૮	૦-૩	૦-૧
નારહનાં અક્ષિતસ્યુત્તો-મૂળ શિલોકા, અથ્ તથા વિવેગન સાચે ૧૪	૦-૩	૦-૧	

ગ્રામનાં કરણું-(આવતી ૩૭) લેઠ સ્વામી માધવતીર્થઃ ૬૪	૦-૩	૦-૧
શ્રીરામકૃષ્ણ વાર્તાલાય-(૧) અનેક રસપ્રદ આધાક		
પ્રસંગો-ઉપહેરો ... ... ... ૬૯	૦-૧	૦-૧
શ્રીરામકૃષ્ણ ઉપહેરો-માધવતીર્થ ઉપહેરો ... ૮૮	૦-૪	૦-૧
વિદ્યારચ્છ્વરીઓફય-સ્વામીશ્રી માધવતીર્થઃ ... ૬૦	૦-૩	૦-૧
હિંદુ જીવન-ડો. હરિપ્રસાદ પ્રભરાય ડેસાઈઃ (આ. ૫૩૧) ૫૯	૦-૩	૦-૧
ખ્રાન અને ઝ્રાન-લેઠ સ્વામી માધવતીર્થઃ નવી આવતીર્થ ૦-૩	૦-૩	૦-૧
માંસીમાં અગવાને શું ગાયું? (સ્વામી પદ્ધિયારકૃત) ૬૪	૦-૩	૦-૧

### ચરિત્રો

શામાયણુની રહસ્યકથા-રામાયણનાં પાઠનોં સાર ૧૯	૦-૧	૦-૧
ચંદ્રહાસ-નક્કા ચંદ્રહાસની કથા સારતો ... ૬૪	૦-૩	૦-૧
જાકત જલાશામ-મહાન પ્રભુનક્તાના જીવનપ્રસંગો ૬૪	૦-૩	૦-૧
સુદ્ધામાચચરિત-પ્રેરણાંદ્રુતા ... ... ૬૪	૦-૩	૦-૧
દાઅત દૈપ્લિકાસ-ચરિત ... ... ૪૮	૦-૩	૦-૧
સ્વામી રામતીર્થ-ફિરોરો માટે પ્રેરણાદાચી દુંડું ચરિત ૭૨	૦-૪	૦-૧
સત્તી સાવિત્રી-સલ્વાન ને સાવિત્રીની રોચક કથા ૫૨	૦-૩	૦-૧
ચેનાવતી ને જોપીચંહ તથા ભર્તીલિંગ ને વિકલ ૪૮	૦-૩	૦-૧
જેસલ ને તેચલ તથા જલાધર ને જોપીચંહ-૨૭. કલાપીયદ	૦-૩	૦-૧
દાયતરાજ ખનુમાન-દુંડું જીવનચરિત ... ... ૭૬	૦-૬	૦-૧
શ્રીતૈલંગસ્વામી-વિદ્યુદ્ધાનંદ તથા પૌરાણિકાભાનાં ચરિત્રો ૮૮	૦-૪	૦-૧
ખાળુકેના વિવેકાંદ-ખાળોપાયોગી દુંડું ચરિત ૬૪	૦-૪	૦-૧
અણણ બાપા-ચાદાં સાંચ ... ... ... ૬૪	૦-૪	૦-૧
સાંત કથીર-(ચિન્તન)સચોટ પ્રસંગો આયોગું દુંડું ચરિત ૫૬	૦-૩	૦-૧
જાકત આંધરીષ-ચરિત ... ... ... ૫૬	૦-૩	૦-૧
શ્રીરામકૃષ્ણ પરમહંસ- (ફિરોરો માટે) ... ૮૮	૦-૬	૦-૧
નાનશહુ બાપા-એક આદર્શ વેદ (આવતી બીજા) ૭૨	૦-૩	૦-૧
નાનક-(આ. બીજા) ચરિત, ૨૩ જન્મનો સાથે ... ૧૦૪	૦-૬	૦-૧

### સંતવાળી

હરિપાઠ-શ્રીજ્ઞાનહેવ રચિત રટ અભિગો ... ૩૨	૦-૨	૦-૧
જાકત સ્કૂરહાસનાં પહોં-કંકા જીવનચરિત સાથે ૮૦	૦-૪	૦-૧
ધીરા ભગતનાં પહોં-ક. શ્રી. હુંગરશી ધરમશી સંપદ: ૮૦	૦-૪	૦-૧
લોળ ભગતનાં ચાખાખાં-ક. „ „ „ ૬૬	૦-૬	૦-૧
છાટમની પાણું-મહાત્મા છાટમની ૬૬ પહોનોં સંબંધ ૭૨	૦-૪	૦-૧
કથીરની સાખીઓ-ગુજરાતી અર્થ સાથે ... ૮૦	૦-૪	૦-૧
પુલસીહાસની સાખીઓ-સમનૂહી સાથે ... ૭૨	૦-૩	૦-૧
સો ભજનો-કંઠ સુનિ નાનશહું ... ૬૪	૦-૬	૦-૧

## વાતીયો—નાટકો

અમણુ નારદ ને પંડુ જ્વેશી—અતુ: પદ્માવતી હેસાઈઃ ૫૨	૦-૩	૦-૧
મહાલક્ષ્મા અને અલ્પર્ક્ષ—ચરિત્ર સાથે તત્ત્વજ્ઞાનનો ઉપકેશ ૬૬	૦-૫	૦-૧
કુષ્યંત ને શકુંતલા અને બીજી વાતો— ... ૬૬	૦-૬	૦-૧
ધારણ્યકી ધાર અને બીજી વાતો—દેં ચૂનીલાલ મહિયા:		
માનવરવભાવ ને બાળણી પ્રગત કરી રૂપાતો ૭૬	૦-૩	૦-૧
કાળગુણી અને બીજી વાતો—(સચિવ) દેં ચૂનીલાલ મહિયા:		
કાદિયાવારી જીવનની રસિક પણ નિરોધ પ વાતો ૭૪	૦-૩	૦-૧
સાખાટ ક્રેચિક અને હેવી નાંદા—નેન સંસ્કૃતિની		
એ નાટકોયો ... ... ... ... ૭૪	૦-૩	૦-૧
કેરીની મેલાસમ અને બીજી વાતો—દેણક: શયદા. માનવ—		
ફલ્દ્યાની સારીનરસી લાગણ્યમેંથો બ્યાન કરી રૂપ વાતો ૭૬	૦-૫	૦-૧
અણોણે અને નરું રેલથે સ્ટેશન—કો. ચૂનીલાલ ન. દાઢા: ૯૦	૦-૪	૦-૧
જીવનનો મર્મ—દેણક: રોપાન: ... ... ૮૪	૦-૬	૦-૧
નબળવાણ	૯૪	૦-૪
અણિંસાણું રહણ્ય	૭૨	૦-૪
એ હુલ પુરુષ!	૫૬	૦-૪
આશાને અભિવાણો	૫૬	૦-૪

## કાઠયો

ગીતાંજલિ—શી રતીનદેનાથ ટાંગારાહુત ... ... ૧૦૪	૦-૬	૦-૧
મનને—આધુનિ રથ ... ... ... ૩૨	૦-૩	૦-૧
શ્રીમતોનો સ્ફોર્ટ—(આ. બીજ) દેં શ્રી. સંભર દ્વાળક્યા: ૬૪	૦-૪	૦-૧
જ્યબારતી—દેં “શયદા”-ભારતની ચક્કાપદીનું દિંદર્શન ૩૬	૦-૬	૦-૧

## ખાળકોને ઉપયોગી

ખાળકોના આચાર—ખાળકોને સહૂલતન શીખવતા પાડો ૪૦	૦-૨	૦-૧
ખાળકોની દીતભાત— “ ” ” ” ૪૮	૦-૩	૦-૧
ખાળકોનો આનંદ—શાધક પાડો ” ” ” ૬૬	૦-૪	૦-૧

## આરોગ્ય ને વૈદક

ઓદ્ધાકમાં ઓર-ઓરાકગાં યતા બેળસેળ વિષે માહિતી ૮૦	૦-૪	૦-૧
માંદગામાં ઉપવાસ— ” ” ૧૧૯	૦-૬	૦-૧
પાટ-ઔષધિ—સિયાળામાં આવા લાયક ૮૦ પાડો		
બનાવવાની રીત તથા ઉપયોગ ... ... ૮૦	૦-૬	૦-૧
વૈદકના અકસ્મીન ઉપયોગ—બાલશ્વાધીદ્વારા નામની		
પુરિતકા ઉપરથી તૈયાર કરેલું શ્વેષા, અથ્વ અને		
ઉપયોગી દિંપલ્લું સાથેનું મુરતક ... ... ૧૧૨	૦-૬	૦-૧

## ૧૬૯

અથનાચાર્યા-હિન્દુચાર્યા, રાત્રિચાર્યા, જગતુચાર્યા અને

સદ્ગુરૂતનના નિયમો (નવી આવૃત્તિ)	...	૮૦	૦-૬	૦-૧
સેનેરી સૂચનો-કે૦ ટો. રસિકલાલ પરીખ:		૧૧૨	૦-૬	૦-૧
કવાચ-ઓપથિ-સો ડપથોગી કવાચો તથા તેનો ડપથોગ ૧૪	૦-૬	૦-૧		
હરદે-(સચિત્ર) સુધારાવધારા સાચેની ભીજ આવૃત્તિ	૮૦	૦-૬	૦-૧	
શૂર્ણ-ઓપથિ-સો ડપથોગી ચૂંઝી બનાવવાની				
રીત તથા ડપથોગ...	...	૭૧	૦-૩	૦-૧
માંડાનો આહારવિહાર-આયુર્વેદ પદ્ધતિએ માર્ગદર્શન ૧૪	૦-૩	૦-૧		
માંડળિનાં કાશથોટ-	"	૬૬	૦-૬	૦-૧

વધુ માહિતી માટે વિસ્તૃત સૂચિપત્ર મંગાવો :

## સર્વતું સાહિત્ય વર્ધક કાર્યાલય

બદ્ર ગારો, પોરટ એન્ડ સ નં. ૫૦, અમદાવાદ અને  
કાલાહેવી રોડ, હાથી જીલ્ડિંગ, નીલે મારો, ગુંબાઈ-૨

## શ્રીચોના વિવિધ પ્રશ્નો

પૃષ્ઠ: ૨૯૪, ડિ. ૧-૮-૦

### નળાખ્યાન

પૃષ્ઠ: ૧૩૯, ડિ. ૧-૦-૦

### અભાજુરણુ

પૃષ્ઠ: ૧૧૨, ડિ. ૦-૮-૦

### પાકશાસ્ન

પૃષ્ઠ: ૨૯૪, ડિ. ૨-૮-૦

### મેહિની અને બીજી વાતો

પૃષ્ઠ: ૧૫૬, ડિ. ૧-૦-૦

### હેરાણુનો કલાહ અને બીજી વાતો

પૃષ્ઠ: ૧૨૨, ડિ. ૧-૦-૦

### ગરીબાઈનો સંસાર અને બીજી વાતો

પૃષ્ઠ: ૧૪૫, ડિ. ૧-૦-૦

### નળાણુનો ઝેર અને બીજી વાતો

પૃષ્ઠ: ૧૮૮, ડિ. ૧-૦-૦

### સરસું સાહિત્ય વર્ધક કાયીલય-અમદાવાદ

કોવણી, લમ, વારસાદક્ષ,  
ગામડાંની રીતોનોના મ્રદ,  
કાર્યક્રોચ, શારીરિક સંપત્તિ,  
ગુહજીવોગ, શ્રીચોની ક્રદ  
સત્ત્વાદિ અનેક વિષયો.

યુદ્ધરાત્રના મહાકાવ્ય પ્રેમાનંદ  
રચિત કરણું-રસિક આખ્યાન  
પરથીતેયારકરી મોટાટાએખિયાં.

મદાકવિશી પ્રેમાનંદું મોટા  
અસ્કરોમાં, અખરા શાખદેના  
અર્થ સાચે.

મિષ્ટાન, ઇરસાયુ, શાકભાજ  
ઓ, ચટણી, કંબુંબરા તથા  
રાયતું, અથાણાં, પાડા અને  
કેટલાંક ચૂણો અનાવણાની  
સરળ રિતા.

સંસારજીવનમાં ડાઢિયું કરાવના  
સોધક અને સામાજિક દુઃ્ખ  
વાર્તાઓ.

કંદુંલાણનાં કડુંના અને  
માધુર્યાલયી અસ્કરોનાં હાયદ  
ચિતાર આપતી વાર્તાઓ.

હિંદુ સમાજના કલેજર ઉપર  
પ્રકારા નાયતી રસભરી  
નિરોપ વાર્તાઓ.

માનવહૃદયના ધયકારાને શાખ-  
દેશ આપતી પ્રેરણાદાના દુઃ્ખ  
વાર્તાઓ.

